2010-05-08 -Divya Bhaskar -Invitation & Consitution Passed [393]

**સુવિચાર**

વીર ચોક્કસપણે બનો, પરંતુ વધુ પડતા ખતરાથી ખેલવાનો શોખ ન રાખો.

જોન લીલી


ભારતનું સૌથી ઝડપી વિકસતું અખબાર

# દિવ્ય ભાસ્કર

ભુજ -ગાંધીધામ | કુલ પાના ૧૪ | કિંમત ૨:૫૦ રૂ.

ભારતનું સૌ પ્રથમ લાઇવ ન્યૂઝપેપર divyabhaskar.com | બાળ ભાસ્કર | શનિવાર | ૮ મે, ૨૦૧૦ અ. વૈશાખ વદ-૧૦, વિક્રમ સંવત : ૨૦૬૬


| | | |
|---|---|---|
| સેન્સેક્સ | 16,769.11 | |
| પાછલો 16,987.53 | | તફાવત -218.42 |
| નિફ્ટી | 5018.05 | |
| પાછલો 5090.85 | | તફાવત -72.80 |
| સોનું | 17,950.00 | |
| પાછલો 17700.00 | | તફાવત 250.00 |
| ચાંદી | 27,800.00 | |
| પાછલો 27700.00 | | તફાવત 100.00 |
| ડોલર | 45.49 | |
| પાછલો 44.31 | | તફાવત 0.18 |

૧૦ લલિત મોદી સામે વધુ એક આક્ષેપ

realpatidar.com

# ગેસ પ્રકરણમાં મુકેશ અંબાણીને ફાયદો

## કુદરતી ગેસ રાષ્ટ્રીય સંપત્તિ, ભાવ નક્કી કરવાનો હક્ક માત્ર સરકારને જ : સુપ્રીમ કોર્ટની બેન્ચનો 2 વિરુદ્ધ 1થી ચુકાદો

બંને ભાઈઓને સાથે મળીને છ સપ્તાહમાં નવા કરાર કરવાની સલાહ

**પ્રમોદકુમાર . નવી દિલ્હી**

મુકેશ અંબાણી જૂથની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પાસેથી સસ્તા ગેસની માગણી સાથેની અનિલ અંબાણી જૂથની અરજીને સુપ્રીમ કોર્ટે શુક્રવારે નકારી કાઢી છે. કોર્ટે આ સાથે જ કહ્યું હતું કે કુદરતી ગેસ એ રાષ્ટ્રીય સંપત્તિ છે અને તેનું એક્સ્પ્લોરેશન અને ઉત્પાદન ખાનગી કંપની દ્વારા કરાતું હોય તેમ છતાં તેના ભાવ નક્કી કરવાનો અધિકાર માત્ર અને માત્ર સરકારને જ છે. કોર્ટે કહ્યું હતું કે બન્ને ભાઈઓ વચ્ચે થયેલા કરાર કાનૂની રીતે અને ટેક્નિકલી બંધનકર્તા નથી.

મુખ્ય ન્યાયમૂર્તિ કે.જી. બાલક્રિશ્નનની અધ્યક્ષતા હેઠળની ત્રણ ન્યાયમૂર્તિઓની બેન્ચે બે વિરુદ્ધ એકથી

**હવે શું?:** સુપ્રીમનો ચુકાદો સાંભળવા આવેલા અનિલના ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાતી હતી.

### રિવ્યૂ પિટિશન નહીં : અનિલ

અડાગ જૂથના ચેરમેન અનિલ અંબાણીએ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના ચુકાદા અંગે રિવ્યૂ પિટિશન કરવાની તાત્કાલિક કોઈ યોજના નથી. આરએનઆરએલ સુપ્રીમ કોર્ટે કહ્યા મુજબ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સાથે છ સપ્તાહના સમયમાં ગેસપુરવઠા અંગે શક્ય એટલા ઝડપથી અને સફળતાપૂર્વક નવેસરથી વાટાઘાટો કરવાની દિશામાં આગળ વધશે. તેમણે કહ્યું હતું કે આરએનઆરએલના શેરધારકોનાં હિતોનું સંપૂર્ણપણે ધ્યાન રખાશે.

### ૧૭ વર્ષ માટે ગેસ નહીં : રિલાયન્સ

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પીએમએસ પ્રસાદે ચુકાદા અંગે પ્રતિક્રિયામાં કહ્યું હતું કે તે આરએનઆરએલને સરકાર દ્વારા નક્કી કરાયેલા ૪.૨ ડોલર પ્રતિ એમએમબીટીયુના ભાવે ગેસ સપ્લાય કરી શકે તેમ છે. વળી તેણે કહ્યું કે તે ૧૭ વર્ષ માટે ગેસ આપી શકે તેમ નથી, કારણ કે કેજી-ડીદ્દ બેઝીનમાંથી મહત્તમ ૧૧ વર્ષ સુધી ગેસ નીકળી શકે તેમ છે. એટલું જ નહીં, ગેસનો પુરવઠો સરકાર નક્કી કરે તે મુજબનો પુરવઠો તે આરએનઆરએલને આપશે.

**ચુકાદો** કોની તરફેણમાં છે તે અંગે હું કોઈ ટિપ્પણી નહીં કરું. પરંતુ એકવાત સાબિત થઈ ગઈ છે કે આ મામલે સરકારનું વલણ યોગ્ય હતું.

**- વીરપ્પા મોઈલી,** કાયદા મંત્રી



**સુપ્રીમ** કોર્ટના ચુકાદાથી સરકાર હસ્તકની એનટીપીસી અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ વચ્ચેના વિવાદ પર કોઈ અસર નહીં થાય.

**- સુશીલકુમાર શિંદે,** ઊર્જા મંત્રી

**ચુકાદાથી** એ સાબિત થઈ ગયું છે કે ગેસ પર સરકાર અને દેશની જનતાનો જ હક છે. કોઈ(અનિલ અંબાણી) ગમે તે કહે, પરંતુ રાષ્ટ્ર સર્વોપરી છે.

**- મુરલી દેવરા,** પેટ્રોલિયમ મંત્રી

## અનિલ જૂથના શેરોમાં ધોવાણ, RILમાં ઉછાળો

એડીએજી જૂથના માર્કેટ કેપમાં રૂ. ૯૧૦૦ કરોડનું ધોવાણ, આરએનઆરએલ ૨૩ ટકા ઘટ્યો

**બિઝનેસ ડેસ્ક . અમદાવાદ**

સુપ્રીમ કોર્ટે અંબાણી ગેસના વિવાદમાં ચુકાદો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને લાભ થાય તેવો આપતાં તેના આકરા પ્રત્યાઘાત અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપ (એડીએજી)ના શેરોમાં જોવાયા હતા અને તેનો સૌથી મોટો આંચકો રિલાયન્સ નેચરલ રિર્સોસ (આરએનઆરએલ)ના શેરમાં ૨૩ ટકા કડાકા સાથે જોવાયો હતો.

...અનુસંધાન પાના નં.૭

**શેરના ભાવ** (રૂ.માં)

| કંપની | ઘટ્યો/વધ્યો | બંધ |
|---|---|---|
| રિલાયન્સ ઇન્ડ. | +૨૨.૯૫ | ૧૦૩૩.૮૫ |
| રિલાયન્સ ઇ.ઇન્ફ્રા. | -૧.૫૦ | ૭૯૬.૬૦ |
| આરએનઆરએલ | -૧૫.૬૦ | ૫૨.૭૫ |
| રિલાયન્સ પાવર | -૧૩.૮૦ | ૧૪૦.૧૦ |
| રિલાયન્સ કેપિટલ | -૨૫.૯૫ | ૬૮૩.૮૫ |
| આરકોમ | -૪.૨૦ | ૧૫૨.૮૫ |
| રિલાયન્સ ઇન્ફ્રા. | -૭૩.૮૫ | ૯૭૯.૭૦ |
| આરમીડિયાવર્લ્ડ | -૨.૯૦ | ૫૫.૪૫ |
| આરમીડિયાવર્ક્સ | -૧૩.૦૫ | ૧૮૭.૦૫ |

### ન્યૂઝ ઇનબોક્સ

**ઇવાનું કેટવોક**

આર્જેન્ટિનાના બ્યુએનોસ એરિસમાં યોજાયેલા ફેશન શોમાં જાણીતી મોડેલ ઇવા પેરોન વ્હાઇટ બ્યૂટિ બનીને આવી પહોંચી હતી. એપી

### કેન્દ્રીય વિદ્યાલયોમાં સાંસદોનો ક્વોટા યથાવત્ રખાશે

**નવી દિલ્હી:** સંસદમાં ભારે હોબાળા પછી સરકારે કેન્દ્રીય વિદ્યાલયોમાં સાંસદોના ક્વોટાને યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. માનવ સંસાધન વિકાસ મંત્રી કપિલ સિબ્બલે શુક્રવારે રાજ્યસભામાં જણાવ્યું હતું કે હવે સંસદના બન્ને ગૃહોના સદસ્યો કેન્દ્રીય વિદ્યાલયોમાં બે-બે વિદ્યાર્થીઓના નામાંકનની ભલામણ કરી શકશે.

### દેશના પૂર્વી રાજ્યોમાં ભારે વંટોળ સાથે વરસાદ: ૧૫નાં મૃત્યુ

**નવીદિલ્હી:** દેશના પૂર્વી રાજ્યોમાં જોરદાર વંટોળ સાથે ધોધમાર વરસાદને પગલે ૧૫ લોકોના મૃત્યુ નિપજ્યા હતા. જેમાં સૌથી વધુ મૃત્યુ ઉત્તરપ્રદેશમાં નોંધાયા છે. ઉત્તરપ્રદેશના જૌનપુર જિલ્લામાં ભારે વંટોળને લીધે નવ, બલિઆમાં ચાર અને ગાઝીપુર તેમજ વારાણસીમાં એક-એક મૃત્યુ થયા હતા. નવી દિલ્હીમાં પણ વંટોળ ફૂંકાયો હતો. રાજધાનીમાં આજે મહત્તમ તાપમાન ઘટીને ૩૫.૬ ડિગ્રી સેલ્સિયસ હતું.

### આજની મેચ

પાકિસ્તાન વિ. ન્યૂઝિલેન્ડ
સાંજે ૭ વાગ્યે

ઇંગ્લેન્ડ વિ. સાઉથ આફ્રિકા
રાત્રે ૧૧ વાગ્યે

### હવામાન — ભુજ

| મહત્તમ | લઘુત્તમ |
|---|---|
| 40.2°c | 26.2°c |

## સેન્સેક્સમાં ૨૧૮ પોઈન્ટનું ગાબડું

**બિઝનેસ ડેસ્ક. અમદાવાદ**

આંતરરાષ્ટ્રિય બજારમાં મંદીનો માહોલ છવાયેલો રહેતાં રિલાયન્સની તરફેણ કરતો ચુકાદો આવવા છતાં બજારમાં તેની અસર જોવાઈ નહોતી અને સેન્સેક્સ ૨૧૮ પોઈન્ટ ઘટીને ૧૬,૭૬૯ની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૭૩ પોઈન્ટ ઘટીને ૫૦૧૮ની સપાટીએ બંધ રહ્યો હતો. ગ્રીસનું પેકેજ મંજૂર કરવામાં આવ્યું હોવાના સમાચારની કોઈ અસર નહોતી. નવી એવી દહેશત

...અનુસંધાન પાના નં. ૭

**વૈશ્વિક આંકમાં નરમાઇ**

| | |
|---|---|
| અમેરિકા- ડાઉ | -૧૦૫ |
| બ્રાઝિલ-બોવાસ્પા | -૩૮૨ |
| લંડન-ફિત્સીઇ | -૧૦૫ |
| જર્મની-ડેક્સ | -૧૬૭ |
| ફ્રાંસ-કેક | -૧૭૭ |
| સ્પેન-આઇબીએક્સ | -૩૦૭ |
| ઇટાલી-મિબ | -૫૬૪ |
| ગ્રીસ-એથેક્સ | -૪૮ |

## રાજ્યપાલોને મનસ્વીપણે કેન્દ્ર બદલી ન શકે : સુપ્રીમ

કેન્દ્રમાં નવી સરકારની રચના સાથે જ રાજ્યપાલોને બદલવાની પરંપરા અયોગ્ય

**પીટીઆઇ. નવી દિલ્હી**

કેન્દ્રમાં નવી સરકારની રચના સાથે જ રાજ્યપાલોને બદલવાની પરંપરા સાથે અસહમતી દર્શાવતા સર્વોચ્ચ અદાલતે આજે ઠેરવ્યું હતું કે, રાજ્યપાલોને આવી મનસ્વી રીતે દૂર કરી શકાય નહીં. ચીફ જસ્ટિસ કે.જી. બાલાક્રિષ્નનની અગ્રતાવાળી પાંચ જજોની બનેલી બંધારણીય બેંચે શુક્રવારે કહ્યું હતું કે, ગેર વર્તણૂક અથવા અન્ય અનિયમિતતાઓના સ્પષ્ટ કિસ્સાઓ સામે આવે તો જ રાજ્યપાલોને તેમની મુદત પહેલાં હટાવી શકાય નહીં. બેંચે જણાવ્યું હતું કે, રાજ્યપાલોની નિમણૂક

...અનુસંધાન પાના નં.૯

## સોનું ફરી રૂપિયા ૧૮૦૦૦ પાંચ માસના શિખરે પહોંચ્યું

**ભાસ્કર ન્યૂઝ. રાજકોટ, અમદાવાદ**

ઈક્વિટી માર્કેટની અવઢવભરી સ્થિતિના કારણે સલામત રોકાણ ગણાતા સોના-ચાંદીમાં વધી રહેલા વૈશ્વિક મૂડીરોકાણના કારણે બન્ને કિંમતી ધાતુઓમાં આગઝરતી તેજી જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રિય ભાવો પાછળ ઘરઆંગણે પણ સોના-

...અનુસંધાન પાના નં.૯

**સોના-ચાંદીમાં સુધારો**

| શહેર | સોનું | વૃદ્ધિ(રૂ.) | ચાંદી | વૃદ્ધિ(રૂ.) |
|---|---|---|---|---|
| અમદાવાદ | 18075 | 325 | 27900 | 100 |
| રાજકોટ | 17950 | 250 | 27800 | 100 |
| મુંબઇ | 17845 | 375 | 28400 | 135 |
| દિલ્હી | 18110 | 495 | 28165 | 565 |

## ન્યૂયોર્કના ટાઇમ્સ સ્ક્વેરમાં ફરી શંકાસ્પદ વસ્તુ મળી

ટાઇમ્સ સ્ક્વેરના ચાર બ્લોક ખાલી કરાવાયા

**પીટીઆઇ . ન્યૂ યોર્ક**



પાકિસ્તાની મૂળના અમેરિકી ફૈસલ શહેઝાદે નિષ્ફળ કારબોમ્બ હુમલો કર્યાના એક સપ્તાહ પછી પર્યટકોના પ્રિય સ્થળ ટાઇમ્સ સ્ક્વેરમાં પોલીસને ફરી શંકાસ્પદ પેકેટ મળી આવતાં વિસ્તારને ફરીથી ખાલી કરાવવામાં આવ્યો હતો. ન્યૂ યોર્કના પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે ૪૫મી સ્ટ્રીટ નજીક શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો હતો. પોલીસે વધુ કોઈ વિગત આપી નથી. આ ઘટનાને પગલે ટાઇમ્સ સ્ક્વેરના ચાર બ્લોક ખાલી કરાવાયા હતા. આ સફેદ રંગનું કૂલર મળી આવતા પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી. જો કે પોલીસે તરત જ હરકતમાં આવી પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી અને જનવ્યવહાર રાબેતા મુજબનો થઈ ગયો હતો.

## સરોગેટ મધર : નાની બનશે પુત્રીનાં બાળકની માતા

**મૃગા કાપડિયા . સુરત**

નવ માસ સુધી ગર્ભની અંદર ઉછરી રહેલા બાળકની દરેક હલનચલનને માત્ર અનુભવવી નહીં પરંતુ માણવી પણ એ એક સ્ત્રીને મળેલી ઈશ્વરીય ભેટ છે. તેથી જ 'મા' બનવાનાં સૌભાગ્ય માટે દરેક મહિલા તડપતી હોય છે. પણ રાજકોટની પ્રીતિ જોષી (નામ બદલ્યું છે) માટે માતા બનવાનું સૌભાગ્ય ભગવાન જન્મથી જ છીનવી ચૂક્યા છે. કારણ પ્રીતિના શરીરમાં જન્મથી ગર્ભાશય ન હોવાથી તેનામાં મા બનવાની ક્ષમતા નહોતી. ત્રણ વર્ષનાં સુખી લગ્નજીવનમાં હવે બાળકના ખિલખિલાટની કમીનો અહેસાસ થઈ રહ્યો હતો. પ્રીતિ મા બનવા માગતી હતી. તેને પોતાનું બાળક જોઈતું હતું. કુદરત સામે લાચાર પ્રીતિ માટે જોકે મેડિક્લ સાયન્સ વાહરે આવ્યું છે.

પોતાની દીકરી જ્યારે મા બનવાની ઈચ્છા ધરાવે અને તે ઈચ્છા માટે દીકરીની મા પોતાનો ગર્ભ ભાડે આપે ત્યારે તે માતાને શું કહેવું? બસ, આવું જ કંઈક પ્રીતિનાં ૪૫ વર્ષીય મમ્મી પોતાની દીકરી માટે કરી રહ્યાં છે. ભગવાને પ્રીતિ પાસેથી ભલે મા બનવાનો અધિકાર છીનવી લીધો પરંતુ પ્રીતિને માતૃત્વ સુખ મળી રહે તે માટે પ્રીતિની મમ્મી 'સેરોગેટ મધર' બનીને તેને મા કહી શકનાર બાળક આપશે. મધર્સ ડે પર આ માને જેટલી

... અનુસંધાન પાના નં.૭

## નર્મદા નિગમના ડાયરેક્ટર પદે મુકેશભાઈ ઝવેરીની નિમણૂક

કચ્છ માટે અતિ મહત્ત્વના નિગમમાં સ્થાન મળતાં જિલ્લાવાસીઓમાં આવકાર સાથે આનંદ

**ભાસ્કર ન્યૂઝ. ભુજ**

કચ્છ જિલ્લા માટે તાતી જરૂરિયાત સમાન નર્મદા નીરની વહીવટી પ્રક્રિયા જ્યાં થાય છે એવા સરદાર સરોવર નિગમ લિમિટેડ (ગાંધીનગર)માં ભુજના પૂર્વ ધારાસભ્ય મુકેશ ઝવેરીની ડાયરેક્ટર પદે વરણી કરાઈ છે. કચ્છ માટે મહત્ત્વના નિગમમાં સ્થાન મળતાં નર્મદા પ્રશ્નોને અગ્રતા મળશે તેવી અશાઓ સાથે આ નિમણૂકને વધાવવામાં આવી રહી છે.

મળતી વિગતો અનુસાર સરદાર સરોવર નિગમમાં તાજેતરમાં થયેલી નિમણૂકો અંતર્ગત કચ્છી અગ્રણીનો સમાવેશ થયો છે. ભુજના પૂર્વ ધારાસભ્ય અને લિગ્નાઇટ ક્ષેત્રે મહત્વનું પ્રદાન આપનારા ગુજરાત

...અનુસંધાન પાના નં.૭

## આઇફા એવોર્ડ્ઝ-૨૦૧૦માં થ્રી-ઇડિયટ્સને મળ્યા ૧૪ નોમિનેશન

**કદર** ૩ થી પાંચ જૂન દરમિયાન કોલંબોમાં ભવ્ય આયોજન

**ભાસ્કર ન્યૂઝ. મુંબઈ**

ભારતીય ફિલ્મ ઉદ્યોગ માટે બોક્સ ઓફિસ પર ઝમકદાર પરફોર્મન્સના એક વર્ષ સાથે ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેડેમી (આઈફા)એ હવે આઈફા એવોર્ડસ ૨૦૧૦નાં નામાંકનો જાહેર કર્યા છે. વિડિયોકોન આઈફા વીક એન્ડ અને માઈક્રોમેક્સ આઈફા એવોર્ડસનો સમારંભ આગામી ૩થી ૫ જૂન-૨૦૧૦ દરમિયાન શ્રીલંકાના પાટનગર કોલંબોના સુઘટદાસ સ્ટેડિયમમાં યોજાશે.

આ નામાંકનો માટે માર્ચ મહિનામાં ફિલ્મ ઉદ્યોગમાં લોકમત લેવાયો હતો. તેનું ઓનલાઈન મતદાન ૧૦ મેથી ૧૦જૂન સુધી યોજાશે. તેમાં ભારતીય સિનેમાના દર્શકો મતદાન કરી શકશે. આ મતદાનને આધારે એવોર્ડ વિજેતાઓ નક્કી કરાશે.

ગયા વર્ષની સફળ અને લોકપ્રિય ફિલ્મોમાંથી 'થ્રી ઈડિયટસ', 'વોન્ટડ', 'કમીને', 'પા' અને 'દેવ ડી'ની ઉમેદવારી શ્રેષ્ઠ ફિલ્મની કેટગેરી માટે કરાઈ છે. શ્રેષ્ઠ દિગ્દર્શનના એવોર્ડ માટેના ઉમેદવારો રાજકુમાર હિરાની (થ્રી ઈડિયટસ), અનુરાગ કશ્યપ (દેવ ડી), અયાન

...અનુસંધાન પાના નં.૭

વર્ષ ૩ · અંક ૩૦૫ · કચ્છ··· | ભાસ્કર જૂથ | ૧૧ રાજ્ય . ૪૮ આવૃત્તિ & ગુજરાત . મધ્યપ્રદેશ . છત્તીસગઢ . રાજસ્થાન . હરિયાણા . નવી દિલ્હી . ચંદીગઢ . પંજાબ . મહારાષ્ટ્ર .હિમાચલપ્રદેશ . ઉત્તરાખંડ . ભુજ, રાજકોટ, જામનગર, અમદાવાદ, સુરત, વડોદરા, મુંબઇ અને નોર્થ અમેરિકાથી પ્રકાશિત . ભુજ ઓફિસ ફોન : ૦૨૮૩૨-૩૯૮૮૮૮, ફેક્સ : ૦૨૮૩૨-૨૫૫૧૮૦-૮૧

Digitially Archived by: www.realpatidar.com/library

# Real Patidar Library

This book/literature/article/material may be used for research, teaching, and private study purposes. Any substantial or systematic reproduction, redistribution, reselling, loan, sub-licensing, systematic supply, or distribution in any form to anyone is expressly forbidden.

The library does not give any warranty express or implied or make any representation that the contents will be complete or accurate or up to date. The library shall not be liable for any loss, actions, claims, proceedings, demand, or costs or damages whatsoever or howsoever caused arising directly or indirectly in connection with or arising out of the use of this material.

Full terms and conditions of use: http://www.realpatidar.com

## About Real Patidar books

Real Patidar's mission is to organize the information on Satpanth religion, which is a  Nizari Ismaili sect of Shia branch of Islam, and to make it universally accessible and useful. Real Patidar Books helps readers discover the material on Satpanth online while helping authors and researchers in their studies. You can know more by visiting http://www.realpatidar.com

You can resize and move this box in any PDF Application like Adobe Acrobat Reader.

For page numbers, see the page footer. Page numbers are in 'Page x of y' format
For Reference See Pages: 1, 10, 13.

2010-05-08 -Divya Bhaskar -Invitation & Consitution Passed [393]

See Page 10 & 13

**સુવિચાર**

વીર ચોક્કસપણે બનો, પરંતુ વધુ પડતા ખતરાથી ખેલવાનો શોખ ન રાખો.

જોન લીલી


# દિવ્ય ભાસ્કર

ભારતનું સૌથી ઝડપી વિકસતું અખબાર

ભુજ -ગાંધીધામ | કુલ પાના ૧૪ | કિંમત ૨:૫૦ રૂ.

ભારતનું સૌ પ્રથમ લાઇવ ન્યૂઝપેપર divyabhaskar.com | બાળ ભાસ્કર | શનિવાર | ૮ મે, ૨૦૧૦ અ. વૈશાખ વદ-૧૦, વિક્રમ સંવત : ૨૦૬૬


Digitally signed by realpatidar.com DN: cn=realpatidar.com, c=IN, o=realpatidar.com, email=mail@realpatidar.com Reason: I have reviewed this document Date: 2025.05.05 17:57:00 +05'30'

Real Patidar Unravel Truth

realpatidar.com

| | | |
|---|---|---|
| સેન્સેક્સ | 16,769.11 | |
| પાછલો 16,987.53 | તફાવત -218.42 | |
| નિફ્ટી | 5018.05 | |
| પાછલો 5090.85 | તફાવત -72.80 | |
| સોનું | 17,950.00 | |
| પાછલો 17700.00 | તફાવત 250.00 | |
| ચાંદી | 27,800.00 | |
| પાછલો 27700.00 | તફાવત 100.00 | |
| ડોલર | 45.49 | |
| પાછલો 44.31 | તફાવત 0.18 | |

૧૦ લલિત મોદી સામે વધુ એક આક્ષેપ

# ગેસ પ્રકરણમાં મુકેશ અંબાણીને ફાયદો

## કુદરતી ગેસ રાષ્ટ્રીય સંપત્તિ, ભાવ નક્કી કરવાનો હક્ક માત્ર સરકારને જ : સુપ્રીમ કોર્ટની બેન્ચનો 2 વિરુદ્ધ 1થી ચુકાદો

### બંને ભાઈઓને સાથે મળીને છ સપ્તાહમાં નવા કરાર કરવાની સલાહ

**પ્રમોદકુમાર . નવી દિલ્હી**

મુકેશ અંબાણી જૂથની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પાસેથી સસ્તા ગેસની માગણી સાથેની અનિલ અંબાણી જૂથની અરજીને સુપ્રીમ કોર્ટે શુક્રવારે નકારી કાઢી છે. કોર્ટે આ સાથે જ કહ્યું હતું કે કુદરતી ગેસ એ રાષ્ટ્રીય સંપત્તિ છે અને તેનું એક્સ્પલોરેશન અને ઉત્પાદન ખાનગી કંપની દ્વારા કરાતું હોય તેમ છતાં તેના ભાવ નક્કી કરવાનો અધિકાર માત્ર અને માત્ર સરકારને જ છે. કોર્ટે કહ્યું હતું કે બન્ને ભાઈઓ વચ્ચે થયેલા કરાર કાનૂની રીતે અને ટેક્નિકલી બંધનકર્તા નથી.

મુખ્ય ન્યાયમૂર્તિ કે.જી. બાલક્રિશ્નનની અધ્યક્ષતા હેઠળની ત્રણ ન્યાયમૂર્તિઓની બેન્ચે બે વિરુદ્ધ એકથી

**હવે શું?:** સુપ્રીમનો ચુકાદો સાંભળવા આવેલા અનિલના ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાતી હતી.

### રિવ્યૂ પિટિશન નહીં : અનિલ

અડાગ જૂથના ચેરમેન અનિલ અંબાણીએ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના ચુકાદા અંગે રિવ્યૂ પિટિશન કરવાની તાત્કાલિક કોઈ યોજના નથી. આરએનઆરએલ સુપ્રીમ કોર્ટે કહ્યા મુજબ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સાથે છ સપ્તાહના સમયમાં ગેસપુરવઠા અંગે શક્ય એટલા ઝડપથી અને સફળતાપૂર્વક નવેસરથી વાટાઘાટો કરવાની દિશામાં આગળ વધશે. તેમણે કહ્યું હતું કે આરએનઆરએલના શેરધારકોનાં હિતોનું સંપૂર્ણપણે ધ્યાન રખાશે.

### ૧૭ વર્ષ માટે ગેસ નહીં : રિલાયન્સ

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પીએમએસ પ્રસાદે ચુકાદા અંગે પ્રતિક્રિયામાં કહ્યું હતું કે તે આરએનઆરએલને સરકાર દ્વારા નક્કી કરાયેલા ૪.૨ ડોલર પ્રતિ એમએમબીટીયુના ભાવે ગેસ સપ્લાય કરી શકે તેમ છે. વળી તેણે કહ્યું કે તે ૧૭ વર્ષ માટે ગેસ આપી શકે તેમ નથી, કારણ કે કેજી-ડીદ્દ બેઝીનમાંથી મહત્તમ ૧૧ વર્ષ સુધી ગેસ નીકળી શકે તેમ છે. એટલું જ નહીં, ગેસનો પુરવઠો સરકાર નક્કી કરે તે મુજબનો પુરવઠો તે આરએનઆરએલને આપશે.

**ચુકાદો** કોની તરફેણમાં છે તે અંગે હું કોઈ ટિપ્પણી નહીં કરું. પરંતુ એકવાત સાબિત થઈ ગઈ છે કે આ મામલે સરકારનું વલણ યોગ્ય હતું.

**- વીરપ્પા મોઈલી,** કાયદા મંત્રી



**સુપ્રીમ** કોર્ટના ચુકાદાથી સરકાર હસ્તકની એનટીપીસી અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ વચ્ચેના વિવાદ પર કોઈ અસર નહીં થાય.

**- સુશીલકુમાર શિંદે,** ઊર્જા મંત્રી

**ચુકાદાથી** એ સાબિત થઈ ગયું છે કે ગેસ પર સરકાર અને દેશની જનતાનો જ હક છે. કોઈ(અનિલ અંબાણી) ગમે તે કહે, પરંતુ રાષ્ટ્ર સર્વોપરી છે.

**- મુરલી દેવરા,** પેટ્રોલિયમ મંત્રી

### અનિલ જૂથના શેરોમાં ધોવાણ, RILમાં ઉછાળો

એડીએજી જૂથના માર્કેટ કેપમાં રૂ. ૯૧૦૦ કરોડનું ધોવાણ, આરએનઆરએલ ૨૩ ટકા ઘટ્યો

**બિઝનેસ ડેસ્ક . અમદાવાદ**

સુપ્રીમ કોર્ટે અંબાણી ગેસના વિવાદમાં ચુકાદો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને લાભ થાય તેવો આપતાં તેના આકરા પ્રત્યાઘાત અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપ (એડીએજી)ના શેરોમાં જોવાયા હતા અને તેનો સૌથી મોટો આંચકો રિલાયન્સ નેચરલ રિસોર્સ (આરએનઆરએલ)ના શેરમાં ૨૩ ટકા કડાકા સાથે જોવાયો હતો.

...અનુસંધાન પાના નં.૭

**શેરના ભાવ** (રૂ.માં)

| કંપની | ઘટ્યો/વધ્યો | બંધ | કંપની | ઘટ્યો/વધ્યો | બંધ |
|---|---|---|---|---|---|
| રિલાયન્સ ઇન્ડ. | +૨૨.૯૫ | ૧૦૩૩.૮૫ | રિલાયન્સ કેપિટલ | -૨૫.૯૫ | ૬૮૩.૮૫ |
| રિલાયન્સ ઇ.ઇન્ફ્રા. | -૧.૫૦ | ૭૯૬.૬૦ | આરકોમ | -૪.૨૦ | ૧૫૨.૮૫ |
| આરએનઆરએલ | -૧૫.૬૦ | ૫૨.૭૫ | રિલાયન્સ ઇન્ફ્રા. | -૭૩.૮૫ | ૯૭૯.૭૦ |
| રિલાયન્સ પાવર | -૧૩.૮૦ | ૧૪૦.૧૦ | આરમીડિયાવર્લ્ડ | -૨.૯૦ | ૫૫.૪૫ |
| | | | આરમીડિયાવર્ક્સ | -૧૩.૦૫ | ૧૮૭.૦૫ |

**ન્યૂઝ ઇનબોક્સ**

**ઇવાનું કેટવોક**

આર્જેન્ટિનાના બ્યુએનોસ એરિસમાં યોજાયેલા ફેશન શોમાં જાણીતી મોડેલ ઇવા પેરોન વ્હાઇટ બ્યૂટિ બનીને આવી પહોંચી હતી. એપી

### કેન્દ્રીય વિદ્યાલયોમાં સાંસદોનો ક્વોટા યથાવત્ રખાશે

**નવી દિલ્હી:** સંસદમાં ભારે હોબાળા પછી સરકારે કેન્દ્રીય વિદ્યાલયોમાં સાંસદોના ક્વોટાને યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. માનવ સંસાધન વિકાસ મંત્રી કપિલ સિબ્બલે શુક્રવારે રાજ્યસભામાં જણાવ્યું હતું કે હવે સંસદના બન્ને ગૃહોના સદસ્યો કેન્દ્રીય વિદ્યાલયોમાં બે-બે વિદ્યાર્થીઓના નામાંકનની ભલામણ કરી શકશે.

### દેશના પૂર્વી રાજ્યોમાં ભારે વંટોળ સાથે વરસાદ: ૧૫નાં મૃત્યુ

**નવીદિલ્હી:** દેશના પૂર્વી રાજ્યોમાં જોરદાર વંટોળ સાથે ધોધમાર વરસાદને પગલે ૧૫ લોકોના મૃત્યુ નિપજ્યા હતા. જેમાં સૌથી વધુ મૃત્યુ ઉત્તરપ્રદેશમાં નોંધાયા છે. ઉત્તરપ્રદેશના જૌનપુર જિલ્લામાં ભારે વંટોળને લીધે નવ, બલિઆમાં ચાર અને ગાઝીપુર તેમજ વારાણસીમાં એક-એક મૃત્યુ થયા હતા. નવી દિલ્હીમાં પણ વંટોળ ફૂંકાયો હતો. રાજધાનીમાં આજે મહત્તમ તાપમાન ઘટીને ૩૫.૬ ડિગ્રી સેલ્સિયસ હતું.

### સેન્સેક્સમાં ૨૧૮ પોઈન્ટનું ગાબડું

**બિઝનેસ ડેસ્ક. અમદાવાદ**

આંતરરાષ્ટ્રિય બજારમાં મંદીનો માહોલ છવાયેલો રહેતાં રિલાયન્સની તરફેણ કરતો ચુકાદો આવવા છતાં બજારમાં તેની અસર જોવાઇ નહોતી અને સેન્સેક્સ ૨૧૮ પોઈન્ટ ઘટીને ૧૬,૭૬૯ની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૭૩ પોઈન્ટ ઘટીને ૫૦૧૮ની સપાટીએ બંધ રહ્યો હતો. ગ્રીસનું પેકેજ મંજૂર કરવામાં આવ્યું હોવાના સમાચારની કોઈ અસર નહોતી. નવી એવી દહેશત

...અનુસંધાન પાના નં. ૭

**વૈશ્વિક આંકમાં નરમાઇ**

| | |
|---|---|
| અમેરિકા- ડાઉ | -૧૦૫ |
| બ્રાઝિલ-બોવાસ્પા | -૩૮૨ |
| લંડન-ફિત્સીઇ | -૧૦૫ |
| જર્મની-ડેક્સ | -૧૬૭ |
| ફ્રાંસ-કેક | -૧૭૭ |
| સ્પેન-આઇબીએક્સ | -૩૦૭ |
| ઇટાલી-મિબ | -૫૬૪ |
| ગ્રીસ-એથેક્સ | -૪૮ |

### રાજ્યપાલોને મનસ્વીપણે કેન્દ્ર બદલી ન શકે : સુપ્રીમ

કેન્દ્રમાં નવી સરકારની રચના સાથે જ રાજ્યપાલોને બદલવાની પરંપરા અયોગ્ય

**પીટીઆઇ. નવી દિલ્હી**

કેન્દ્રમાં નવી સરકારની રચના સાથે જ રાજ્યપાલોને બદલવાની પરંપરા સાથે અસહમતી દર્શાવતા સર્વોચ્ચ અદાલતે આજે ઠેરવ્યું હતું કે, રાજ્યપાલોને આવી મનસ્વી રીતે દૂર કરી શકાય નહીં. ચીફ જસ્ટિસ કે.જી. બાલાક્રિષ્નનની અગ્રતાવાળી પાંચ જજોની બનેલી બંધારણીય બેંચે શુક્રવારે કહ્યું હતું કે, ગેર વર્તણૂક અથવા અન્ય અનિયમિતતાઓના સ્પષ્ટ કિસ્સાઓ સામે આવે તો જ રાજ્યપાલોને તેમની મુદત પહેલાં હટાવી શકાય નહીં. બેંચે જણાવ્યું હતું કે, રાજ્યપાલોની નિમણૂક

...અનુસંધાન પાના નં.૯

### સોનું ફરી રૂપિયા ૧૮૦૦૦ પાંચ માસના શિખરે પહોંચ્યું

**ભાસ્કર ન્યૂઝ. રાજકોટ, અમદાવાદ**

ઈક્વિટી માર્કેટની અવઢવભરી સ્થિતિના કારણે સલામત રોકાણ ગણાતા સોના-ચાંદીમાં વધી રહેલા વૈશ્વિક મૂડીરોકાણના કારણે બન્ને કિંમતી ધાતુઓમાં આગઝરતી તેજી જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રિય ભાવો પાછળ ઘરઆંગણે પણ સોના-

...અનુસંધાન પાના નં.૯

**સોના-ચાંદીમાં સુધારો**

| શહેર | સોનું | વૃદ્ધિ(રૂ.) | ચાંદી | વૃદ્ધિ(રૂ.) |
|---|---|---|---|---|
| અમદાવાદ | 18075 | 325 | 27900 | 100 |
| રાજકોટ | 17950 | 250 | 27800 | 100 |
| મુંબઇ | 17845 | 375 | 28400 | 135 |
| દિલ્હી | 18110 | 495 | 28165 | 565 |

### ન્યૂયોર્કના ટાઇમ્સ સ્ક્વેરમાં ફરી શંકાસ્પદ વસ્તુ મળી

ટાઇમ્સ સ્ક્વેરના ચાર બ્લોક ખાલી કરાવાયા

**પીટીઆઇ . ન્યૂ યોર્ક**



પાકિસ્તાની મૂળના અમેરિકી ફૈસલ શહેજાદે નિષ્ફળ કારબોમ્બ હુમલો કર્યાના એક સપ્તાહ પછી પર્યટકોના પ્રિય સ્થળ ટાઇમ્સ સ્ક્વેરમાં પોલીસને ફરી શંકાસ્પદ પેકેટ મળી આવતાં વિસ્તારને ફરીથી ખાલી કરાવવામાં આવ્યો હતો. ન્યૂ યોર્કના પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે ૪૫મી સ્ટ્રીટ નજીક શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો હતો. પોલીસે વધુ કોઈ વિગત આપી નથી. આ ઘટનાને પગલે ટાઇમ્સ સ્ક્વેરના ચાર બ્લોક ખાલી કરાવાયા હતા. આ સફેદ રંગનું કૂલર મળી આવતા પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી. જો કે પોલીસે તરત જ હરકતમાં આવી પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી અને જનવ્યવહાર રાબેતા મુજબનો થઈ ગયો હતો.

### સરોગેટ મધર : નાની બનશે પુત્રીનાં બાળકની માતા

**મૃગા કાપડિયા . સુરત**

નવ માસ સુધી ગર્ભની અંદર ઉછરી રહેલા બાળકની દરેક હલનચલનને માત્ર અનુભવવી નહીં પરંતુ માણવી પણ એ એક સ્ત્રીને મળેલી ઈશ્વરીય ભેટ છે. તેથી જ 'મા' બનવાનાં સૌભાગ્ય માટે દરેક મહિલા તડપતી હોય છે. પણ રાજકોટની પ્રીતિ જોષી (નામ બદલ્યું છે) માટે માતા બનવાનું સૌભાગ્ય ભગવાન જન્મથી જ છીનવી ચૂક્યા છે. કારણ પ્રીતિના શરીરમાં જન્મથી ગર્ભાશય ન હોવાથી તેનામાં મા બનવાની ક્ષમતા નહોતી. ત્રણ વર્ષનાં સુખી લગ્નજીવનમાં હવે બાળકના ખિલખિલાટની કમીનો અહેસાસ થઈ રહ્યો હતો. પ્રીતિ મા બનવા માગતી હતી. તેને પોતાનું બાળક જોઈતું હતું. કુદરત સામે લાચાર પ્રીતિ માટે જોકે મેડિક્લ સાયન્સ વાહરે આવ્યું છે.

પોતાની દીકરી જ્યારે મા બનવાની ઈચ્છા ધરાવે અને તે ઈચ્છા માટે દીકરીની મા પોતાનો ગર્ભ ભાડે આપે ત્યારે તે માતાને શું કહેવું? બસ, આવું જ કંઈક પ્રીતિનાં ૪૫ વર્ષીય મમ્મી પોતાની દીકરી માટે કરી રહ્યાં છે. ભગવાને પ્રીતિ પાસેથી ભલે મા બનવાનો અધિકાર છીનવી લીધો પરંતુ પ્રીતિને માતૃત્વ સુખ મળી રહે તે માટે પ્રીતિની મમ્મી 'સેરોગેટ મધર' બનીને તેને મા કહી શકનાર બાળક આપશે. મધર્સ ડે પર આ માને જેટલી

... અનુસંધાન પાના નં.૭

**આજની મેચ**

પાકિસ્તાન વિ. ન્યૂઝિલેન્ડ
સાંજે ૭ વાગ્યે

ઇંગ્લેન્ડ વિ. સાઉથ આફ્રિકા
રાત્રે ૧૧ વાગ્યે

**હવામાન** ભુજ

| મહત્તમ | લઘુત્તમ |
|---|---|
| 40.2°c | 26.2°c |

### નર્મદા નિગમના ડાયરેક્ટર પદે મુકેશભાઈ ઝવેરીની નિમણૂક

કચ્છ માટે અતિ મહત્ત્વના નિગમમાં સ્થાન મળતાં જિલ્લાવાસીઓમાં આવકાર સાથે આનંદ

**ભાસ્કર ન્યૂઝ. ભુજ**

કચ્છ જિલ્લા માટે તાતી જરૂરિયાત સમાન નર્મદા નીરની વહીવટી પ્રક્રિયા જ્યાં થાય છે એવા સરદાર સરોવર નિગમ લિમિટેડ (ગાંધીનગર)માં ભુજના પૂર્વ ધારાસભ્ય મુકેશ ઝવેરીની ડાયરેક્ટર પદે વરણી કરાઈ છે. કચ્છ માટે મહત્ત્વના નિગમમાં સ્થાન મળતાં નર્મદા પ્રશ્નોને અગ્રતા મળશે તેવી અશાઓ સાથે આ નિમણૂકને વધાવવામાં આવી રહી છે.

મળતી વિગતો અનુસાર સરદાર સરોવર નિગમમાં તાજેતરમાં થયેલી નિમણૂકો અંતર્ગત કચ્છી અગ્રણીનો સમાવેશ થયો છે. ભુજના પૂર્વ ધારાસભ્ય અને લિગ્નાઈટ ક્ષેત્રે મહત્વનું પ્રદાન આપનારા ગુજરાત

...અનુસંધાન પાના નં.૭

### આઇફા એવોર્ડ્ઝ-૨૦૧૦માં થ્રી-ઇડિયટ્સને મળ્યા ૧૪ નોમિનેશન

**કદર** ૩ થી પાંચ જૂન દરમિયાન કોલંબોમાં ભવ્ય આયોજન

**ભાસ્કર ન્યૂઝ. મુંબઈ**




ભારતીય ફિલ્મ ઉદ્યોગ માટે બોક્સ ઓફિસ પર ઝમકદાર પરફોર્મન્સના એક વર્ષ સાથે ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેડેમી (આઈફા)એ હવે આઈફા એવોર્ડસ ૨૦૧૦નાં નામાંકનો જાહેર કર્યાં છે. વિડિયોકોન આઈફા વીક એન્ડ અને માઈક્રોમેક્સ આઈફા એવોર્ડસનો સમારંભ આગામી ૩થી ૫ જૂન-૨૦૧૦ દરમિયાન શ્રીલંકાના પાટનગર કોલંબોના સુઘટદાસ સ્ટેડિયમમાં યોજાશે.

આ નામાંકનો માટે માર્ચ મહિનામાં ફિલ્મ ઉદ્યોગમાં લોકમત લેવાયો હતો. તેનું ઓનલાઈન મતદાન ૧૦ મેથી ૧૦જૂન સુધી યોજાશે. તેમાં ભારતીય સિનેમાના દર્શકો મતદાન કરી શકશે. આ મતદાનને આધારે એવોર્ડ વિજેતાઓ નક્કી કરાશે.

ગયા વર્ષની સફળ અને લોકપ્રિય ફિલ્મોમાંથી 'થ્રી ઈડિયટસ', 'વોન્ટડ', 'કમીને', 'પા' અને 'દેવ ડી'ની ઉમેદવારી શ્રેષ્ઠ ફિલ્મની કેટગેરી માટે કરાઈ છે. શ્રેષ્ઠ દિગ્દર્શનના એવોર્ડ માટેના ઉમેદવારો રાજકુમાર હિરાની (થ્રી ઈડિયટસ), અનુરાગ કશ્યપ (દેવ ડી), અયાન

...અનુસંધાન પાના નં.૭



Digitially Archived by: www.realpatidar.com/library

2010-05-08 -Divya Bhaskar -Invitation & Consitution Passed [393]



**શહેરમાં આજે ખાસ** — **હોસ્પિટલ નૂતન સંકુલ લોકાર્પણ**
**ક્યાં :** સરદાર પટેલ સંકુલ, મુન્દ્રા રોડ, ભુજ **સમય :** સાંજે 4.00

# પ્રથમ વર્ષ B.B.A.નું પરિણામ ૮૪ ટકા

ભાસ્કર ન્યૂઝ. ભુજ

ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી દ્વારા માર્ચ માસમાં લેવાયેલી પ્રથમ વર્ષ બી.બી.એ.ની પરીક્ષાનું પરિણામ આજે જાહેર થયું હતું, જેમાં ૮૩.૭૫ ટકા વિદ્યાર્થીઓ સફળતાને વર્યા હતા. કુલ ૨૪૪ છાત્રોમાંથી ૯૧ને પ્રથમ, ૮૨ને દ્વિતીય તેમજ ૨૮ને પાસ ક્લાસ આવ્યો હતો.

કુંજલ ભગત

**વિરાયતનનો પ્રથમ વર્ગમાં પણ શ્રેષ્ઠ દેખાવ**

માંડવી સ્થિત વિરાયતન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટનું પરિણામ ૯૪% સાથે સમગ્ર યુનિવર્સિટીમાં સૌથી વધુ આવ્યું છે. પ્રથમ વર્ગમાં ઉર્તિણ થનારા વિદ્યાર્થીઓ પણ વિરાયતન પ્રથમ છે. ૫૮.૩૩% પ્રથમ વર્ગમાં ૩૫% ઉતિર્ણ થયા છે. કચ્છના વડા સાધ્વીજી શિલાપીજીએ વિદ્યાર્થીઓના સ્ટાફને આ સિદ્ધિ બદલ આવકાર આપ્યો હતો.

ટોપટેનમાં વિદ્યાર્થીનીઓ છવાઇ હતી. સંસ્કાર ઇન્સ્ટિટ્યૂટની સાત અને એસ.આર.કે. ઇન્સ્ટિટ્યૂટની ત્રણ વિદ્યાર્થીનીઓનો સમાવેશ થાય છે.

**ટોપટેન :** ૧. કુંજલ ડાહ્યાલાલ ભગત - સંસ્કાર ઇન્સ્ટિટ્યૂટ, ભુજ, ૨. મેઘના પ્રફુલ્લભાઇ વાઘેલા - એસ.આર.કે., સાપેડા,૩. રિદ્ધિ શરદભાઇ મહેતા - સંસ્કાર ઇન્સ્ટિટ્યૂટ, ભુજ, ૪. નિરાલી સતિષભાઇ પોમલ - સંસ્કાર ઇન્સ્ટિટ્યૂટ, ભુજ, ૫. પૂજા સુરેશભાઇ ભટ્ટ - સંસ્કાર ઇન્સ્ટિટ્યૂટ, ભુજ, ૬. ખુશ્બૂ શરદભાઇ ભાટિયા - એસ.આર.કે., સાપેડા, ૭. હેમાલી સુરેશભાઇ ગોર - સંસ્કાર ઇન્સ્ટિટ્યૂટ, ભુજ, ૮. પ્રીતિ દિલિપસિંઘ તન્વર - એસ.આર.કે., સાપેડા, ૯. મયૂરી કેશવલાલ સોંલકી - સંસ્કાર ઇન્સ્ટિટ્યૂટ, ભુજ, ૧૦. અનિશા જિગરભાઇ છાંગાણી - સંસ્કાર ઇન્સ્ટિટ્યૂટ, ભુજ.

## અંજારમાંથી બાઇકની ચોરી

ભાસ્કર ન્યૂઝ. ગાંધીધામ

અંજારના પોશ વિસ્તાર ગણાતા દેવળિયા નાકે તા. ૫ના ચોરાયેલી બાઇકની શુક્રવારે પોલીસ ચોપડે ફરિયાદ નોંધાવાઇ હતી.

અંજાર પોલીસે જણાવ્યું હતું કે, કપિલ વિશનજી મિસ્ત્રીએ તા. પાંચના પોતાની બાઇક નં. જીજે૧૨એક્યુ ૯૦૯ શહેરના દેવળિયા નાકા પાસે પાર્ક કરી હતી તેવામાં રાત્રિના ૮થી ૮:૩૦ વાગ્યા વચ્ચે તેની ચોરી થઇ ગઇ હતી.

બાઇકની કિંમત રૂ. ૧૫ હજાર આંકવામાં આવી છે.

**'સર્જન' નિહાળતા સંતો...**

તસવીર સમીર ભટ્ટ રાત્રે ૯:૧૫


ભુજના વ્યાયામ શાળા મેદાનમાં જેમના માર્ગદર્શનથી ઉભા થયેલા નરનારાયણ દેવ પ્રદર્શનની ખુદ સ્વામિનારાયણ મંદિરના સંતોએ શુક્રવારે રાત્રે ખાસ મુલાકાત લીધી હતી.


ભાસ્કર classified

**એજ્યુકેશન**

કોમ્પ્યુટર રીપેરીંગ શીખો હાર્ડવેર & નેટવર્કીંગ
એક્ટીવ હાટકેશ કોમ્પલેક્ષ, બીજે માળે, છઠ્ઠીબારી, ભુજ. મો: ૯૮૨૪૨ ૭૧૬૭૬

Admission Open
ધો.10-12 કોમર્સ-આર્ટસ
વિદ્યાનિકેતન
વંડી ફળીયા ચોક, પેરીસ બેકરીની બાજુમાં, ભુજ. M. 98242 52354, Time : 5 to 7

**જોઇએ છે**

જોઈએ છે
ગુજરાતની પ્રસિદ્ધ કંપની રજિ. નં. ૧૮૦૧૨૫૯ ધરાવતી એસ. એસ. ડબલ્યુ. કું. ને ઓફિસ સ્ટાફની જરૂર છે.
● લાયકાત : ૮ પાસ ઉપર
● પગાર : ૬૦૦૦ થી ૮૦૦૦ (કંડીશન એપ્લાય)
આદિપુર : સંપર્ક : ૯૯૭૮૭ ૩૭૧૨૫ ૯૯૭૯૭ ૯૭૩૩૩

જગ્યા ખાલી છે
ઔદ્યોગિક કંપનીને ઓફિસ સ્ટાફ માટે ૧૫ છોકરા-છોકરીઓની ભરતી ચાલુ છે. ડોક્યુમેન્ટ સાથે રૂબરૂ સંપર્ક.
પગાર : ૮૦૦૦ (કંડીશન એપ્લાય)
ઉંમર : ૧૮ થી ૩૦ વર્ષ
અભ્યાસ : ૭ પાસથી ગ્રેજ્યુએટ
Mo : 81412 36736, 89802 11733

**જ્યોતિષ**

શ્રી હનુમાન જ્યોતિષ ૧૦૧% ગેરંટી
પ્રેમલગ્ન, છૂટાછેડા, માંગલિક, કાલસર્પ, યોગ, અણબનાવ, નિઃસંતાન, ઘરકંકાશ, લક્ષ્મી રૂકાવટ, જન્મકુંડલી, લવપ્રોબલેમ, વિદેશ યોગ, ધંધા, મેલીવિદ્યા, વશીકરણ જીવનના તમામ મુંજવતા પ્રશ્નના પૂજાપાઠ વિધિ વિધાંતી નિવારણ માટે મળો
સંપર્ક : જૂની રાજપૂત વંડી, સવાશા ફળિયા ચોક, પ્રવીણભાઇ ડિશવાળાની બાજુમાં, ભુજ. સમય : ૯ થી ૮ સુધી Mo. : 99 13 5656 34 Mo. : 96875 08734

**નામ બદલેલ છે**

CHANGE OF NAME
I POMAL SAROJBEN BHUPENDRAKUMAR R/O: 68, KAMDHENU SOCIETY-3, AT:ANJAR, DIST : KUTCH. PREVIOUSLY KNOWN AS SONI SAROJBALA HARILAL. BUT AFTER MARRIAGE I AM CALLED AND KNOWN AS POMAL SAROJBEN BHUPENDRAKUMAR

**ધંધાકીય**

માંડવી ગણેશ યાત્રા સંઘ
ચાલો શેરડી સાંઇબાબા, સની સીંગ્નાપુર, નાસીક, ત્રબંકેશ્વર, ધુસ્મેશ્વર, ૨ જ્યોતીલીંગ, ઇલોરાગુફા, પાવાગઢ ડાકોર અન્ય
રૂા. ૨૮૫૧ ઉ.તા. ૧૩/૫
થોડી સીટ બાકી
મો : ૯૫૮૬૪ ૩૦૪૮૮

હોટપ્રેસ લેમીનેશન કોલ્ડ લેમીનેશન કલાત્મક ફોટો ફ્રેમીંગ
પદ્માવતી ફ્રેમ એન્ડ લેમીનેશન મો. ૯૮૭૯૨ ૦૩૫૧૧

ઝેરની પડીકી, જંતુનાશક દવા વગરની કેસર કેરી માટે
// સંસ્કૃતિ //
લાલ ટેકરી, ભુજ. ફોનઃ ૨૫૧૫૦૬

રામાપીર ટ્રાવેલ્સ
આજે જ ઉપડશે
કળયુગના અવતારી ગરીબોના બેલી....
રણુજાના રાજા રામદેવપીર દર્શન
માત્ર રામાપીર ભકતો માટે
રૂા. ૫૫૧/ તા. ૮/૫/૧૦
માત્ર ૫ સીટ બાકી (બપોરે ૨ વાગ્યા સુધી બુકીંગ)
સોદાગર - ૯૮૨૫૨ ૫૯૦૨૬

**આપવાનું છે**

ફેન્યાયસી આપવાની છે.
બીઝનેસમેન અને સર્વિસ ક્લાસ માટે,
ફાયનાન્સીયલ ફેન્ચાયસી મેળવી સરકાર માન્યતા,કૌશલ્ય અને આવક વધારો
ઉમર : ૨૫ વર્ષ કે તેથી વધુ
માત્ર ગાંધીધામ,આદીપુર, અંજાર અને તેના ગામડાઓ માટે.
99040 00088

**ખાના ખજાના**

• સ્પે. કેરીનો રસ
• સ્પે. કેસર શ્રીખંડ
• સ્પે. ડ્રાયફુટ શ્રીખંડ
• સ્પે. એલાયચી શ્રીખંડ
તેમજ બંગાળી સ્વીટમાં વેરાયટી તેમજ દુધની તથા ડ્રાયફ્રુટની મીઠાઇઓ.
ખાવડા સ્વીટ એન્ડ નમકીન
જ્યુબીલી ગ્રાઉન્ડ સામે, રાજુભાઇ પુરીશાક વાળાની બાજુમાં, ભુજ.
M. 99253 14603 / 99251 34383

રિલાયન્સ સમર વેકેશન ધમાકા
રિલાયન્સ ઇન્ટરનેટ કનેકશન હવે માત્ર Rs. 1499*માં સાથે ૧ માસ અનલિમિટેડ ફ્રી* !
વરૂણ એન્ટરપ્રાઇઝ
૬-૭, ગોલ્ડન પેલેસ એપાર્ટમેન્ટ, ભુજ. મો. ૯૩૨૮૮ ૦૭૨૭૭

ક્ષત્રિય
જાડેજા, સરવૈયાના બેંકમાં સર્વિસ કરતા ઝાલા, જાડેજા, સરવૈયાના એન્જીનિયર દિકરાઓ તેમજ ૯૦૦ દિકરાઓ અને૧૭૫૦ દિકરીઓના બાયોડેટામાંથી પસંદગી કરવા માટે
ક્ષત્રિય મેરેજ બ્યુરો, 9824237724

KENT
our Stall No. B-9 at KACEA-EXPO-10 EXHIBITION
Dt. 7/5/10 to 9/5/10 Jubilli Ground, Bhuj
Time : 11.00 am to 9.00 pm
Autho. Dealer SHIV ENTERPRISE
Gandhidham : 98252 29405 Bhuj/Mundra : 90999 23924

**ધંધાકિય**
Wheatgrass powder (health product) company wants dealers from home/shop. SMS your address 09922004343 (Pune) for details by post.

**MCX Metals**
Intraday Trading Levels ફક્ત ૩૩૩ દર મહિને - GoldSilverAlert.com - 09920033678

**ધંધાકિય**
યુએસથી ટુંક સમય માટે આવેલ, ૧૯૮૦, ૫'.૩", BBM, સારીજોબ, જૈન યુવકને અમેરિકા સ્થિત/જવા ઇચ્છુક સમકક્ષ કન્યાના વડિલો સંપર્ક. (પાંચ વર્ષ પહેલા કીડની ટ્રાન્સપ્લાન્ટ કરેલ, હાલમાં એકદમ તંદુરસ્ત)(૦૨૨) ૨૬૮૩૫૩૩૦, chinny28@yahoo.com

**જોઇએ છે**
સરકારી નોકરીઓ : અસમ રાઇફલ્સમાં ક્લાર્કોની ભરતી છોકરા/છોકરીઓ યોગ્યા આયુ ૧૮-૨૭, પગાર ૧૪૦૦૦ ફાર્મ ! બુક મંગાવો ૦૮૦૫૪૧-૭૧૧૭૮, ૦૯૮૮૮૮-૭૦૫૨૭, ૦૯૮૮૧-૦૯૨૫૮ (સીસી-૭૯૦૭)

**લોન**
મહિન્દ્રા ફાઇનાન્સીયલ બધી પ્રકારની લોન માત્ર ૩૬ કલાકમાં ૩ ગણા વર્ષનો વ્યાજ, ૩૩ ટકા છૂટ, એજન્ટ આમંત્રણ સંપર્ક : ૦૮૯૫૦૭૨૬૦૦૮, ૦૮૯૫૦૭૨૬૦૦૯ (સીસી ૬૨૨૭)

**લોન**
ન કમીશન, ન ગારન્ટર (૧૯૭૪ થી રજિસ્ટ્રેડ) સાંઇરામ એસોસીએટ કરે છે ! માર્કશીટ, પ્રોપર્ટી, વ્હીકલ, પ્રોજેક્ટ લોન ક્યાં પણ ઘર બેઠાં ૦૯૭૨૮૭ ૭૪૯૨૨, ૦૯૭૨૮૮૩૨૪૦૨ (સીસી-૬૨૨૫)

**જ્યોતિષ**
ખુલ્લો ચેલેન્જ પં.અજય શર્મા ૨૧ મિનિટમાં સમાધાન, મનપસંદ પ્રેમ, લગ્ન, વશીકરણ,લવમેરેજ,ઘરકંકાસ,દુશ્મન થી છુટકારો, જાદુમંત્રર ૦૯૮૧૪૮૨૨૮૩૭, ૦૯૬૪૬૦૯૧૬૫૧.(એજી ૮૨૫૦)

**જ્યોતિષ**
બી. કે. શ્રીમાળી જોધપુર વાળા, ફોન પર ઘર બેઠા ૨ કલાકમાં સમાધાન. લગ્ન, પ્યારમાં દગો, સૌતન, પ્રેમવિવાહ, તલાક પતિ-પત્નીઅણબનાવ.

૦૯૮૧૫૦૬૨૫૫૩, ૦૯૮૭૬૨૪૬૫૨૫ (એજી- ૨૯૦૩૭

**જોઇએ છે**
(ધન નિરંકર જી) સિંગાપુર, ઇટલી, પૌલેંડ, ન્યુઝીલેન્ડ પૈકિંગ કામ કરવા માટે ઇચ્છુક વ્યકિત જનૂં પોતાનૂ પાસપોર્ટ હોય કામ ની પરમીટ ના અમે કોઇ ચાર્જ લેતા નથી , અમારી મ્કબ્પની ી નામે કોઇ ને પૈસા દેવા નહી, એજન્ટો થી સાવધાન , ચુકે માટે અરજી કરો.(Limited Seats ) ISO 9001:2008 Registration CCPL/QMS/C 1227. jet international placement serviece4 SCF - 54; 1st floor; Phase Mohali Phon : 01726574962, 6535739, 9257206579, 9215632332, 9216532333 (AG 7067)

**જોઇએ છે**
મલેશિયા માં પૈકિંગ કામ કરવા માટે ઇચ્છુક વ્યકિત જનૂં પોતાનૂ પાસપોર્ટ હોય કામ ની પરમીટ ના અમે કોઇ ચાર્જ લેતા નથી , અમારી કંપની ના નામે કોઇ ને પૈસા દેવા નહી, એજન્ટો થી સાવધાન , ચુકે માટે અરજી કરો.Good Salary ISO 9001:2008 Registration CCPL/QMS/C 1227. jet international placement serviece SCO - 7 1st floor; Phase Mohali Phon : 0172-5096307, 9780205262, 9872418566 (AG 7065)

**જોઇએ છે**
કેનેડામાં કામ કરવા માટે ઇચ્છુક વ્યકિત જનૂં પોતાનૂ પાસપોર્ટ હોય ને એક વર્ષ સુધી કામ ની પરમીટ સ્પેસીયલ ઓફર નો એડવાન્સ અમે કોઇ ચાર્જ લેતા નથી , અમારી કંપની નામે કોઇ ને પૈસા દેવા નહી,, ચુકે માટે અરજી કરો.Good Salary ISO 9001:2008 Registration CCPL/QMS/C 1227. jet international placement serviece SCO - 54. Phase -6 Mohali Phon : 0172-6535739,6574962, 6537279, 92572-06579, 9216532332, 9216532333.(AG 7066)

**લોન**
લોનધમાકામફ્તઓફર લોન માત્ર ૫ મિનિટમાં ન ફાઇલ ચાર્જ, ન ગેરેન્ટર, માર્કશીટ, પ્રોપર્ટી, છૂટ ૩૩ પ્રતિશત વ્યાજ૦પ્રતિશત(એજન્ટ આમંત્રિત) લક્કી ફાઇનાન્સ ૦૯૦૪૫૯૯૪૫૪૨, ૦૯૦૪૫૯૯૪૫૪૩ ીસીદ૧૮૦)

**જ્યોતિષ**
પંડિત રીતિક શર્મા ઓલ વર્લ્ડ ઓપન ચેલેન્જ ૨૧ મિનિમાંલવમેરેજ,વશીકરણ, મનપસંદલગ્ન,કારોબાર,ઘર કંકાસ, પતિ-પત્ની અણબન, ૦૯૮૭૮૧૩૩૭૧૮(એજી૮૧૨૯)

**લોન**
એબીસીકેપિટલ ફાઇનાંસની લોન સુવિધા નો લાભ ઉપાડો, ઘરે બેઠા ફોન પર લોન મેળવો પ્રમાણપત્ર, ખાનગી,મિલકત્ત ૦૮૯૫૦૭૮૮૧૧૯, ૦૮૯૫૦૮૩૮૨૦૧.(સીસી-૬૧૭૨)

**લોન**
એબીસીકેપિટલ ફાઇનાંસની લોન સુવિધા નો લાભ ઉપાડો, ઘરે બેઠા ફોન પર લોન મેળવો પ્રમાણપત્ર, ખાનગી,મિલકત્ત ૦૮૯૫૦૭૮૮૧૧૯, ૦૮૯૫૦૮૩૮૨૦૧.(સીસી-૬૧૭૨)

**મેડિકલ**
પથરી,ડાયાબિટિશ,વધુ વજન ઘટાડો આર્યુવેદિક વનસ્પતિઓથી આડઅસર વગર ચોક્કસ ફાયદો આર્યુવેદિક બીડી કફના દર્દીઓ માટેઆર્શીવાદરૂપસંર્પકભાનુ શાલીનગર ભુજ.૯૯૨૫૬ ૦૯૯૭૫.

**લોન**
લોન ૭૨ કલાક માં ઘર લોન, એગ્રીકલ્ચર લોન, વ્યાજ ૪ ટકા, છુટ ૩૦ ટકા મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા એન્ટરપ્રાઇજ દિલ્હી.૦૮૯૫૦૪૮૪૧૫૯,૦૮૯૫૦૭૦૧૯૭૯ (સીસીદ૧૮૯)

**લોન**
લોન ૪૮ કલાક માં ઘર બેઠા માર્કશીટ,ઘરલોન, એગ્રીકલ્ચર લોન, વ્યાજ ૪ ટકા, છુટ ૩૦ ટકા પેરાડાઇજ એન્ટરપ્રાઇજદિલ્હી.૦૮૯૫૦૨૮૫૬૯૨,૦૮૯૫૦૪૮૭૬૪૩(સીસીદ૧૯૦)

**લોન**
૨૦ વર્ષજુની કંપની લોન ૪૮ કલાક માં ઘર બેઠા માર્કશીટ, ઘર લોન, એગ્રીકલ્ચર લોન, વ્યાજ ૪ ટકા, છુટ ૨૫ ટકા ભવાની એન્ટરપ્રાઇજ દિલ્હી.૦૮૯૫૦૬૪૪૪૩૫ ૦૮૯૫૦૬૪૪૪૫૩ (સીસી-૬૧૯૧)


# રાજકીયક્ષેત્રે યુવાનોને આગળ વધવા હાકલ

ગઢશીશા ખાતે શેઠિયા, પરવાડિયા, ભીમાણી પરિવારોના સંમેલન યોજાયું

ભાસ્કર ન્યૂઝ. ગઢશીશા

રાજકીય ક્ષેત્રે યુવાનોને આગળ આવવા શેઠિયા, પરવાડિયા, ભીમાણી પરિવારોના સ્નેહમિલનમાં અગ્રણીઓ દ્વારા હાકલ કરાઇ હતી.

કચ્છ કડવા પાટીદાર ભીમાણી, પરવાડિયા વટવૃક્ષ જેવા શેઠિયા પરિવારના ત્રિદિવસીય દ્વિતીય સ્નેહમિલનમાં વિશ્રામનગર ખાતે ઉત્સવ વર્તાઇ રહ્યો છે. કચ્છ બહાર અને દેશ-વિદેશમાં વસતા પાંચ હજાર જેટલા પરિવારજનોએ મહોત્સવમાં હાજરી આપી મહોત્સવને દીપાવ્યો છે. ગઇકાલ બપોરના સત્રમાં પ્રાસલા આશ્રમના સંત ધર્મબંધુજીએ પુરુષાર્થલક્ષી પ્રભાવશાળી પ્રવચન કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. આજે પરિવારના ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ યુવા ભાઇ-બહેનો તેમજ વિવિધક્ષેત્રે સિદ્ધિઓ હાંસલ કરનારાઓનું વિશિષ્ટ સન્માન કરાયું હતું. સાથે વયવંદના કાર્યક્રમ પણ યોજાયો હતો. જેમાં પરિવારના ૭૦ વર્ષથી ઉપરની વયના વડીલોનું અભિવાદન કરાયું હતું.

આ પ્રસંગે ધીરજભાઇ પટેલ, રાજકોટ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના માજી ચેરમેન અને ભારતીય કિસાન સંઘના રાજકોટ જિલ્લાના મહામંત્રી ધીરુભાઇ મોરબીવાળા, ગુજરાત પ્રદેશ કિસાન સંઘ માજી ઉપપ્રમુખ વિઠ્ઠલભાઇ ભીમાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા. શાંતિભાઇ ભીમાણી, બાગાયતક્ષેત્રે પ્રગતિશીલ ખેડૂત દેશ-વિદેશની ખેડૂત શિબિરોમાં ભાગ લેનાર કાંતિભાઇ રવજી ભીમાણી સહિતના સિદ્ધિઓ હાંસલ કરનારા અગ્રણીઓનું સન્માન કરાયું હતું. જ્યોતિષ વિષય પર આચાર્યની પદ્વી મેળવનારી મંગવાણાની પુત્રવધૂ અને પરિવારની દીકરી અરૂણાબેન મયુર ભીમાણીએ નવગ્રહોની ઓળખ આપતાં અંધશ્રદ્ધાને દૂર કરવાના પ્રયાસરૂપ જ્યોતિષ અને જ્યોતિષના માધ્યમથી સમાજસેવાની વાત કરી હતી. ગઇકાલ રાત્રે પરિવારના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો, આજે રાત્રે ૯.૦૦ કલાકે નામાંકિત કાનગોપી ગ્રૂપ, સોયત્રા તા.ઉપલેટા દ્વારા કૃષ્ણલીલા રજૂ કરાશે. ગઇકાલ સમૂહ પ્રસાહના દાતા શિવજી નાનજી ભીમાણી પરિવાર હસ્તે વિઠ્ઠલભાઇ, કલ્યાણપર (ભચાઉ) અને આજના બીજા દિવસના સમૂહ પ્રસાદના દાતા નર્મદાબેન જેઠાલાલ વેલજી ભીમાણી પરિવાર ગામ : મંગવાણા હાલે ઘાટકોપરવાળા રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન શાંતિભાઇ શિવજી ભીમાણી, કાંતિભાઇ ધનજી ભીમાણી, શાંતિભાઇ કરશન પરાવડિયા અને હિતેશભાઇ વાલજી ભીમાણીએ કર્યુ હતું. મહોત્સવને સફળ બનાવવા પરિવારજનો અગ્રણી કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.

રવિભાણ આશ્રમ મોટી વિરાણી મહંત શાંતિદાસજી બાપુ, ચંદુમાં તેમજ જનકમાંએ આશીર્વચન આપ્યાં હતાં. પરિવારના વસતી ગણતરી ગ્રંથનું વિમોચન તેમજ વેબસાઇટનો પ્રારંભ કરાયો હતો. પરિવારના પ્રમુખ ગોવિંદભાઇ, જયંતીભાઇ દેવજીભાઇ, દામજીભાઇ, મોહનભાઇ પરાવાડિયા, સામજીભાઇ પરાવડિયા, નરશીભાઇ, મગનભાઇ રાજેશભાઇ ખાસ હાજર રહ્ય હતા.

# શ્રેષ્ઠ કામગીરી બદલ પોલીસ સ્ટાફનું સન્માન

ભુજમાં વિશ્વકર્મા મંચ દ્વારા કરાયું આયોજન

ભાસ્કર ન્યૂઝ. ભુજ

ભુજ તાલુકા પી.એસ.આઇ. બળવંતસિંહ ચાવડાનું સન્માન કરતા મહેશભાઇ પિત્રોડા.

ભુજમાં સ્વર્ણિમ ગુજરાત ઉજવણી નિમિત્તે યોજાયેલા વિશિષ્ઠ પોલીસ સન્માન કાર્યક્રમના ભાગ રૂપે કચ્છ વિશ્વકર્મા યુવા મંચ દ્વારા પોલીસ સ્ટાફના અધિકારીઓ અને કર્મચારીઓને સન્માનાયા હતા.

ડી.વાય.એસ.પી. એ.જે.ગોહિલ, પી.આઇ. બળવંતસિંહ ચાવડા, પી.એસ.આઇ. મલેક, હે.કો.નરેન્દ્રસિંહ જાડેજા, ઇમતિહાઝભાઇ, હસમુખ પરમાર, રમેશ મહેશ્વરીનું સ્વાગત અને મોમેન્ટો અર્પણવિધિ કચ્છ વિશ્વકર્મા યુવા મંચ તરફથી રતિલાલ સુથાર, કિશોર પરમાર, હર્ષદ પિત્રોડા, મનોજ લુહાર, વિજય પિત્રોડા, વિપુલ રાઠોડ, મહેશ પિત્રોડા, મેહૂલ પિત્રોડા, વિનુભાઇ પિત્રોડા, રજનીકાંત પિત્રોડા, હિતેન પિત્રોડા, રમેશ પરમાર, નરેન્દ્ર પંચાલ, ભગવાનદાસ પંચાલ, છગન પંચાલ, લક્ષ્મીકાંત પિત્રોડા, પ્રવિણ સુથારે કરી હતી.

આ પ્રસંગે પી.એસ.આઇ. રાઠોડનું સન્માન ગૌરક્ષક સેવા સમિતિ વતી ગાંધીધામના પુરૂષોત્તમભાઇ રાજગોરે શિલ્ડ અને રતિલાલ સુથારે પ્રમાણપત્ર દ્વારા કર્યુ હતું.

**સ્વર્ણિમ રેલી...**

તસવીર રાહુલ દાવડા


ગુજરાત સ્થાપના દિવસે મુન્દ્રા ખાતે વૈવિધ્યસભર ઉજવણી કરાઇ હતી. ભાજપ દ્વારા યોજાયેલી બાઇક રેલીમાં મુન્દ્રાના ધારાસભ્ય રમેશભાઇ મહેશ્વરી, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ગિરીશભાઇ છેડા તથા અન્ય હોદ્દેદારો કાર્યકરતો જોડાયા હતા.


Tours & TRAVELS
Contact for Advt : Bhuj - 9909059339 G'Dham - 9909917277

METRO TRAVELS
International & Domestic Air Ticket, Railway Ticket, Booking, Hotel Reservation, Passport, & Visa Formalities
બેંક ઓફ બરોડાની બાજુમાં, સ્ટેશન રોડ, ભુજ-કચ્છ. ફોન : 229751, મો. 9979714426, 9428895395

શ્રી હરી ટ્રાવેલ્સ
ટૂર ઓર્ગેનાઇઝર તથા બસ, 3x2, 2x2, 56 સીટ લકઝરી બસ આપના શુભ પ્રસંગોમાં ભાડેથી મેળવવા માટે સંપર્ક કરો.
ગાયત્રી ચાર રસ્તા, એસ.ટી. સ્ટેશન રોડ, અંજાર(કચ્છ)
હરીભાઇ સોરઠીયા : મો. ૯૮૨૪૪૨૬૫૩૬

સેટેલાઇટ ટ્રાવેલ્સ
ડેઇલી સર્વિસ : અમદાવાદ, જામનગર, વડોદરા, મુંબઇ, આણંદ, વિદ્યાનગર, પાલનપુર, ઉંઝા, વિસનગર, નાશિક, શિરડી
અમારે ત્યાં કાર તથા 3x2, 2x2 બસ વ્યાજબી ભાવે ભાડે મળશે.
•રેલ્વે બુકિંગ •એર બુકિંગ •બસ બુકિંગ
બસ સ્ટેન્ડ પાસે, અંજાર(કચ્છ)
૦૨૮૩૬-૨૪૨૮૨૦ મો. ૯૮૨૫૧ ૮૪૬૩૮
2x2 સ્લીપીંગ, વોલ્વો, એ.સી. લકઝરી

સોનલ ટ્રાવેલ્સ કન્સલ્ટન્સી
મો. ૯૭૨૪૮૬૮૪૮૬/૯૯૭૮૭ ૬૮૨૮૨
બુકિંગ
● એર ટિકિટ
● રેલવે ટિકિટ
● દરેક ટ્રાવેલ્સની લકઝરી બસની ટિકિટ તથા બસ ભાડેથી મળશે
● ટેકસી ભાડેથી મળશે
ગાયત્રી કોમ્પલેક્સ, ડો. રાવ હોસ્પિટલ નીચે, હોસ્પિટલ રોડ, ભુજ, ફોન : (૦૨૮૩૨) ૨૨૦૦૭૭

શ્રી હરિ શ્રી સ્વામિનારાયણ ટ્રાવેલ્સ એજન્સી
માંડવી-ભુજ થી અમદાવાદ-આણંદ-નડીયાદ-વિદ્યાનગર-વડોદરા
મુન્દ્રા-અંજાર-આદીપુર-ગાંધીધામથી અમદાવાદ નડીયાદ-આણંદ-વિદ્યાનગર-વડોદરા ડેઇલી સર્વિસ
ભુજ થી બરોડા પાર્સલ સર્વિસ ચાલુ છે.
મુન્દ્રા : ૭૦૯૯૯ ૪૩૦૭૫, ૯૮૭૯૦ ૮૦૮૦૮
અંજાર : ૭૦૯૯૯ ૪૩૦૭૪, ૨૪૨૮૨૦
ગાંધીધામ : ૭૦૯૯૯૪૩૦૭૩, ૯૮૨૫૮૦૪૭૦૩, ૨૨૨૩૧૩
માંડવી : ૭૦૯૯૯ ૪૩૦૭૭, ૨૨૩૩૫૩
ભુજ : ૭૦૯૯૯ ૪૩૦૭૦, ૯૮૨૫૮ ૦૪૭૬૩
અમદાવાદ : ૭૦૯૯૯ ૪૩૦૭૧, ૯૮૨૫૮ ૦૪૭૬૨
લકઝરી બસો ભાડેથી મળશે

Apply For PR
CANADA AUSTRALIA DENMARK UK
Send Your Resume To Check Your Eligibility
IELTS Training Center
SHREE SAI IMMIGRATION
303, Paras Appartment, Hospital Road, Bhuj. Ph. 258731
e-mail : enquiryatssi@gmail.com

ભારત ટ્રાવેલ્સ એજન્સી
લગ્ન પ્રસંગે, યાત્રા, પ્રવાસ માટે ૨×૨, ૩×૨ લકઝરી બસ, સ્કોર્પિયો, તુફાન તથા અન્ય ગાડી ભાડેથી મળશે.
ડીવીડી કોચ તથા આરામદાયક સિટીંગ સાથે.
ભુજ શોપ નં. ૭, શેવંતી કોમ્પલેક્સ, જિલ્લા પંચાયત સામે, ભુજ. મો. ૯૨૨૭૩૨૭૭૪૬
અંજાર શોપ નં. ૧, જીઇબી લાઇન ઓફિસની પાછળ, હોટલ ગુડી સામે, દેવળીયા નાકા, અંજાર. મો. ૭૫૧૨૪૧૧૧૮૯
માંડવી શ્યામજી કૃષ્ણવર્મા સંકેત સામે, બંદર રોડ, માંડવી. મો. ૯૮૨૫૩૬૭૨૨૫
અજીજભાઇ-૯૯૨૫૭ ૦૫૯૮૦
રહેમતુલ્લાભાઇ-૯૭૨૭૮ ૬૭૪૪૨

શ્રી સહજાનંદ ટ્રાવેલ્સ
હેડ ઓફિસ અમદાવાદ ૯૮૨૫૮૦૧૩૫૪/૨૬૫૭૫૯૮૮ સેટેલાઇટ : ૬૫૨૫૭૩૪૭
ભુજ : V.D. - 222437
ભુજ : S.T. - 222236
ગાંધીધામ:227328/29
મુન્દ્રા : 224239
માંડવી : 223611
ડેઇલી સર્વિસ : VOLVO બસ સવારે ૮ વાગ્યે, બપોરે ૧૨:૩૦, ૩:૦૦, રાત્રે ૯, ૯:૧૫, ૯:૩૦, ૧૦:૦૦, ૧૦:૩૦
જામનગર-અમદાવાદ-આણંદ-વિદ્યાનગર-બરોડા-મુંબઇ-પુના-નાસિક-સીરડી-સુરત


### ઇ-રજિસ્ટ્રેશનના પાઇલોટ પ્રોજેક્ટ હેઠળ

# નખત્રાણા ખેડૂત ખાતેદારની ફિંગરપ્રિન્ટ-ફોટોગ્રાફી થશે

તાલુકાના ૧૨૯ ગામમાં પાંચ ટીમ બાવન હજાર ખેડૂતોની મોજણી કરશે

ભાસ્કર ન્યૂઝ. ભુજ

રાજ્યભરમાં શરૂ થઇ રહેલા ઇ-રજિસ્ટ્રેશનના પાઇલોટ પ્રોજેક્ટ હેઠળ કચ્છમાં નખત્રાણા તાલુકાને પસંદ કરવામાં આવ્યો છે, ત્યારે તાલુકાના ૧૨૯ ગામોમાંથી બાવન હજાર જેટલા ખેડૂત ખાતેદારોની ફોટોગ્રાફી અને ફિંગરપ્રિન્ટ લેવાની કામગીરી માટે તંત્ર સજ્જ થયું હતું.

નખત્રાણાના મામલતદાર બી. આઇ. ભગલાણીએ આ અંગે તાલુકાના તલાટીઓને ઘનિષ્ઠ આયોજન કરવાની જરૂરિયાત સાથે આ ક્રાંતિકારી પ્રોજેક્ટ તૈયાર કરવાની ટીમ જ્યારે ગામમાં આવે ત્યારે ખેડૂત ખાતેદારોની યાદી મુજબ ડેટા ઇનપુટ શીટની વિગતો ખેડૂતો પાસેથી ભરાવવા જણાવ્યું હતું. જરૂરી વિગતો ભરાઇ ગયા બાદ કિસાન ખાતેદારો ફોટો અને આંગળાની છાપ પણ ટીમ દ્વારા લેવામાં આવશે તેમ મામલતદારે જણાવ્યું હતું. દરેક ગામમાં પંચાયત કચેરી અથવા પ્રાથમિક શાળાના મકાનમાં અનુકૂળ જગ્યાએ આ પાઇલોટ પ્રોજેક્ટ હેઠળ કામગીરી કરવાની હોવાથી પદાધિકારીઓ કિસાન સંગઠન અને તલાટીઓ દ્વારા આ અંગે આગોતરું આયોજન કરવામાં આવનારું છે. તા. ૭મેથી શરૂ થયેલો આ કાર્યક્રમ આગામી ૨૮ મે સુધી ચાલશે, જેમાં જુદી જુદી પાંચ ટીમો આ પાઇલોટ પ્રોજેક્ટ હેઠળ કામ કરશે.

**કચ્છ સિનેમા**

**ભુજ - સુરમંદિર**
હાઉસફૂલ 12.45,3.30,6.30,9.40
**રવિ**
રાતકા પ્યાર 11.30, 1.15, 3.30,7.00, 8.45
**મોર્ડન**
બદમાશ કંપની 12.45, 3.30, 6.30, 9.45
**સેવન સ્કાય મલ્ટીપ્લેક્સ**
બદમાશ કંપની 12.45, 3.45, 6.45, 9.45
હાઉસફુલ 12.30, 3.30, 6.30, 9.30
**માધાપર-સિતારા**
હાઉસફૂલ 12.45, 3.45, 6.45, 9.45
**ગાંધીધામ - ઓમ સિનેપ્લેક્સ**
સ્ક્રીન: ૧
હાઉસફુલ 12.45,3.45, 6.45,10.00
સ્ક્રીન: ૨
બદમાશ કંપની12.30, 3.45, 6.45, 10.00
**મધુબન**
બદમાશ કંપની12.30, 3.30, 6.30, 9.30
હાઉસફુલ 12.30, 3.30, 6.30, 9.30
ગેમર 12.45, 3.45, 6.45, 9.45
**વિનય-આદિપુર**
હાઉસફુલ 10.30,1.15, 9.45
બદમાશ કંપની 3.45, 6.45

realpatidar.com
Digitially Archived by: www.realpatidar.com/library

# જીવનમાં પાણી અને વાણી સમજણથી વાપરવા હાકલ

realpatidar.com

**ભુજ સ્થિત રાવલવાડી મધ્યે ૨૦ લાખ પાણીનો સંગ્રહ કરી શકે તેવો ટાંકો અને આરઓ પ્લાન્ટ લોકાર્પણ કરાયા**

ભાસ્કર ન્યૂઝ. ભુજ

ભુજમાં નવ નિર્માણ પામેલા નરનારાયણ દેવ નૂતન મંદિરના ઉપલક્ષમાં યોજાનારા મહોત્સમાં લાખો ભાવિકો દેશ પરદેશથી ઉમટવાના છે. જેના અંતર્ગત પાણીની વ્યવસ્થા માટે ઘનશ્યામ રાવલવાડીમાં ૨૦ લાખ લિટર પાણીનો સંગ્રહ કરી શકે તેવા વિશાળ અંડર ગ્રાઉન્ડ ટાંકાનું પૂજન કરી ત્યાં સેટ-અપ કરાયેલા આરો પ્લાન્ટનું પૂજન કરી ફિલ્ટર પ્લાન્ટને મહંત સ્વામીએ ખુલ્લો મુખ્યો હતો.

આ અવસરે મહંત પુરાણી સ્વામી ધર્મનંદનદાસજીએ છેલ્લા ત્રણ માસથી પાણીની વ્યવસ્થામાં જોડાયેલા સંતો અને હરિભક્તોના કાર્યને બિરદાવી જણાવ્યું હતું કે, જીવનમાં પાણી અને વાણી સમજણથી વપરાય તો શ્રીજી મહારાજ આપણા પર રાજી થાય. આ કાર્યક્રમમાં સ્વામી પ્રેમપ્રકાશદાસજી, સ્વામીસનાતનદાસજી, પાર્ષદ જાદવજી ભગત, સ્વામી કૃષ્ણ પ્રકાશદાસજી, કોઠારી પ્રેમજીભાઈ રાઘવાણી, કોઠારી રવજીભાઈ ભૂડિયા, પુરુષોત્તમબાપા (નળીયાદ વાળા), તેમજ સુખપર, માનકૂવા, રામપર વેકરા અને માંડવીના યુવાનો અને વડીલો લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

ઘનશ્યામવાડીમાં આર.ઓ. પ્લાન્ટનું પૂજન કરતા મહંત સ્વામી. મયૂર ચૌહાણ

સ્વામિનારાયણ નગરમાં આવેલા સહજાનંદ સભામંડપમાં નવ નવ દિવસ સુધી ચાલનારા કથા મહોત્સવ દરમિયાન લાખેલાખ શ્રોતાગણને આરો પ્લાન્ટથી ફિલ્ટર કરાયેલું પાણી અને પ્રાકૃતિક રીતે ફિલ્ટર કરાયેલ પાણી દરેક શ્રોતાગણને મળી શકે તેવી વ્યવસ્થા કરાઇ છે. તેમજ પાણીની વ્યવસ્થા માટે ૨૦,૦૦,૦૦૦ લિટર પાણીનો સંગ્રહ કરી શકે એવો વિશાળ અંડરગ્રાઉન્ડ ટાંકો બનાવાયો છે. આ ટાંકામાં પાણી સતત ભર્યું રહે તેના માટે બોરવેલ અને ટેન્કરોની વ્યવસ્થા કરાઇ છે. આ ટાંકામાંથી કલાકમાં ૧૦,૦૦૦ લિટર પાણી ફિલ્ટર થઇ શકે એવા બે આરો પ્લાન્ટ સેટઅપ કરાયા છે. આ આરો પ્લાન્ટ સતત ૨૩ કલાક પાણી ફિલ્ટર કરતું રહેશે. કેવળ ૧ કલાક બંધ રહેશે અને એ દરમિયાન વોટર સપ્લાયની સમિતિમાં નિયુક્ત થયેલા યુવાન હરિભક્તો અને કુશળ કાર્યકરો આ પ્લાન્ટ સાફ કરશે. આવશ્યકતા પ્રમાણે બીજા પણ આરો પ્લાન્ટ અને પ્રાકૃતિક ફિલ્ટર પ્લાન્ટ બેસાડવાની યોજના કાર્યરત છે.

મંદિરના ઉપલક્ષમાં આયોજિત આ મહોત્સવમાં વિશ્વભરમાંથી જ્યારે માનવ મહેરામણ ઉમટશે ત્યારે એ સર્વે ભક્તજનોને પાણી અને પ્રસાદીની વ્યવસ્થા માટે અદભૂત વ્યવસ્થા ઉભી કરાઇ છે. વોટર સપ્લાયની લાઇનોથી (ઘનશ્યામવાડી) લગભગ આખી ચીતરાઇ ગઇ છે અને વોટર સપ્લાયની લાઇનો પ્રદર્શન વિભાગમાં અને છેક સભાખંડમાં અને છેલ્લે મંદિર સુધી વિસ્તરેલી છે.

રાવલવાડી વિસ્તારમાં પ્રસાદની વ્યવસ્થા માટે પાણીની મોટી જરૂરિયાત હોઇ અને એમના માટે વોટર સપ્લાય સમિતિના કન્વીનર પુરાણી સ્વામી નિષ્કામચરણદાસજી અને સ્વામી અક્ષરવિહારીદાસજીની સુઝબુઝ પ્રમાણે ૨૦,૦૦૦ મીટરથી વધારે પાઇપલાઇનો બીછાવાઇ છે. સ્વામી રાધારમણદાસજીએ જણાવ્યું હતું કે, ત્રણ ત્રણ ટ્રકો પાઇપની મંગાવેલી છે.

સખત ગરમી હોવાને કારણે પાણીની જરૂરિયાત બહુ રહેશે એ ધ્યાનમાં રાખીને પ્રાકૃતિક ફિલ્ટર પ્લાન્ટ અને આરો પ્લાન્ટની બંને અલગ અલગ લાઇનો બીછાવવા માનકુવા, રામપર વેકરા, માંડવી સુખપર વગેરે ગામોના સમર્પિત યુવાનો અને વડીલો અને પ્લંબર નિષ્ણાતોએ પોતાની ચતુરાઇ યોજના ઘડી અને લાઇનો પાથરી છે.

ચાલો ભુજ... ચાલો ભુજ... ચાલો ભુજ
કચ્છી લેવા પટેલ જ્ઞાતિજનોને જાહેર નિમંત્રણ
જ્ઞાતિબંધુઓ... ચાલો, વૈશ્વિક સ્તરે હરણફાળ ભરી અપ્રતિમ સંગઠનના સર્જક આપણે સૌ એકતાને ફરીવાર માંજીએ.. એક એક જ્ઞાતિજનના મન બાંધી ભવિષ્યને ઉજમાળીએ.
શ્રી કચ્છી લેવા પટેલ સમાજનું અસ્મિતા પર્વ

તા. ૮/૫/૨૦૧૦, શનિવાર
હોસ્પિટલ નૂતન સંકુલ લોકાર્પણ : સવારે ૯:૦૦ થી ૧૨:૦૦
ઉદ્ઘાટા : પ.પૂ. પુરાણી મહંત સ્વામી ધર્મનંદનદાસજી સ્વામી - મહંતશ્રી સ્વામિનારાયણ મંદિર-ભુજ
● મા.શ્રી પરબતભાઇ પટેલ, રાજ્યમંત્રી (આરોગ્ય વિભાગ ગુજરાત રાજ્ય)
● મા.શ્રી વાસણભાઇ આહિર - મંત્રીશ્રી, સમાજ કલ્યાણ ગુજરાત રાજય
● મા.શ્રી કેશવલાલભાઇ પ્રેમજી પટેલ - હોસ્પિટલ નૂતન સંકુલ નિર્માણના શ્રેષ્ઠીવર્ય દાતાશ્રી
સમારંભ અધ્યક્ષ : મા.શ્રી અરજણભાઇ ગાંગજી પિંડોરિયા - પ્રમુખશ્રી કચ્છી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ-ભુજ
જ્ઞાતિ સમૂહભોજન : બપોરે ૧૨:૩૦
સાંસ્કૃતિક કાર્યક્રમ તથા શ્રેષ્ઠીવર્ય દાતાશ્રીઓનું સન્માન: બપોરે ૩:૦૦ થી ૬:૦૦
કન્યા સંસ્કારધામ તેમજ માતૃશ્રી આર. ડી. વરસાણી કુમાર વિદ્યાધામના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ
અતિથિ વિશેષ : મા.શ્રી રામજીભાઇ કરમશી નાકરાણી - પ્રમુખશ્રી, અ.ભા.ક.ક.પા. સમાજ ● મા.શ્રી મુલજીભાઇ લાલજી પિંડોલીયા-કુંદનપર
● મા.શ્રી શીવજીભાઇ જાદવા પરબત વરસાણી - નારણપર ● મા.શ્રી કરસનભાઇ રવજી કારા - દહિંસરા
તા. ૯/૫/૨૦૧૦, રવિવાર
લેવા પટેલ જ્ઞાતિજનોનું સંમેલન : સવારે ૯:૦૦ થી ૧૨:૦૦
સમારંભ અધ્યક્ષ : મા.શ્રી હરિભાઇ કેશરા હાલાઇ - પ્રમુખ, શ્રી કચ્છી લેવા પટેલ સમાજ - ભુજ
મુખ્ય મહેમાન : મા.શ્રી કેશુભાઇ પટેલ (લેવા પટેલ જ્ઞાતિના મોભી તથા પૂર્વ મુખ્યમંત્રીશ્રી ગુજરાત રાજય)
અતિથિ વિશેષ : ● મા.શ્રી કેશવલાલ પ્રેમજી પટેલ -ફોટડી ● મા.શ્રી કરશનભાઇ પ્રેમજી ભુડિયા - સુખપર રોહા
● મા.શ્રી રામજીભાઇ દેવજી વરસાણી-સામત્રા ● મા.શ્રી લક્ષ્મણભાઇ ભીમજી રાઘવાણી - બળદિયા
● મા.શ્રી દેવશીભાઇ કરશન હાલાઇ - ગોડપર ● મા.શ્રી વિશ્રામભાઇ જાદવા મેઘજી વરસાણી-ભારાસર ● જ્ઞાતિ સમૂહભોજન : બપોરે ૧૨:૩૦
નિમંત્રક
● શ્રી કચ્છી લેવા પટેલ સમાજ-ભુજ
● શ્રી કચ્છી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ-ભુજ
● શ્રી કચ્છી લેવા પટેલ યુવક સંઘ-ભુજ
સ્થળ
સરદાર પટેલ સંકુલ, ભુજ-મુન્દ્રા રોડ, ભુજ-કચ્છ
સૌજન્ય
KENFORD UK ● માવજી ધનજી જાદવા વેકરિયા (બળદિયા)
KAYBALT ● કે. કે. પટેલ સામત્રા હાલે નૈરોબી
● કેનન એલ્યુમિનિયમ પરબતભાઈ લાલજી પિંડોરિયા -સુખપર(રોહા)
● અ.નિ. કાનજીભાઈ પ્રેમજી જેઠા ભુડિયા હ. કેશવલાલભાઈ

# માતૃદિને મહિલા સંસ્થાઓ દ્વારા ભુજમાં અનોખો રોડ શો

**બેબી જોલી આંખે પાટા બાંધી બાઇક ચલાવશે**

ભાસ્કર ન્યૂઝ. ભુજ

બેટી બચાવો અભિયાન હેઠળ મધર્સ ડેના ઉપલક્ષમાં રવિવારે ભુજ આવેલી દુનિયાની સૌથી નાની વયની જાદુગર બેબી જોલી આંખે પાટા બાંધી શહેરભરમાં બાઇક ચલાવશે. ભ્રુણહત્યા કરતા અને કરાવતા હત્યારાઓની આંખો ખોલવા યોજાનારી રેલી અંગે ઓપન થિયેટર ખાતે વિવિધ મહિલા સંસ્થાઓની મળેલી બેઠકમાં ભુજ તાલુકા કુટુંબ અને બાલ કલ્યાણ સમિતિ સંચાલિત કુટુંબ સલાહ કેન્દ્ર પી.એન.ડી.ટી. એક્ટ જિલ્લા પંચાયત, વડનગરા નાગર મહિલા મંડળ, કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર, સહારા મહિલા મંડળ, સખી મહિલા મંડળ, શ્રદ્ધા મહિલા વિકાસ ટ્રસ્ટ, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર, અજરામર મહિલા મંડળ, અેરા. આર.પી. મહિલા ગૃહઉદ્યોગ, લાયોનેશ કલબ, ઇન્નરવ્હીલ કલબ, માહેશ્વરી મહિલા સમાજ, જાગૃતિ મહિલ મંડળ, ઇન્દિરા ક્લબ, નરસિંહ મહેતા નગર મહિલા મંડળ વગેરેના સભ્યો બેનરો સાથે રોડ શોમાં જોડાશે. સવારે ૭.૩૦ કલાકે મહાદેવ નાકે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે બેબી જોલીને આંખે પાટા બાંધીને બાઇક રેલીને સ્ટાર્ટ આપવામાં આવશે. જે હજુ પણ મહિલા સંસ્થાઓ જોડાવવા માગતી હોય તેમને મોબાઇલ નં.૦૯૪૨૮૭ ૨૬૦૦૬નો સંપર્ક કરવા જણાવાયું છે.

**કયા રૂટ પર ફરશે**

આંખે પાટા બાંધી બાઇકથી બેટી બચાવ અભિયાન રેલી, ગાંધીજીની પ્રતિમાથી પસાર થઇ ઓલ્ફ્રેડ હાઇસ્કૂલ, એસટી બસ સ્ટેન્ડ, વાણિયાવાડ, મહેરઅલી ચોક, અપના બજાર, શરાફ બજાર, જૂની શાકમાર્કેટ, દરબાર ગઢ, પારેશ્વર ચોક, હાટકેશ્વર મંદિર, મહાદેવ નાકે, હમીરસર તળાવ, રાજેન્દ્ર પાર્ક, ગાયત્રી મંદિર, નવી રાવલવાડી, હિલગાર્ડન, મુન્દ્રા રિલોકેશન, આરટીઓ રિલોકેશન, ફાયર સ્ટેશન, આત્મારામ સર્કલ, ભીડ બજાર, સ્ટેશન રોડ, બીએમ પંપ, એસટી બસ સ્ટેન્ડ, ઓપન થિયેટર પર પૂર્ણ થશે.

આદીપુરમાં રાજકોટની પ્રખ્યાત ડે એન્ડ રેસીડેન્ટ પબ્લીક સ્કૂલ
શ્રી આર.બી. સાયન્સ સ્કૂલ-રાજકોટ દ્વારા
ફ્રિ સેમીનાર / પ્રવેશ પરિક્ષા
ધો. ૩ થી ૧૨ના બાળકોને અભ્યાસલક્ષી માર્ગદર્શન માટે ફ્રી સેમીનારનું આયોજન કરેલ છે તેમજ પ્રવેશ પરિક્ષા રાખેલ છે.
૧૦ વિઘા જગ્યામાં વિસ્તરેલી આધુનિક સગવડતા ધરાવતી શૈક્ષણિક સંસ્થા તેમજ ધો. ૧૦ અને ૧૨માં ઉચ્ચતમ ઝળહળતું પરિણામ આપતી એકમાત્ર શાળામાં પ્રવેશ મેળવવા આજે જ સંપર્ક કરો / રૂબરૂ મળો
સ્થળ : માતૃછાયા પ્રાયમરી સ્કૂલ, વોર્ડ ૪-એ, સિંધુવર્ષા બજારની બાજુમાં, આદીપુર.
તા. ૯-૫-૨૦૧૦, રવિવાર, સમય : બપોરે ૧૨ થી ૫
વધુ માહિતી માટે સંપર્ક : (વિનયભાઇ લોખિલ) ૯૮૨૪૨ ૪૮૩૬૯

SUMANDEEP VIDYAPEETH
(Declared as a deemed to be university U/S 3 of UGC act 1956)
SBKS Medical Institute & Research Centre
At & P.O. Piparia, Tal. Waghodia, Dist. Vadodara-391760 (Guj.) INDIA
Tel.: 02668-245267, (M) 9998184013, E-mail : svadmission@gmail.com
Website : www.sumandeepuniversity.co.in
FOR P.G. ADMISSION ( Medical )
An application are invited for the following Subject in PG Degree / PG Diploma. - Apply prior to 25th May 2010
IN PG DEGREE: MS - Anatomy; MD - PSM, Microbiology, Physiology
IN PG DIPLOMA: PSM, Psychiatry, ENT
Tutorship may also be offered to those eligible candidate as per available posts.
SCHOLARSHIP will be offered to candidates who fulfill the Uni. Rules and Regulations.
MONARCH

THOMAS SCOTT

NEW ARRIVALS
SPRING SUMMER COLLECTION
PAY FOR 1 TAKE 3*
+
SHOP FOR Rs. 2,000/- & ABOVE and GET A T-SHIRT FREE*
*conditions apply
makani
SHIRTS • TROUSERS • DENIMS • T-SHIRTS • JACKETS • PULLOVERS • SWEATERS • SUITS • ACCESSORIES
Exclusive Brand Outlets: AHMEDABAD : Kshitij Mall, Shop No. 7, 1st Flr., Satellite Road, Tel.: 079 - 40026820 • Iscon Mall, Shop No. 22, Ground Flr., Sarkhej Gandhinagar Highway, Tel.: 079 - 40031067 • Dev Arcade Mall : Shop No. 105, 1st Flr., S. G Road, Tel.: 079 - 40025621 • ANAND : G/8 Triveni Shopping Arcade, V. V. Nagar Road, Tel.: 02692 - 248771 • GANDHIDHAM: ShopNo. N - 46, Main Market, Opp. Spykar, Kundan Avenue. Tel.: 02836 - 232275 • JAMNAGAR : Shop no. 2/B, Satvas Building, Opp. Patel Colony - 6, P . N . Marg, Mob.: 09428838097 • SURAT : Adajan, Shop No. 4, Shilvar Plaza, Anand Mahal Road, Tel.: 0261- 3065349 • Iscon Mall, Shop No. 321, 2nd Flr., Dumas Road, Tel.: 0261 - 2253685 RAJKOT : M/S OM Enterprises Shop No. 115, First Floor Crystal Mall, Kalawad Road, Tel.: 0281-2562525 • VADODARA : Sevenseas Mall, Shop No.11, 1st Flr., Fatehgunj, Tel.: 0265 - 3019502, Center Square Mall: Shop No. 10, 1st Flr., Sarabhai Circle, Tel.: 0265 - 3052728 • BLUE PLUS : GF - 63,64 Trident Complex, Race Course Road, Tel.: 0265 - 2358323.
For Franchisee Enquiries : Mob.: 090999 49645 • Tel.: 022 - 6660 7965 / 66 / 67 / 68 / 69 • Fax : 022 - 6660 7970 • Email : bol@banggroup.com

KENT Mineral RO™ Water Purifiers
તમારું શુદ્ધ કરેલું પાણી કેટલું શુદ્ધ છે?
RO + UF + UV + TDS કન્ટ્રોલ

• ઓગળેલી અશુદ્ધિ દૂર કરે
• કુદરતી મિનરલ તત્વોને જાળવી રાખે
• ડબલ પ્યોરિફિકેશનઃ બેક્ટીરિયા અને વાયરસનો સંપૂર્ણપણે નાશ કરે
પિઓ દુનિયાનું સર્વોત્તમ શુદ્ધ પાણી
હવે દરેક પરિવાર થશે સ્વસ્થ ....કેન્ટથી

કેન્ટ ટેક્નોલોજી
ડબલ પ્યોરિફિકેશન, ઓગળેલી અશુદ્ધિ દૂર કરે અને મિનરલ તત્વોને જાળવી રાખે
RO + UF + UV + TDS કન્ટ્રોલ
For Free Demo | Call Toll Free 1800 100 1000 SMS 'KENT' to 53636
LAW & KENNETH
Available at: Gandhidham: Arihant Sales & Services 9825057300
For Dealer Enquiries Call: 9377966030/ 09711110222 Website: www.kent.co.in

સફેદ ડાઘ
જડીબુટ્ટીઓ દ્વારા ૧૦૦% સફળ ઈલાજ
અમારી જડીબુટ્ટીઓની નવી સારવારની શોધથી સફેદ ડાઘ નવા હોય કે જુના, મોટા હોય કે નાના. માત્ર ૭ કલાકમાં રંગ પરિવર્તન કરી મુળમાંથી દૂર કરે છે. ફોન પર સારવારની દવા મફત મંગાવો.
વૈદ્યશ્રી જ્વાલા પ્રસાદ, ગીતા આયુર્વેદ ભવન
09939418517, 09939418077, 06112-289304

CALLER'S 18 YRS. + ISD RATE APPLY
v-chat in VTALK Dial 5664465
CALL CHARGES RS. 12/- Per Min.
009609711131
0085099922217 GUJ.
006703305124
0085099922213
002392211330
0085099922219 PUN.
009609613116 ENG.
009609612862 TELGU
009609711464
009609613018
0085099922215

EXCHANGE | Insurance | MGA
MARUTI SUZUKI Way of Life!
મારુતિ મે મહાબચત મહિનો
WagonR એક્સચેન્જ બોનસ રૂ.12000
SX4 કુલ ફાયદો રૂ.45000
ESTILO કુલ ફાયદો રૂ.35000
ALTO કુલ ફાયદો રૂ.24000
A-STAR કુલ ફાયદો રૂ.35000
RITZ કુલ ફાયદો રૂ.30000
MARUTI 800 કુલ ફાયદો રૂ.15000
OMNI કુલ ફાયદો રૂ.20000
8%# INTEREST RATE
# Applicable on the first year of loan tenure.
# Loan at the sole discretion & conditions of State Bank of India
Total Benefit is inclusive of Consumer + Exchange Offer.

Special Offer for Govt. Employees, Bank Employees, Teachers & C. As -
"SX4" is available in DGS & D Rate Contract".
Kindly contact at sudeep.bhagwat@maruti.co.in
■ BHUJ ● K. D. MOTORS : (02832) 232531 / 32, 99099 53102 ■ BHACHAU ● K. D. MOTORS : (02837) 223401/02, 9909953057
■ GANDHIDHAM ● B.M. Autolink : (02836) 223331, 9727728203 ■ MUNDRA ● B.M. Autolink : 02838 - 296020, 296030, 9727728220

realpatidar.com

# કચ્છની નોંધપોથી

## ભુજ : ગોવર્ધનનાથજીની હવેલી

શ્રીનાથધામ ગોવર્ધનનાથજીની હવેલી મધ્યે અધિક માસ નિમિતે ચાલતી સમૂહ ભાગવત કથાનો વિરામ સાંજે ૫ કલાકે તેમજ ૭ થી ૮ દરમિયાન દીપદાન મનોરથનો કાર્યક્રમ યોજાશે.

## લોહાણા મહાજન શિક્ષણ સમિતિ

ભુજ લોહાણા મહાજન શિક્ષણ સમિતિ દ્વારા વર્ષ ૨૦૦૯/૧૦માં આપવામાં આવેલા પાઠ્ય પુસ્તકો તા. ૯/૫ના સવારે ૧૦ થી ૧૨ દરમિયાન ધો. ૧૨ અને કોલેજના વિદ્યાર્થીઓને અવશ્ય જમા કરાવી જવા.

## વાંચે ગુજરાત અભિયાન અંતર્ગત વિચાર ગોષ્ઠિનું આયોજન

કચ્છ યુવક સંઘ (મુંબઇ) દ્વારા સ્વર્ણિમ જયંતી નિમિત્તે વાંચે ગુજરાત અભિયાન અંતર્ગત વિચાર ગોષ્ઠિ તા. ૮/૫ના સાંજે ૬.૩૦ કલાકે કચ્છ યુવક સંઘ કાર્યાલય, માંડવી ઓક્ટ્રોય સામે ભુજ.

## કચ્છી દશા શ્રીમાળી જૈન વણિક જ્ઞાતિ

જ્ઞાતિનાતમામ વિદ્યાર્થીઓએ પરીક્ષા પૂર્ણ થયે તાત્કાલિક નવા વરસ માટેના પુસ્તકો માટે ફોર્મ મેળવી લેવા જે પરિણામ આવેથી પાસ થયાની માર્કશીટની નકલ ઓફિસ કાર્યાલય આપી જવી તેમજ જ્ઞાતિજનોએ વર્ષ ૨૦૧૦/૨૦૧૧ની વાર્ષિક સભ્ય ફી કચેરીમાં ભરી અને પહોંચ મેળવી લેવી.

## વિનામૂલ્યે પોલિયો તથા ત્રિગુણી રસી

પોલિયો તથા ત્રિગુણી રસી દર રવિવારે સવારે ૧૦ થી ૧૨ સુધીમાં તથા ઓરીની રસી મહિનામાં દર ચોથા રવિવારે બાળકોને વિનામૂલ્યે આપશે. જાયન્ટ્સ હોલ, કચ્છી જવેલર્સ વાળી ગલી, હોસ્પિટલ રોડ, ભુજ.

## ગુજરાત રાજ્ય અર્ધસરકારી ઔદ્યોગિક કર્મચારી સંઘ

ગુજરાત રાજ્ય અર્ધ સરકારી ઔદ્યોગિક કર્મ. સંઘ અને પબ્લિક એસોસિયેશનના સંયુક્ત ઉપક્રમે કચ્છ જિલ્લાની વન વિભાગની તાબા હેઠળની ફરજ રેન્જ કચેરીઓ તેમજ નર્સરીઓમાં બજાવતા રોજમદાર કર્મ. ભાઇ-બહેનોના વિવિધ પ્રશ્નો અંગે તા.૯/૫નાસવારે ૧૦ વાગ્યે ભુજ ગણેશનગર મધ્યે મીટિંગ.

## કચ્છી સારસ્વત બ્રાહ્મણ

કચ્છમાં વસતા કચ્છી સારસ્વત બ્રાહ્મણ જ્ઞાતિના વિદ્યાર્થીઓ તથા વાલીઓને જાણ કરવાની કે ચાલુ વર્ષે ધોરણ ૯,૧૦ કે ૧૨ના કોઈપણ પ્રવાહ અને શૈક્ષણિક માધ્યમમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીના ચાલુ વર્ષે મળેલા પરિણામ પત્રકની ઝેરોક્ષ નકલ સાથે સંસ્થાના નિયત કરેલા અરજી પત્રક જે દરેક તાલુકા વિસ્તારના જ્ઞાતિના મહાસ્થાનના હોદ્દેદારો અને અથવા સક્રિય સમાજ સેવકો પાસેથી મેળવી, માગલી વિગતો સંપૂર્ણ ભરી, અરજી પત્રકમાં દર્શાવેલા સરનામે પરિણામ મળ્યાના ૧૦ દિવસની મોકલવા અનુરોધ કરાયો છે. તો સંસ્થા તરફથી ફંડની ઉપલબ્ધતા અનુસાર મોડર્ન મેગેઝિનના પ્રસિદ્ધ અંકો નિઃશુલ્ક મોકલવામાં આવશે.

## બી.એલ.ઓ.ની બેઠક

સરકારની સૂચના મુજબ મતદારયાદી સુધારણા કાર્યક્રમ ૨૦૧૦ના અનુસંધાનને ફોટો ઇમેજીસની કામગીરી માટે ૩-ભુજ તથા ૪ અંજાર વિધાનસભા મતદાર વિભાગના તમામ બી.એલ.ઓ. (બુથ લેવલ ઓફિસર)ની બેઠક તા. ૧૨/૫ના બપોરે ૩.૩૦ કલાકે સહયોગ હોલ, બસ સ્ટેશન રોડ, ભુજ મધ્યે તમામ બી.એલ.ઓ.ની બિનચૂક હાજર રહેવા મામલતદાર ભુજની યાદીમાં જણાવાયું છે.

## ઇન્દ્રાબાઇ ગર્લ્સ હાઇસ્કૂલ

આચાર્ય ઈન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલની યાદીમાં જણાવાયું છે કે, આ શાળામાં પ્રવેશ મેળવવા માગતી વિદ્યાર્થિનીઓએ તા. ૧૦/૫થી સવારે ૯ થી ૧૨ દરમિયાન શાળાનો સંપર્ક સાધવો.

## ર.ટો.વોરા મેડિકલ ચેકઅપ સેન્ટર

રતનશી ટોકરશી વોરા મેડિકલ ચેકઅપ સેન્ટર ભુજ મધ્યે સવારે ૯ થી ૧૧ અમદાવાદના ન્યૂરો સર્જ ડો. મનીષ રાઠી દાર્દીઓની તપાસણી કરશે સવારે ૯ થી ૧૧ સાંજે ૪.૩૦ થી ૬.૩૦ દંતરોગ નિષ્ણાંત ડો. ફાલ્ગુનીબેન મહેતા તેમજ સાંજે ૫.૩૦ થી ૬.૩૦ ડો. અશોક ત્રિવેદી (હોમિયોપેથીક) સેવા આપશે.

## આર્ટ ઓફ લિવિંગ-મહા સુદર્શનક્રિયા

આર્ટ ઓફ લિવિગ સંસ્થા દ્વારા બેઝિક કોર્સ કરેલા સાધકો માટે શ્રીશ્રી રવિશંકરજીના શિષ્ય નિત્યપ્રજ્ઞાજી સાજે મહાસુદર્શન ક્રિયા - જ્ઞાન સત્સંગ તા. ૧૦/૫ના સાંજે ૭.૩૦ કલાકે માતૃછાયા કન્યા વિદ્યાલય મધ્યે.

## કચ્છી રાજગોર શૈક્ષણિક અને સામાજિક પ્રગતિ મંડળ

સંસ્થા મારફતે મેળવેલ પુસ્તકોની યાદી-નામ- એડ્રસ અને ફોન/મોબાઈલ નંબર સાથે મંડળના કાર્યાલય ખાતે રૂબરૂ જમા કરાવી જવા તેમજ પુસ્તકો મેળવવા માટેનો ફોર્મ તૈયાર થતાં જાણ કરવામાં આવશે. મંડળની વ્યવસ્થા સમિતિની મીટિંગ તા. ૯/૫ના સવારે ૧૦.૩૦ કલાકે છત્રીબારી, કાર્યાલય ખાતે.

## યુવા બેરોજગાર માટે ત્રિમાસિક તાલીમ યોજના

ભુજ નગર સેવા સદન દ્વારા સંચાલિત યુવા બેરોજગારો માટે ભુજમાં રાજ્ય સરકાર દ્વારા ત્રિમાસિક તાલીમ યોજના અંતર્ગત તાલીમ વ્યાયામ શાળા ખાતે વર્ગખંડમાં અપાઇ રહી છે. જેના માટે ૧૮ થી ૩૫ વર્ષના વય મર્યાદાવાળા યુવક, યુવતીઓને પ્રવેશ આપવામાં આવે છે. અહીં વિવિધ મહેંદી ડીઝાઇન એન્ડ બ્યૂટી પાર્લર અને ટેલરિંગ એન્ડ ફેશન ડિઝાઇનિંગ માટે ફ્રી સેમિનાર રાખાવામાં આવ્યા છે. આ ત્રણ માસની તાલીમ પૂર્ણ કર્યા બાદ રાજ્ય સરકારનું માન્યતા પ્રાપ્ત સર્ટિફિકેટ અપાશે.

## સત્યનારાયણ ભગવાનની સામૂહિક કથા

તા. ૯ અને તા. ૧૦/૫ના સવારે ૯.૦૦ વાગ્યે સત્યનારાયણના મંદિર મધ્યે. રામધૂન પાસે, ભુજ.

## મારૂ કંસારા સોની જ્ઞાતિ મહિલા મંડળ

મારૂ કંસારા સોની જ્ઞાતિ મહિલા મંડળ ભુજ આયોજિત સમરકેમ્પની તા. ૮/૫ના પૂર્ણાહુતિ પ્રસંગે બાળકોએ બનાવેલી વિવિધ વસ્તુઓનું એક પ્રદર્શન સમાજની લગ્નવાડી મધ્યે સાંજે ૬.૦૦ કલાકે.

## તાલુકાના તલાટીઓ, ગ્રામ સેવકો તથા આંગણવાડી કાર્યકર અંગે

ભુજ તાલુકા લોક કલ્યાણ ગરીબ મેળાને અનુલક્ષી ભુજ તાલુકાના તલાટી સહમંત્રી, ગ્રામ સેવક, આંગણાવાડી કાર્યકર તથા અમલીકરણ અધિ. તમામ તા. ભુજ વાળા જોગ તા. ૧૦/૦૫ના સાંજે ૫ કલાકે એક બેઠક જિલ્લા કલેકટર તથા જિ.વિ.અ.ની સૂચના અન્વયે રાખવામાં આવી છે. આ મીટિંગ સહયોગ હોલ ભુજ મધ્યે.

## દેસાઇ એકેડેમી

બી.આર.બાવસે દ્વારા સંચાલિત જનરલ નોલેજના નિઃશુલ્ક વર્ગોનું આયોજન .

## એક્સ્પો ૧૦માં ટપાલ ટિકિટ પ્રદર્શન

ભુજમાં એક્સ્પો ૧૦માં ગ્લોબલ કચ્છ- હોબી કોર્નર અને કચ્છ ફિલાટેલિક એસોસિએશન દ્વારા સી-વીંગમાં સ્ટોલ નં. ૯ અને ૧૦માં ટપાલ ટિકિટ અને સિક્કાઓનું પ્રદર્શન તા. ૮ અને ૯ના સવારના ૧૧ થી ૯ સુધી નિઃશુલ્ક નિહાળી શકાશે.

## જિલ્લા જાહેર આરોગ્ય સેવા કર્મચારી મહામંડળની બેઠક

કચ્છ જિલ્લા જાહેર આરોગ્ય સેવા કર્મચારી મહામંડળની કારોબારીની બેઠક તા.૮/૫ ના જિલ્લા પંચાયત ભવનના પ્રાંગણમાં બપોરે ૩ કલાકેઆરોગ્ય કર્મચારી મહામંડળના તમામ કરોબારી સભ્ય તથા સંલગ્ન મંડળના હોદ્દેદારો તથા તાલુકા મંડળના હોદ્દેદારોએ હાજર રહેવું.

## લોહાણા બોર્ડિંગ હાઉસમાં પ્રવેશ અંગે

રાજકોટ લોહાણા બોર્ડિંગ હાઉસમાં જૂન ૨૦૧૦થી શરૂ થતા શૈક્ષણિક વર્ષથી ધોરણ ૧૧થી ઉચ્ચ શિક્ષણની ફેકલ્ટીઓમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓને છાત્રાલયમાં પ્રવેશ મળશે. ઈચ્છુક વિદ્યાર્થીઓએ પ્રાથમિક પ્રવેશ ફોર્મ છાત્રાલયના કાર્યાલય ૮, રજપૂતપરા, રાજકોટ -૧થી સવારે ૯ થી ૧૨ સુધી મેળવી લેવાનું રહેશે.

## જન કલ્યાણ મેડિકલ સોસાયટી માંડવી દ્વારા હોમકેર તથા હોસપિસ પ્રોજેક્ટ

જન કલ્યાણ મેડિકલ સોસાયટી માંડવી દ્વારા કેન્સર રિસર્ચ કેન્દ્રમાં જેમનો રોગ કેન્સર અંતિમ અવસ્થામાં પહોંચી ગયો હોય તેમના માટે વિશ્રાંતિ/આશ્રય કેન્દ્ર (હોસ્પિસ) માટેની સુવિધાઓનો લાભ લેવા કચ્છમાં કેન્સરના છેલ્લા તબક્કાના રોગીઓને અનુરોધ કરાયો છે. આ પ્રકારની વિશિષ્ટ સેવા સેન્ટરમાં બીપીએલ કાર્ડ ધારકો માટે સારવાર રાહત દરે આમ છતાં જે દર્દીઓ સેન્ટર સુધી ન પહોંચી શકતા હોય તેમના માટે હોમકેર પ્રોજેક્ટ દર્દીઓને ઘેર બેઠા પીડાશામક સારવાર અને માર્ગદર્શન અપાશે. માંડવી તાલુકાના જરૂરતમંદ દર્દીઓએ આ નિઃશુલ્ક સુવિધાનો લાભ લેવા અપીલ છે. આ માટે ફોન નં. ૦૨૮૩૪ - ૨૨૪૧૦૮ અને પ્રોજેક્ટ સંયોજકો : ડો. આદિત્ય ચંદારણા, મો. ૯૮૨૫૨ ૩૫૮૩૮ અને ડો. હિરેન ત્રિવેદી મો. ૯૭૨૬૧ ૧૦૧૦૧ પર સંપર્ક કરવો.

## દિવ્ય સમાજ નિર્માણ અભિયાન

શેઠ ખીમજી રામદાસ કાું. અને ચેમ્બર ઓફ કોમર્સના સંયુક્ત ઉપક્રમે આર્ટ ઓફ લિવિંગના સ્થાપક શ્રીશ્રી રવિશંકરજીના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલા દિવ્ય સમાજ નિર્માણ અભિયાન અને લોકોમાં હકારાત્મક દ્રષ્ટિકોણ કેળવી શકે તે હેતુથી માંડવી શહેરના પ્રબુદ્ધ નાગરિકો સાથે પ્રશિક્ષકો તુષાર વાંકાણી, આનંદ શર્મા સાથે તા. ૯/૫ના સવારે ૧૦ કલાકે ભાટિઆ યજ્ઞ શાળા મધ્યે.

## મુન્દ્રા તાલુકાના બુથ લેવલ ઓફિસરની બેઠક

મુન્દ્રા તાલુકામાં ફોટો મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત તાલુકાના તમામ બી.એલ.ઓ. મીટિંગ તા.૧૧/૫ ના બપોરે : ૧૨ કલાકે મામલતદાર કચેરી મુન્દ્રા મધ્યે.

## મુન્દ્રામાં ગાયત્રી યજ્ઞ

અધિક માસની પૂર્ણાહૂતિ નિમિત્તે સોમેશ્વર મહાદેવના મંદિરના પ્રાંગણમાં નવાનગર ખાતે વિશ્વશાંતિ અર્થે ગાયત્રી પરિવાર દ્વારા ૨૪ કુંડીય ગાયત્રી મહાયજ્ઞનું આયોજન તા. ૯/૫ના સવારે ૮ કલાકે.

## અંજાર : પરશુરામ જયંતી મહોત્સવ

પરશુરામ જયંતી ઉત્સવ નિમિત્તે તા.૧૬- ૫ના સાંજે ૪ વાગ્યે શોભાયાત્રાનું આયોજન કરાયું છે. શોભાયાત્રામાં ઉપસ્થિત રહેવા માગતી કળશધારી કન્યાઓએ પોતાની વિગત આપવા માટે ૧૧ - ૫ સુધીમાં હંસાબેન જોશી (૯૯૨૬૫ ૮૦૫૪૮) તેમજ સુધાબેન દવે (૯૪૨૭૫ ૧૨૭૪૨)નો સંપર્ક કરવો.

## કાંડાગરામાં જૈન મૂનિઓનો પ્રવેશ

વર્ષીતપના પારણા અને આયંબિલ ઓળી તેમજ અઠ્ઠાઇતપના પારણા પ્રસંગના મહોત્સવ નિમિત્તે આઠકોટિમોટી પક્ષ જૈન સંપ્રદાયના કાર્યવાહક તારાચંદમુનિ, પ્રશાંતમુનિ, પાર્શ્વચંદ્રગચ્છિય ઉપાધ્યાય, ભુવન ચંદ્રજી મ.સા., મનોક્ષચંદ્રજી મ.સા. અને પૂન્યરત્નચંદ્રજી મ.સા. અને મહાસતિઓનો કાંડાગરા (તા. મુન્દ્રા) મધ્યે તા. ૯/૫ના સવારના ૮ કલાકે પ્રવેશ થશે.

# આજનું પંચાંગ

| | | |
|---|---|---|
| વિક્રમ સંવત | : | ૨૦૬૬ |
| શાલિવાહન સંવત | : | ૧૯૩૨ |
| ખ્રિસ્તી સંવત | : | ૨૦૧૦ |
| રાષ્ટ્રીય દિનાંક | : | ૧૮ |
| યુગાબ્દ | : | ૫૧૧૨ |
| જૈન સંવત | : | ૨૫૩૬ |
| ઈસ્લામિક સંવત | : | ૧૪૩૧ |
| પારસી વર્ષ | : | ૧૩૭૯ |




**તિથિ :** અધિક વૈશાખ વદ - ૧૦ **ખ્રિસ્તી તિથિ :** ૮ મે, શનિવાર
**પારસી :** ૨૩ **ઈસ્લામિક :** ૨૨ - જમાદિલ અવ્વલ
સૂર્યોદય-સૂર્યાસ્ત :

| શહેર | સૂર્યોદય | નવકારશી | સૂર્યાસ્ત | ચંદ્રોદય | ચંદ્રાસ્ત |
|---|---|---|---|---|---|
| સુરજબારી | ૬.૧૧ | ૬.૫૯ | ૧૯.૧૬ | ૨૪.૩૩ | ૧૦.૫૫ |
| ગાંધીધામ | ૬.૧૩ | ૭.૦૧ | ૧૯.૧૮ | ૨૪.૩૫ | ૧૦.૫૭ |
| ભુજ | ૬.૧૫ | ૭.૦૩ | ૧૯.૨૦ | ૨૪.૩૭ | ૧૦.૫૯ |
| નખત્રાણા | ૬.૧૬ | ૭.૦૪ | ૧૯.૨૧ | ૨૪.૩૮ | ૧૧.૦૦ |
| કોટેશ્વર | ૬.૧૯ | ૭.૦૭ | ૧૯.૨૪ | ૨૪.૪૧ | ૧૧.૦૩ |

**સૂર્ય :** મેષ **નક્ષત્ર :** શતતારા **યોગ :** ઐન્દ્ર **કરણ :** વણિજ
રાહુકાળ : ૦૯-૦૦થી ૧૦-૩૦ સુધી (રાહુકાલમાં શુભારંભ ન કરવો.)
દિશાશૂલ : પૂર્વ (તે દિશામાં પ્રવાસ ન કરવો.)
**ગોચર ગ્રહ: ૧ મેષ ૨ વૃષભ ૩ મિથુન ૪ કર્ક ૬ કન્યા ૯ ધન ૧૧ કુંભ ૧૨ મીન**
સ્થિતિ : સૂ.બુ. શુ. કે. મં. શ. રા. ચં. ગુ.
**આજની ચંદ્રરાશિ :** કુંભ **નામાક્ષર :** ગ, શ, ષ, સ
**દિવસનાં ચોઘડિયાં :** કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ
(પ્રત્યેક ચોઘડિયું ૧ા। કલાકનું સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી)
**રાત્રિનાં ચોઘડિયાં :** લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ

# આજનું રાશિફળ

કંદર્પભાઇ ત્રિવેદી

**મેષ**

શુભ રંગ : લાલ — શુભ અંક : ૧-૮
**ધંધાકીય** પ્રવૃત્તિ માટે પ્રવાસ થાય. અડોશ-પડોશમાં સંબંધો સુધરે. વિદ્યાર્થીઓને અભ્યાસ માટે વધુ મહેનત કરવી પડે.

**વૃષભ**

શુભ રંગ : સફેદ — શુભ અંક : ૨-૭
**બહારગામથી** સારા સમાચાર મળે. કૌટુંબિક સુખ-સગવડમાં વધારો થાય. વાહન ચલાવનારાએ સાવચેતી રાખવી.

**મિથુન**

શુભ રંગ : લીંબુ કલર — શુભ અંક : ૩-૬
**ક્લેશ** થાય તેવી વાણી બોલવી નહીં. અન્યની મદદ માટે દોડધામ કરવી પડે.

**કર્ક**

શુભ રંગ : દૂધિયો-કલર — શુભ અંક : ૪
**મુસાફરી** માટેના નિર્ધારિત કાર્યક્રમમાં વિલંબ થાય. સંતાનોના અભ્યાસ અંગે ચિંતા રહે. નાણાકીય સહાય મળવાથી ચિંતા ટળે.

**સિંહ**

શુભ રંગ : સોનેરી-કેસરી — શુભ અંક : ૫
**પ્રતિકૂળ** વાતાવરણને કારણે તબિયત અસ્વસ્થ જણાય. દોડધામ બને ત્યાં સુધી ટાળવી.

**કન્યા**

શુભ રંગ : ઘેરો લીલો — શુભ અંક : ૬-૩
**પ્રયાસ** કે ટૂંકી મુસાફરી દ્વારા પ્રગતિની તક મળે. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી દ્વારા પ્રોત્સાહન મળે.

**તુલા**

શુભ રંગ : સફેદ ચળકતો — શુભ અંક : ૭-૨
**સાથી** કર્મચારી કે અન્યની જવાબદારી સંભાળવામાં ધ્યાન રાખવું. પરિવારમાં કોઇ પ્રસંગ માટે ખર્ચનું ભારણ વધે.

**વૃશ્ચિક**

શુભ રંગ : ઘેરો લાલ — શુભ અંક : ૮-૧
**કોઈની** સાથે અણબનાવ થયો હોય તો સંબંધો સુધારવાની તક મળે. વેપાર-દંધામાં ભાગીદાર સાથે પ્રવાસ થાય. સંતાનોના

**ધન**

શુભ રંગ : ઘેરો પીળો — શુભ અંક : ૯-૧૨
**નાણાકીય** લેવડદેવડમાં સાવચેતી રાખવી. આજે કોઈ કરાર ઉપર હસ્તાક્ષર કરવા નહીં.

**મકર**

શુભ રંગ : વાદળી-આકાશી — શુભ અંક : ૧૦-૧૧
**સ્થાવર** મિલકત ખરીદવા અંગે સાનુકૂળ તક ઊભી થાય. વારસાગત પ્રશ્નોમાં ઉકેલ આવે.

**કુંભ**

શુભ રંગ : ઘેરો વાદળી — શુભ અંક : ૧૧-૧૦
**વડીલોપાર્જિત** મિલકત અંગે ચર્ચા થાય. વડીલો અને સ્ત્રીવર્ગના સભ્યોની તબિયત જળવાઈ રહે.

**મીન**

શુભ રંગ : આછો પીળો — શુભ અંક : ૧૨-૯
**ભવિષ્યની** ચિંતામાં ખોટી દોડધામ કરવાથી બચવું. વર્તમાન સ્થિતિમાં જીદ છોડી દેવાથી પ્રશ્ન ઉકેલાય.

# અવસાન નોંધ

**ભુજ :** શ્રીમાળી સોની સમાજ હાલે દુબઇ કોંઢિયા **હિંમતલાલ ગોવિંદજી** તે ગોવિંદજી થાવરના પુત્ર, હીરાબેનના પતિ, સ્વ. જાદવાજીભાઇ, સ્વ.મગનભાઇ, સ્વ.હિરાભાઇ, સ્વ.ચંદુભાઇ, સ્વ.હરિભાઇ, નવીનભાઇ, સ્વ.કંકુબેન, સ્વ.સુશીલાબેન, પુષ્પાબેનના ભાઇ, દિલીપ, વિજય, ભાવના, રેખા, અંજુ, પારૂલબેનના પિતા, સ્વ.શંભુલાલ, સ્વ.કાંતિલાલ, સ્વ.કનૈયાલાલ, છોટાલાલ, બાલેન્દ્ર, રમેશભાઇના કાકા, માંડવીના કેશવલાલ જુઠ્ઠાના જમાઇ તા.૪/૫ના દુબઇ મધ્યે અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તા.૮/૫ના સાંજે ૫થી ૬ દરમિયાન બ્રહ્માં કુમારી હોલ ભુજ મધ્યે.

**ગાંધીધામ :** મૂળ ખાખલ, તા.હારીજના હાલે ગાંધીધામ **મજીઠિયા કાંતિલાલ ઠાકરશીભાઇ** (ઉ.વ.૫૬) તે શિહોરીના રતાણી નારણલાલ દેવજીના જમાઇ, ગં.સ્વ.શારદાબેનના પતિ, હિતેષકુમાર, હરેશભાઇ, વર્ષાબેન, મનિષા, જાગૃતિના પિતા, વિમળાબેન, મંગુબેન, જોષનાબેન, શંકુતલાબેનના ભાઇ, મહેશકુમાર, વિજેશકુમાર, વિપુલકુમાર, લતાબેનના સસરા, અક્ષય, મીલનના દાદા, તા.૭/૫ના અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તા.૯/૫ના સાંજે ૫થી ૬ ભાઇઓ તથા બહેનો માટે નૂતન લોહાણા મહાજનવાડી ભારતનગર મધ્યે.

**જખૌ : (અબડાસા) : ભઘુ હાજીયાણી મરીયાંબાઇ (ઉ.વ.૮૦)** તે હાજી જુમાના પત્ની, હાજી ઓસમાણ, હાજી આમંદ, પનુભા, ખતુબાઇ, હફુબાઇ, ફાપુબાઇના માતા, હાજી અભરામ (વડસર) અલાના અલીમામદ (મોટીબેર), હસણ અલીમામદ (મોટીબોર)ના સાસુ, તા.૬/૫ના અવસાન પામ્યા છે. તેમની જિયારત તા.૮/૫ના જખૌ મધ્યે સવારે ૧૧ વાગ્યે તેમના નિવાસસ્થાને.

**નલિયા :** મૂળ સાંધાણના **કચરા પૂંજા કન્નર** તે ગીતા, જ્યોતિ, ચંદાના પિતા, હાસંબાઇ દેવજી મતિયા (નલિયા) તથા સુમલબેન કારે માતંગ (ગાંધીધામ)ના નાનાભાઇ તા.૬/૫ના અવસાન પામ્યા છે. તેમની ધાર્મિક ક્રિયા પૂર્ણ થયેલ છે. સાદડી નલિયા દક્ષિણ મહેશ્વરીવાસ મતિયા દેવજી કારાના નિવાસસ્થાને.

**સુખપર (ભુજ)**
**ગોસ્વામી અમૃતપુરી વિજયપુરી** (ઉ.વ.૮૩) મૂળ માંડવીના તે સ્વ.રમાબેનના પતિ, સ્વ.માણેકબાઇ વિજયપુરીના મોટા પુત્ર, નારણપુરી (માંડવી), ચંચલપુરી (રાજકોટ), સ્વ.વનરાજપુરી (ભુજ)ના ભાઇ, રાજેન્દ્રપુરી (મિરજાપર), ઘનશ્યામપુરી, ઉમેદપુરી, (મિરજાપર), પ્રબોધપુરી (ભુજ) હંસાબેનના પિતા, બેચરગર (ભુજ)ના જમાઇ, જિતેન્દ્ર, વીરેન્દ્ર, સુરેન્દ્ર, રાહુલ, સુનીત, શિવમના દાદા તા.૫/૫ના અવસાન પામ્યા છે. તેમનું ઉઠમણું તા.૮/૫ના સાંજે ૫થી ૬ તેમના નિવાસ સ્થાને દરબારવાડી સામે, જૂનાવાસ સુખપર મધ્યે.

**ખેડબ્રહ્મા :** (સાબરકાંઠા) **સોલંકી હર્ષદભાઇ દામજીભાઇ** (ઉ.વ.૪૯) તે સ્વ.સોલંકી દામજીભાઇ માધવજીભાઈ (માંડવીવાળા)ના પુત્ર, નરેશભાઇ, ગિરીશભાઇ, શોભનાબેન, કોકિલાબેન, ચંદ્રિકાબેન, રક્ષાબેનના ભાઇ, વલ્લભદાસ છોટાલાલ પરમાર (કેશોદ)ના જમાઇ તા.૭/૫ના અવસાન પામ્યા છે. તેમનું ઉઠમણું તા.૧૦/૫ના બપોરે ૩થી ૬ દરમિયાન ખેડબ્રહ્મા તેમના નિવાસ સ્થાને (૨૪-પટેલ સોસાયટી) મધ્યે.

**મુંબઇ**
**કચ્છી લોહાણા**
**કલ્યાણજી હરિરામ ગણાત્રા** (ઉં. વ. ૮૫) તે વેલબાઇના પતિ. સ્વ. વેલજીભાઇ, સ્વ. હિરજીભાઇ, સ્વ. વાલજીભાઇ, સ્વ. સાકરબેન, સ્વ. મણીબેન, સ્વ. લક્ષ્મીબેન, સ્વ. શાંતાબેન, સ્વ. કાશીબેનના ભાઇ. ચંદુ માં. જનક માં, જયાબેન, તુલશીદાસ, હર્ષદભાઇ, ઉષાબેનના પિતા. ખટાઉ ઠાકરશી, સુમરી રોહાના જમાઇ ૪-૫-૧૦ના કચ્છ ગઢશીશા અવસાન પામેલ છે. પ્રાર્થનાસભા ૭-૫-૧૦ના ૫ થી ૭ કચ્છી લોહાણા મહાજનવાડી, પવાણી હોલ, મુલુંડ (વે.). લૌ. વ્ય. બંધ છે.

**કચ્છી ભાનુશાલી**
સ્વ. ભા. ધરમદાસ ત્રીકમદાસ દામા જખૌવાલાના પુત્ર **પ્રહલાદ (ઉં. વ. ૩૯)** ૫-૫-૧૦ના મુંબઇ મધ્યે ઓધવશરણ પામેલ છે. પ્રાર્થના પુત્ર ધ્રુવ. ભાઇ મનોહર. કાકા નરોત્તમ ત્રીકમદાસ. મોસાળ પક્ષે ભગવાનદાસ તથા હરગોવિંદ શંકરલાલ ભદ્રા, સાસરા પક્ષે દયારામ આણંદજી હુરબડા તથા ધનજી આણંદજી હુરબડા જંગડીયાવાલા તરફથી ૭-૫-૧૦નાં સાંજના ૫ થી ૭. ભાનુશાલી વાડી, ગ્રાઉન્ડ ફ્લોર હોલ, તીલક રોડ, ઘાટકોપર (ઇ.).

સ્વ. ભાનુશાલી દામજી જખુભાઇ ખાનિયા ભવાનીપુરવાલાના પુત્ર **શંભુરામ (ઉં. વ. ૪૪)** ૫-૫-૧૦ના દેશ મધ્યે ઓધવશરણ પામેલ છે. પ્રાર્થના માવિત્ર સ્વ. પ્રધાન જખુભાઇ. પુત્ર જય, ધવલ. ભાઇ ધરમસી, વાલજી, બાબુભાઇ પ્રેમજી, સ્વ. નવિન મેગજી. મોસાળ પક્ષે ખીંણશી નરશી મંગે, તથા સાસરા પક્ષે શીવજી નારાણજી ખીચડા કરૈયા. બનેવી હંસરાજ કલ્યાણજી માવ, નવિન પ્રસોતમ કટારમલ ભવાનીપુર તરફથી ૭-૫-૧૦ શુક્રવારના સાંજે ૫ થી ૭. સ્થળઃ ભાનુશાલી વાડી, પહેલે માળે, તીલક રોડ, ઘાટકોપર (ઇ.).

**ભા. કાકુભાઇ વેલજી કટારીયા** (ઉં. વ. ૭૩) કચ્છ બીટ્ટા મધ્યે ૫-૫-૧૦ બુધવારના ઓધવશરણ પામેલ છે. પ્રાર્થના ભાઇ બુધીયાભાઇ, મોહનલાલ વેલજી કટારીયા, પુત્રોઃ ગીરીશ, નરેશ કાકુભાઇ કટારીયા. સાસરા પક્ષે સ્વ. ભા. માધવજી પ્રેમજી ભદ્રા. જમાઇ ગોવિંદજી જેઠાલાલ ગજરા બાલાપર, દામજી ગાંગજી મંગે મોથાળા, જીતેન્દ્ર ઓધવજી ખાનીયા નાંગીયા, રમેશચંદ્ર કરસનદાસ મેંગર નુંધાતડ. મોસાળ પક્ષે સ્વ. લક્ષ્મીદાસ તથા ગોપાલજી મેરાજ મંગે તરફથી ૭-૫-૧૦ શુક્રવાર સાંજના ૫ થી ૭. ઠે. ઉષા મંડપ હોલ, ભાનુશાલી વાડી, તિલક રોડ, ઘાટકોપર (પૂ.).

**ક. વિ. ઓ. જૈન**
**ખારૂઆના વેલબાઇ ખીમજી ગડા** (ઉં. વ. ૮૨) અવસાન પામેલ છે. સ્વ. ખીમજી વાલજીના પત્ની. હીમઈબાઇ વાલજીના પુત્રવધૂ. લક્ષ્મી, શાંતીલાલ, ઉમરશીના માતા. મોથારા મુલબાઇ દાઇઆ ખેતશીના પુત્રી. નાનજી દાઇઆ ગોરબાઇ વાલજી, જેતબાઇ દાઇઆ, દેવપુરના જેઠીબાઇ ખીમજીના બેન. પ્રા. કરસન લધુ હોલ, દાદર ટા. ૨ થી ૩.૩૦. નિ. ઉમરશી ગડા, ઉમીયા સોસાયટી, બી-૩૬, આગરકર રોડ, ડોંબીવલી (ઇ.).

**રાયણના ગંગાબાઇ દામજી** (ઉં. વ. ૮૮) ૩-૫ના અવસાન પામેલ છે. સ્વ. દામજીભાઇના પત્ની. સ્વ. માંકબાઇ ઉમરશી માલશીના પુત્રવધૂ. નવીનના માતા. નવાવાસના નલીનીબેન કાંતીલાલના માતૃતુલ્ય સ્વ. લધીબાઇ ધારશી ગેલાભાઇના પુત્રી. પ્રા. કરસન લધુ હોલ, દાદર. ટા. ૪ થી ૫.૩૦. નિ. દામજી ઉમરશી, ૭૪૯, રામદેવી મેનશન, ૧૦મો રોડ, ખાર (વે.).

ભીસરાના સ્વ. પાનબા દામજી તેજશીના પુત્રી **શાંતાબેન પ્રમોદ** (ઉં. વ. ૫૬) અવસાન પામેલ છે. મુંબઇના પ્રમોદ બેળણકરની ધર્મપત્ની. હેતલના માતા. વીરજી ચાંપશીના દોહીત્રી. લાયજાના સ્વ. નવલબેન ખીંયશી, બાડાના સ્વ. નાનબાઇ કુંવરજી, બેરાજા અમૃતબેન વસંતલાલના બેન. પ્રાર્થના રાખેલ નથી. ચક્ષુદાન કરેલ છે. નિ. વસંતલાલ વિરજી, ૭, અહમદ મેનશન, ઈર્લા સોસા. રોડ, વિલેપારલા (વે.).

**ફરાદીના દામજી કુંવરજી વીરા** (ઉં. વ. ૬૩) કચ્છમાં ૪-૫-૧૦ના અવસાન પામેલ છે. ગં. સ્વ. દેવકાંબેનના પુત્ર. નિર્મળાના પતિ. સ્વ. ગાંગજીના ભાઇ. પુલીન, અખીલના પિતા. મેરાઉના સ્વ. પ્રેમજી નાનજી દેઢીઆના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. પુલીન દામજી, ૨૦૩, ડીસોઝા મેનશન, જે. એસ. રોડ, દહીસર (વે.).

**કચ્છ વાગડ લેઉવા પટીદાર :** ગામ કલ્યાણપરના કુંવરબહેન દેવજી માંડણ સરૈયાના પુત્ર **હરજીભાઇ** (ઉં. વ. ૩૮) મુંબઈ મધ્યે બુધવાર, ૫ મેના રામશરણ પામેલ છે. પરમાબહેનના પતિ. યશ, પ્રીતના પિતાશ્રી. ડાઈબહેન, વસાભાઈ, કરશનભાઈના ભાઈ. હરજીભાઈ, કેશવજી, માવજીના કાકાઈ ભાઈ. ગામ કાનપરના ગોવિંદ પરબત દુબરીયાના જમાઈ. સ્વ. ભાંડવા, વીરા, ધનાના ભાણેજ. પ્રાર્થનાસભા શનિવાર, ૮ મે સાંજે ૪થી ૫.૩૦. સ્થળ : ગુજરાત ભવન, સેક્ટર ૧૫, વાશી, નવી મુંબઈ.

**શ્રીમાળી સૌની :** કચ્છ ભુજવાળા હાલ દુબઈ સ્વ. ગોવિંદજી થાવર કોંડિયાના પુત્ર **હિમતલાલ ગોવિંદડી કોંડિયા** (ઉં. વ. ૭૬) તે હીરાબહેનના પતિ. દિલીપભાઈ, વિજયભાઈ, ભાવનાબહેન, રેખાબહેન, અંજુબહેન, પારુલબહેનના પિતા. સ્વ. જાદવજીભાઈ, સ્વ. મગનભાઈ, સ્વ. હીરાલાલભાઈ, સ્વ. ચંદુભાઈ, સ્વ. હરિલાલભાઈ, નવીનચંદ્ર, પુષ્પાબહેન મદનલાલ, સુશીલાબહેન પ્રાગજીભાઈના ભાઈ. ૪ મે દુબઈ મધ્યે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનસભા ૮, મે શનિવારે ગ્રાઉન્ડફલોર હોલમાં સાંજે ૪થી ૬માં રાખેલ છે.

**બેસણું**

અમારા વડીલ પરમ પૂજ્ય મોટાભાઈ
**જયંતિલાલ કરૂણાશંકર ત્રિપાઠી (રામરામ)** અમેરીકા મુકામે તા. ૪-૫-૨૦૧૦ને મંગળવારના રોજ હરિશરણ થયેલ છે.
સદ્ગતનું બેસણું આવતીકાલ તા. ૯-૫-૨૦૧૦ને રવિવારના રોજ સવારે ૮.૦૦ થી ૧૧.૦૦ નીચેના સ્થળે રાખેલ છે.
**સ્થળ : સરખેજ મોઢ બ્રાહ્મણની વાડી નં.૨, સરખેજ ગામ, અમદાવાદ.**

| | |
|---|---|
| વિનુભાઈ કરૂણાશંકર ત્રિપાઠી (ભાઈ) | કુસુમબેન જયંતિલાલ ત્રિપાઠી (પત્નિ) |
| ગિરીશભાઈ શંકરલાલ ત્રિપાઠી (ભત્રીજો) | મહેશ જયંતિલાલ ત્રિપાઠી (પુત્ર) |
| રોહિતભાઈ બાલકૃષ્ણ ત્રિવેદી (ભત્રીજો) | દ્વારકેશ જયંતિલાલ ત્રિપાઠી (પુત્ર) |

દિવ્ય ભાસ્કર **દુઃખદ અવસાન, બેસણું, ઉઠમણું, શ્રદ્ધાંજલિ, પ્રાર્થનાસભા ની જાહેર ખબર અંદરના પાને (દરરોજ) આપવા માટે**

| ફિક્સ સાઇઝ | બ્લેક એન્ડ વ્હાઇટ | કલર |
|---|---|---|
| ૫×૨ / ૧૦×૧ | રૂ.૫૦૦/- | રૂ.૬૦૦/- |
| ૧૦×૨ | રૂ.૧૦૦૦/- | રૂ.૧૫૦૦/- |

૨૦ સે.મી. થી વધારે સે.મી.ની જા.ખ.ના દર
રૂા. ૧૦૦/- બ્લેક એન્ડ વ્હાઇટ, રૂા. ૧૫૦/- કલરના લાગુ પડશે.
સંપર્ક :ભુજ : ૯૯૦૯૯ ૪૪૦૬૦. ગાંધીધામ : ૯૯૨૫૯ ૭૭૬૭૭, ૯૯૦૯૯ ૧૭૨૭૭

ફોન પર અવસાન નોંધ લખાવવા માટે સંપર્ક સાધો : ૯૯૧૩૭ ૦૦૦૩૬, ૯૪૨૬૨ ૫૧૯૭૪

# ગઢશીશામાં સ્વ. કલ્યાણજી બાપાની શોક સભા યોજાઈ

ભાસ્કર ન્યૂઝ. ગઢશીશા

ગઢશીશાના જૂની પેઢીના વેપારી એવા કલ્યાણજીભાઈ ગણાત્રાની શોકસભા મણિકૃપાધામ અંબાજી મંદિરે યોજાઈ હતી.

સદ્ગત ૮૫ વર્ષે પણ સતત સેવા પારાયણ જીવન જીવ્યા હતા. અંબિકા ચંદ્રનિકેતનમાં આવતા સંતો ભકતોની સહદય ભાવનાથી સેવા કરનારા કલ્યાણજી બાપાનું જીવન ભકિતમય હતું.તેમના નિધનથી ગઢશીશામાં શોકનું મોજુ ફેલાયું હતું.

સદ્ગત ચંદુમાં તથા જનકમાંના પિતાજી હતાં. સતત પ્રવૃત્તિમય જીવન વ્યતિત કરનાર કલ્યાણજીબાપા ગરીબોના જલાબાપા કહેવાતા હતા. તેઓ ગૌસેવા અને શ્વાનપ્રેમી હતા. મંદિરમાં ચાલતી સેવાકીય પ્રવૃત્તિમાં સદાય અગ્રેસર રહેતા. બાપા સૌ ભાવિક ભકતોમાં પ્રિય હતાં. સદ્ગતની પ્રાર્થના સભામાં તારાચંદભાઈ છેડા, માંડવીના હરીશભાઈ ગણત્રા, દિનકરભાઈ રૂપારેલ, સરપંચ લીલાવંતીબેન ચોથાણી, માંડવીના રેન્જ ફોરેસ્ટ ઓફિસર આઈ.કે.બારડ, તેમજ ગઢશીશા ગામના વિષ્ણુ સમાજ, પાટીદાર સમાજ, લોહાણા સમાજ , જૈન સમાજ, બ્રહ્મ સમાજ, ક્ષત્રિય સમાજ, દલિત સમાજ, મુસ્લિમના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા. માંડવીના ધારાસભ્ય ધનજીભાઈ સેંઘાણીએ શોક સંદેશ પાઠવ્યો હતો. મુંબઈ, બરોડા, અમદાવાદ,ભુજ તેમજ આંણદ, ખેડા જિલ્લાના માના ભકતો તેમજ ગઢશીશા ગ્રામ્ય વિસ્તારના રામપર, લુડવા,રત્નાપર, મંઊ, શેરડી, દુજાપર, કોજાચોરા, શેરડી તેમજ આસપાસના ગામના આગેવાનો હાજર રહ્યા હતા.

### ગાયોને ચારો અપાશે

ગૌસેવા યાદમાં પ્રાગપર, ભુજપુર, ગઢશીશા, પોલડિયા, પાંજરાપોળમાં ગાયો માટે ચારાનું નીરણ અન્ય ગામોમાં પણ ચારો મોકલાશે. ચંદુમાં અને જનકમાંએ જણાવ્યું કે, પશુપક્ષી શ્વાનોની સેવા પિતાની યાદમાં અવિરત ચાલુ રહેશે.

# ક્રોસવર્ડ-૨૦૨૫

ભૂપેન્દ્ર શાહ 'શંભુ'



**આડી ચાવી**

1. કીમતી કાગળો કે વસ્તુ લઇ જનારો, આંગડિયો (અં) (4)
3. સભા કે સમિતિનો પ્રમુખ (અં) (4)
5. સંજય દત્ત, સલમાન, માધુરીની ફિલ્મ (3)
6. બેંકમાંથી નાણાં ઉપાડવાની ચિઠ્ઠી (અં) (2)
7. ખેડવાથી પડતો લાંબો આંકો (2)
8. નાનું, હ્રસ્વ (2)
10. બળિયાના રોગની દેવી (3)
12. ટાઢું, ઠંડું (2)
13. નમાજ પહેલાં હાથ-મોં ધોવાં તે (2)
14. ભાગ, હિસ્સો (2)
15. શારીરિક ખામી (2)
16. ઔષધ વાટવાનો પથ્થર (3)
18. મધમાખીઓએ એકઠો કરેલો ફૂલોનો રસ (2)
20. અનાજનો બારીક ભૂકો (2)
21. અક્કલ, સમજદારી (2)
22. પ્રભાત, મળસકું (3)
23. તડામાર, ઝડી (4)
24. ડરપોક, બીકણ (4)

**ઊભી ચાવી**

1. નવું જાણવાની ઉત્કંઠા (4)
2. ખેંચાખેંચી, ચડસપૂર્વક ખેંચવું (4)
3. હાવભાવ, લટકા (4)
4. ઘૃણા, તિરસ્કાર (4)
9. રાત્રે જ દેખી શકતું પક્ષી (3)
11. ચોર (3)
12. એક જાતનું લાકડું (3)
15. મગર પર સવાર એક માતાજી (4)
16. પ્રાપંચિત ગોઠવણ, પંચાત, કડાકૂટ (4)
17. બીકથી લપલપ થાય તેમ (4)
19. પૃથ્વીનું તળ (4)

**જવાબ ક્રોસ વર્ડ 2024**

| | | | | | | | | |
|---|---|---|---|---|---|---|---|---|
| ન્યા | ય | મૂ | ર્તિ | | વે | ઈ | ટ | ર |
| ત | | સ | | પ | | શા | | વો |
| | ગો | ળી | | રી | | ન | ખ | |
| લા | પી | | સુ | ખ | ડ | | ગ | તિ |
| | | સૂ | ર | | મ | ધ્ય | | |
| કા | કા | | ભિ | ખા | રી | | કો | પી |
| | જી | પ | | ખ | | ઝ | ડી | |
| શ | | ર | | રો | | ર | | પા |
| ક | બૂ | ત | ર | | અ | ખ | ત | રો |

realpatidar.com

## મંગલ આરંભ

દીપ પ્રાગટ્ય કરી રહેલા વાસણભાઇ આહિર, ભુજ નગર પ્રમુખ દેવરાજભાઇ ગઢવી, કાશિયાના પ્રમુખ સંજયભાઇ દેસાઇ,નરેશ રાઠી, યુરો સિરામિકના ડાયરેક્ટર તલકશીભાઇ નંદુ તથા અન્યો નજરે પડે છે.

## અંજારના તાલુકામાં ૭ લાખની વીજ ચોરી પકડાઇ

ભાસ્કર ન્યૂઝ. ભુજ

અંજારના ગ્રામ્ય વિસ્તારમાં વીજ કંપનીની ચેકિંગ ટીમોએ ત્રાટકીને રૂા.૭ લાખની વીજ ચોરી ઝડપી પાડી હતી.

અંજાર ડિવિઝનના ગ્રામ્ય પેટા વિભાગ-૨ની ટીમ દ્વારા રહેણાકના ૩૬૨, વાણિજ્યના ૩૬, ખેતીવાડીના ૩ અને ૧ ઔદ્યોગિક મળી ૪૪૯ કનેકશનોની ચકાસણી કરાઇ હતી. જે પૈકી ૨૦ રહેણાક અને ૧ વાણિજ્યમાં પાવર ચોરી તથા ૧૩ ખેતીવાડી કનેકશનોમાં માલ પ્રેક્ટિસ બદલ રૂા.૭,૩૨,૫૨૦ના બિલો ફટકારાયા હતા.

સાપેડામાં લાલજી શામજી સુથાર નામના વ્યક્તિને રૂા. ૫,૯૦,૦૦૦નું બિલ ફટકારાયું હતું. તેમ અધિક મુખ્ય ઇજનેરે જણાવ્યું છે.

### સરહદી વિસ્તારોમાં લશ્કરની સંયુક્ત કવાયત દરમિયાન

# કચ્છમાં ૪૯ ત્રાસવાદી ઝડપાયા!

નર્મદાની પાણીની લાઇન તોડવા જતાં ત્રાસવાદીઓને સામખિયાળીમાંથી, સાંઘીથી અને રોડાસરના જંગલમાં પોલીસે કરેલું ઓપરેશન

ભાસ્કર ન્યૂઝ. ભુજ

કચ્છના સરહદી વિસ્તારોમાં સુરક્ષાદળોની અને વિવિધ એજન્સી સતર્કતા તપાસવા માટે ગુરુવાર બપોરથી સંયુક્ત લશ્કરી કવાયત હાથ ધરવામાં આવી હતી જેમાં કચ્છના પ્રવેશદ્વાર સામખિયાળીમાંથી ચાર, લખપત તાલુકાના રોડસર ગામના જંગલમાંથી ૨૧ અને અબડાસા તાલુકામાં સાંઘી ચાર રસ્તા પાસેથી ૨૪ ખૂંખાર આતંકવાદીઓને પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ઝડપી લીધા હતા. જો કે આ વ્યક્તિઓની પૂછપરછ કરતાં તેઓ વિવિધ સુરક્ષાદળોના જવાન હોવાનું અને ત્રણ દિવસ ચાલનારી આર્મિની કંબાઇન્ડ મિલિટરી એક્સસાઇઝમાં ભાગ લઇ રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

કચ્છના પ્રવેશદ્વાર સૂરજબારી ચેકપોસ્ટ ઉપર આધોઇ પોલીસ સ્ટેશનની ટીમ તેમના સબઇન્સ્પેક્ટર કે. આર. પરમારની આગેવાની હેઠળ ચકાસણી કરી રહી હતી દરમિયાન ભુજથી નીકળેલી જી.જે. ૧૮ વાય ૬૪૮ નંબર વાળી અને ભુજ અમદાવાદ-દહેગામ રૂટની એસટી બસનું ચેકિંગ કરવામાં આવતાં ચાર શંકાસ્પદ વ્યક્તિઓની વર્તણૂંક ભેદી લાગતાં પોલીસે તેમને બસમાંથી નીચે ઉતારીને પૂછપરછ કરી હતી. જેમાંથી ત્રણ વ્યક્તિ પોતે આર્મિમાં અને એક વ્યક્તિએ પોલીસમાં હોવાનું જણાવ્યું હતું. આ બીજી બાજુ શુક્રવારે સવારે આઇબી તરફથી પશ્ચિમી કચ્છમાં કેટલાક શંકાસ્પદ લોકો ફરી રહ્યા હોવાની બાતમી પોલીસને આપવામાં આવી હતી. આથી નખત્રાણા ડિવિઝનની પોલીસે સઘન પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. દરમિયાન નારાયણ સરોવર પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર બી. એમ. પરમારને બાતમી મળી કે, રોડાસર ગામના જંગલમાં કેટલાક લોકો વાહન સાથે ફરી રહ્યા છે. આથી તેઓ પોલીસની ટીમ સાથે જંગલમાં ધસી ગયા હતા અને જંગલમાં બે વાહનોમાં બેઠેલા ૨૧ સંદિગ્ધ માણસોને ઝડપી લીધા હતા. પૂછપરછ દરમિયાન ખબર પડી કે આ વ્યક્તિઓ આર્મિ, બીએસએફ, નેવી અને કોસ્ટગાર્ડના જવાનો હતા જેઓ મોકડ્રિલમાં ભાગ લેવા જઇ રહ્યા હતા.બીજી બાજુ વાયોર પોલીસ સ્ટેશનના સબઇન્સપેક્ટર કે. વી. દાફડા સાંઘીના ચાર રસ્તા તરફ એક જીપ અને મેટાડોર પૂરઝડપે શંકાસ્પદ રીતે આ બંને વાહનોમાંથી સુરક્ષાદળોના ૨૪ વ્યક્તિઓ મળી આવ્યા હતા.

બીજે દિવસે પોલીસ દ્વારા કુલ ૪૯ નકલી ત્રાસવાદીઓને ઝડપી લેવામાં આવ્યા હતા.

### આર્મિના હેલિકોપ્ટરો ઉડ્યા

કચ્છમાં ત્રણ દિવસ ચાલનારી જોઇન્ટ મિલિટરી એક્સરસાઇઝ માટે સેના દ્વારા ભુજથી હેલિકોપ્ટર સરહદી વિસ્તારોમાં મોકલતાં લોકોમાં કુતુહલ ફેલાયું હતું. આર્મિની સાથે એરફોર્સ તેના લડાકુ વિમાન પણ કવાયતમાં લગાડ્યા હતા.

# કચ્છના વિકાસમાં બાંધકામ વ્યવસાય મહત્ત્વનું પરિબળ

ભુજમાં 'કાશિયા' આયોજિત એક્સ્પો-૨૦૧૦ને રાજ્યમંત્રીએ ખુલ્લો મુક્યો

ભાસ્કર ન્યૂઝ. ભુજ

કચ્છ જિલ્લો બાંધકામ ક્ષેત્રે ઉંચાઇઓ સર કરવા જઇ રહ્યો છે ત્યારે તેની ડેવલોપમેન્ટની પ્રક્રિયામાં કચ્છનો બાંધકામ ક્ષેત્ર ખૂબ જ અગત્યના પરિબળ તરીકે ભાગ ભજવશે તેવું ભુજ ખાતે 'કાશિયા' દ્વારા આયોજિત એક્સ્પો ૨૦૧૦ વિધિવત રીતે ખુલ્લો મૂકતાં ભુજના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી વાસણભાઇ આહિરે જણાવ્યું હતું.

કચ્છી એન્જિનિયરો તેમની અદ્યતન ટેક્નોલોજી સાથે ગમે તેવી કુદરતી આફતમાં ટકી રહે તેવા મકાનના નકશા અને બાંધકામ મટિરિયલની ગુણવત્તાને બારીકાઇથી ચકાસણી કરે તેવું વાસણભાઇ આહિરે જણાવ્યું હતું. અને 'કાશિયા એટ એ ગ્લાન્સ' સભ્યોની પરિચય પુસ્તિકાનું વિમોચન પણ કર્યું હતું. રાજ્યકક્ષાના મંત્રી આહિરની સાથે ભુજ નગરપાલિકાના પ્રમુખ દેવરાજભાઇ ગઢવી પણ ઉપસ્થિત રહ્યા હતા.

કાશિયાના પ્રમુખ સંજય દેસાઇએ સંસ્થાના બે માસમાં ૫૦ લાખના ખર્ચે ઉભું થનારા ટેક્નોલોજી સેન્ટરની માહિતી આપીને આ અલગ અસ્તિત્વને ઓળખ અંગેની ખાસિયત જણાવતા કહ્યું હતું કે, બાંધકામ એ એન્જિનિયરોનું કઠિન કાર્ય છે અને ભૂકંપ બાદ તેમાં એન્જિનિયરોના ફાળા અને ભૂમિકાને આવકારી હતી. આ પ્રસંગે પરફેક્ટ ગ્લેઝડ દ્વારા મુખ્યમંત્રીના કન્યા કેળવણીના ફંડમાં ૧૧ હજારના દાનની જાહેરાત કરાઇ હતી.

યુરો સિરામિકના ડાયરેક્ટર તલકશીભાઇ નંદુએ હાજર રહીને પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.


**Admissions Open**

**Ashok Hall Girls' Residential School, Majkhali, Uttarakhand, India**
(Affiliated to the Council for Indian School Certificate Examination)

Limited seats available in classes IV to IX and XI.

For details, contact: Saumitra Sarkar on +91 99039 85429 , 090880 10479 / Principal on + 91 96900 05522 (www.ahgrs.net) / e - mail : ahgrsmajkhali@rediffmail.com



**ભાવભિની શ્રદ્ધાંજલિ**

**સ્વ. લુહાર રાઘવજીભાઈ જાદવજીભાઈ પરમાર**
સ્વ. તા. ૬-૫-૨૦૧૦, આદિપુર

આપનું વાત્સલ્ય સભર, નિઃસ્વાર્થ, પરોપકારી જીવન અને ધૂપસળીની જેમ પ્રસરાયેલ આપની જીવનયાત્રાની સુવાસ અમોને સદૈવ પ્રેરણા અને હૂંફ બક્ષે, આપ દેહથી ભલે દૂર થયા, પણ આત્માથી તો હંમેશા સમિપ જ છો. આપના દિવ્ય આત્માને પ્રભુ શાંતિ અર્પે એજ પ્રાર્થના...

- તુલસીદાસ જાદવજી પરમાર - ભાઈ • પુજાબેન મુકેશભાઈ પરમાર
- ધનજીભાઈ જાદવજી પરમાર - ભાઈ • જયશ્રીબેન નરેશભાઈ પરમાર
- લીલાવંતીબેન તુલસીદાસ પરમાર • વિજય ધનજીભાઈ પરમાર - ભત્રીજા
- કમળાબેન ધનજીભાઈ પરમાર • વૈશાલીબેન વિજયભાઈ પરમાર
- મુકેશ તુલસીદાસ પરમાર - ભત્રીજા • પ્રદીપ ધનજીભાઈ પરમાર - ભત્રીજા
- નરેશ તુલસીદાસ પરમાર - ભત્રીજા • ભવ્ય,માધવી,ભૂમિ,હર્ષ,ખુશી - પૌત્ર-પૌત્રી

સમસ્ત પરમાર પરિવારના જય શ્રી કૃષ્ણ



**naaptol** હૉટ ડીલ્સ દિવ્ય ભાસ્કર વાચકો માટે
અત્યારે જ ઑર્ડર નોંધાવો સવારના 7 થી રાતના 11
કૉલ: 0922 345 6000
SMS: naaptol 58888 પર • વિઝિટ : naaptol.com/hot
ચુકવણી : ડિલિવરી સામે રોકડા/ક્રેડિટ કાર્ડ/હોમ ડિલિવરી | તમારો પિન કોડ તૈયાર રાખો

ઓરિજનલ **BOSS e Phone 3300**
3.2" અતિ પાતળો, ટચ સ્ક્રીન મોબાઈલ
~~રૂા.9000~~
રૂા.3999
LOWEST PRICE CHALLENGE
તમને આ મૉડલ આનાથી સસ્તામાં મળે તો અમે તમને ભાવ ફરકની દસ ગણી રકમ ચુકવીશું.
- 3.2"(81mm) LCD ટચ સ્ક્રીન, QWERTY કીપૅડ
- 1.3MP કૅમેરા, MP3/MP4 પ્લેયર
- 10 પાનાની ફ્લીપ મેનુ સ્ક્રિન
- 4.5 કલાક ટૉક ટાઇમ, 72 કલાક સ્ટૅન્ડબાય ટાઇમ
- 100% માન્ય IMEI નંબર

6 મહિનાની સેલર વૉરન્ટી * શિપિંગ ખર્ચ રૂા.200/- વધારાના*
મફત 9 ભેટ રૂા.2000 ની
સ્પેશ્યલ પાઉચ, યુએસબી કાર ચાર્જર, સ્ક્રીન સ્ક્રેચ કાર્ડ, ફોન સ્ટ્રિંગ, ટીએફ કાર્ડ રીડર, સ્ટાયલસ, સ્ટીરિયો ઇયર ફોન, યુએસબી કેબલ, રેડીયેશન ગાર્ડ
ફક્ત ડિલીવરી પછી જ ચુકવણી કરો.

**સ્પાય પેન વિડીયો કૅમેરો**
16GB પેન ડ્રાઈવ + વૉઈસ રેકૉર્ડર

82% બચાવો
~~રૂા.8990~~
રૂા.1599
લાક્ષણિકતાઓ :
- વન ટચ વીડ્યો રેકૉર્ડિંગ બટન
- USB પીસી ચાર્જીંગ
- VGA કૅમેરો
- સ્ટૉરેજ સમય : 16GB માં 10 કલાક સુધી
- બૅટરી : લિથિયમ-આયન 800mAh
- ચાર્જીંગ સમયઃ 2 - 3 કલાક

6 મહિનાની સેલર વૉરન્ટી *
શિપિંગ ખર્ચ રૂા.150/- વધારાના*

*નિયમો અને શરતો લાગુ. વપરાશમાં લેવાયેલા લૉગોના કોપીરાઇટ્સ તેમના સંબંધિત માલિકોના છે. ઑર્ડરને ટ્રૅક / ગ્રાહક સેવા નંબર : 09223516148 / 09223526148 (7 AM થી 10 PM)
નાપતોલ કિયા ક્યા?



**જાહેરાત માટે સંપર્ક કરો**
**ફોન : ૩૦૮૨૨૩, ૩૦૮૨૨૬**



**KADI SARVA VISHWAVIDYALAYA**
Nr. Kh 5 Circle, Besides ITI, Sector-15, Gandhinagar.
(A University Established Vide State Act of Gujarat and Recognised by UGC)

**ADMISSION ANNOUNCEMENT For M. Phil/Ph.D programmes for the academic year 2010-11**

Kadi Sarva Vishwavidyalaya, Gandhinagar invites applications for admission to M. Phil/Ph.D programmes for the academic year 2010-11. The applications for M. Phil/Ph.D can be obtained from the University office at the above address on payment of Rs.300/- on all working days from 10th of May 2010 between 10-00 a.m. and 5-00 p.m. The applications can also be downloaded from our Website **www.ksvuniversity.org.in** and the same be submitted in our office along with a DD for Rs.300/- favouring Kadi Sarva Vishwavidyalaya, Gandhinagar payable at Gandhinagar on or before 6th June 2010. Those who have applied earlier need to apply a fresh in the prescribed format and those whose proposals were not accepted by RDC also need to apply afresh again. **The admission to the above programmes will be through an entrance test to be conducted at Gandhinagar on 12th of June 2010 followed by presentation before RDC of the successful candidates in entrance test for Ph.D.** For M. Phil programme the admission will be through an entrance test and personal interview. The details regarding the various branches in which M. Phil and Ph.D programmes are offered can be obtained from our website **www.ksvuniversity.org.in.**

REGISTRAR



**University of Pune**
UNIVERSITY WITH POTENTIAL FOR EXCELLANCE)
**Admission Notice 2010 - 11**
Through Entrance Test to the following courses of University Departments

''यः क्रियावान स पंडितः''
*****
NAAC ACCREDITED

| M.Sc. | Contact No. | M.A. | Contact No. |
|---|---|---|---|
| Bioinformatics | Ph.25690195 | Geography | Ph.25601364 |
| Biotechnology | Ph.25691333 | Master of Journalism and Mass Communication | Ph.25654069 |
| (Institute of Bioinformatics & Biotechnology) (Five Years Integrated after 12th Science)** | | Mathematics | Ph. 25601357 |
| Botany | Ph.25601439 | Performing Arts (Music, Dance, Theatre)* (Gurukul Pattern) | Ph.25692182 |
| Chemistry | Ph.25601397 | Statistics | Ph.25698752 |
| Electronic Science | Ph.25699841 | Statistics Actuarial | Ph.25698752 |
| Environmental Science | Ph25691195 | **B.A.** | |
| Geography | Ph.25601364 | Performing Arts (Dance, Theatre, Music) * (Gurukul Pattern) | Ph.25692182 |
| Geoinformatics | Ph.25601364 | M.Com | Ph.25601312 |
| Geology | Ph.25695373 | **PG Diploma in :** | |
| Health Sciences | Ph.25691758 | Geotechnology | Ph.25695373 |
| Master in Public Health | Ph.25691758 | Geoenvironmental Appraisal and Management (Geology) | Ph.25695373 |
| Instrumentation Science | Ph.25695195 | **Diploma in :** | |
| Microbiology | Ph.25690643 | Mass Media (English Medium) | |
| M.Cm.S. (Communication Studies) | Ph.25696348 | Journalism (Marathi Medium) | Ph.25654069. |
| Mathematics | Ph.25601357 | Diploma in Advance Network Security | Ph.25601371 |
| Physics | Ph.25692678 | **PG B.Sc. (Applied) in** | |
| Statistics | Ph.25698752 | Analytical Techniques | Ph.25601397 |
| Statistics Actuarial | Ph.25698752 | GIS and Remote Sensing | Ph.25601364 |
| Virology- (IBB) | Ph.26006304 | **Others :** | |
| Zoology | Ph.25698432 | M.Tech.(Atmospheric Sciences) | Ph.25691712 |
| | | M.Tech (Industrial Mathematics with Computer Applications) | Ph. 25601357 |
| | | M.Tech in Modeling & Simulation | Ph.25690842 |

(Internet explorer version 5.0 and above) Please follow the instruction available on website **www.unipune.ac.in** from 10th May 2010

**Eligibility** : Information is available on University website.
**Reservation** : 50% seats are reserved for SC, ST, DTNT & OBC, 3% seats are reserved for physically handicapped students, 30% seats are reserved for female candidates for Graduate courses as per Government of Maharashtra Rules.
**Quota** : for other university students 30%
**Entrance Test Fee:** (non-refundable & non-transferable)
(a) **Rs. 500/-** for candidates belonging to open category and Outside Maharashtra,
(b) **Rs. 350/-** for candidates belonging to SC: ST, DT (A), NT (B), NT (C), NT (D) and OBC categories having caste certificate issued by 'Government of Maharashtra' only.
*Entrance Test Fees (Performing Arts): **Rs. 900 /-** and 650/- for above (a) and (b) candidates respectively.
**Biotechnology (Five years Integrated) : **Rs. 1000/-** and 600/- for above (a) and (b) candidates respectively.
**Mode of Payment :** Demand Draft of any Nationalized bank in favour of **"Registrar, University of Pune"** payable at pune.
**Last Date:** Coursewise last dates of application are available on website.
Advt. No. : 21
Date : 6-5-2010

**Dr. M. L. Jadhav**
**Registrar**



**વાળ ખરવાનો કે સફેદ થવાનો ડર...**
**રાહ ના જુઓ, ન્યૂટ્રીચાર્જ લો !**

ન્યૂટ્રીચાર્જ વાળને ખરવાથી રોકવામાં મદદ કરે છે -
ન્યૂટ્રીચાર્જમાં છે વિટામીન બી3, બી5, બી6, ફોલીક એસિડ, મેગ્નેશિયમ, ઝીંક જે વાળને મજબૂતી આપે છે, તેને ખરવાથી રોકવામાં મદદ કરે છે. તેમાં ઉપલબ્ધ બાયોટીન અને અમીનો એસિડ્સ, જેમ કે એલ-મિથયોનિન વાળને ઘેરા અને ચમકદાર બનાવે છે. વિટામીન એ, સી, ઈ વાળને ફ્રી રેડિકલ્સથી બચાવીને તેને સ્વસ્થ રાખે છે. સાયન્ટીફિક ફૂડ ન્યૂટ્રીચાર્જની એક ગોળી રોજ નાસ્તા પછી લો અને આશ્ચર્યજનક ફરકનો અનુભવ કરો.

ન્યૂટ્રીચાર્જના ફાયદા- • એનર્જી અને સ્ટેમિના વધારે છે • પ્રતિરોધકતા વધારે છે • વધુ સારી યાદશક્તિ માટે • દ્રષ્ટીનું તેજ જાળવે છે • હૃદયને સ્વસ્થ રાખે છે • વાળને ખરતા રોકે છે • કૉમ્પિટિશનમાં આગળ રાખે છે • સ્ટ્રેસ ઓછો કરે છે • બ્લડ શુગર અને કોલેસ્ટ્રોલનું વધુ સારૂં વ્યવસ્થાપન કરે છે

**વધતી ઉંમરના ખરાબ પ્રભાવોની રાહ ના જુઓ, ન્યૂટ્રીચાર્જ લો.**

ખરીદવા માટે 'SMS' કરો- Nutricharge ના પછી પોતાનો ઓર્ડર, નામ અને સરનામું મોકલો
**98708 01717**
ઓનલાઈન ખરીદવા માટે **www.nutricharge.com**
માત્ર રૂા.270 (ત્રીસ ગોળી) એક મહિનાનું પેક
nutricharge SCIENTIFIC FOOD FOR MEN

2010-05-08 -Divya Bhaskar -Invitation & Consitution Passed [393]



# મુંબઈની જીવાદોરી લોકલ ટ્રેનની જન્મપત્રિકા

## રેલવે દર વર્ષે ૭૨.૮ કરોડ ટન ભારનું અને દરરોજ ૧.૭ કરોડ મુસાફરોનું પરિવહન કરે છે

realpatidar.com

સેમ્યુઅલ જોન્સન નામના સાહિત્યકારે ૧૭૮૬માં લખેલું કે 'ઈન ટ્રાવેલિંગ એ મેન મસ્ટ કેરી નોલેજ વિથ હીમ એન્ડ હી વીલ બ્રિંગ હોમ ધ નોલેજ.' અર્થાત્ માનવીએ મુસાફરી કરતી વખતે તેની સાથે જ્ઞાન લઈ જવું જેથી તે ઘરે જ્ઞાન લઈને આવે. મુંબઈની લોકલ ટ્રેન અગર કોઈ પણ ભારતીય ટ્રેનનો મુસાફર મુસાફરી કરીને જ્ઞાન જ નહીં પણ ફિલોસોફર બનીને ઘરે આવે છે અને ખાસ તો જીવનની ક્ષણભંગુરતા સમજે છે. ગુજરાતના એક પ્રધાને આઠ વર્ષ પહેલાં 'છૂક છૂક ગાડી' ઉપર લેખ લખેલો.અમારી લોકલ ટ્રેન વીજળીથી એન્જિન વગર ચાલતી ટ્રેન છે એમ છતાં તેણે અશોકકુમારનું ગીત રેલગાડી, રેલગાડી છૂક છૂક છૂક બીચવાલે સ્ટેશન બોલે રૂક રૂક રૂકનું લોકપ્રિય ગીત ટાંકેલું. વડોદરાના સયાજીબાગમાં બાળકોની રેલગાડીમાં બેસીને શમ્મી કપૂરે 'ચક્કે પે ચક્કા, ચક્કે પે ગાડી'નું ગીત ગાયેલું. અમારી લોકલ ગાડી મંગળવારે રૂક રૂક રૂકના ગીતની જેમ સાવ બંધ થઈ ગયેલી. પણ મમતા બેનરજીની કોલસાવાળી છૂક છૂક ગાડી જોરદાર ચાલે છે. રેલવે બોર્ડના ચેરમેન કેસી જેનાએ જગતમાં બીજે નંબરે આવતી આપણી રેલવે વિશેના આંખો પહોળી કરનારા સ્ટેટીસ્ટીક્સ આપ્યા છેઃ

ભારતીય રેલવેના ૭૦૦૦ સ્ટેશનો છે અને છૂક છૂક ગાડીના ૬૨૦૦૦ કિલોમીટર લાંબા પાટા છે. ૪૫૦૦૦ જેટલા શશી થરુર કહે છે તેવા પેસેન્જરોના 'ઢોર'ના ડબા છે અને ૨૬૧૦૦૦ માલવેગનો છે. આ ગાડી દર વર્ષે ૭૨.૮ કરોડ ટન ભારનું અને દરરોજ ૧.૭ કરોડ મુસાફરોનું પરિવહન કરે છે. એટલે કે જગતના ૩૫ દેશોની વસતિને રોજેરોજ ભારતીય રેલવે વહે છે-દર વર્ષે જગતની વસતિ જેટલા ૬ અબજ ઉતારુઓ વહન કરે છે. ૩૦૦૦ ટ્રેનોમાં ૮ લાખ જેટલી સીટો રિઝર્વ કરાય છે અને આજે અમદાવાદ બેઠાં તમે મુંબઈ કે દિલ્હી કે કોલકાતાની ગાડીની બેઠક રિઝર્વ કરાવી શકો છો. આવા જંગી આંકડા રેલવે બોર્ડના ચેરમેને આપ્યા પણ ભારતીય રેલવેને જન્મ ક્યાં થયો તે લખ્યું નથી.

તેનું જન્મસ્થળ અમારું મુંબઈ યાને કે થાણા (થાણે) છે. એપ્રિલ,૧૮૫૩માં મુંબઈ અને થાણે વચ્ચે એક લોકલ ટ્રેને સૌ પ્રથમ વખત ૩૪ કિલોમીટરનું અંતર કાપેલું. પછી આજે જે છત્રપતિ શિવાજી ટર્મિનસ તરીકે ઓળખાય છે તે વિક્ટોરિયા ટર્મિનસ ઉર્ફે બોરીબંદરથી ૪૦૦ મુંબઈગરાને લઈને એ ટ્રેન ઊપડેલી ત્યારે સૌને માટે ઉજાણીનો દિવસ હતો. રેલવે પ્રધાન મોટે ભાગે નિંદાઈ જાય છે. મધુ દંડવતેએ ૩૦ વર્ષ પહેલાં લોકલ ટ્રેનના સિઝન ટિકિટના ભાવ બમણા કરીને અમારી 'સમાજવાદી ગાળો' ખાધેલી. પણ અમે એ વધારાને અને આજની ઢોર જેવી ગિરદીને પચાવી ગયા છીએ. શું કામ નહીં?

કાંદિવલીમાં શેઠિયા રહેતા ત્યારે કોઈની પાસે મોટર નહોતી માત્ર ગોરા ગવર્નરને ઘરે મોટર હતી. લક્ષાધિપતિ શેઠિયા શેરબજાર કે કાપડબજારમાં જાય ત્યારે સુશીલ પત્નીઓ તેમને ટિફિન બંધાવી આપતી. પછી શેઠિયાઓ ચાલતી લોકલ ટ્રેને ટિફિન ખોલીને એકબીજાની પત્નીઓના અથાણાં, સંભારિયા મરચાં અને અડદની દાળના વખાણ કરતા. આ લોકલ ટ્રેનમાં સુવાવડી બહેનો તેના બાળક માટે અગર નવપરણેતર તેના પ્રિયતમ માટે સ્વેટર ગૂંથતી. ૧૬ એપ્રિલ, ૧૮૫૩ના રોજ લોકલ ટ્રેન બોરીબંદરથી થાણા જવા ઊપડી ત્યારે તે સમયના ગવર્નર લોર્ડ ફોકલેન્ડને તો થાણા (થાણે)નો ઉચ્ચાર પણ આવડતો નહીં. તે થાણાને તન્ના કહેતા ત્યારે બોરીબંદરથી 'તન્ના' જવાની ટિકિટ ફક્ત સવાપાંચ આના હતી. આ લોર્ડ ફોકલેન્ડના માનમાં મુંબઈની એક શેરીનું નામ 'ફોકલેન્ડ રોડ' રખાયું. પૂણેના અંગ્રેજી વહીવટકારે ત્યાંની વેશ્યાઓને કાઢી મૂકી તે મુંબઈ આવીને ફોકલેન્ડ રોડ પર વસેલી. તેથી તે ફોકલેન્ડ રોડ નિંદાઈ ગયો છે. એ વખતે હજી લોકલ ટ્રેન વીજળીથી નહીં પણ છૂક છૂક ગાડીના કોલસાનાં એન્જિનથી ચાલતી, તેવા ચાર એન્જિનો આ લોકલ ટ્રેન સાથે જોડાયેલા તે દિવસે ૧૬-૪-૧૮૫૩ના રોજ હરખ કરવા બૅન્કો અને સરકારી ઑફિસોમાં રજા પળાયેલી. ૧૫૭ વર્ષ પહેલાં તો લોકો લોકલ ટ્રેન જોઈને એટલા આનંદિત થયેલા કે થાણા પહોંચીને ત્યાં તંબુ નાખીને કોકટેલ ડીનર રાખેલું. ટ્રેનને ૨૧ તોપની સલામી અપાયેલી. બીજે દિવસે મુંબઈના સર જમશેદજી જીજીભાઈ નામના પારસીએ અમદાવાદના મિલમાલિક મિત્રો અને બીજાને બોલાવી આખી ટ્રેન રિઝર્વ કરાવી લોકલ ટ્રેનની સફર કરાવેલી.

આજે તમે જે મોટરમેનને વીજળીથી ચાલતી ટ્રેન ચલાવતા જુઓ છો તે ૩-૨-૧૯૨૫માં પ્રથમવાર બોરીબંદરથી કુર્લા સુધી દોડેલી. ૧૯૩૧માં તો મુંબઈથી પુના જતાં ટ્રેનને ૫ દિવસ લાગતા. પણ વીજળી ટ્રેનથી પુના પહોંચતાં માત્ર ૬ કલાક લાગતા. આજે માત્ર ત્રણ કલાક લાગે છે. બોરીવલીથી ચર્ચગેટનું અંતર ફક્ત ૬૫ કિલોમીટર છે તે કાપતાં લોકલ ટ્રેનને માત્ર ૫૦ મિનિટ થાય છે. જ્યારે મુંબઈના મોટરમાલિક બોરીવલીથી તેની મોટરમાં બેસી મુંબઈની શેરબજારમાં મોડો મોડો ૧૩૦થી ૧૪૦ મિનિટે પહોંચે એટલો જંગી ટ્રાફિક છે. લોકલ ટ્રેન તે માટે વધુ સ્પીડવાળી છે. એક જમાનામાં લોકલ ટ્રેન હાલતાચાલતા મંદિર હતાં. લોકલના ઘણા ડબામાં ગણેશની છબી લટકાવાતી. લીલા તોરણ બંધાતા. જુદી જુદી ભજનમંડળી જે ચાલતી ટ્રેને ભજન ગાય તેમના નામોનું બોર્ડ લટકાવાતું. ઘણા વૃદ્ધો તો માત્ર સમય પસાર કરવા જ લોકલ ટ્રેનમાં મુસાફરી કરતા. વીજળી ટ્રેન આવી ત્યારે તેને ચલાવનારા ડ્રાઈવર નહીં પણ ઈલેક્ટ્રિકલ ઈજનેરીનો ડિપ્લોમા ધરાવનારને રૂ.૯૦૦થી રૂ. ૧૧૦૦ના પગારની નોકરી મળતી તે મોટરમેન કહેવાતા. તેમને વર્કશોપમાં નવ મહિના સુધી ટ્રેન ચલાવવાની તાલીમ અને ૩ મહિના ઈલેક્ટ્રિક થિયરીનું જ્ઞાન અપાતું. એક મોટરમેને સિગ્નલોને કઈ રીતે અનુસરવા તે વાત એક પત્રકારને કહેલી.

ઘણીબધી તાલીમ પછી મોટરમેનની આંખોની તબીબી તપાસ થાય. એ તપાસ પછી પણ દર વર્ષે મોટરમેનની આંખો તપાસાય છે. અમુક નંબરના જ માઈનસ-પ્લસ નંબરનાં ચશ્માં હોય તો નજરઅંદાજ કરાય છે. મોટરમેનમાંથી એક જણ કેન્દ્રના કોઈ પ્રધાનનો સગો હતો ત્યારે મોટરમેનની તકલીફો સમજાતાં તેઓના પગાર વધીને માંડ મહિને રૂ.૧૨૦૦ના થયા. તે ૩૨ વર્ષે વધીને માત્ર માત્ર રૂ.૪૦૦૦ આસપાસ થયા છે. મલ્ટિનેશનલ કંપનીના પિયૂન આનાથી દોઢો પગાર મેળવે છે. જાનને જોખમે મોટરમેનો ઓવરટાઈમ કરે છે.

### તંત્રીલેખ

# વર્લ્ડ ચેમ્પિયન ટીમ આ રીતે રમે?

## દરેક મોટી ટૂર્નામેન્ટમાં ભારત એકાદ વખત આવું વિચિત્ર રમે જ છે

ઑસ્ટ્રેલિયા સામેની ટી-૨૦ વર્લ્ડકપની સુપર એઈટ મેચમાં ભારત જે રીતે રમ્યું તે કોઈ પણ ક્રિકેટ ચાહકને નિરાશ કરનાર હતું. ઑસ્ટ્રેલિયાએ પહેલા તો ભારતના બોલર્સને આડેધડ ધોયા. છેલ્લી ચાર ઓવર અને હરભજનની ઓવરોને બાદ કરતાં ઑસ્ટ્રેલિયન બેટસમેન કયારેય દબાયા નહોતા. ભારતની બીજી જ ઓવરમાં પહેલી વિકેટ પડી ગઈ. ટાર્ગેટ સાવ અશક્ય નહોતો. પણ ૯૭ રનમાં આઠ વિકેટ ફેંકી દીધા પછી કોઈ શક્યતા બચતી નહોતી. ૧૩૫ રનમાં આખી ટીમ પેવેલિયન ભેગી થઈ જાય એ તો હદ થઈ. એકમાત્ર રોહિત શર્મા ઝઝુમતો રહ્યો. આ મેચે દેખાડયું છે કે ભારતની ટીમ જેટલી દેખાય છે એટલી મજબૂત નથી. મેચ પહેલાંની મીડિયા ચર્ચામાં બે મજબૂત ટીમના મુકાબલાની વાતો થતી હતી. અહીં તો આખી મેચ એક તરફી થઈ ગઈ. હવે પરાજયનાં કારણોની ચર્ચાની સાથે જ દોષારોપણ પણ થશે. મેચ ફિક્સ થઈ ગઈ હતી એવો આરોપ કરવાથી માંડીને ક્રિકેટરો જાહેરાતમાં જ ધ્યાન આપે છે, મેદાન બહારની એક્ટિવિટી વધી ગઈ છે, આઈપીએલમાં રમીને થાકી ગયા એટલે રમી ન શકયા વગેરે આરોપો મુકાશે. મહેન્દ્રસિંહ ધોની ઉપર છાણાં થપાશે. ધોનીએ ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો તે ખોટો હતો અને સ્પિનરોના સ્થાને મીડિયમ પેસર લેવા જોઈતા હતા, બેટિંગ લાઈનઅપ મજબૂત બનાવવાના મોહમાં ધોનીએ ભૂલ કરી વગેરે વગેરે. પણ જો રોહિત શર્મા રમી શકયો તો અન્ય ખેલાડીઓ પણ રમી શકયા હોત. આ મેચ હારવા પાછળ માત્ર બોલર્સ જવાબદાર નહોતા, ૧૮૫નો ટાર્ગેટ સાવ અશક્ય નહોતો જો ભારતની પ્રથમ વિકેટ ૫૦ રનમાં ન પડી ગઈ હોત. હકીકત એ છે કે મોટી ટૂર્નામેન્ટસમાં ભારત એકાદ વખત તો આવું વિચિત્ર રમે જ છે. ભારત ફાઈનલ સુધી પૂરા ડોમિનન્સથી પહોંચી ગયું હોય તેવું બહુધા બનતું નથી. ફલાણી ટીમ હારે અને આટલાં માર્જીનથી હારે તો ભારત સેમિફાઈનલ કે ફાઈનલમાં પહોંચે એવી ગણતરીઓ ક્રિકેટરસિકોએ કરવી જ પડતી હોય છે. આ વખતે પણ આ પરાજય પછી એટલું તો નક્કી થઈ ગયું જ છે કે સેમિફાઈનલમાં પહોંચવા માટે ભારતે હવે પછીની બંને મેચ ફરજિયાત જીતવી પડશે. આવું શરમજનક પ્રદર્શન ચાલુ રહેશે તો બંને મેચ જીતવી સહેલી તો નહીં જ હોય. પ્રથમ ટી-૨૦ વર્લ્ડકપ જીત્યા બાદ ભારતનું પ્રદર્શન સારું રહ્યું નથી. ધોનીની ટીમ પાસેથી અપેક્ષા વધુ છે, આશા ઓછી.

### મેનેજમેન્ટ ફંડા

એન. રઘુરામન

# રિયાલિટી શૉ જ અંતિમ મુકામ નથી

તાજેતરમાં જ દેશના જુદા જુદા ભાગોમાં ત્રણ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો, કેમ કે તેમને ટીવી ચેનલ પર ચાલતા રિયાલિટી શૉની ગાયન હરીફાઈમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી ન હતી. આ ત્રણમાંથી એક નેહા સાવંત નામની છોકરી હતી, જેનું મોત થઈ ગયું. બાકી બેની ઓળખ બતાવવી ઉચિત નથી લાગતું. આ મુદ્દે બીજા પણ અનેક યુવાનો પોતાના માતાપિતાથી નારાજ હશ. આજની પેઢીનું ફક્ત એ વાત પર ધ્યાન દોરવા માગું છું કે તે વિજેતાઓનું શું થયું જે છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન ઈન્ડિયન આઈડોલનો ખિતાબ મેળવી ચૂક્યા છે. કોઈ પણ ક્ષેત્ર સાથે જોડાયેલા તમામ પાસાઓ પર વિચાર કર્યા બાદ જ અંતિમ નિર્ણય લેવો જોઈએ.

સૌથી પહેલા આપણે પ્રથમ ઈન્ડિયન આઈડોલ બનેલા મુંબઈના અભિજિત સાવંતની વાત કરીએ. આ ૨૮ વર્ષનો ગાયક બોલિવૂડમાં બ્રેક મેળવવા આજે પણ સંઘર્ષ કરી રહ્યો છે. વર્તમાનમાં ઈન્ડસ્ટ્રીમાંથી તેની પાસે એક પણ ઑફર નથી. તેણે મીડિયાને જણાવ્યા અનુસાર તે હોસ્ટો શૉ પર વધુ ધ્યાન આપે છે. બીજો ઈન્ડિયન આઈડોલ સંદીપ આચાર્ય બન્યો હતો. બીકાનેરનો આ યુવાન અત્યારે ભોજપુરી ફિલ્મોના ગીતોમાં પોતાનો અવાજ આપી રહ્યો છે. સંદીપના અનુસાર બોલિવૂડ પણ હવે વધુ દૂર નથી. તે સ્વીકારે છે કે ગાવાની કેરિયરને ઉચ્ચ સ્તરે પહોંચાડવા માટેનો સંઘર્ષ ચાલુ છે. ત્રીજો ઈન્ડિયન આઈડોલ બનેલો દાર્જિલિંગના પ્રશાંત તમાંગને પણ હજુ સુધી બોલિવૂડમાં તક મળી નથી. ૨૪ વર્ષની સૌરભી દેબબર્મા ગયા વર્ષે આ શ્રેણીમાં ખિતાબ જીતનારી પ્રથમ મહિલા હતી. અગરતલાની આ વિદ્યાર્થિની કેટલીય સંગીત કંપનીઓ સાથે વાટાઘાટો કરી રહી છે, પરંતુ હજુ સફળ થઈ નથી. સૌરભી કહે છે કે સંઘર્ષ ચાલુ છે અને આજે પણ તે તકની વાટ જોઈ રહી છે.

આ જ રીતે બીજા રિયાલિટી શૉના વિજેતાઓની પણ આવી જ સ્થિતિ છે. તેનાથી ક્ષણિક સફળતા તો મળી જાય છે, પરંતુ આગળનો માર્ગ સરળ હોતો નથી. આવા સંજોગોમાં શું એ ઉચિત છે કે આ પ્રકારની બાબત માટે ગુસ્સો કરીને આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવે? હું આ રિયાલિટી શૉનો વિરોધી નથી, પરંતુ દુનિયા તેના કરતાં ઘણી વિશાળ છે.

ફંડા એ છે કે જો તમે ગાયક બનવા માગતા હો તો એ ન વિચારો કે તમારા માર્ગમાં ફક્ત ફૂલ જ ફૂલ પાથરેલા હશે. ફૂલોની સાથે કાંટા પણ હોય

# પોતાના જ પડછાયાથી દૂર ભાગતા ફિલ્મ સ્ટાર

### પરદે કે પીછે

જયપ્રકાશ ચૌકસે

મોટા ભાગના સુપરસ્ટાર્સને રાતે ઊંઘ આવતી હોતી નથી, એ એક આશ્ચર્યની બાબત છે. રાજ કપૂરથી લઈને રાજેશ ખન્ના, અમિતાભ બચ્ચન, સલમાન ખાન, શાહરુખ ખાન વગેરે તમામ અનિદ્રા (ઈન્સોમ્નિયા)ની વ્યાધિ ધરાવે છે. છેવટે સિતારાઓની મહેફિલમાં રાતના જાગરણ શા માટે હોય છે? નવી પેઢીના અભિનેતાઓમાં ફક્ત અક્ષયકુમાર રાતે દસ વાગ્યા સુધીમાં ઊંઘી જાય છે. આ અનિદ્રાનો રોગ અનિયમિત જીવનશૈલીને લીધે થાય છે કે પછી તેઓ પોતાના સ્ટાર સ્ટેટસનો અધિકતમ ઉપયોગ કરવા રાતે અલખ જગાવે છે.

એક જમાનામાં મધ્યપ્રદેશના એક મુખ્યપ્રધાનના નિવાસસ્થાને રાતે મોડે સુધી મેળો જામતો હતો. તેનું કારણ પૂછતાં તેમણે કહ્યું હતું કે તેઓ સત્તાનો વધુમાં વધુ લાભ લેવા ઈચ્છે છે અને ઊંઘી જાય તો આ સુવર્ણકાળને પૂરેપૂરો વટાવી નહીં શકે. સત્તા શક્તિ બનીને નસોમાં વહે છે, એ જ ઊર્જા છે.

આજના દોરમાં ફિલ્મ સ્ટાર્સના હાથોમાં ઘણી સત્તા હોય છે અને તેમના ઈશારાથી ઘણાં કામો થઈ શકે છે. નિર્માતા, દિગ્દર્શક, લેખક, હીરોઈનો વગેરે વગેરે બધાં હાથ જોડીને તેમની સાથે કામ કરવા વિનંતીઓ કરતા હોય છે. નેતાઓ અને ઉદ્યોગપતિઓ પણ કતારમાં ઊભા હોય છે. સ્ટારને છીંક આવે તોયે આખા દેશમાં ઠંડીની લહેર ફેલાઈ હોય એવો શોરબકોર 'મીડિયા' મચાવે છે. પોતાના પ્રભાવ-વટની નિયોન રોશનીમાં ડૂબેલી વ્યક્તિ ઊંઘીને એટલો વખત પોતાના એ વટ-દરજજાના દબદબાની અનુભૂતિથી દૂર રહે છે. એ પોતાના હરીફથી વધુ પોતાની જાતથી જ આતંકિત હોય છે અને લાખ પ્રયાસો છતાં એ બિચારા માટે સહજ સ્વાભાવિક થવું અઘરું હોય છે.

ફિલ્મો હજારો વૉટની રોશનીમાં બને છે, પણ અંધારા સિનેમાગૃહમાં બતાવાય છે, જ્યાં સિતારા હૈસિયત એટલે કે સ્ટારડમ-સ્ટાર સ્ટેટસનો નિર્ણય લેવાય છે. તેથી જ આ સિતારાઓને રાતો વધુ અનુકૂળ હોય છે.

એ સામાન્ય માનવીની જેમ મહેનત નથી કરતો. કારણ કે તેને રાતે કોઈ દુઃસ્વપ્ન વિના ઘેરી ઊંઘ આવે. રાતના મોહ અને હંમેશાં માટે રહેતી થોડી બેચેની તેનો માનસિક ખોરાક છે. બેચેનીના તરંગો અને તેમાંથી જન્મેલી અનિદ્રા તેને ગમે છે. તેથી જ સામાન્ય પરિસ્થિતિઓ તેને અજીબ વિચિત્ર લાગે છે. પોતાનાથી બહેતર ઘણા હોવાના તથ્ય તરફ એ આંખ આડા કાન કરે છે. તેની સફળતામાં તેની મહેનત અને પ્રતિભાથી વધુ સંજોગ-નસીબનું યોગદાન હોવાની હકીકત એ પચાવી શકતો નથી. આ તથ્યને નકારવામાં તેનો મહાનતમ હોવાનો ભ્રમ યથાવત્ રહે છે. ઊંઘી જાય તો સ્વપ્નમાં તેને પોતાની નબળાઈઓના ભૂત ડરાવી શકે એમ હોય છે.

ફિલ્મ સ્ટાર આખો દહાડો ભીડથી ઘેરાયેલો રહે છે. તેણે તો અંતરંગ પ્રેમદશ્યો પણ સો માણસોના યુનિટની સામે, હજારો વૉટની રોશનીમાં ભજવવાના હોય છે, પ્રશંસક, પ્રાયોજક વગેરેથી તેને રાતે જ મુક્તિ મળે છે. રાતનું એકાંત તેના આત્માનો અરીસો બની જાય છે. એ વખતે જ એ પોતાના નિકટતમ લોકોની સાથે, પ્રચારની ચમકદમકથી દૂર રહી શકે છે. આખો દહાડો એ અનેક પરિતાપો ઝીલે છે અને રાતે તેને રાહતના પંખાની હવા રાહત રૂપે મળે છે. તેથી જ સિતારાઓને મોડેથી ઊંઘ આવે છે.

'ઈક રિદા-એ-તીરગી હૈ ઔર ખ્વાબે કાપનાત ડૂબતે જાતે હૈ તારે ભીગતી જાતી હૈ રાત'

# સેવા, સંપ, સંગઠનમાં શિરમોર કચ્છી લેવા પટેલ સમાજ

કચ્છી લેવા પટેલ સમાજ આજે દરેક ક્ષેત્રે હરણફાળ ભરી રહયો છે હવે ભૂતકાળના દિવસો ભૂલી જવાના છે. જો ભૂતકાળની વાત કરીએતો દોઢ લાખ જેટલા લેવા પટેલો માંથી આજ દિવસ સુધી પોતાનો ધારાસભ્ય પણ નસીબ નથી થયો, કણબીનો દીકરો કાં પાણી વાળે કે બળદના પૂંછળા આમડે જેવા કામો કરે તેને 'રાજ' કરવાનું ન હોય એવી માન્યતા હતી. સ્ત્રીવર્ગની હાલત પણ ખૂબજ નાજુક હતી. ખાવાના સાંસા હોય ત્યાં શિક્ષણ આરોગ્યની વાતો કયાં કરવી. અજ્ઞાનતા પણ ચરમ સીમાએ હતી. આજે આ દિવસોએ વિદાય લીધા છે. જ્ઞાતિમાં શિક્ષણનું પ્રમાણ દિન-પ્રતિદિન વધતું જાય છે. સમાજમાં હવે તબીબ, એન્જિનિયરિંગ, કમ્પ્યૂટર ક્ષેત્રે પણ ઘણી પ્રગતિ નોંધાઇ છે.

અથાગ મહેનતના અંતે વિદેશમાં પણ સારી નામના અને સંપત્તિ મેળવી છે. વિદેશમાં હવે રાજકારણમાં પણ પ્રવેશ કર્યો છે. જ્ઞાતિનું ગૌરવ વધારી મોભો જાળવી રાખ્યો છે. કહેવાય છે એક સરખો સમય કોઇનો રહેતો નથી. લેવા પટેલ મહેનતું જાતિ છે.મહેનતમાં કદી પીછેહઠ કરતા નથી. આ મહેનત અને શિક્ષણે જ્ઞાતિનું પાનું બદલી નાખ્યું છે. આજે જ્ઞાન સાથે સમૃધ્ધિને પ્રાપ્ત કરી છે. એકતા અને સંગઠન શકિત પણ મોટી છે. વિદેશમાં તા.૩/૧/૪૮ ના મોમ્બાસા લેવા પટેલની સ્થાપના કરી ૧૫/૮ના કચ્છી કણબીઓનું અધિવેશન મળ્યું જેમાં ખોવાયેલી અસ્મિતા પાછી આણવાની સમજ આપી ચિનગારી ભડકી ઉઠી તા.૨૬/૧૨/૧૯૫૪ના નૈરોબી લેવા પટેલ સમાજની ઐતિહાસિક શરૂઆતથી એકતાની ઓળખ થવા લાગી તા.૧૬/૧/૪૬ના રચાયેલું એક મંડળ કચ્છી લેવા પટેલ સમાજનુંક્રાંતિબીજ હતું. સ્વ. નારણ ગોપાલ(સુખપર રોહા) મનજી કરશન, હરજી લધા, ખીમજી વસ્તા, કરશન પ્રેમજી ભુડિયા આણંદા કાનજી જેવા અનેક યુવાનો એકતા સાથે ખૂબ મહેનત કરીને આજે સંગઠનની મજબૂત ઈમારત ઉભી થઇ ગઇ. છેલ્લે તા.૧૪/૪/૧૯૬૫ના સ્થપાયેલા કચ્છી લેવા પટેલ સમાજ, ભુજની સ્થાપના જે એક સુખાકારી રહસ્ય છે. જ્ઞાતિજનોને એકઠા કરીને સેવાકિય પ્રવૃતિઓ અને કચ્છના વિકાશ માટે આ સંગઠનના કાર્યો મહત્વના રહ્યાં છે. જેમાં સ્વ.ખીમજી રામજી, સ્વ. વાગજી પીંડોરિયા, સ્વ. હરજી કરશન દબાસિયા, સ્વ. વી.કે પટેલ, મેઘજી રત્ના પીંડોરિયા, અને વર્તમાન મોવડી આર. આર. પટેલે સંગઠનની સાચી ઓળખ કરવી. જુન ૧૯૮૮માં સ્થાપાયેલા કન્યા સંસ્કાર ધામ, ઈ.સ.૨૦૦૦માં જિલ્લાની શ્રેષ્ઠ માતુશ્રી મેઘબાઇ પ્રેમજી જેઠા હોસ્પિટલ, ઈ.સ. ૧૯૯૯માં માતુશ્રી આર.ડી. વરસાણી વિદ્યાધામ, સમાજ હોલ સહિતના માઈલ સ્ટોન નિર્મિત થયા. સમાજના બાળકોએ પણ રમત ગમત અને સાંસ્કૃતિક પ્રવૃતિઓમાં રાજય અને રાષ્ટ્રના સીમા ચિહ્નો પ્રાપ્ત કર્યા છે. જેણે સમાજની ગરિમા વધારી છે.

આજે ઉંચી ઉડાન ભરી રહેલો સમાજ ગૌરવવંતો બની ગયો છે. ભુજ સમાજે તા.૯/૫ના વિશ્વના અધિવેશનની જાહેરાત કરી છે. જેમાં દેશ વિદેશના લેવા પટેલના ગઢ ગણાતા રાજકોટ, જામનગર, ભાવનગર,અમરેલી, રાજસ્થાનના ડુંગરપુર, બાસવાડા, એમપીના ધાર, બદનાવર સહિતના વડાઓ એક છત્ર ધારણ કરશે. તેમજ અરસ પરસ રોટી-બેટી વ્યવહારથી લઇને રાજકીય, સામાજીક અને આર્થિક સમિશ્રણો સંતુલિત કરવા ગોષ્ઠિ કરશે. કચ્છી લેવા પટેલ મસમોટી સંગઠન શકિતની તાકાત પ્રદર્શિત કરશે. સમૂહ લગ્નોત્સવ, તા.૮/૫ ના સમાજના અતિ મહત્વકાક્ષી હોસ્પિટલ વિતરણ પ્રોજેન્કટનો શુભારંભ અને સરદાર પટેલ વિદ્યા સંકુલ લાલજી રૂડા પીંડોરિયા સ્પોર્ટસ મેદાન જે સંમેલનના સાક્ષી બનશે. સપર્ક સૂત્ર પુસ્તિકા, જ્ઞાતિ ગામ પરિચય અને પ્રતિભાવો મેળવશે. પથદર્શકો પ્રમુખ હરિભાઇ કેસરા હાલાઇ, મેડિકલ એજયુ. પ્રમુખ અરજણભાઇ ગાંગજી પીંડોરિયા, આર.આર.હિરાણી, કે.કે. હિરાણી યુવક મંડળ તેમજ ચોવીસ જ્ઞાતિ બંધુઓ 'ઘર ચલો અભિયાન' આર.આર. પટેલના માર્ગદર્શન હેઠળ આગળ નથી રહયા છે.

સમાજના આધાર સ્થંભ પૈકી કેશવલાલ પ્રેમજી ભૂડિયા, રામજી દેવજી વરસાણી, દેવજી કરશન હાલાઇ, લક્ષ્મણ ભીમજી રાઘવાણી, વિશ્રામભાઇ જાદવા વરસાણી, વિશ્રામ મૂરજી દેવરાજ હાલાઇ, મૂલજી લાલજી પીંડોરીયા સહિતનું સંકલન મનજીભાઇ કાનજી રાઘવાણી (પ્રમુખ) યુ.કે. કોમ્યુનિટી, પ્રમુખ અરજણભાઇ કરશનદાસ વેકરિયા, જયારે ટાન્ઝેનિયા, સેસલ્સ, મોરેશિયસ અમેરિકા માટે ખાસ તૈયારીઓ કરાઇ છે.

કચ્છી લેવા પટેલના આવા સમાજ રત્નોને પોતાની માતૃભૂમિ પ્રત્યે પ્રેમ છે જે ઋણ ચૂકવવાનો મોકા જવા નંહી દે હજુ વધુને વધુ નવી યોજનાઓ બનાવી કચ્છ અને સમાજનું ગૌરવ વધારી દેશે.

### સરકારી પ્લોટ અંગે મહેસૂલ વિભાગ દ્વારા ચાલી રહેલી તપાસ

# પુરવઠા ઈન્સ્પેક્ટરની અચાનક વસતી ગણતરીમાં બદલીથી ચકચાર

વહીવટી તંત્ર ઉપરાંત ભુજ વિસ્તાર વિકાસ ઓથોરિટીમાં પણ ચાલી રહેલી તપાસ

ભાસ્કર ન્યૂઝ. ભુજ

જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા શુક્રવારે પુરવઠા ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા એક નાયબ મામલતદારનો ટ્રાન્સફરનો સિંગલ ઓર્ડર થતાં તંત્રમાં ચકચાર મચી ગઇ હતી. આ કર્મચારી સામે મહેસૂલી તપાસપંચ ઉપરાંત જિલ્લાના મહેસૂલ વિભાગ ઉપરાંત ભુજના પ્રાંત અધિકારી અને મામલતદાર દ્વારા સરકારી પ્લોટ અંગે તપાસ ચાલી રહી છે, ત્યારે તેમની આ ટ્રાન્સફર પાછળ તપાસ કારણભૂત હોવાનું માનવામાં આવી રહ્યું છે.

શુક્રવારે જિલ્લા પુરવઠા વિભાગમાં નિરીક્ષક તરીકે ફરજ બજાવતા અશોકભાઇ રાઠીની બદલી વસતી ગણતરી માટે રચવામાં આવેલા વિભાગમાં કરવામાં આવી હતી. જ્યારે અન્ય ત્રણ તાલુકામાં નાયબ મામલતદારકક્ષાના કર્મચારીઓને વધારાનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે, જ્યારે અન્ય સાત તાલુકાઓમાં નિવૃત્ત કર્મચારીઓને દસ હજાર રૂપિયાના ફિક્સ પગારથી કોન્ટ્રાક્ટ ઉપર રાખવામાં આવ્યા છે. વસતી ગણતરી માટે નવી જગ્યાઓ મંજૂર થતાં નાયબ મામલતદારકક્ષાની ટ્રાન્સફરનો એક રાઉન્ડ થવાની શક્યતા હતી, ત્યારે પુરવઠા નિરીક્ષક રાઠીની અચાનક બદલી થઈ જતાં તંત્રમાં આ ટ્રાન્સફર ચર્ચાનો વિષય બની હતી.

ઈન્સ્પેક્ટર રાઠી સામે ભુજના કેમ્પ વિસ્તારમાં રહેતી જે. કે. ઠક્કર નામની વ્યક્તિએ રેવેન્યુ ઈન્સ્પેક્શન કમિશનમાં એવી લેખિત ફરિયાદ કરી હતી કે તેમણે પત્નીના નામે ઉમેદનગર કોલોનીમાં ૪૮૭ નંબરવાળો ફ્લેટ ધરાવતા હોવા છતાં ખોટું સોગંદનામું કરીને ગેરકાયદે ગાયત્રી શક્તિપીઠ રોડ પર આવેલા ગાયત્રી કોલોનીમાં ૩૫ નં. નો પ્લોટ મંજૂર કરાવ્યો હતો. મહેસૂલી તપાસણી પંચને લખાયેલા આ પત્રની એક નકલ જિલ્લા કલેક્ટર કચેરીએ પણ મોકલતાં સમગ્ર મામલો મહેસૂલ બ્રાન્ચમાં પહોંચ્યો હતો અને ત્યાર બાદ આ પ્રકરણની તપાસ ભુજના પ્રાંત અધિકારીને સોંપવામાં આવી છે. ભુજના મામલતદાર દ્વારા પણ ઈન્સ્પેક્ટર રાઠી વિરુદ્ધ તપાસ ચાલુ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

# શ્રદ્ધા ધરાવતા લોકોનો તિરસ્કાર ન કરો

મોટી ખેડોઇ ખાતે જ્યોતિ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન

ભાસ્કર ન્યૂઝ. અંજાર

અંજારના મોટી ખેડોઇ ખાતે અખિલ ભારતીય સતપંથ સમાજનો ત્રિદિવસીય પ્રતિષ્ઠા મહોત્સવ ભક્તિભાવપૂર્વક સંપન્ન થયો હતો, જેમાં મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કચ્છ જિલ્લાના ૬૩મા ભગવાન નિષ્કલંકી નારાયણના સિંહાસન જ્યોતિ પ્રાગટ્ય ઉત્સવમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા.આ પ્રસંગે જલગાંવ પીઠના મહંત જનાર્દનજી મહારાજે વર્તમાન સમયમાં વૈદિક સંસ્કૃતિના જતન માટે શીખ આપી સંસ્કૃતિ પ્રત્યે શ્રદ્ધા ધરાવતા લોકોનો તિરસ્કાર ન કરવાનો ઉપદેશ આપ્યો હતો.

આ મહોત્સવમાં જગદગુરુ રામાનંદ આચાર્ય, સ્વામી હંસદેવાચાર્ય, સંત પ્રેમદાસજી, શામળદાસજી, ગુરૂ નાનકદાસજી તેમજ પ્રદીપ મહારાજ ઉપસ્થિત રહ્યા હતા. અગ્રણીઓ ડો. નીમાબેન આચાર્ય, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ બાપાલાલ જાડેજા, અંજાર તાલુકા પંચાયત ઉપપ્રમુખ હિનાબા જાડેજા, અંજારના નગરપતિ વસંત કોડરાણી, રમેશ મહેશ્વરી, સૈયદ લતીફશા બાપુ, સરપંચ મૃદુંગાબા જાડેજા, ઉપસરપંચ ધ્રુપદસિંહ જાડેજા, સજુભા જાડેજા,કચ્છ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રસિકબા જાડેજા તેમજ ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા.

ત્રિદિવસીય મહોત્સવ નિમિત્તે યોજાયેલા રાત્રિ કાર્યક્રમમાં ફરીદા મીરની સંતવાણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે સતપંથ સમાજના અગ્રણીઓ જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન સુરેશ પટેલે સંભાયું હતું. સમગ્ર આયોજનની વ્યવસ્થા મહિલા મંડળ તેમજ યુવક મંડળના

# શુકદેવ કે ભગવાન જીરો ક્યોં

મુંજા પ્રિય વાંચક ધોસ્ત બિરાદર... અજ આંકે અધિક મેણે જે એડે પ્રસંગ જી ગાલ કરેલા વિનાંતો કે, આંજો જિયણ હકિકતે આંકે અનમોલ લગધો કુલાય કે, ઐંઇ અધિકમેણે જો વ્રત કર્યોતાંઃ હિન મેણે જી તાકત કેડી ? ત અગ્યા જી કથા વાંચિયું...

ગૌતમીને સુદેવ ભ્રામણ પુતર શુકદેવ જી મોત પોઆ સાવ સુના-સુના થિઇ વયા. ઊંતા મસાણમેં જ વિઠા ઐંઇ. ઊંતે જ ભગવાન જો નાલો જપીએંતા. નતાં ખેં કે નતાં સુમે હિકડો જ રટણ શ્રીહરિ... શ્રીહરિ... શ્રીહરિ...

હાંણે અજ કાલ કરીંધે બ મેણા નીકરી વયા. ત્રયો મેણું ચોમાસું જોરધાર મીં સોંત અધિકમેણું વિઠો. સજો મેણું નકોરા ઉપવાસ કરીંધા ગૌતમી ને સુદેવ ભીંજધા ધુબધા મસાણ મેં વિઠા હરિ કે યાધ કરી રહ્યા ઐંઇ. સજો મેણું અધિક જો પૂરો થયો આયને ઉમાસ થિઇ તેર ભગવાન પુરુષોત્તમ પિંઢ પિંઢ જા પાવન ડર્સન ગૌતમીને સુદેવ કે ડિનો. બોલો ! પુરુષોત્તમ ભગવાન કી જય... ભગવાન ડર્શન ડિને ચયો :-




'હે સુદેવ ! તુ ચિંધા છડ ! અજાણે મેં તુ ને તોજી ઘરવારી સજો પુરુષોત્તમ મેણું કયા અયો. ઈન મેણે જે ફુલસ્વરૂપ આંજો મોત કે ભેટલ પુતર શુકદેવ સજીવ કઈયાતો, ને શુકદેવ કે, બારો હજાર વરેં જો આયુસ્ય ડાન ડિયાંતો...

ગૌતમીને સુદેવ તાં ભગવાન પુરુષોત્તમ જે પગેમેં- ચરણેમેં લેટી પયા. ને ભારી મને ભગવાન જી ભાવનું સ્તુતિ કેણ લગા...

કમલનયન શ્રીપતિ પુરુષોત્તમ પ્યારા
નટવર નંદ દુલારા જય જય રઢિયાળા, જય રાધા રમણા જય રાધા રમણા,
કુંજ બિહારી દયાળુ જય પાતક હરણા,
સહસ્રફેણ રાજે ત્રિભોવન ત્રિપુરારી,
ગિરધારી મોરારી જય મોરલી વાળા કમલ નયન શ્રીપતિ પુરુષોત્તમ પ્યારા...
।। જયશ્રી કૃષ્ણ ।।

પ્રકાશક, મુદ્રક આર. કે. ગુપ્તા દ્વારા માલિક મેસર્સ ડી.બી.કોર્પ. લિમિટેડ વતી ભુજોડી સર્વે નંબર ૧૫૮, ભુજ - અંજાર રોડ ખાતેથી મુદ્રિત તેમજ સ્વામિનારાયણ વાણિજ્ય સંકુલ, પહેલો માળ, હોસ્પિટલ રોડ, ભુજ - કચ્છથી પ્રકાશિત. એડિટર (ગુજરાત) : **અજય ઉમટ**.
ડેપ્યુટી એડિટર : **વિપુલ વૈદ્ય*** (*સમાચાર પસંદગી માટે પી.આર.બી.ઍક્ટ હેઠળ જવાબદાર) ફોન નં. ભુજ-(૦૨૮૩૨) ૩૯૮૮૮૮, ફેક્સ : (૦૨૮૩૨) ૨૫૫૧૮૦

Digitially Archived by: www.realpatidar.com/library

2010-05-08 -Divya Bhaskar -Invitation & Consitution Passed [393]



# કચ્છના પ્રા. શિક્ષકોને પગાર માટે રૂા. ૨૮.૩૦ કરોડ ફાળવાયા

realpatidar.com

**પગાર, છઠ્ઠા પગારપંચના એરિયર્સની રકમ આજે જ ચૂકવાશેઃ સોમવારથી વેકેશન**

**ભાસ્કર ન્યૂઝ. ભુજ**

કચ્છની પ્રા. શાળાઓના શૈક્ષણિક સ્ટાફના પગાર થતાં એરિયર્સના હપ્તા માટે રૂ.૨૮.૩૦ કરોડની રકમ ફાળવી છે. આજે શનિવારે તે દરેકને ચૂકવાઇ પણ જશે. વિદ્યાસહાયકો પ્રથમ વખત ૨૫૦૦ના બદલે ૪૫૦૦ પગાર મેળવશે.

આ અંગે જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ સરકાર તરફથી જાહેર કરાયેલા છઠ્ઠા પગારપંચ મુજબ જાન્યુઆરીથી એપ્રિલ માસના આઠ ટકા મોંઘવારી ભથ્થાના બીજા હપ્તો ૨૦ ટકા પ્રમાણો એરિયર્સ અને નિવૃત્તિવયની રજા તફાવતની ગ્રાન્ટ વગેરેની શિક્ષણ વિભાગના સ્ટાફને આજે તા.૮/૫ને શનિવારના જ ચૂકવણી થઇ જશે.

**ફાળવાયેલી પગાર ગ્રાન્ટ**

| | |
|---|---|
| ભુજ | ૬૫૦ લાખ |
| માંડવી | ૩૫૦ લાખ |
| મુન્દ્રા | ૧૮૦ લાખ |
| અંજાર | ૨૮૫ લાખ |
| ગાંધીધામ | ૨૭૫ લાખ |
| ભચાઉ | ૨૪૫ લાખ |
| રાપર | ૩૩૫ લાખ |
| નખત્રાણા | ૨૭૫ લાખ |
| અબડાસા | ૧૮૦ લાખ |
| લખપત | ૫૫ લાખ |
| કુલ | ૨૮૩૦ લાખ |

જિલ્લા શિક્ષણ વિભાગે દરેક તાલુકાઓ માટે ૨૮.૩૦ કરોડની રકમ જમા કરાવી છે, જેમાં સૌથી વધુ ભુજ તાલુકા માટે ૬.૫૦ કરોડ ફાળવાયા છે.

તા.૧૦/૫ ને સોમવારથી પ્રા.શાળાઓમાં ઉનાળુ વેકેશનનો પ્રારંભ થઇ રહ્યો છે તે પૂર્વે જ આ રકમ ચૂકવાઇ જશે, તેથી શૈક્ષણિક સ્ટાફનું વેકેશન સુધરી જશે. તંત્રના આ નિર્ણયથી ખુશીની લાગણી પ્રસરી ગઇ છે અને વસતી ગણતરીમાં જોડાયેલા શિક્ષકોને બાદ કરતા તમામ વેકેશનમાં ફરવા જવાની તૈયારીમાં લાગી ગયા છે. આ અંગે અબડાસા પ્રા.શિક્ષણ સમાજના પ્રમુખ રામસંગભાઇ જાડેજાએ જણાવ્યું કે, વિદ્યાસહાયકોને ૨૫૦૦ પગાર મળતો હતો જેમાં ગુજરાન તો ઠિક પેટ્રોલનો ખર્ચ પણ નિકળતો નહોતો. તેઓ આ વખતે ૪૫૦૦ પગાર મેળવશે. અબડાસા તાલુકામાં પગાર માટે કુલ ૧.૩૫ કરોડની રકમ ફાળવાઇ છે.

સોમવારથી વેકેશન શરૂ થતાં બાળકો પણ આખું વર્ષ સ્કૂલે જવાની ઝંઝટમાંથી થોડો સમય મુક્તિ મેળવીને વેકેશન માણવા જવાની તૈયારીમાં લાગી ગયા છે. પ્રા.શિક્ષણ સમાજના પ્રમુખ રશ્મિભાઇ પંડયા અને મહામંત્રી દિનેશભાઇ શાહે પણ તંત્ર દ્વારા પગાર ગ્રાન્ટની ફાળવણીને આવકાર આપ્યો હતો.

# ભીમાસર નજીક કંપનીમાં પ્રાંતવાદ મુદ્દે મારામારી

**ભાસ્કર ન્યૂઝ. ગાંધીધામ**

અંજારના ભીમાસર પાસે આવેલી લોખંડ બનાવતી કંપની મેટ ટ્રેડ ઇન્ડિયા પ્રા.લિ.માં શુક્રવારે પ્રાંતવાદના મુદ્દે બે કોન્ટ્રાક્ટ કંપનીઓ વચ્ચે બોલાચાલી થતાં એક કંપનીના ટોળાંએ ઉશ્કેરાઇને બીજી કંપનીના ડ્રાઇવર પર શસ્ત્ર હુમલો કરી માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.

આ કંપનીમાં સત્યમ્ કોન્ટ્રાક્ટ અને આર.જે. કોન્ટ્રાક્ટના શ્રમિકો વચ્ચે શુક્રવારે બોલાચાલી થઇ હતી. તેવામાં આર.જે. કોન્ટ્રાક્ટના મજૂરોએ ઉશ્કેરાઇને સત્યમ્ કોન્ટ્રાક્ટના ડ્રાઇવર સિકંદર પર લાકડી વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી.

ઘટનાના પગલે ગામ લોકોએ દરમિયાનગીરી કરતાં મામલો ઠંડો પડી ગયો હતો. જોકે, આ સમગ્ર મામલો પોલીસ ચોપડે ચડ્યો ન હતો.

# તલવાણામાં પેટ્રોલપંપના ચેક ચોરનારો આરોપી પકડાયો

**માંડવી :** તલવાણાના પેટ્રોલપંપના માલિકના પર્સમાંથી રૂા.૬ લાખના ચેકને વટાવી લેનારા આરોપીની પોલીસે ધરપકડ કરીને બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. તલવાણા ગામના સુદર્શન પેટ્રોલપંપના માલિક મંજુબેન વસાવાના પર્સમાંથી ડ્રાઇવર કુંવર લાલજી પટેલે સહી કરેલો કોરો ચેક ચોરી લીધો હતો અને તેમાં છ લાખની રકમ ભરીને કાંતિલાલ શિરોખા તથા કુંવરજીએ અશ્વિનભાઇ નામના શખ્સના ખાતામાં જમા કરાવીને વટાવી લીધો હતો. આ કેસમાં માંડવી પોલીસે કુંવરજી લાલજી પટેલની ધરપકડ કરી હતી. પૂછપરછ માટે રિમાન્ડની માગણી સાથે તેને અદાલતમાં રજૂ કરાયો હતો. કોર્ટે તેના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

## કચ્છ બજારના ભાવ

**ભુજ સ્થાનિક બજારભાવ (૧૦૦ કિલોના)**

| | |
|---|---|
| ઘઉં નવા | ૧૨૫૦-૧૯૫૦ |
| બાજરો | ૧૦૭૦-૧૧૭૦ |
| ચોખા આઈઆર | ૧૬૫૦-૧૭૫૦ |
| ચોખા બેગમી | ૧૯૦૦-૨૦૫૦ |
| ચોખા જેડ જીરાસર | ૨૦૦૦-૪૦૦૦ |
| મગ નવા | ૭૪૦૦-૭૬૦૦ |
| મગ ફાડા | ૭૭૦૦-૭૯૦૦ |
| મોગરદાળ | ૮૭૦૦-૮૯૦૦ |
| તુવેરદાળ | ૬૨૦૦-૬૫૦૦ |
| તુવેરદાળ રેંટિયો | ૭૪૦૦-૭૭૦૦ |
| ચણાદાળ | ૨૬૫૦-૨૮૫૦ |
| અડદદાળ | ૬૯૦૦-૭૩૦૦ |
| ખાંડ એસ | ૨૯૮૦-૩૦૦૦ |
| ખાંડ એમ | ૩૦૪૦-૩૦૬૦ |
| ખાંડ આયાતી | ૨૮૮૦-૨૯૫૦ |

**ટીનના ભાવ (વેટ સહિત)**

| | |
|---|---|
| સીંગતેલ ૧૫ લિટર | ૧૦૮૦-૧૦૯૦ |
| સીંગતેલ ૧૫ કિલો | ૧૧૪૦-૧૧૮૦ |
| વેજીટેબલ ૧૫ કિલો | ૭૦૦-૭૫૦ |
| કપાસિયા તેલ | ૭૧૫-૭૯૦ |
| કપાસિયા તેલ ૧૫ લિટર | ૭૨૫-૭૩૦ |
| કોપરેલ ૧૫ કિલો | ૯૭૦-૯૯૦ |
| પામોલીન | ૬૪૬-૬૪૮ |
| સૂરજમુખી | ૮૩૦-૮૬૦ |
| સોયાબીન | ૭૨૦-૭૨૫ |

**૨૦ કિલોના ભાવ**

| | |
|---|---|
| કોલ્હાપુરી ગોળ | ૬૩૦-૭૦૦ |
| | એક ગૂણીના ભાવ |
| ઝીણુ ભૂસું | ૫૨૫-૫૫૫ |
| બેસન ૫૦ કિલો | ૧૪૬૦-૧૭૮૦ |
| કપાસિયા ખોળ | ૫૦૦-૫૧૦ |
| કપાસિયા જાડા (વેટ સહિત) | ૬૯૦ |
| યુપી ભીલી | ૫૩૦-૫૪૦ |

**ભુજ માર્કેટ યાર્ડ**

| | ભુજ ૧૦૦ કિલોના ભાવ |
|---|---|
| મઠ | ૫૦૦૦-૫૩૫૦ |
| ચણા | ૧૯૦૦-૨૦૨૫ |
| જવ | ૯૦૦-૯૨૦ |
| જુવાર | ૧૧૫૦-૧૭૦૦ |
| ગોવાર | ૨૨૦૦-૨૨૩૩ |
| ઘઉં કચ્છના | ૧૨૦૦-૧૪૦૦ |
| બાજરી નવી | ૯૦૦-૧૦૫૦ |
| મગ | ૬૩૫૦-૬૯૬૦ |
| મગ જુના | ૫૮૦૦-૬૨૦૦ |

**૪૦ કિલોના ભાવ**

| | |
|---|---|
| એરંડા | ૧૧૭૦-૧૧૮૫ |
| રાયડો | ૮૨૫-૮૫૦ |
| ઇશબગુલ | ૧૪૫૦-૧૮૬૫ |
| ધાણા | ૮૬૦-૯૬૦ |
| ખાદ્યા જીરૂ | ૩૮૦૦-૪૩૬૦ |
| તલી નવી | ૧૮૦૦-૨૦૦૦ |

**અંજાર ૧૦૦ કિલોના ભાવ**

| | |
|---|---|
| મગ | ૫૫૦૦-૬૦૫૦ |
| ગોવાર | ૨૨૦૦-૨૨૨૫ |
| જુવાર | ૧૮૦૦-૨૦૪૦ |
| ઘઉં | ૧૧૭૫-૧૪૦૦ |

**૪૦ કિલો**

| | |
|---|---|
| એરંડા | ૧૧૭૨-૧૧૮૩ |
| કપાસ | ૧૦૫૦-૧૧૮૫ |
| તલી | ૧૯૫૦-૨૦૧૦ |
| જીરૂ | ૩૮૦૦-૪૬૦૪ |
| ઇસબગુલ | ૧૪૫૦-૧૭૦૦ |
| ધાણા | ૮૦૦-૮૮૦ |

**મુન્દ્રા**

| | |
|---|---|
| બાજરી | ૧૯૨૫-૨૦૮૧ |
| જુવાર | ૧૧૫૦-૧૬૦૦ |
| ગોવાર | ૨૧૧૧-૨૧૮૫ |
| એરંડા | ૧૧૪૫-૧૧૮૦ |

**ઉંઝા માર્કેટ યાર્ડ- ૨૦ કિલોના**

| | |
|---|---|
| જીરૂ | ૧૪૩૦-૨૫૭૫ |
| વરિયાળી | ૯૦૦-૨૪૨૧ |
| ઇસબગુલ | ૭૯૫-૧૦૧૧ |
| સરસવ | ૪૫૦-૪૬૮ |
| રાયડો | ૪૦૯-૪૭૮ |
| તલ | ૮૧૧-૯૯૦ |
| સુવા | ૮૩૦-૯૦૦ |
| મેથી | ૫૨૫ |
| અજમો | ૧૫૦૦ |
| એરંડા | ૫૭૮-૫૯૭ |

**ભુજ શાક માર્કેટ**

| | |
|---|---|
| ડુંગળી | ૪-૬ |
| બટાટા | ૬.૫-૭.૫ |
| ટમેટા | ૫-૭ |
| મરચા | ૧૬-૧૮ |
| રીંગણા | ૫-૬ |
| કોબી | ૪-૬ |
| ફુલાવર | ૮-૧૨ |
| ગોવાર | ૧૨-૨૦ |
| ધાણા | ૧૨-૧૬ |
| ભીંડા | ૧૦-૧૨ |
| કાકડી | ૩-૪ |
| પાલક | ૪-૬ |
| લસણ | ૩૦-૪૫ |
| લીંબુ | ૨૫-૩૨ |
| ગીસોડી | ૧૦-૧૨ |
| દુધી | ૪-૫ |
| આદુ | ૪૦-૪૩ |
| કારેલા | ૭-૧૦ |
| સક્કરીયા | ૧૦-૧૨ |
| ચોળા | ૮-૧૫ |
| કેળા કાચા | ૭-૮ |
| કેળા પાકા | ૧૦-૧૨ |
| પપૈયા કાચા | ૫-૬ |
| પપૈયા પાકા | ૪-૫ |
| સક્કર ટેટી | ૪-૭ |
| ચીકુ | ૭-૧૦ |
| કાચી કેરી | ૩-૭ |
| પાકી કેરી | ૨૦-૩૫ |
| પીતાઇ ગાજર | ૬-૭ |

**કચ્છી કંપની શેરબજારમાં**

| | |
|---|---|
| ૨૦ માઇક્રોન | ૪૧.૦૦ |
| આરતી ડ્રગ | ૧૧૮.૦૦ |
| આરતી ઇન્ડ | ૪૭.૯૦ |
| અદાણી પાવર | ૧૨૨.૬૫ |
| એલાઇડ કોમ્પ્યુટર્સ ઇન્ટ. | ૦.૪૧ |
| આશાપુરા માઇનકેમ | ૬૨.૫૦ |
| એસ્ટ્રોલ ચોક એન્ડ પ્રો. | ૭.૧૬ |
| ડાગર ફોર્સ્ટ | ૧૪.૪૯ |
| ઇલેક્ટ્રોથર્મ ઇન | ૩૦૭.૧૦ |
| યુરો સીરામીક લિ. | ૫૪.૪૦ |
| યુરો મલ્ટીવિઝન લિ. | ૨૬.૪૦ |
| એવરેસ્ટ કાંટો | ૧૩૪.૩૫ |
| એક્સેલ ક્રોપ કેર | ૨૦૧.૩૦ |
| એક્સેલ ઇન્ડસ્ટ્રીઝ | ૬૭.૪૦ |
| ગેલન્ટ મેટલ | ૨૭.૧૫ |
| જીનસ પાવર | ૧૮૫.૫૦ |
| ગોકુલ રિફોઇલ્સ | ૭૫.૮૫ |
| ગુજ.મિનટલડેવ | ૧૩૦.૬૦ |
| ગુજરાત એનઆરઇ કોક | ૭૯.૪૦ |
| હરીયા એક્સપોર્ટ લી. | ૫.૭૨ |
| હિન્દુસ્તાન લિવર | ૨૩૨.૪૦ |
| ઇપ્કા લેબોરેટરી | ૨૬૫.૩૫ |
| જિંદાલ સો લિ. | ૨૦૫.૯૦ |
| કચ્છ મિનરલ્સ લિ. | ૯.૯૩ |
| કનોરિયા કેમિકલ્સ | ૩૩.૫૦ |
| કેશર એન્ટરપ્રાઇઝ | ૧૩૦.૩૦ |
| માન ઇન્ડ. ઇન્ડિયા | ૬૮.૯૦ |
| માનકસીઆ લિ. | ૧૧૪.૪૦ |
| મુન્દ્રા પોર્ટ એન્ડ એસઇઝેડ | ૬૮૫.૫૦ |

**સ્થાનિક સોના ચાંદી બજાર ભાવ**

| | |
|---|---|
| ચાંદી ચોરસા | ૨૮૭૫૦-૨૭૭૦૦ |
| સોનું સ્ટાન્ડર્ડ | ૧૭૬૧૦-૧૭૬૩૦ |
| સોનું તેજાબી | ૧૭૫૮૦-૧૭૬૦૦ |
| દાગીના ૨૧ કેરેટ | ૧૫૬૪૦ |
| દાગીના ૨૨ કેરેટ | ૧૬૩૬૫ |
| હોલમાર્ક | ૧૬૮૧૫ |
| ૧૦૦ગ્રા કેડબરી | ૧૭૬૩૦૦ |
| ૧૦૦ગ્રા બિસ્કિટ૧ | ૧૭૭૦૦૦ |

**વિદેશી હુંડિયામણ**

| ટ્રાવેલર્સ ચેક | ખરીદ | વેચાણ |
|---|---|---|
| ડોલર | ૪૪.૦૦ | ૪૫.૯૦ |
| પાઉન્ડ | ૬૬.૨૫ | ૬૯.૬૫ |
| યુરો | ૫૬.૬૫ | ૫૯.૧૦ |
| કરન્સી | | |
| ડોલર | ૪૪.૨૫ | ૪૫.૮૦ |
| પાઉન્ડ | ૬૬.૬૦ | ૬૯.૫૦ |
| યુરો | ૫૬.૩૫ | ૫૯.૨૫ |
| ગોલ્ડ કોઇન | | ૧૮૯૨૦ |

## આજે હોસ્પિટલ નૂતન સંકુલનું લોકાર્પણ

અસ્મિતા પર્વના બીજા દિવસે હોસ્પિટલના નૂતન સંકુલના લોકાર્પણનો સમારંભ યોજાશે. સ્વામિનારાયણ મંદિર ભુજના મહંત સ્વામી ધર્મનંદનદાસજી વિધિથી પ્રારંભ કરાવશે. આરોગ્ય રાજ્યમંત્રી પરબતભાઇ પટેલ, રાજ્યમંત્રી વાસણભાઇ આહિર, કેશવલાલ પટેલ, અરજણભાઇ ગાંગજી પીંડોરિયા વગેરે ઉપસ્થિત રહેશે. બપોર બાદ દાતાઓના સન્માનમાં અ.ભા. ક. ક.પા. સમાજના પ્રમુખ રામજીભાઇ કરમશી નાકરાણી, મૂળજીભાઇ પીંડોલિયા, શિવજી જાદવા પરબત વરસાણી, કરસનભાઇ રવજી કારા વગેરે ખાસ હાજર રહેશે.

## અનુસંધાન...

# ગેસ પ્રકરણમાં મુકેશને ફાયદો

**પહેલા પાનનું...**

આ ચુકાદો આપ્યો હતો. અનિલ અંબાણીએ આ ચુકાદા સામે રિવ્યૂ પિટીશનની હાલ કોઈ યોજના ન હોવાનું કહ્યું છે. સુપ્રીમ કોર્ટે આ સાથે જ બન્ને ભાઈઓને સાથે બેસીને સરકારની નીતિને અનુરૂપ ક્રિશ્રા-ગોદાવરી(કેજી) બેઝીનમાંથી ગેસના પુરવઠા અને તેની કિંમત અંગે છ સપ્તાહમાં ફરીથી કરાર કરવાની સલાહ આપી છે. બેન્ચે કહ્યું કે ગેસ શેરિંગ કોન્ટ્રેક્ટ(જીએસસી) કરવાથી કંપની ગેસની માલિક નથી બની જતી.

**અનિલ જૂથના શેરોમાં....**

એડીએજીના શેરોમાં આવેલી વેચવાલી પાછળ ગ્રુપના માર્કેટ કેપિટલાઇઝેશનમાં રૂ. ૯,૧૦૦ કરોડનું ધોવાણ થયું હતું. આનાથી વિરુદ્ધ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માર્કેટ કેપમાં રૂ. ૭,૫૦૦ કરોડની વૃદ્ધિ થઈ હતી. આજે એ ગ્રુપમાં પણ નરમ રહેનારી ટોચની ત્રણ કંપનીમાં એડીએજીના શેરો રહ્યા હતા. છેલ્લા થોડા દિવસથી આરએનઆરએલમાં જે મજબૂતાઈ જોવાઈ હતી તેનો બમણો આંચકો તેના શેરના ભાવમાં આવ્યો હતો. આગામી છ સપ્તાહમાં હવે બન્ને જૂથ વચ્ચે સરકારનાં ધોરણોને અનુસાર કેવી રીતે ગેસનો ભાવ, ગેસ જથ્થાની પ્રાપ્તિ અને કેટલાં વર્ષની વહેંચણીના કરાર થાય છે તેના પર એડીએજીની ત્રણ કંપનીઓની નફાક્ષમતાનું ભાવિ રહેશે એવા અનુમાન વચ્ચે આરએનઆરએલમાં શું કોલ કાઢવો તેની દ્વિધા એનાલિસ્ટોમાં જોવાતી હતી, તેનાથી વિરુદ્ધ રિલાયન્સ ઈન્ડ.માં બ્રોકરો લાંબા ગાળાનો લેવાલીનો કોલ આપતા હતા.

**સેન્સેક્સમાં ૨૧૮ પોઇન્ટનું ...**

વ્યક્ત કરવામાં આવી રહી છે કે વર્તમાન કટોકટીને કારણે યુરોપિયન દેશોના સંગઠનમાં તિરાડ પડશે અને અમુક દેશો નવો ચીલો ચાતરે.

**રાજ્યપાલોને મનસ્વીપણે...**

રાષ્ટ્રપતિ કરે છે અને તેમની ઈચ્છા પર જ રાજ્યપાલના પદ પર જારી રહેવાનો આધાર છે. પરંતુ, તેમને ફક્ત એ કારણ સબબ દૂર કરી ન શકાય કે તેમને શાસક પક્ષ સાથે સંકલન નથી.

કેન્દ્ર દ્વારા એવી દલીલ કરાઈ હતી કે, રાજ્યપાલના અભિપ્રાય રાષ્ટ્રીય નીતિના સંદર્ભે વિરોધાભાસી હોવાને કારણે તેને પાંચ વર્ષની મુદ્દત પહેલાં જ દૂર કરી શકાય છે. રાજ્યપાલ કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સેતુનું કામ કરે છે અને એ સ્વરૂપે સરકાર સાથે અસહમત થઇ શકે નહીં. લોકતંત્રમાં જો કોઇ પક્ષને ખાસ સામાજિક-આર્થિક એજન્ડા પૂર્ણ કરવા આદેશ મળે તો રાજ્યપાલ એમ કરી શકે નહીં કે તેઓ આ સાથે સહમત નથી.

ગત યુપીએ સરકાર દ્વારા ૨૦૦૪માં સત્તારુઢ થયા બાદ ચાર રાજ્યોના રાજ્યપાલોને દૂર કરવાના પગલાંને પડકારતા તત્કાલીન ભાજપ સાંસદ બી.પી. સિંઘલે આ જાહેર હિતની અરજી કરી હતી.

**સોનું ફરી રૂપિયા૧૮૦૦૦...**

ચાંદીના ભાવો કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. દિલ્હી ખાતે આજે સોનાનો ૧૦ ગ્રામદીઠ ભાવ રૂ. ૪૯૫ જ્યારે કિલોદીઠ ચાંદીનો ભાવ રૂ. ૬૫૬ વધી ગયો હતો. સોનાનો ભાવ રૂ. ૧૭૮૪૫ અને ચાંદીનો ભાવ રૂ. ૧૭૪૭૦ની સપાટીએ રહ્યો હતો.

દેશાવરોના અહેવાલો પાછળ અમદાવાદ ખાતે સોનું રૂ. ૩૨૫ વધી રૂ. ૧૮૦૨૫-૧૮૦૭૫ની સપાટીએ જ્યારે ચાંદી રૂ. ૧૦૦ વધી રૂ. ૨૭૭૦૦-૨૭૯૦૦ની સપાટીએ બંધ રહ્યા હતા. રાજકોટ ખાતે સોનું રૂ.૨૫૦ વધી રૂ.૧૭૯૫૦, સોનું બિસ્કિટ રૂ.૩૦૦૦ વધી રૂ.૨,૦૯,૪૦૦ અને ચાંદી રૂ.૧૦૦ વધી રૂ.૨૭૮૦૦ના મથાળે હતી. બે દિવસમાં સોનામાં રૂ.૬૫૦નો ઝડપી ભાવવધારો જોવા મળ્યો છે. સોનાની સાથે ચાંદીમાં પણ રૂ.૪૦૦નો ઉછાળો આવ્યો છે.

**સરોગેટ મધર : નાની બનશે ...**

સલામી અને શાબાશી આપીએ એટલી ઓછી છે. સેરોગેટ મધર બનતા અનેક કેસમાં ઘણી વખત મધર બાળકને લઈને ભાગી જતી હોય છે કે તો ભવિષ્યમા ક્યારેક બ્લેકમેઇલ કરીને પૈસા પણ પડાવતા હોય ત્યારે આ કેસમા મા જ પોતાની દીકરીનાં બાળકને જન્મ આપતી હોવાથી આ દરેક પડોજણમાથી તેમને રાહત મળશે. જોકે ખૂબ જ સ્વાભાવિક લાગતો પ્રશ્ન એ હતો કે પ્રીતિને આ ખામી હોવા છતાં તેના સાસરિયાએ તેને અપનાવી ત્યારે ડો. પૂજા કહે છે કે આ માટે પારિવારિક સહકાર પણ એટલો જ જરૂરી હોય છે. પ્રીતિનાં લવ મેરેજ છે એટલે તેના પતિ અને સાસરિયાને પહેલેથી જ આ વાતની ખબર હતી.

એક મા પોતાનાં બાળક માટે શું કરી શકે તેનો આ એક સીધો સાદો જવાબ છે. પોતાની દીકરીની ખુશી માટે મા આજે રાજીખુશીથી પોતાની કૂખ ભાડે આપી રહી છે તે જ મધર્સનો સાચો અર્થ સાર્થક કરી રહી છે.

રાજકોટના રહેવાસી પ્રીતિબેન અને તેમનાં પરિવાર માટે જોકે હવે ખુશીનો માહોલ છવાયો છે. કારણ પ્રીતિબેનનું બાળક તેમના મમ્મીનાં ગર્ભમાં દોઢ મહિનાથી ઉછરી રહ્યું છે. પ્રીતિબેનનાં શરીરમાં જન્મથી જ ગર્ભાશય નથી, તેથી તેમના માટે મા બનવું તદ્દન અશક્ય છે. પતિ-પત્નીના બીજ ભેગા કરી અન્ય ગર્ભાશયમાં મૂકાય છે

પ્રીતિબહેનને પોતાનું બાળક જોઈતું હોવાથી તેમની મમ્મી સેરોગેટ મધર બનવા માટે તૈયાર થયા હતા તેમ જણાવતા ૨૧ સેન્ચ્યુરી હોસ્પિટલનાં ડો. પૂર્ણિમા નાડકર્ણી અને ડો. પૂજા નાડકર્ણીકહે છે કે પ્રીતિને એક મહિના પહેલા હોર્મોન ઈન્જેકશન આપીને બીજ બનાવવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેના પતિનાં બીજ સાથે તે બીજને ભેગું કરીને ટેસ્ટ ટ્યૂબ બેબી મૂકીને પ્રીતિબેનનાં મમ્મીનાં ગર્ભમાં મૂકવામાં આવ્યું છે. હાલ બાળકનો છેલ્લાં દોઢ મહિનાથી સુરક્ષિત રીતે વિકાસ થઈ રહ્યો છે.

**નર્મદા નિગમના ડાયરેક્ટર...**

મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (જીએમડીસી)ના માજી ચેરમેન મુકેશભાઇ ઝવેરીને નર્મદા નિગમમાં ડાયરેક્ટર તરીક સ્થાન મળ્યું છે. પાંચમી મેના નિગમ દ્વારા જારી કરાયેલા સત્તાવાર પત્રમાં જણાવાયા મુજબ એમ.એસ. ડાગુરની જગ્યાએ મુકેશભાઇને બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સ્થાન અપાયું છે. આ ઉપરાંત નણાં વિભાગના પૂર્વ ડાયરેક્ટર વસંત રાવલને પણ ડો.વી.જી.પટેલની જગ્યાએ નિમણૂક આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, જીએમડીસીના અધ્યક્ષ તરીકે પણ ઝવેરીએ જિલ્લામાં કરેલા લોકહિતન કાર્યોની સરવાણીને યાદ કરીને હવે નર્મદાના મુદ્દે પણ કચ્છના પ્રતિનિધિત્વને બિરદાવાઇ રહ્યું છે. ભુજના જય માતાજી મિત્ર મંડળના મંત્રી મિતેષ શાહે મુકેશભાઇ જેવી સક્ષમ વ્યક્તિની નિમણૂકને આવકારીને આનંદનો અવસર આવ્યો હોવાનું યાદીમાં જણાવ્યું હતું.

**આઇફા એવોર્ડ્ઝ-૨૦૧૦માં ..**

મુખર્જી (વેક એપ સિદ), વિશાલ ભારદ્વાજ (કમિને), ઈમ્તિયાઝ અલી (લવ આજ કલ) અને આર બાલ્કી (પા) છે.

પરફોર્મન્સ ઈન લીડિંગ રોલ (મેલ) એટલે કે શ્રેષ્ઠ અભિનેતાના એવોર્ડ માટેના ઉમેદવારો આમિર ખાન (થ્રી ઈડિયટ્સ), અમિતાભ બચ્ચન (પા), સૈફ અલી ખાન (લવ આજ કલ), સલમાન ખાન (વોન્ટેડ), શાહિદ કપૂર (કમિને) અને રણબીર કપૂર (વેક અપ સિદ) છે. પરફોર્મન્સ ઈન લીડિંગ રોલ (ફિમેલ) એટલે કે શ્રેષ્ઠ અભિનેત્રીના એવોર્ડ માટેની પસંદગી કરીના કપૂર (થ્રી ઈડિયટ્સ), પ્રિયંકા ચોપરા (કમિને), દીપિકા પદુકોણ (લવ આજ કલ), વિદ્યા બાલન (પા) અને માહી ગિલ (દેવ ડી)માંથી કરવામાં આવશે.

# ચાંદ્રોડામાં જમીન મુદ્દે ધમાસાણ

**છેલ્લા પાનનું...**

કરવાની રજૂઆત કરી હતી. આ વચ્ચે શુક્રવારે પોલીસ બંદોબસ્ત સાથે વહીવટી તંત્રે જમીન માપણીની કામગીરી હાથ ધરી હતી. આ જાણકારી મળતાં ગામલોકોનું ટોળું ઘટનાસ્થળે ધસી આવ્યું હતું. ગ્રામજનોએ શરૂઆતમાં ઉપસ્થિત જવાબદારો સાથે ચર્ચા કરી આ અંગે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો, પણ ગ્રામલોકોને કોઇ જ દાદ ન મળી હોવાથી અંતે લોકોએ પથ્થર મારો કર્યા હતો જેથી પોલીસ તથા ગામલોકો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી.

ઉશ્કેરાયેલા ગ્રામજનોએ પોલીસ જીપ પર પથ્થરમારો કરતાં જેમાં જીપમાં બેઠેલા અંજાર પીએસઆઇ એમ.બી. ખિલેરી તથા અન્ય એક કોન્સ્ટેબલને ઈજા થઇ હતી. સામે પ-નો પોલીસે પણ જવાબમાં ગ્રામજનો લાઠીચાર્જ કરતા મંગલજી ડાંગર, રાઘું વેલા મરંડ, ગીતાબેન રાઘું મરંડ, રવા પોચા મરંડ, રૂપાબેન વેલા આહિર સહિતના લોકો ઇજા પહોચી હતી.

બીજી બાજુ ઘટનાને પગલે અંજાર, આદિપુર, ગાંધીધામ, કંડલા અને મુન્દ્રા સહિતના પોલીસ જવાનોને ચાંદ્રોડા ગામમાં ખડકી દેવાયો હતો.

બનાવ બાદ ગામમાં કરફ્યું જેવો માહોલ છવાઇ ગયો હતો. અંજાર મામલતદાર પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ મામલે ગામના સરપંચનો સંપર્ક શકય બન્યો નહોતો. તેમનો મોબાઇલ ફોન સ્વીચ ઓફ આવતો હતો.

**૩૭૫ જણના ...**

શાંતિલાલ રવા બકુત્રા, ઉપસરપંચ મંગા તેજા મરંડ, માજી સરપંચ રાઘુ રવા મરંડ સહિત કુલ ૨૭ ગ્રામજનો તથા ૩૭૫ લોકોના ટોળાં સામે સરકારી ફરજમાં રૂકાવટ, સરકારી કર્મચારીઓ પર સામૂહિક હુલમો તથા સરકારી વાહનને રૂપિયા ૧.૫૦ લાખના નુકસાન પહોંચાડવા સહિતની કલમો નોંધી તમામ સામે ગુનો નોંધ્યો હતો.

**સીનુગ્રા પાસે અકસ્મા...**

અકસ્માતમાં પ્રભાબેન શાંતિલાલ પટેલ (ઉ.વ.૪૫) અને તેમનો પુત્ર નિતિશ શાંતિલાલ પટેલ (ઉ.વ.૨૦), સચિન વિનોદ પટેલ (ઉ.વ.૧૫)નું નું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે હેમંત પટેલ (ઉ.વ.૪૦) તથા તેજસ પટેલ (ઉ.વ.૧૫)ને સારવાર માટે ભુજ ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં અન્ય આઠથી દસ જેટલા લોકો પણ ઘાયલ થયા હતા. જેઓને અંજારની અલગ-અલગ ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બીજી બાજુ આ અકસ્માતના પગલે સિનુગ્રાના ગામવાસીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને ઘાયલોને સારવાર માટે પહોંચતા કર્યા હતા. દરમિયાન લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો. ઉશ્કેરાયેલા ગ્રામજનોએ અકસ્માત સર્જનાર ટ્રેઇલરને સળગાવી દીધું હતું. આગથી અકસ્માતગ્રસ્ત ટ્રેક્ટર પણ સળગી ગયું હતું. આગને કાબૂમાં લેવા અંજાર નગરપાલિકાની ફાયરબ્રિગેડની ટીમ કામે લાગી હતી, પરંતુ બંને વાહનો સળગીને ખાખ થઇ ગયાં હતાં.

કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ જીવાભાઇ આહિર, વિપ-ના નેતા દેવેન્દ્રસિંહ જેઠવા, અંજાર નગરપતિ વસંત કોડરાણી, પૂર્વનગરપતિ ભરત શાહ, શહેર ભાજપ પ્રમુખ કિશોર ઠક્કર, ખેડોઇના ઉપસરપંચ ધ્રુપતસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ એન. જાડેજા, સહદેવસિંહ જાડેજા, સજુભા જાડેજા, ક.જિ.ભાજપ ઉપપ્રમુખ રસિકબા જાડેજા, બાપાલાલ જાડેજા, અનિલસિંહ જાડેજા, જગતસિંહ જાડેજા, જયપાલસિંહ ઝાલા, ઈમરાન પઠાણ, એડવોકેટક કિરણ પટેલની સાથે મોટી સંખ્યામાં ખેડોઇના ગ્રામજનો ખડેપગે હાજર રહ્યા હતા.

**કચ્છી લેવા પટેલ...**

પ્રમાણે જણાવ્યું હતું. વહેલી સવારે સમૂહલગ્નની વિધિ સાથે શરૂ થયેલા કાર્યક્રમો અંતર્ગત યોજાયેલા જ્ઞાતિમિલનના કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજના મોવડી એવા રણછોડભાઇ ફળદુએ કહ્યું કે, જે રીતે ગુજરાત સરકારે ટૂંકાગાળામાં જ વિકાસના સોપાનો સર કર્યા છે, બસ એ જ રીતે કચ્છના સમાજને એક મંચ પર લાવવાના પ્રયાસને પણ તેમણે બિરદાવ્યો હતો.

સરદાર પટેલ સંકુલ ખાતે યોજાઇ રહેલા કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં સમાજના ભાઇઓ-બહેનો ઉમટી પડ્યા હતા. આજે ૨૮ જેટલા નવ યુગલોએ પ્રભુતામાં પગલાં માંડયા હતાં. પ્રારંભમાં સંસ્થાના અરજણભાઇ પીંડોરિયાએ આવકાર આપ્યો હતો.

આર. આર. પટેલે સમાજની બે દાયકાની વિકાસ સફર કન્યા કેળવણી માટેની તત્પરતા, આરોગ્ય અંગે પ્રદાનની વિગતો આપી હતી. સમારંભમાં જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઇ ભાનુશાલી, તારાચંદ છેડા, વિશ્રામભાઇ મૂરજી, દેવરાજ હાલાઇ, રામબાઇ કાનજી ભીમજી રાઘવાણી, ધારાસભ્યો ડો. નીમાબેન આચાર્ય, રમેશભાઇ મહેશ્વરી, ધનજીભાઇ સેંઘાણી સહિત અનેક આગેવાનો પણ હાજર રહ્યા હતા. બપોર બાદ યોજાયેલા સમારંભમાં કલેક્ટર થેન્નારસન, ડીડીઓ રાજકુમાર બેનિવાલ, એસ.પી. વાબાંગ જામીર, અરજણભાઇ વેકરિયા, વેલજીભાઇ ગોરસિયા વગેરેના હસ્તે દાતાઓનું અભિવાદન કરાયું હતું.

ભારતમાં ખૂંખાર આતંકવાદી હુમલાઓનો કાવતરાખોર અને પાકિસ્તાનમાં બેઠેલા દાઉદના સાગરીત આતંકવાદી સોહરાબુદ્દીન માટે આટલો હોબાળો?

realpatidar.com



જેને ૨૦૦૦ની સાલમાં ટાડા હેઠળ ૧૦ વર્ષની સજા થઇ તેવા આતંકવાદી સોહરાબુદ્દીન માટે આટલી લાગણી?

આતંકવાદી સોહરાબુદ્દીનના ઘરેથી ૨૪ AK-47, ૨૭ હેન્ડ ગ્રેનેડ્સ અને ૫,૨૫૦ કારતુસ મળ્યા હતા. તેના માટે આટલો પ્રેમ?

જન અધિકાર સમિતિ, વડોદરા દ્વારા જનહિતમાં પ્રકાશિત

realpatidar.com

## પ્રિન્સિપલની કલમે

# શિક્ષકનો જગતમાં કોઈ વિકલ્પ નથી

**ઈન્દ્રસિંહ રાઓલ**
**(નવસર્જન હાઈસ્કૂલ, માણસા, ગાંધીનગર)**

વિશ્વની પ્રાચીન સંસ્કૃતિઓમાં યુગોથી ગુરુ-શિષ્ય પરંપરા ચાલતી આવી છે, અને આજે પણ આ પરંપરા યથાવત છે. ગુરુ પાસે એવું કંઈક મહાન, કંઈક શાશ્વત છે કે જેથી વિદ્યાર્થી ગુરુ પ્રત્યે આદરભાવ અનુભવે છે. ગુરુ પાસે જ્ઞાન છે. આ જ્ઞાન એટલે માત્ર પુસ્તકીયું જ્ઞાન નહીં, પણ જીવન અને જગતનું જ્ઞાન. વિદ્યાર્થી આ જ્ઞાન દ્વારા જ સમાજનો અને સમગ્ર વિશ્વનો સારો નાગરિક બને છે. વિદ્યાર્થી વાણી, વર્તન, સામાજિક મૂલ્યો અને નાગરિકત્વના પાઠ ગુરુ પાસે શીખે છે. વિદ્યાર્થી એની કારકિર્દીના ઘડતર માટે ગુરુ પાસે જાય છે, જેથી આજના હરીફાઈના યુગમાં વિદ્યાર્થી સારો ડૉક્ટર, એન્જિનિયર કે સારો વકીલ બની શકે. વિદ્યાર્થીનું સર્જન કરવાનું ભગીરથ કાર્ય શિક્ષક દ્વારા જ થાય છે. માટે શિક્ષણની પદ્ધતિઓમાં ફેરફાર થયા છે, પણ શિક્ષકના ઊંચા સ્થાનમાં કોઈ ફેરફાર થયો નથી અને થશે પણ નહીં. આદર્શ જીવનના પાઠ વિદ્યાર્થી શિક્ષક પાસેથી શીખે છે. વડીલોને માન આપવું, પ્રાણીઓ અને પક્ષીઓ પ્રત્યે દયા દાખવવી, સત્ય બોલવું, ચોરી ન કરવી, આવા ચારિત્ર્ય ઘડતરના સિદ્ધાંતો વિદ્યાર્થી ગુરુ પાસેથી જ શીખે છે. ટેક્નોલોજીના આ યુગમાં માણસ મશીનો વચ્ચે રહીને માનવતા ખોઈ બેઠો છે એવી ફરિયાદો થાય છે, પણ આજના જટિલ યુગમાં પણ શિક્ષકે માનવતાની જ્યોત પ્રગટાવી છે.

નવા યુગ, નવી વ્યવસ્થાઓ તો આવવાની જ છે, પણ શિક્ષકની ભૂમિકા અજોડ છે. એટલે જ તો બર્ટ્રાન્ડ રસેલે કહ્યું છે, 'There is indeed no alternative of a teacher.' (શિક્ષકનો જગતમાં કોઈ જ વિકલ્પ નથી.)

**સ્કૂલમાં મહત્ત્વપૂર્ણ જવાબદારી નિભાવતા પ્રિન્સિપલનું વિદ્યાર્થીના જીવન ઘડતરમાં મહત્ત્વનું યોગદાન છે. આ કોલમ અંતર્ગત કોઈ પણ સ્કૂલના પ્રિન્સિપલ વિદ્યાર્થીઓ અને વાલીઓને ઉપયોગી બાબતોનું માર્ગદર્શન આપી શકે છે. લેખની સાથે પાસપોર્ટ સાઈઝનો ફોટો મોકલાવવો જરૂરી છે. વધુ વિગત માટે અહીં આપેલા ફોન નંબર : ૩૯૮૧૪૦૭૯ પર સંપર્ક કરવો.**

દિવ્ય ભાસ્કર, **બાળ ભાસ્કર**, ૨૮૦, મકરબા,
સરખેજ-ગાંધીનગર હાઈ-વે, અમદાવાદ-૧૫,
ઈ-મેલ : **balbhaskar@guj.bhaskarnet.com**

## કેરીના વિવિધ નામ



| | |
|---|---|
| (૧) બગા | (૩૭) રૂસ |
| (૨) ભારે નમણો | (૩૮) શ્રાવણિયા |
| (3) પ્રવાસી | (૩૯) મકારામ |
| (૪) ઢીલી | (૪૦) મહીસુરી |
| (૫) માલદાર | (૪૧) બદામીહાફુસ |
| (૬) બાટલી | (૪૨) દિલહાફુસ |
| (૭) ટાઢિયો | (૪૩) વણજારિયા |
| (૮) રંગારો | (૪૪) ગંભીરિયા |
| (૯) પછાતિયો | (૪૫) કાળોહાફુસ |
| (૧૦) કેસર | (૪૬) ગોબી |
| (૧૧) તોતાપુરી | (૪૭) ફળ |
| (૧૨) રાજાપુરી | (૪૮) રેંગણપરી |
| (૧૩) સરદાર | (૪૯) લાલબાગ |
| (૧૪) માનકુલાશ | (૫૦) માલનીશ |
| (૧૫) પોપટિયા | (૫૧) ફજલી |
| (૧૬) રૂમાની | (૫૨) સાકરિયા |
| (૧૭) લંગડો | (૫૩) કુદડિયા |
| (૧૮) મલગુબ્બો | (૫૪) ગોદડિયા |
| (૧૯) બાફણિયા | (૫૫) દાડમિયા |
| (૨૦) નારંગી | (૫૬) લીમડી |
| (૨૧) કરેજિયા | (૫૭) ધરમપુરિયા |
| (૨૨) ગુંદરિયા | (૫૮) જમરૂખિયા |
| (૨૩)સફરજનિયા | (૫૯) ખભરી |
| (૨૪) અજમેરિયા | (૬૦) નીલમ |
| (૨૫) ટીટિયા | (૬૧) મલબારી |
| (૨૬) પીટિયા | (૬૨) બાડવિયા |
| (૨૭) ગંધરપિયા | (૬૩) બટકુટિયા |
| (૨૮) મીઠીસબગર | (૬૪) વલસાડી |
| (૨૯) માખણિયા | (૬૫) સૂરતી |
| (30) જમાદાર | (૬૬) મધકપુરી |
| (૩૧) બારમાસી | (૬૭) કારેલિયા |
| (૩૨) હાફુસ | (૬૮) ઘાટો |
| (33) પાયરી | (૬૯) આફ્રિકન મેંગો |
| (૩૪) સિંદુરિયા | (૭૦) ગધેમાર |
| (૩૫) અનારસિયા | (૭૧) દેવાળિયા |
| (૩૬) ચિનાઈપાયરી | (૭૨) ભડદા દુબળા |

**સંકલન : સંજય રાવલ**, (અમદાવાદ)

## Puzzle wheel

Write the first of each picture in the space in the centre of the puzzle wheel. Unscramble the letters and you will spell a new word.



Puzzle Wheel : RABBIT

## મારું ભાસ્કર મારી તસવીર...

**નિયતિ ભૂપેશભાઈ ચંદે**
માતાનું નામ : પૂજાબેન
ઉંમર : આઠ માસ
ધોરણ : --
શાળા: --
ગામ : મઉં મોટી

**આકાશ વિજયભાઈ છાભૈયા**
માતાનું નામ : નીતાબેન
ઉંમર : --
ધોરણ : ૩
શાળા: ઉમા વિદ્યાલય
નગર : નખત્રાણા

**હર્ષલ પ્રકાશભાઈ નાથાણી**
માતાનું નામ : વિજયાબેન
ઉંમર : --
ધોરણ : ૨
શાળા: ઉમા વિદ્યાલય
નગર : નખત્રાણા

**હર્ષિદા પ્રકાશભાઈ દાફડા**
માતાનું નામ : કેશરબેન
ઉંમર : --
ધોરણ : ૩
શાળા: ઉમા વિદ્યાલય
નગર : નખત્રાણા

**અંજનાબા જગતસિંહ સોઢા**
માતાનું નામ : કિરણબા
ઉંમર : --
ધોરણ : ૨
શાળા : ઉમા વિદ્યાલય
નગર :નખત્રાણા

**વત્સલ કમલેશભાઈ પટેલ**
માતાનું નામ : કલ્પનાબેન
ઉંમર : --
ધોરણ : ૬
શાળા : ઉમા વિદ્યાલય
નગર : નખત્રાણા

**મીરાં ભગવાનદાસ ધનાણી**
માતાનું નામ : છાયાબેન
ઉંમર : --
ધોરણ : શિશુ મંદિર-૧
શાળા : ઉમા વિદ્યાલય
નગર : નખત્રાણા



**ધરતી શાંતિલાલ નાથાણી**
માતાનું નામ : દિવ્યાબેન
ઉંમર : --
ધોરણ : એલ.કે.જી.
શાળા: ઉમા વિદ્યાલય
નગર : નખત્રાણા

**યોગા રાજેશભાઈ ભટ્ટી**
માતાનું નામ : હર્ષાબેન
ઉંમર : --
ધોરણ : ૧
શાળા: ઉમા વિદ્યાલય
નગર : નખત્રાણા

**વંશિકા વિનોદ નામોરી**
માતાનું નામ : શાંતાબેન
ઉંમર : --
ધોરણ : --
શાળા: --
ગામ : જિયાપર

**શ્રીદત્ત ગુરુદત્ત શર્મા**
માતાનું નામ : સાધનાબેન
ઉંમર : ---
ધોરણ : --
શાળા : --
નગર : અંજાર

**ઓમદત્ત ગુરુદત્ત શર્મા**
માતાનું નામ : સાધનાબેન
ઉંમર : ---
ધોરણ : --
શાળા: --
નગર : અંજાર

**નીર પ્રશાંતભાઈ ગોર**
માતાનું નામ : --
ઉંમર : ૪
ધોરણ : એલ.કે.જી.
શાળા: સંસ્કાર સ્કૂલ
શહેર : ભુજ

**કાવ્ય પુનિતભાઈ પોમલ**
માતાનું નામ : હિનાબેન
ઉંમર : ૩
ધોરણ : --
શાળા : મોમ્સ નર્સરી
શહેર : ભુજ

**હર્ષ પ્રદીપભાઈ સોલંકી**
માતાનું નામ : ચાંદનીબેન
ઉંમર : -
ધોરણ : -
શાળા : -
શહેર : ભુજ

**કાજલ ભરતભાઈ નામોરી**
માતાનું નામ : નિર્મલાબેન
ઉંમર : -
ધોરણ : -
શાળા : -
ગામ : જિયાપર

**ક્રિષ્ના ચેતનભાઈ પટેલ**
માતાનું નામ : વર્ષાબેન
ઉંમર : ૧.૫ વર્ષ
ધોરણ : -
શાળા : -
નગર : દયાપર

**હેતવ દિગંત અંતાણી**
માતાનું નામ : દીપાલીબેન
ઉંમર : ૪ વર્ષ
ધોરણ : યુકજી
શાળા : સંસ્કાર નર્સરી
શહેર : ભુજ

**પ્રવાસ**

# વન્યસૃષ્ટિને સાચવતાં નેશનલ પાર્ક

**વનની નીરવ શાંતિમાં કંઈક સળવળાટ થાય કે તરત જ તમને થશે કે એ વાઘ આવ્યો... આવો રોમાંચ અને કુદરતી રમણીય સૌંદર્ય તમને નેશનલ પાર્કમાં જોવા મળશે. આપણા દેશની ચોતરફ ખૂબ જ જાણીતા નેશનલ પાર્ક આવેલા છે. પૂર્વમાં કાઝીરંગા, પશ્ચિમમાં રણથંભોર, ઉત્તરમાં કોર્બેટ અને દક્ષિણમાં નગરહોલ તો મધ્ય ભારતમાં બાંધવગઢ.. આ બધા જ નેશનલ પાર્ક દેશનો સમૃદ્ધ વારસો છે.**

### સિંહની વસતી ગણતરી

ગુજરાતમાં ગીર એટલે કે સાસણગીર એક માત્ર એવું સ્થળ છે જ્યાં સિંહ વસે છે. દોસ્તો, તમે જાણો છો કે જેમ માણસોની વસતી ગણતરી ચોક્કસ સમયાંતરે થતી હોય છે તેવી જ રીતે સિંહની પણ વસતી ગણતરી કરાય છે. સિંહની વસતી ગણતરી આ વર્ષે કરાઈ. થોડા સમય પહેલાં જ આ કામ પૂરું થયું. અગાઉની વસતી ગણતરી પ્રમાણે જંગલના રાજાની કુલ સંખ્યા ૨૧૩ હતી, જે હવે વધીને ૪૦૫ થઈ છે. તો દોસ્તો, આપણા પ્રદેશમાં સાવજ વધુ સુરક્ષિત બન્યા છે.

### કોર્બેટ

ઉત્તરાખંડના હીલ સ્ટેશન નૈનિતાલમાં આવેલા આ પ્રખ્યાત નેશનલ પાર્કની ખાસ વિશેષતા તેના વાઘ છે. ૧૯૩૬માં કોર્બેટ નેશનલ પાર્કની સ્થાપના થઈ હતી. આ નેશનલ પાર્કમાં વાઘની જેટલી વસતી છે એટલી કદાચ વિશ્વના બીજા કોઈ વન કે અભયારણ્યમાં નથી. અરે, હાથીભાઈના ઝૂંડ, ચાલાક શિયાળ કે નમણાં એવા સાબરથી માંડીને જુદા-જુદા વન્ય પ્રાણીઓને આંખમાં વસાવવાનો અવસર તમને અહીં જ મળે. વાઘને જોવાની મજા આવે છે એટલી જ મજા માછલીઓને જોવાની પણ છે.

**આકર્ષણ**
વાઘ, હાથી, રીંછ, શિયાળ, કેટફિશ, જુદી-જુદી પ્રજાતિના અસંખ્ય પક્ષીઓ.

### રણથંભોર

રાજસ્થાનમાં આવેલા રણથંભોર કિલ્લાના નામ પરથી આ નેશનલ પાર્કનું નામ રણથંભોર રાખવામાં આવ્યું છે. અહીં વાઘની એક ઝલક જોવા માટે પ્રવાસીઓ ઘેલા બને છે. વાઘ ઉપરાંત પાતળી સોટી જેવા પગવાળા ચીતળ, જંગલી ભૂંડ, સાબર, શિયાળ જોવાનો પણ એક લહાવો છે, તો સાબર જેવા પ્રાણીઓના ટોળા પણ અદ્‌ભુત નજારો ઉત્પન્ન કરે છે. માત્ર પ્રાણીઓ જ નહીં પણ ૨૬૪ કરતાંય વધારે પ્રજાતિના રંગબેરંગી પક્ષીઓ પણ પ્રવાસીઓને આકર્ષે છે.

**આકર્ષણ**
વાઘ, સાબર, શાહુડી, મગર, વાંદરા તેમજ અનેક પક્ષીઓ

### નગરહોલ

કર્ણાટકની આગવી ઓળખ એટલે નગરહોલ નેશનલપાર્ક. તમને ખબર છે દોસ્તો, આ સુંદર મજાના નેશનલ પાર્કમાં જાડીયાપાડીયા એશિયન હાથીઓની સંખ્યા સારા એવા પ્રમાણમાં છે. લગભગ ૬૪૩ ચોરસ કિલોમીટરમાં પથરાયેલા આ નેશનલ પાર્કમાં હાથીઓની ચિંઘાડ સાંભળવાનો આહ્‌લાદક અનુભવ છે. આ નેશનલ પાર્ક ભીમકાય હાથીદાદાનો ગઢ તો ખરો જ પણ અહીં બિલાડીકૂળના ભયાનક એવા વાઘભાઈનોય ભેટો તો થઈ જાય. લીલાંછમ ઘાસમાં ચરતા હાથીઓ અને તેમનાં મદનિયાને જોવાનો સુંદર નજારો અદ્‌ભુત દૃશ્ય ખડું કરે છે.

**આકર્ષણ**
એશિયન હાથી, વાઘ, જંગલી બિલાડી, જંગલી કૂતરાં, વિવિધ પક્ષીઓ.

### બાંધવગઢ

મધ્યપ્રદેશની બરાબર મધ્યમાં આવેલા બાંધવગઢ નેશનલપાર્કની એક વખતની મુલાકાત કદાચ તમને વારંવાર આવવા માટે પ્રેરે તેવી છે. અહીંનું મુખ્ય આકર્ષણ ટાઈગર શો છે. બાંધવગઢ નેશનલપાર્કની મુલાકાત લેતા તમને એટલી તો ખાતરી થાય જ કે અહીં તમે વાઘ જોયા વગર તો પાછા નહીં જ જાઓ. રીંછ, વાઘ, હરણ રંગબેરંગી પક્ષીઓ, મોર જોવાનો જે રોમાંચ છે તે અવર્ણનીય છે. હાથીની સવારી પર વાઘને નજરોનજર નિહાળવાનો અદ્‌ભુત નજારો જોવા જેવો છે.

**આકર્ષણ**
વાઘ, સાબર, ચીતળ, રીંછ, શિયાળ, અનેક પ્રજાતિની ચકલીઓ.

### કાઝીરંગા

આસામમાં આવેલા આ સોહામણા નેશનલ પાર્કનું મુખ્ય આકર્ષણ અતિશય જાડી ચામડીવાળા એક શિંગડાવાળા ગેંડાભાઈ છે. ૧૯૦૪માં કાઝીરંગાને અભયારણ્ય જાહેર કરવામાં આવ્યું. વોટર બફેલો, બારહશિંગાના ટોળાં પણ અહીં જોવા મળે છે. એવું પણ માનવામાં આવે છે કે વિશ્વમાં લગભગ ૨૭૦૦ જેટલા એક શિંગડાવાળા ગેંડાઓમાં લગભગ ૧૮૦૦ જેટલા ગેંડા ફક્ત આ નેશનલ પાર્કમાં છે. ગેંડાને તમે છંછેડો નહીં ત્યાં સુધી એ કોઈને કંઈ ન કરે. સિંહ, વાઘ જેવા પ્રાણીઓ પર જો તે એક શિંગડાથી પ્રહાર કરે તો એ પ્રાણીઓને પોતાનો જીવ બચાવવો ભારે પડી જાય.

**આકર્ષણ**
એક શિંગડાવાળો એશિયન ગેંડો, ભેંસ, વાઘ, હાથી, હરણ, અને પક્ષીઓ.

# સુપર અર્થની સહેલ

**સ્ટોરી કોર્નર**

સાંજનો સમય હતો. પ્રદૂષણને કારણે મોન્ટુની આંખમાંથી પાણી નીકળતું હતું. એને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી. ઘરે આવતા જ મોન્ટુ સીધો પથારીમાં પડ્યો.

'મોન્ટુ બેટા, તારી આંખ તો લાલઘૂમ થઈ ગઈ છે. લાવ, ગુલાબજળના ટીપાં નાખી દઉં. તને ઠંડક લાગશે.' મમ્મીએ મોન્ટુની આંખમાં ગુલાબજળના ટીપાં નાખ્યા. તરત જ મોન્ટુએ આંખ બંધ કરી. અચાનક કોઈકના મધુર અવાજે તેને જગાડી દીધો, 'મારી સાથે ફરવા આવીશ?' મોન્ટુએ આંખ ખોલી. લાલ રંગના વાંકળીયા વાળવાળી તેના જેવડી એક છોકરી સામે ઊભી હતી. મોન્ટુએ આશ્ચર્યથી પૂછ્યું, 'તું કોણ છે? 'હું એસ.જી. ૧૯૦૭૭ છું અને ઈ.સ. ૨૫૨૦ પરથી આવી છું.' છોકરીએ કહ્યું.

એની વાત સાંભળીને મોન્ટુને નવાઈ લાગી, 'એટલે કે હું ભવિષ્યની વ્યક્તિને મળી રહ્યો છું, પણ તારું નામ કેમ વિચિત્ર છે?' મોન્ટુએ કહ્યું. 'આ મારું નામ નથી પણ કોડવર્ડ છે. તું મને 'સાઈગા' નામથી બોલાવી શકે. હું માનવ અને મશીનના મિશ્રણથી બની છું. હું બધા જ પ્રકારનો અવાજ સાંભળી શકું છું. તું હવે ચાલ મારી સાથે.' એટલું કહી સાઈગા અને મોન્ટુ અગાશી પર ગયા. 'આ અમારું ચક્રયાન છે. આપણે આ ચક્રયાનમાં બેસીને અમારા ગ્રહ પર જઈશું.' સાઈગાએ કહ્યું. જોરદાર આંચકા સાથે ચક્રયાન વિવિધ ગ્રહો-નક્ષત્રો વચ્ચેથી પસાર થયું. ધીરે-ધીરે મોન્ટુની આંખ બંધ થઈ ગઈ. થોડી વાર પછી તે જાગ્યો અને બેઠો થઈ ગયો.

'ગ્લીઝ ૫૮૧-સી પર તમારું સ્વાગત છે દોસ્ત.' સાઈગા જેવી અનેક છોકરીઓ અને છોકરાઓ તેની સામે હતા. સ્વચ્છ પવન અને મીઠી સુગંધથી મોન્ટુને એવું લાગતું હતું કે જાણે તે બગીચામાં બેઠો હોય. સાઈગાએ મોન્ટુના હાથમાં પ્લેટ ધરી. પ્લેટમાં સોનેરી, લાલ, વાદળી, લીલા રંગની ગોળીઓ હતી. 'તમે લોકો આવું ખાઓ છો?' એટલું કહી કમને મોન્ટુએ ગોળીઓ મોઢામાં મૂકી. અરે, એમાં તો તેની ભાવતી ખીર અને સમોસાનો સ્વાદ હતો. 'હવે હું તને અમારા ગ્રહના અનોખા સંગ્રહાલયમાં લઈ જાઉં' સાઈગાએ કહ્યું. રૂમની બહાર આવી તેઓ કેપ્સૂલ આકારના એક યંત્રમાં બેઠા. તેમનું યંત્ર એવું તો ઉડ્યું કે જાણે પવન સાથે સ્પર્ધા ન હોય! પછી એક લીલા રંગની પથ્થરની બનેલી સુંદર બિલ્ડિંગ સામે તેમનું યંત્ર ઊભું રહ્યું. ત્યાં મોન્ટુએ જે દૃશ્ય જોયું એ જોઈને તેની નવાઈનો પાર ન રહ્યો. આગ્રાનો તાજમહાલ, પેરિસનો એફિલ ટાવર ઉપરાંત કેટલીય સુંદર બિલ્ડિંગ હતી. પ્રખ્યાત વિજ્ઞાનીઓ સર આઈઝેક ન્યૂટન, આઈન્સ્ટાઈન, જગદીશચંદ્ર બોઝ અને મહાત્મા ગાંધીની મૂર્તિ પણ ત્યાંની શોભા વધારતી હતી. મોન્ટુએ પૂછ્યું, 'આ બધું અહીં ક્યાંથી?' સાઈગાએ કહ્યું, 'અમારા પૂર્વજોનો વારસો છે. ધરતી પરના માનવોને કારણે જ અમારો ગ્રહ અસ્તિત્વમાં આવ્યો. ધરતીથી ૨૦ પ્રકાશવર્ષ દૂર અમારો આ ગ્રહ ગ્લીઝ ૫૮૧-સી તમારી પૃથ્વીના આકાર કરતાં દોઢ ગણો મોટો અને પાંચ ગણો ભારે છે. કેટલાક લોકો અમારા ગ્રહને પૃથ્વીની મોટી બહેન અથવા સુપર અર્થ કહે છે.'

**◆◆◆ જોરદાર આંચકા સાથે અસંખ્ય ગ્રહો-નક્ષત્રો વચ્ચેથી ચક્રયાન પસાર થયું. ◆◆◆**

મોન્ટુને યાદ આવ્યું કે ક્લાસટીચરે પણ કહ્યું હતું કે આ નવો શોધાયેલો ગ્રહ લગભગ પૃથ્વીને મળતો આવે છે. ત્યાં જીવન હોય એવું પણ બની શકે. 'ધરતી પર પ્રદૂષણ વધવાથી ગ્લોબલ વૉર્મિંગ જેવી સમસ્યાઓ વધતી ગઈ. એ વખતે માણસોએ પોતાની બીજી દુનિયા વસાવવાનું નક્કી કર્યું. પ્રકાશની ગતિથી ચાલતા અવકાશ યાન બનાવ્યા અને જ્યાં જીવન શક્ય હતું એ ગ્રહ પર વસવાટ કરવાનું નક્કી કર્યું. એમાંનો જ એક ગ્રહ અમારો છે' સાઈગાએ કહ્યું. મોન્ટુએ કહ્યું, 'તમારા ગ્રહ પર કેટલી શાંતિ છે? માટી, ધુમાડો કે બૂમબરાડા પણ નહીં.' 'હા, અહીં આવ્યા પછી માણસે ધરતી પર જે ભૂલો કરી એવી ભૂલો ના કરી. પરમાણુ પરીક્ષણ, યુદ્ધ, હથિયાર કે પછી પ્રકૃતિનું શોષણ આમાંની એક પણ ભૂલ અહીં આવીને તેણે ના કરી' સાઈગાએ કહ્યું. થોડી વાર પછી મોન્ટુએ કહ્યું, 'થેંક યુ, સાઈગા, અને હવે મારે જવું જોઈએ.'

ચક્રયાનમાં બેસતાં થોડી વારમાં તો મોન્ટુ તેના ઘરની અગાશીએ હતો. તેણે ઘડિયાળમાં નજર કરી તો આઠ વાગ્યા હતા. એટલે કે ધરતી પરથી ગયાને માત્ર બે કલાક થયા હતા. ધીમા પગલે આવીને તે પથારીમાં સૂઈ ગયો, પણ આશાનું અજવાળું તેના મનના એક ખૂણે પથરાયું હતું કે સાઈગા ફરીથી તેને મળવા ચોક્કસ આવશે.

realpatidar.com

2010-05-08 -Divya Bhaskar -Invitation & Consitution Passed [393]



# ન્યૂમોનિયા સામે જાગૃતિ કેળવો

ગાંધીધામમાં તબીબો અને સંસ્થા વચ્ચે સેમિનાર યોજાયો

realpatidar.com

ભાસ્કર ન્યૂઝ. ગાંધીધામ

ફોરગોટન કિલર તરીકે ઓળખાતી બિમારી ન્યૂમોનિયા દર વર્ષે ભારતમાં પાંચ વર્ષથી નીચેની વયના ચાર લાખ બાળકોને ભરખી જાય છે. જ્યારે ગુજરાતમાં દર વર્ષે ૧૪ હજાર જેટલા બાળકો પાંચ વર્ષના થાય તે પહેલા જ આ બિમારીના કારણે પોતાનો દમ તોડી દે છે. તેમ છતાં ન્યૂમોનિયા વિશે જેટલી જાગૃતિ અને તેને અટકાવવાના પ્રયાસો થવા જોઇએ તે થતા નથી તેવી વ્યથા ગાંધીધામ ખાતે યોજાયેલા એક સેમિનારમાં ઇન્ડિયન પીડિયાટ્રિક એસો.ના સભ્યોએ વ્યક્ત કરી હતી.

જ્હોન હોપ્કીંગ્સ ઓફ પબ્લિક હેલ્થ દ્વારા શુક્રવારે ગાંધીધામમાં સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અહીંના ડોક્ટરોએ ન્યૂમોનિયાની વધતી ટકાવારી સામે કચ્છની ભૌગોલિક પરિસ્થિતિ પણ કારણભૂત ઠરાવી હતી. ડૉ. નરેશ ઠક્કરે જણાવ્યું હતું કે, કચ્છ ખૂબજ વિશાળ જિલ્લો હોવાથી છેવાડાના લોકોને સારવાર માટે છેક ભુજ આવવું પડે છે તેના કારણે ન્યૂમોનિયાના ભોગ બનેલા બાળકને તાત્કાલિક સારવાર મળી શકતી નથી. મોટાભાગના પરિવારો પણ બાળકમાં આ બીમારીના લક્ષણો દેખાતા ડોક્ટરની સલાહ લેવાની આળસ કરે છે અને ઘરગથ્થુ ઇલાજ પણ અપનાવે છે તેના કારણે જ્યારે બીમારી બાળકના શરીર પર હાવી થઇ જાય છે ત્યારે ઘણું મોડું થઇ ગયું હોય છે. ન્યૂમોનિયાના રોકવા માટેની જે વેક્સિન બજારમાં ઉપબ્ધ છે તેનો ઉપયોગ પણ માત્ર પ્રાઇવેટ ડોક્ટરો કરે છે. સરકારી દવાખાનામાં પણ આ વેક્સિનનો ઉપયોગ થાય તે જરૂરી છે.

સેમિનારમાં ન્યૂમોનિયાની બીમારી વિશે ચર્ચા કરાઇ હતી. - મનોજ રાઠોડ

ગુજરાત આઇએપીના એક્ઝિક્યુટિવ બોર્ડ મેમ્બર ડૉ. રાજેશ જેસ્વાણીએ જણાવ્યું હતું કે, આ બીમારી અંગે જાગૃતિ વધારવા અને મૃત્યુદર ઘટાડવા ગાંધીધામના પીડિયાટ્રિક્સે પ્રયાસો શરૂ કરી દીધા છે. આગામી દિવસોમાં અખિલ ભારતીય મીઠા ઉદ્યોગ ઓસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ હીરાલાલ પારખના આર્થિક સહયોગથી ગાંધીધામના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા એક હજાર બાળકોને ન્યૂમોનિયાની વેક્સિન આપવામાં આવશે. તો બીજી બાજુ જ્હોન હોપ્કીંગ્સ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના સભ્યોએ ગાંધીધામમાં ન્યૂમોનિયાથી ગ્રસ્ત બાળકો અને તેમના પરિવારજનોની મુલાકાત લઇ તેઓને આશ્વાસન પૂરું પાડ્યું હતું.

# કેન્દ્રીય શિપિંગ સચિવ આજથી કંડલાની મુલાકાતે

ભાસ્કર ન્યૂઝ. ગાંધીધામ

કેન્દ્રીય શિપિંગ મંત્રાલયના સચિવ કે. મોહનદાસ શનિવારે કંડલા પોર્ટની મુલાકાતે આવી રહ્યા છે.

શિપિંગ મંત્રાલયના સચિવ કે. મોહનદાસ શનિવારે સવારે મુંબઇથી કંડલા એરપોર્ટ પર આવશે. ત્યાર બાદ સવારે નવ વાગ્યે તેઓ કંડલા પોર્ટની મુલાકાત લેશે. આ પછી સરકારના શિપિંગ સેક્રેટરી ડીજીના અધિકારીઓ સાથે બેઠક યોજશે. બપોરે ત્રણ વાગ્યે પોર્ટ વપરાશકારો, યુનિયનો, ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને એસઆરસી સાથે વિવિધ મુદ્દે બેઠક કરી ચર્ચા-વિચારણા કરશે. ત્યાર બાદ તેઓ રવિવારે કંડલાથી મુંબઇ માટે રવાના થશે. આ મુલાકાતમાં તેઓ કંડલા પોર્ટને લગતા પ્રશ્નોથી વાકેફ થશે તેવું સત્તાવાર રીતે જણાવાયું હતું.

## પંચરંગી સજાવટ...

તસવીર મનાજ રાઠોડ

પંચરંગી શહેર ગાંધીધામમાં દરેક સમાજ અને ધર્મના લોકો વસે છે, તેથી આ શહેરમાં પંચરંગી સંસ્કૃતિનો સમન્વય સધાયો છે. શહેરના માર્ગો પર હાલે વેચાઇ રહેલું રાજસ્થાન સંસ્કૃતિની બનાવટનું રાચરચિલું લોકોમાં ભારે લોકપ્રિય બની રહ્યું છે.

# ઔદ્યોગિક ક્ષેત્રે કુશળ ક્રેઇન ઓપરેટરોની આવશ્યકતા

આદિપુર પોલિટેકનિક કોલેજમાં ક્રેઇન ઓપરેટર ટ્રેનિંગ કોર્સ શરૂ

ભાસ્કર ન્યૂઝ. ગાંધીધામ



ભૂકંપ બાદ કચ્છમાં આવેલા ઔદ્યોગિક વિકાસના પગલે કાર્યક્ષમ કારીગરો અને કર્મચારીઓની માંગ વધી છે, પરંતુ ઔદ્યોગિક ગૃહોની આ માંગ સંતોષાઇ નથી, ત્યારે કુશળ કારીગરોને તૈયાર કરવા માટે શૈક્ષણિક સંસ્થા અને ઔદ્યોગિક ગૃહો હાથ મિલાવે તો આ સમસ્યાનો મહદ્અંશે હલ આવી શકે છે તેવું આદિપુર ટીમ્સ ખાતે ક્રેઇન ઓપરેટરર્સ ટ્રેનિંગ પ્રોગ્રામના ઉદ્દઘાટન સમારોહમાં મુન્દ્રા પોર્ટ અને એસઇઝેડના ચીફ ઓપરેટિંગ ઓફિસર કેપ્ટન ઉમેશ અભયંકરે જણાવ્યું હતું.

તોલાણી પોલિટેકનિક કોલેજ દ્વારા નોડલ ઇન્સ્ટિટ્યૂટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંતર્ગત તાજેતરમાં મેશન ટ્રેનિંગ પ્રોગ્રામ શરૂ કરાયા બાદ શુક્રવારે ક્રેઇન ઓપરેટર ટ્રે"નગ પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી છે. આ ટ્રેનિંગ પ્રોગ્રામમાં અદાણી ફાઉન્ડેશન પણ તોલાણી કોલેજની સહભાગી સંસ્થા બની છે. પ્રિન્સિપાલ નિતિન ભંભાણીએ નોડલ ઇન્સ્ટિટ્યૂટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિશે માહિતી આપી હતી. અદાણી ગ્રૂપના ટેકનિકલ ટ્રેનિંગના હેડ મિહિરદાસે જણાવ્યું હતું કે, પોર્ટ તેમજ ઔદ્યોગિક એકમોમાં કુશળ ક્રેઇન ઓપરેટર્સની માંગ વધી છે. પરંતુ તેની કમીના કારણે ઔદ્યોગિક એકમો પર માલનું પરિવહન કરવામાં સમય વેડફાય છે ત્યારે આ પ્રકારના ટ્રેનિંગ પ્રોગ્રામથી કુશળ ક્રેઇન ઓપરેટર્સ બહાર આવશે અને તેના કારણે માલનું પરિવહન ઝડપી બની શકશે.

આ પ્રસંગે પ્લેસમેન્ટ બ્રાઉઝરનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. ડો. એ.કે. રાઠી, અદાણી ફાઉન્ડેશનના સીઇઓ સુષ્મા ઓઝા, મિતેશ ધરમશી, એલ.એસ. દરિયાણી વગેરેએ ઉદ્દબોધન કર્યું હતું. કાર્યક્રમમાં જીસીબીના ટ્રસ્ટી દાદી ક્રિષ્ના ભંભાણી, પ્રો.વેકેંટેશ્વરુ, પ્રો.વરનંદાણી સહિત અન્ય પ્રાધ્યાપકગણ તથા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન પ્રો. સીતાપરાએ કર્યું હતું.

# જૈન યુવાનની હત્યામાં પોલીસે નિવેદનો લીધાં

પ્રારંભિક તપાસમાં કોઇ નક્કર સુરાગ ન મળતાં પોલીસ પણ મૂંઝવણમાં

ભાસ્કર ન્યૂઝ. ગાંધીધામ

ગાંધીધામના સેક્ટર પાંચમાં ગુરુવારે રાત્રે થયેલી જૈન યુવાનની હત્યાનું રહસ્ય વધુને વધુ ઘેરું બનતું જાય છે. ઘટનાના બે દિવસ પછી પણ કોઇ મહત્ત્વપૂર્ણ સુરાગ ન મળતાં પોલીસ માથું ખંજવાળી રહી છે.

ગાંધીધામમાં પોતાના ઘર આંગણમાં સૂતેલા ૩૮ વર્ષીય યુવાન લેબર કોન્ટ્રાક્ટર નરેન્દ્ર આણંદજી ખોનાને અજાણ્યા હત્યારાઓએ તી-ણ હથિયારના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ ઘટના પ્રકાશમાં આવ્યા પછી હરકતમાં આવી ગયેલી પોલીસે ઘટનાસ્થળની ડોફવોડ તથા અન્ય આધુનિક સવલતો વડે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી, પરંતુ તેમાં કોઇ મહત્ત્વપૂર્ણ સુરાગ પોલીસને હાથ લાગ્યો નથી. બીજી બાજુ શુક્રવારે પોલીસે ભોગ બનનારા યુવાનના પરિવારજનો તથા મિત્રોના નિવેદન પણ લીધા હતા. હત્યામાં મરણજનાર નરેન્દ્રની સાથે કોઇને દુશ્મની પણ ન હતી તથા કોઇની સાથે જૂની અદાવત કે નજીકના ભવિષ્યમાં બોલાચાલી પણ ન થઇ હોવાનું પોલીસને પરિવારજનો તથા મિત્રોએ જણાવ્યું હતું.

તપાસનીશ પીઆઇ બી.જી. મોરીએ જણાવ્યું હતું કે, હાલના તબક્કે પોલીસને કોઇ નક્કર પુરાવા હાથ લાગ્યા નથી તેમ છતાં પોલીસે શુક્રવારે ભોગ બનનારાના મિત્રો તેમજ પરિવારજનોના નિવેદન લઇ હત્યારાઓનો તાગ મેળવવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ સિવાય અન્ય કોઇ સુરાગ પોલીસને હાથ લાગ્યા ન હોવાનું તેમણે ઉમેર્યું હતું.

# કસ્ટમે કેટલીક ફાઇલો અટકાવી રાખતાં આશ્ચર્ય

ડીસીઇજીએ તપાસ માટે જરૂરી ફાઇલો આપવા લેખિત પત્ર પાઠવ્યો : ભ્રષ્ટાચારી ઉચ્ચાધિકારીઓએ છાવરવા માટે ફાઇલો અટકાવાયાનો આક્ષેપ

ભાસ્કર ન્યૂઝ. ગાંધીધામ

કંડલા સંકુલમાં આવેલા ટિમ્બર એકમોમાં આચરેલા કથિત રિફંડ કૌભાંડની તપાસ કસ્ટમ પાસેથી ઝૂંટવી લેવાયા પછી ડાયરોક્ટરેટ ઓફ સેન્ટ્રલ એકસાઇસ ઇન્ટેલીજન્સને કસ્ટમે તપાસ સુપરત કરી દીધી છે પણ તેમાં કેટલીક ફાઇલો જાણી જોઇને અટકાવી રખાઇ હોવાનું જાણવા મળે છે. સૂત્રો એવો દાવો કરે છે કે આ ફાઇલોની તપાસ થાય તો આ કૌભાંડમાં કસ્ટમના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓની મિલિભગત બહાર આવી શકે તેમ છે.

ટિમ્બર રિફંડ કૌભાંડ બહાર આવ્યા પછી ઉદ્યોગકારોને અપાતા ત્રાસને પગલે હાઇકોર્ટમાં દાદ મંગાઇ હતી. જેને પગલે અદાલતે કસ્ટમને યોગ્ય કાર્યવાહી જ કરવાનો આદેશ આપ્યો હતો. બીજીતરફ આ કૌભાંડમાં કસ્ટમના ભ્રષ્ટ અધિકારીઓ ૧૪ ટકા મેળવતા હોવાની બાબત પણ પ્રકાશમાં આવી હતી. તેને પગલે ડીસીઇજી તપાસમાં ઉતરી હતી. કસ્ટમ અને ડીસીઇજી વચ્ચે ખેંચતાણ ચાલ્યા પછી થોડા સમય અગાઉ જ બોર્ડના આદેશને પગલે કસ્ટમને મનેકમને તપાસ સોંપવી પડી હતી.

દરમિયાન એવી બાબત બહાર આવી છે કે, આ કૌભાંડમાં કસ્ટમના ભ્રષ્ટ અધિકારીઓની મિલિભગત બહાર લાવવા માટે જ ડીસીઇજીને તપાસ સોંપાઇ હતી. પણ કસ્ટમમાં જેમ અગાઉ આક્ષેપ થઇ ગયા તે પ્રમાણે કેટલાક ઉચ્ચાધિકારીઓને બચાવવા માટે કસ્ટમે જાણી જોઇને કેટલીક ફાઇલોમાં અધૂરાશના નામે તેને અટકાવી રાખી છે. તે સોંપવામાં આવતી નથી. ડીસીઇજી આ ફાઇલો તત્કાળ સોંપવા કસ્ટમને કાગળ પણ લખ્યો છે પણ મન જ મેલું હોય ત્યાં કાગળનો શું પ્રતિભાવે મળે તે સમજી શકાય તેમ છે. આ સ્થિતિમાં ઉપલી કક્ષાએથી દબાણ આવે તો જ કંઇ થઇ શકશે તેમ જાણકારોએ કહ્યું હતું.

## સાર-સમાચાર

### માનવતા ગ્રૂપ દ્વારા પાણીના કુંડાઓનું વિતરણ કરાયું

ગાંધીધામ : કારમી ગરમીથી પાણીની અછતના કારણે પ-ીઓનાં મરણ થતાં હોય છે, ત્યારે લોકો પોતાના ઘેર પક્ષીઓ માટે પાણીના કુંડા મૂકે તેવા ઉમદા આશયથી આદિરપુરના માનવતા ગ્રૂપ દ્વારા દાતાઓના સાથ-સહકારથી પાણીના કુંડાઓનું વિતરણ કરાયું હતું. રાષ્ટ્રીય ભાજપના ઉપાધ્યક્ષ તેમજ રાજ્યસભાના સદસ્ય પુરુષોત્તમ રૂપાલાના હસ્તે ગાંધીનગરમાં કુંડા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. રૂપાલાએ માનવતા ગ્રૂપની આ સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી. માનવતા ગ્રૂપના પ્રમુખ ગોવિંદ દનિચાએ ગ્રૂપના વિવિધ કાર્યોની માહિતી આપી. આ કાર્યક્રમમાં જખા આહિર, રામલાલ ચૌધરી, એ.બી.રાઠોડ, શક્તિ પંજાબી, વિનોદ ચૌહાણ, શૈલેશ પરમાર, રાજુ ઉદાસી, મીઠુ ચૌહાણ તેમજ ગ્રૂપના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.

### જગજીવનરામની જન્મજયંતી ઉજવાઇ

ગાંધીધામ : જગજીવનરામની જન્મજયંતી નિમિત્તે જગજીવનનગર ખાતે આવેલી બાબુ જગજીવનરામની પ્રતિમાને હારારોપણ કરી જન્મજયંતીની ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે ગણેશનગર, મહેશ્વરીનગર, જગજીવનનગરના રહેવાસીઓ તેમજ ઉમેદ જોષી, ઉષાબેન ઠક્કર, લતીફ ખલીફા અને કોંગ્રેસના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

### એઇડ્સ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

ગાંધીધામ : નવજીવન કેર એન્ડ સપોર્ટ સેન્ટર ગાંધીધામ દ્વારા કંડલાના મીઠાપુર વિસ્તારમાં સેન્ટ મેરી સ્કૂલના એસ.એચ.જી. બહેનોમાં એચઆઇવી એઇડ્સ અંગેની જાગૃતિ લાવવા માટે તેમજ ગુ' રોગોની સમજણ અને તેની નિયમિત સારવારના હેતુથી જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. નવજીવનના સ્ટાફ દ્વારા 'જીવન એક સંઘર્ષ' નામનું એક નાટક રજૂ કરાયું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા સેન્ટ મેરી સ્કૂલના સિસ્ટર ફ્રાન્સલીન, નવજીવન કેર સપોર્ટ સેન્ટરના ફાધર જોશ તેમજ સ્ટાફે સહયોગ આપ્યો હતો.

### બે-ચોવીસી સ્થાનકવાસી જૈન મંડળના હોદ્દેદારો વરાયા



પ્રમુખ



ઉપપ્રમુખ



મંત્રી

ગાંધીધામ : બે-ચોવીસી સ્થાનકવાસી જૈન મંડળ ગાંધીધામના વર્ષ ૨૦૧૦-૧૧ માટેના હોદ્દેદારોની વરણી કરાઇ છે, જેમાં પ્રમુખ તરીકે શશિકાંત મહેતા, ઉપપ્રમુખ કિરણ મહેતા, મંત્રી સુનીલ મહેતા, સહમંત્રી દર્શન શેઠ, ખજાનચી પ્રતીક મહેતા તેમજ કારોબારી સભ્યો તરીકે નીરવ મહેતા, નિલેશ મોરબીઆ, હિરણ મોરબીઆ, ધર્મેશ મોરબીઆ, વિકાસ શેઠ તેમજ રૂચર શેઠની વરણી કરવામાં આવી છે.

# ગાંધીધામમાં કોંગ્રેસે વીજતંત્ર સામે રેલી કાઢી

ઝૂંપડાં ધારકોની અરજીઓ રાજકીય ભેદભાવને કારણે અટકાવી દેવાતી હોવાનો આક્ષેપ

ભાસ્કર ન્યૂઝ. ગાંધીધામ

ગાંધીધામના રામબાગ વિસ્તારમાં આવેલી ઝૂંપડપટ્ટીઓના લોકોને પીજીવીસીએલ તંત્ર દ્વારા સરકારી યોજના હેઠળ નવા જોડાણો આપવામાં કરાતા અખાડા સામે આજે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્ય સરકાર, વીજતંત્ર સામે નારા લગાવીને રેલી કાઢી, કાળા વાવટા દેખાડીને આ પ્રશ્નના ઉકેલની માંગ કરી હતી.

કચ્છ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ શૈલેન્દ્રસિંહ જાડેજા, જુમા રાયમા, ઉમેદ જોશી, લતીફ ખલીફા, ચેતન જોશી તથા કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર કર્યો હતો. ગાંધી માર્કેટથી ઓસ્લો સર્કલ નજીક આવેલા વીજ તંત્રની કચેરી સુધી રેલી કઢાઇ હતી.

કચેરી સમક્ષ અગ્રણીઓએ ચૂંટણીકાર્ડ માન્ય ન રાખવા, સહિતના પ્રશ્નો ઉકેલવા માંગ કરી હતી. કોંગ્રેસ દ્વારા એવો આક્ષેપ કરાયો હતો કે તંત્ર સ્થાનિક મંત્રીઓ, ધારાસભ્યોની ભલામણની અરજીઓ તત્કાળ ઉકેલે છે જયારે કોંગ્રેસ તરફી કહેવાય તેવા ગરીબ અને પછાત વર્ગના લોકોની અરજીઓઓનો છ માસ સુધી ઉકેલ આવતો નથી. ત્યારે જરૂર પડયે ભૂખ હડતાલ, આંદોલન અને તાળાબંધી સહિતના પગલાંઓ પણ ભરવાની પણ ચીમકી અપાઇ હતી.

પીજીવીસીએલના નાયબ કાર્યપાલક ઇજનેર મેઘાણીએ કહયું હતું કે, જે ઝૂંપડાધારકો માટે જોડાણો મંગાય છે તે આપી શકાય તેમ નથી. સરકારના ઠરાવ મુજબ સરકારી જમીન પર કે પોતાની જમીન પર ઝૂંપડા ધરાવતા લોકોને જોડાણ આપી શકાય છે. જયારે રામબાગ પાસે રહેતા લોકો કોઇની જમીન પર દબાણ કરીને રહે છે તેથી એસઆરસી સમક્ષ તેનું ના- વાંધા પ્રમાણ મંગાયું હતું. પણ એસઆરસીએ જ ના પાડતા જોડાણ આપી શકાય તેમ નથી. આ રજૂઆત ઉપલી કક્ષાએ મોકલી અપાશે અને જે આદેશ આવશે તે

# મામલતદાર કચેરીમાં નવા પિટિશન રાઇટર જરૂરી

ભાસ્કર ન્યૂઝ. ગાંધીધામ

ગાંધીધામ મામલતદાર કચેરીમાં આવતા જતા રાજકીય પક્ષોના કાર્યકર્તાઓએ દલાલીનો ધંધો શરૂ કરતા લોકો લૂટાતા હોવાની લાંબા સમયથી ફરિયાદ પછી તંત્રે પોલીસ ફરિયાદ સાથે કડક પગલાં ભર્યાં હતાં. આ કારણે લોકો લૂટાતા બચ્યા છે, પણ હવે નવી સમસ્યા શરૂ થઇ છે. કચેરીમાં આવતા અશિક્ષિત અને બારાતુ પ્રજાને ફોર્મ ભરવામાં પડતી મુશ્કેલીને કારણે પિટિશન રાઇટરોની આવશ્યકતા ઊભી થઇ છે. આ કારણે જ દલાલોની જમાવટ થઇ હતી હવે તંત્રે આ સમસ્યા ઉકેલવી જોઇએ તેવી માગણી થઇ રહી છે.

ગાંધીધામ ઔદ્યોગિક રીતે વિકાસ પામતું હોવાથી દેશભરના લોકો મજૂરી અને નોકરી માટે આ શહેરમાં સ્થાયી થઇ રહ્યા છે ,તેથી રાશનકાર્ડ અને અન્ય આધારોની કામગીરી મામલતદાર કચેરીમાં વધી છે. આ સ્થિતિમાં કચેરી કામગીરીમાં પહોંચી શકતી નથી, તેથી લોકોને ભારે હાલાકી પડી રહી છે. આ સ્થિતિનો લાભ લઇને આ કચેરીમાં આવતા જતા રાજકીય પક્ષોના કેટલાક શખ્સોએ દલાલીનો ધંધો શરૂ કરી દીધો હતો. લોકોને અરજીના ફોર્મ ભરવાથી કરીને અરજીઓ પાસ કરાવવાના નામે લૂંટવામાં આવી રહ્યા છે.

તાજેતરમાં અધિક કલેકટરે કરેલી કાર્યવાહીને પગલે આવી દલાલીનો ધંધો બંધ થઇ ગયો છે.

અત્યાર સુધી લોકોને હાલાકી પડતી હતી, તેમાં હવે ઉમેરો થયો છે. અશિક્ષિત પ્રજાને પણ ભારે સહન કરવું પડી રહ્યુ છે. સરકારે મામલતદાર કચેરી બહાર પિટિશન રાઇટરની સુવિધા રાખી છે તેને કારણે અરજદારો નજીવી કિંમતે ફોર્મ મેળવી અને ભરાવી શકે છે, પણ આ કચેરીમાં વર્ષોથી જગ્યાઓ ખાલી છે તેને ભરવા નવા લાઇસન્સ અપાતાં નથી તેથી જ ગેરકાયદે રાઇટરો ઉગી નીકયા હતા. હવે આ દલાલીનું કામ બંધ કરાવી દેવાતાં લોકોને ફોર્મ ભરવા સહિતની પરેશાની થઇ રહી છે. નવા લાઇસન્સ ઇશ્યુ કરવાની જૂની માંગણી તત્કાળ સંતોષાય તેવી માંગ છે.

## સેન્ટ્રલ કચેરીના આદેશ બાદ તંત્ર દોડતું

# કચ્છના તમામ એસ.ટી ડેપોમાં ક્ષતિઓ નિવારો

ભુજમાં ડેપો મેનેજરોની બેઠકમાં કરાઇ તાકીદ

ભાસ્કર ન્યૂઝ. ભુજ

ભુજમાં એસ.ટી.ના તમામ ડેપો મેનેજરની બેઠકમાં તમામ ડેપોમાં ક્ષતિઓ નિવારવા તાકીદ કરાઇ હતી.૧ આ અંગે એસ.ટી.ના અત્યંત વિશ્વાસપાત્ર સૂત્રોના જણાવ્યા મુજબ એસ.ટી.ની ડિવિઝન કચેરી ખાતે શુક્રવારે કચ્છના તમામ એસટી ડેપોના મેનેજરની બેઠક યોજાઇ હતી. જેમાં એસટી તંત્રમાં હાલ જે ક્ષતિઓ છે તે દૂર કરી આવકમાં વધારો થાય તે માટે ખાસ તાકીદ કરાઇ હતી. સૂત્રોએ વધુમાં જણાવ્યું કે, નલિયા ડેપો અંગે સેન્ટ્રલ કચેરીએથી થયેલા હુકમ બાદ ખાસ ટીમ મૂકીને સર્વે કરાયો હતો. જેનો રિપોર્ટ વિભાગીય નિયામકને સુપરત કરી દેવાયો છે. જે મુદ્દાઓ અંગે ચર્ચા થઇ હતી. આ ઉપરાંત તાજેતરમાં એસટીમાં થયેલા ભાવ વધારાની અસરો તેમજ એસટીના અન્ય ડિવિઝનોની સરખામણીએ કચ્છ ડિવિઝનના ડેવલપમેન્ટ માટે શુ કરી શકાય તે અંગે ચર્ચાઓ કરાઇ હોવાનું જણાવ્યું છે. જ્યારે સત્તાવાર સૂત્રોએ આ બેઠકને રૂટિન ગણાવી હતી અને તંત્રના આંતરિક મુદ્દાઓની ચર્ચા જાહેર ન કરી શકાય તેમ જણાવ્યું હતું.

# અંજાર પ્રજાપતિ સોશ્યલ ગ્રૂપ દ્વારા ક્રિકેટ ટુર્ના.નો પ્રારંભ

સ્વ. વિશાલ પ્રજાપતિની સ્મૃતિમાં યોજાઇ રહેલી સ્પર્ધામાં ૩૨ ટીમોએ ઝૂકાવ્યું

ભાસ્કર ન્યૂઝ. ગાંધીધામ

અંજારના દેવનગર ખાતેના ગ્રાઉન્ડમાં પ્રજાપતિ સમાજના ખેલાડીઓ માટે સુપર સિક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો છે, જેમાં ૩૨ ટીમોએ ભાગ લીધો છે. અંજાર પ્રજાપતિ સોશ્યલ ગ્રૂપ દ્વારા સ્વ. વિશાલ પ્રજાપતિની સ્મૃતિમાં વિશાલ કપ-૨૦૧૦નું આયોજન કરવામાં આવ્યું છે.

ટુર્નામેન્ટનો પ્રારંભ સમાજના અગ્રણી રમેશ રાઠોડ તેમજ પ્રજાપતિ સોશ્યલ ગ્રૂપના પ્રમુખ સુરેશ ઓઝાએ કર્યો હતો.

મોહન નાથાણી, હસમુખ ઝીંઝુવાડિયા, જગદીશ નાથાણી, ભરત મકવાણા, નિલેશ ઓઝા, દિલીપભાઇ તેમજ સભ્યો ટુર્નામેન્ટને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.

ટુર્નામેન્ટના પ્રારંભે સ્વ. વિશાલ પ્રજાપતિને સ્મરણાંજલિ અપાઇ હતી.

# સ્વામી રામદેવજીને અંજારમાં અપાશે આવકાર

realpatidar.com

ભાસ્કર ન્યૂઝ. અંજાર

પતંજલિ યોગ સમિતિ, ભારત સ્વાભિમાન ટ્રસ્ટ તેમજ પતંજલિ યોગ સમિતિ અંજારના સંયુક્ત ઉપક્રમે યોગમય ભારતના નિર્માણના હેતુસર તેમજ ભારત સ્વાભિમાન અભિયાનને આગળ ધપાવવા તા.૯/૫ ના રામદેવજી મહારાજ અંજાર ખાતે પ્રથમ વખત પધારી રહ્યા છે. માધાપરની ફૂલવાડી જૂનાવાસ ખાતે સાંજના ૪ વાગ્યે, કુકમા બસ સ્ટેશને ૪:૧૫, રતનાલ કેડીસીસી બેંકની બાજુમાં ૪:૩૦, સુગારીયા ફાટક હાઇવે પર ૪:૪૦ તેમજ સાપેડા બસ સ્ટેશન હાઇવે પર સાંજે ૪:૫૦ વાગ્યે સ્વાગત કાર્યક્રમનું આયોજન કરાયું છે, તેવુ અંજાર પતંજલિ યોગ સમિતિના અધ્યક્ષ ચંદ્રકાંત પલણની યાદીમાં જણાવાયું છે.

Digitially Archived by: www.realpatidar.com/library

2010-05-08 -Divya Bhaskar -Invitation & Consitution Passed [393]



## » શ્રીલંકા સામે પાક. રનઆઉટ

*વેસ્ટ ઇન્ડીઝમાં રમાતાં મહિલા ક્રિકેટ ટી-૨૦ વર્લ્ડ કપમાં શ્રીલંકન ટીમે એક રોમાંચક મુકાબલામાં પાકિસ્તાનને એક રનથી હરાવ્યું હતું. ટૂંકા લક્ષ્યાંક સામે રમવામાં પાકિસ્તાને ઉપરાઉપરી વિકેટો ગુમાવી દીધી હતી. તેની પાંચ ખેલાડી રનઆઉટ થઈ હતી. શ્રીલંકાએ ૧૦૮ રન નોંધાવ્યા હતા.*

## અફઘાન કોચે મદદ માગી

વર્લ્ડ કપમાં રમેલી અફઘાનિસ્તાનની ટીમના કોચ કાદીર ખાને ક્રિકેટ રમી રહેલી અન્ય ટીમો પાસે પોતાના ખેલાડીઓને ક્રિકેટ શીખવવા અંગે સહાય કરવાની માગણી કરી છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ બોલરે કહ્યું હતું કે અમારા દેશમાં ક્રિકેટ અંગે પૂરતી સવલત નથી.

realpatidar.com

# ભારતનો કારમો પરાજય

**ટી૨૦ વર્લ્ડ કપ નંબર ગેમ**

| 15 | 438 | 376 | 26 | 13 |
|---|---|---|---|---|
| વિકેટ અત્યાર સુધીમાં મોર્ને મોર્કેલે ટી૨૦ વર્લ્ડ કપમાં ખેરવી છે. | રન કેવિન પીટરસને વર્લ્ડ કપની ૧૪ મેચમાં નોંધાવ્યા છે. | રન જેક્સ કાલિસે વર્લ્ડ કપની આઠ મેચમાં નોંધાવ્યા છે. | વિકેટ સાથે ઉમર ગુલ અન્ય તમામ બોલર કરતાં આગળ છે. | વિકેટ ડેલ સ્ટેઇન અત્યાર સુધીમાં ઝડપી ચૂક્યો છે. |

ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ભારતનો બેટિંગ અને બોલિંગમાં શરમજનક દેખાવ, ૪૯ રનથી પરાજય, રોહિત શર્માના લડાયક ૭૯

**પીટીઆઈ . બ્રિજટાઉન**

શેન વોટ્સન અને ડેવિડ વોર્નરની આક્રમક બેટિંગ અને ડર્ક નેનેસની ઝંઝાવાતી બોલિંગ સામે શુક્રવારે ભારતીય ટીમનો રકાસ થયો હતો અને અહીં રમાયેલી ટ્વેન્ટી૨૦ ક્રિકેટ વર્લ્ડ કપની સુપર-૮ તબક્કાની મેચમાં ઓસ્ટ્રેલિયા સામે તેનો ૪૯ રનથી પરાજય થયો હતો. મહેન્દ્રસિંહ ધોની માટે આ મેચમાં ટોસ જીતવા સિવાય કોઈ સફળતા સાંપડી ન હતી. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતાં ૨૦ ઓવરમાં ૧૮૪ રનનો વિશાળ સ્કોર નોંધાવ્યો હતો. આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી નોંધાયેલા સ્કોરની સરખામણીએ આ સ્કોર ઘણો વિશાળ હતો. ૧૮૫ રનના લક્ષ્યાંક સામે ભારતનો ધબડકો થયો હતો અને તે ૧૭.૪ ઓવરમાં ૧૩૫ રન જ નોંધાવી શક્યું હતું. રોહિત શર્માએ લડાયક બેટિંગ કરીને અણનમ ૭૯ રન ફટકાર્યા હતા. ભારતની ઈનિંગ્સની શરૂઆત જ કફોડી રહી હતી અને ત્રીજી ઓવરમાં જ બંને ઓપનર મુરલી વિજય અને ગૌતમ ગંભીર પેવેલિયનમાં પરત આવી ગયા હતા. વિજયે બે અને ગંભીરે નવ રન નોંધાવ્યા હતા. ઓપનર્સની વિકેટના આઘાતમાંથી ભારત બહાર આવે એ પહેલાં તો સુરેશ રૈના (૦૫), યુવરાજસિંઘ (૦૧) અને સુકાની મહેન્દ્રસિંહ ધોની (૦૨) પણ આઉટ થઈ ગયા હતા. રોહિત શર્માએ એક છેડો સાચવી રાખીને ગંભીરતાપૂર્વક બેટિંગ કરતાં અડધી સદી ફટકારી હતી પરંતુ સામે છેડે તેનો કોઈ જોડીદાર ટક્યો ન હતો. અગાઉ ઓસ્ટ્રેલિયા માટે શેન વોટ્સન અને ડેવિડ વોર્નરે ઝંઝાવાતી બેટિંગ કરીને ૧૦ ઓવરમાં જ સદીની ભાગીદારી નોંધાવી દીધી હતી.

### સ્કોર બોર્ડ

| ઓસ્ટ્રેલિયા | રન | બોલ | ૪ | ૬ |
|---|---|---|---|---|
| વોટ્સન બો. યુસુફ | ૫૪ | ૩૨ | ૧ | ૬ |
| વોર્નર કો. ધોની બો. યુવરાજ | ૭૨ | ૪૨ | ૨ | ૭ |
| ડી. હસ્સી કો. વિજય બો. નહેરા | ૩૫ | ૨૨ | ૩ | ૨ |
| હેડિન સ્ટ. ધોની બો. યુવરાજ | ૮ | ૭ | ૦ | ૧ |
| વ્હાઈટ અણનમ | ૫ | ૬ | ૦ | ૦ |
| એમ. હસ્સી બો. નહેરા | ૮ | ૧૦ | ૦ | ૦ |
| સ્મિથ અણનમ | ૧ | ૧ | ૦ | ૦ |

એક્સ્ટ્રા : ૦૧. કુલ : (૨૦ ઓવરમાં, પાંચ વિકેટે ) ૧૮૪. વિકેટ : ૧-૧૦૪, ૨-૧૪૨, ૩-૧૬૬, ૪-૧૭૨, ૫-૧૮૩. બોલિંગ : હરભજનસિંઘ : ૪-૧-૧૫-૦, નહેરા : ૪-૦-૩૧-૨, રવીન્દ્ર જાડેજા : ૨-૦-૩૮-૦, ઝહિર ખાન : ૪-૦-૪૫-૦, યુસુફ પઠાણ : ૪-૦-૩૫-૧, યુવરાજસિંઘ : ૨-૦-૨૦-૨.

| ભારત | રન | બોલ | ૪ | ૬ |
|---|---|---|---|---|
| વિજય કો. વ્હાઈટ બો. નેનેસ | ૨ | ૭ | ૦ | ૦ |
| ગંભીર કો. એમ. હસ્સી બો. નેનેસ | ૯ | ૧૦ | ૨ | ૦ |
| રૈના કો. ક્લાર્ક બો. ટેટ | ૫ | ૫ | ૧ | ૦ |
| રોહિત અણનમ | ૭૯ | ૪૬ | ૪ | ૬ |
| યુવરાજ બો. નેનેસ | ૧ | ૨ | ૦ | ૦ |
| ધોની કો. ડી. હસ્સી બો. સ્મિથ | ૨ | ૮ | ૦ | ૦ |
| યુસુફ કો. વોર્નર બો. જ્હોન્સન | ૧ | ૫ | ૦ | ૦ |
| જાડેજા રનઆઉટ | ૪ | ૫ | ૦ | ૦ |
| હરભજન કો. ડી. હસ્સી બો. વોટ્સન | ૧૩ | ૧૧ | ૧ | ૧ |
| ઝહિર કો. ક્લાર્ક બો. ટેટ | ૯ | ૬ | ૦ | ૧ |
| નહેરા બો. ટેટ | ૦ | ૧ | ૦ | ૦ |

એક્સ્ટ્રા : ૧૦. કુલ : (૧૭.૪ ઓવરમાં ) ૧૩૫. વિકેટ : ૧-૧૦, ૨-૧૨, ૩-૧૭, ૪-૨૩, ૫-૩૭, ૬-૪૨, ૭-૫૦, ૮-૯૭, ૯-૧૩૩, ૧૦-૧૩૫. બોલિંગ : નેનેસ : ૪-૦-૨૫-૩, ટેટ : ૩.૪-૦-૨૧-૩, વોટ્સન : ૩-૦-૩૧-૧, જ્હોન્સન : ૩-૦-૨૩-૧, સ્મિથ : ૪-૦-૩૪-૧.

# હોકી : કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ભારતનો ભવ્ય વિજય

અઝલન શાહ કપમાં ભારતનું વર્ચસ્વ જારી, પાક.ને ૪-૨થી પછાડ્યું

**પીટીઆઈ . ઇપોહ**

અઝલન શાહ કપ હોકીમાં વર્તમાન ચેમ્પિયન ભારતે શુક્રવારે શાનદાર રમતનું પ્રદર્શન કરીને કટ્ટર હરીફ પાકિસ્તાનને ૪-૨થી હરાવ્યું હતું. ભારતે બીજા હાફમાં આક્રમક રમત દાખવીને ત્રણ ગોલ ફટકારી દીધા હતા.

ગુરુવારે ચીન સામે છેલ્લી ઘડીએ ગોલ નોંધાવીને મેચ ડ્રો કરનારી ભારતીય ટીમે શુક્રવારે અલગ જ પ્રકારની રમત દાખવી હતી. પ્રથમ હાફમાં સરદારસિંઘે પેનલ્ટી કોર્નરની મદદથી ગોલ નોંધાવ્યો હતો અને ભારતે ૧-૦ની સરસાઈ હાંસલ કરી હતી. આ સરસાઈ પ્રથમ હાફના અંત સુધી રહી હતી. બીજા હાફમાં ૪૭મી મિનિટે મનદીપસિંઘે, ૫૩મી મિનિટે ગુરબાજસિંઘે તથા ૫૬મી મિનિટે તુષાર ખાંડેકરે ભારત માટે ગોલ ફટકાર્યા હતા. પાકિસ્તાન માટે પરાજયનું અંતર ઘટાડવામાં મોહમ્મદ ઈમરાને ૩૭મી મિનિટે તથા કશીફ અલીએ ૬૬મી મિનિટે ગોલ નોંધાવ્યા હતા.

ગુરુવારે ચીન સામેની મેચના કંગાળ દેખાવને પાછળ રાખીને ભારતે આ મહત્ત્વપૂર્ણ મુકાબલામાં આકર્ષક અને આક્રમક રમત દાખવી હતી. ભારતીય મિડફિલ્ડર્સે પાસિંગમાં કમાલ કરી હતી અને પાકિસ્તાની ડિફેન્સને મુશ્કેલીમાં મૂકી દીધું હતું. રૂપિન્દરસિંઘે પ્રથમ પ્રહાર કર્યો હતો અને બોલ હરીફ ગોલપોસ્ટ સુધી પહોંચાડી દીધો હતો પરંતુ છેલ્લી ક્ષણે સુકાની રાજપાલસિંઘ ગોલ ચૂકી ગયો હતો. એ પછી રાજપાલ અને ગુરબાજે પણ પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ ગોલ નોંધાવી શક્યા ન હતા. સરદારસિંઘે પ્રથમ ગોલ નોંધાવ્યો નહીં ત્યાં સુધી ભારતે પાકિસ્તાનને એકેય તક આપી ન હતી અને પરેશાન કર્યું હતું. બીજા હાફને પ્રારંભે પાકિસ્તાને પણ વળતો પ્રહાર કર્યો હતો અને મોહમ્મદ ઈમરાને બીજા હાફની બીજી જ મિનિટે પાકિસ્તાન માટે ગોલ નોંધાવી દીધો હતો, જોકે ૪૭મી મિનિટે મનદીપસિંઘે ફરીથી ભારતને સરસાઈ પર લાવી દીધું હતું. ભારતે એ પછી નવ મિનિટમાં ત્રણ ગોલ નોંધાવીને પાકિસ્તાનને મેચમાંથી લગભગ બહાર કરી દીધું હતું.

દિવ્ય ભાસ્કર
Happy Birthday
મારા ભાસ્કરમાં મારી છબી

રિયા શાહ - માંડવી

'હેપ્પી બર્થ ડે'
ફોટોગ્રાફ ફક્ત રૂ.૫૦/-

★ ૧૦ વર્ષથી નીચેની ઉંમરના બાળકોના જ ફોટા પ્રસિદ્ધ કરવામાં આવશે. ★ બાળકનો પાસપોર્ટ સાઇઝનો કલર ફોટોગ્રાફ (પરત મળશે નહીં), જન્મ તારીખના દાખલાની નકલ સાથે મોકલવાનો રહેશે. ★ આ કોલમમાં ફેરફાર કરવાના તમામ હક્ક દિવ્ય ભાસ્કરને આધિન રહેશે. દિવ્ય ભાસ્કર કાર્યાલય ભુજ : હોસ્પિટલ રોડ. ગાંધીધામ : ડી.બી.ઝેડ. એસ. ૫૫, ખાતે સવારે ૧૦ થી ૬, દરરોજ સ્વીકારવામાં આવશે.

# કિવિ સામે ભારતનો પરાજય

મહિલા ટી૨૦ વર્લ્ડ કપ : પ્રથમ જ મેચમાં ભારત હાર્યું

**પીટીઆઈ . સેંટ કિટ્સ**

મિથાલી રાજના ૪૪ રન સિવાયની અન્ય ખેલાડીઓ નિષ્ફળ રહેતાં વિમેન્સ ટી૨૦ ક્રિકેટ વર્લ્ડ કપની પ્રારંભિક મેચમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતનો દસ રનથી પરાજય થયો હતો. અહીં રમાયેલી મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં ન્યૂઝીલેન્ડે ૨૦ ઓવરમાં આઠ વિકેટે ૧૩૯ રનનો સ્કોર નોંધાવ્યો હતો જેના જવાબમાં ભારતીય ટીમ ૨૦ ઓવરને અંતે આઠ વિકેટે ૧૨૯ રન કરી શકી હતી. મિથાલી રાજે ૩૬ બોલમાં ૪૪ રન ફટકાર્યા હતા જ્યારે ઓપનર સુલક્ષણા નાયક અને અમિતા શર્માએ ૨૮-૨૮ રન નોંધાવ્યા હતા પરંતુ એ સિવાય અન્ય કોઈ ખેલાડી ડબલ ફિગર સુધી પણ પહોંચી શકી ન હતી. ભારત માટે ડાયના ડેવિડે ૨૭ રનમાં ચાર વિકેટ ખેરવી હતી પરંતુ ન્યૂઝીલેન્ડ આ ધબડકામાંથી પણ બહાર આવી ગયું હતું અને ૧૩૯ રનના સ્કોર સુધી પહોંચી ગયું હતું. કિવિ ટીમ માટે ઓપનર સુઝી બેટ્સે ૩૨ રન નોંધાવ્યા હતા.

# લલિત મોદી સામે વધુ એક આક્ષેપ

## આઈપીએલને બ્રિટિશ આવૃત્તિ બનાવવાની, દસ ટીમને ઈંગ્લેન્ડમાં પ્રાથમિકતા આપવાની યોજના હતી

**એજન્સી . નવી દિલ્હી**

એમ લાગે છે કે વિવાદો લલિત મોદીનો પીછો છોડવાનું નામ લેતા નથી. હવે લલિત મોદી ઉપર બ્રિટિશ આઈપીએલ લીગમાં કાઉન્ટી ક્રિકેટના ખેલાડીઓને જોડવા માટે ઉશ્કેરવાનો તેમજ કેટલીક કાઉન્ટી ટીમોને આ માટે મોટી રકમની ઓફર કરી હોવાનો આક્ષેપ લાદવામાં આવ્યો છે.

ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે બીસીસીઆઈને મોકલેલા ઈ-મેલમાં લલિત મોદી પર કેટલાક ગંભીર આક્ષેપો કર્યા છે. આ ઈ-મેલમાં જણાવ્યા અનુસાર મોદીએ ભારતની જેમ ઈંગ્લેન્ડમાં બ્રિટિશ લીગ(ટી-૨૦) બનાવવાની યોજના ઘડી હતી. તેમણે આ સંદર્ભે નવી દિલ્હી અને ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ક્લબો સાથે સંકળાયેલાઓ લોકો તેમજ ખેલાડીઓના પ્રતિનિધિઓ સાથે ચર્ચા પણ કરી હતી.

ઈ-મેલમાં ઈસીબીના પ્રમુખ ક્લાર્કે જણાવ્યું હતું કે મોદી આઈએમજી અને ત્રણ કાઉન્ટીના પ્રમુખો સાથે મળી સમાંતર લીગ શરૂ કરવા માગતા હતા. આ માટે તેમણે તમામ ક્રિકેટ બોર્ડને વિશ્વાસમાં લેવાના બદલે સીધા ખેલાડીઓને વિશ્વાસમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો. ખેલાડીઓને તેઓ મસમોટી રકમ આપી સમાંતર લીગમાં પૂરેપુરો સાથ આપવા માટે તૈયાર કરવા માગતા હતા.

લલિત મોદી સાથે જે ત્રણ કાઉન્ટી ક્લબોનું નામ લેવાયું છે તેમાંથી યોર્કશાયરના અધ્યક્ષ કોલિન ગ્રેવ્સે તમામ આ અહેવાલ ફગાવી દેતાં જણાવ્યું હતું કે મોદી સાથે સમાંતર લીગ શરૂ કરવાની નહીં પરંતુ ભવિષ્યની યોજનાઓ અંગે વ્યવસાયિક ચર્ચા થઈ હતી. બીસીસીઆઈ અને ઈસીબીએ એવો આક્ષેપ કર્યો હતો કે સમાંતર લીગ અંગે બેમાંથી એકેય બોર્ડને ગંધ સુદ્ધાં પણ આવવા દેવાઈ ન હતી.

SHRI A.B.K.K.P. YUVASANGH
2008-2010

॥ શ્રી ઉમિયાયે નમઃ ॥



હાલો ભેગા મળીને ઉજવીએ નખત્રાણામાં

સુવર્ણ જયંતિ મહોત્સવ

જાહેર જનતા જોગ નોંધ : શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમ અંતર્ગત એક્ઝિબીશન તથા ફનફેરના ભાગમાં કચ્છની સમગ્ર જનતાને ભાગ લેવા જણાવવામાં આવે છે. જેમાં જુદી-જુદી રમતો, રાઈડસ, મેજીશ્યન, એડવેન્ચરર્સ, સ્પોર્ટસ વગેરે જેવા વિવિધ કાર્યક્રમો રહેશે.

શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ
નખત્રાણા-કચ્છ

સમારોહ : ડો. શ્રીમતી કમલા મહામહિમ નામદાર રાજ્યપાલ - ગુજરાત રાજ્ય

કાર્યક્રમ દરમિયાન વિશેષ ઉપસ્થિત મહાનુભાવો

- માનનીયશ્રી યોગગુરુ રામદેવજી મહારાજ - પતંજલિ યોગપીઠ, હરિદ્વાર
- માનનીયશ્રી નરોત્તમભાઈ પટેલ - કેબિનેટ મંત્રી, પંચાયત, ગ્રામ, ગૃહ નિર્માણ - ગુજરાત રાજ્ય
- માનનીયશ્રી નિતીનભાઈ પટેલ - કેબિનેટ મંત્રી, પાણી, પુરવઠો અને જળ સંપત્તિ-ગુજરાત રાજ્ય
- માનનીયશ્રી પુરસોત્તમભાઈ રૂપાલા - સાંસદ તથા ભાજપ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ
- માનનીયશ્રી શ્રીમતી સ્મૃતિ ઈરાની - 'તુલસી' સાસ ભી કભી બહુ થી (ફેમ ભાજપ રાષ્ટ્રીય મંત્રી)
- માનનીયશ્રી ઋષિ નિત્ય પ્રગ્યાજી - ગુરુશ્રી રવિશંકર મહારાજ

કાર્યક્રમની રૂપરેખા : તા. ૯-૫-૨૦૧૦, રવિવાર

- સવારે ૦૫:૦૦ કલાકે : યોગ શિબિર - પતંજલિ યોગપીઠ, હરિદ્વાર
- સવારે ૦૭:૦૦ કલાકે : શોભાયાત્રા - દેવાઆશિષ હોસ્પિટલથી શરૂઆત
- સવારે ૦૮:૩૦ કલાકે : ૨૯ ઝોન પ્રસ્તુતિ
- સવારે ૧૧:૩૦ કલાકે : ઈતિહાસ વિદ ગ્રંથ વિમોચન તથા કાર્યક્રમ ડો. મંગુભાઈ પટેલ (ઈતિહાસકાર)
- બપોરે ૦૨:૩૦ કલાકે : ડો. શ્રીમતી કમલા મહામહિમ નામદાર રાજ્યપાલ - ગુજરાત રાજ્ય
- બપોરે ૦૪:૦૦ કલાકે : ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન
- બપોરે ૦૫:૦૦ કલાકે : બિઝનેસ અને કેરિયર થીમ આધારિત કાર્યક્રમ
- રાત્રે ૦૮:૩૦ કલાકે : સાંસ્કૃતિક કાર્યક્રમ

realpatidar.com

SHREE A.B.K.K.P.YUVASANGH
• Education & Health
• Business & Career
• Political & Leadership

નોંધ : સ્વર્ણિમ મહોત્સવ નિમિત્તે યોજાતા ફનફેર અને એક્ઝિબીશનમાં કચ્છની તમામ જ્ઞાતિના લોકો ભાગ લઈ શકશે જેની સર્વે જનતાએ નોંધ લેવી.

શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ (નખત્રાણા)

સૌજન્ય

• રામાણી ટ્રાવેલ્સ-નખત્રાણા • શિવશક્તિ ડેવલોપર્સ-નખત્રાણા • ઉમિયા મેટલ-નખત્રાણા • એન.સી. રેડિયો એન્ડ ઈલેક્ટ્રીક-નખત્રાણા • ઈશ્વર મેટલ-નખત્રાણા • સમલેશ્વરી પ્લાયવુડ એન્ડ ગ્લાસ-નખત્રાણા • દર્પણ ફેમિલી શોપ-નખત્રાણા • વિણા પ્રોવિઝન સ્ટોર્સ-નખત્રાણા • અંજલી કિરાણા ભંડાર-નખત્રાણા • ગીતા સ્ટોર્સ-નખત્રાણા • કલ્પતરૂ, મેઈન બજાર -નખત્રાણા • કિંજલ ફેમિલી શોપ-નખત્રાણા • જય ટ્રેડર્સ-નખત્રાણા • ભારત ઓટો પાર્ટસ-નખત્રાણા • આદર્શ કલોથ સ્ટોર્સ-નખત્રાણા • લક્ષ્મી જનરલ સ્ટોર્સ-નખત્રાણા • ઉમિયા સિમેન્ટ ડેપો-નખત્રાણા • પાદુકા ફુટવેર-નખત્રાણા • ગાયત્રી ટ્રાવેલ્સ-નખત્રાણા • લક્ષ્મી ફર્નિચર-નખત્રાણા • પ્રગતિ ટ્રેડિંગ-નખત્રાણા • રિદ્ધિ સિદ્ધિ સેલ્સ-નખત્રાણા • સૂર્યા સીડ્સ-નખત્રાણા • શ્રી ઉમિયા એગ્રો-નખત્રાણા • મહાદેવ ટ્રેડર્સ-નખત્રાણા • હોટલ જે પી -નખત્રાણા • ખેતેશ્વર આઈસ્ક્રીમ-નખત્રાણા • અંબિકા ટ્રેડર્સ-નખત્રાણા • આર્ય ફુટ એન્ડ વેજીટેબલ-નખત્રાણા • મન સુપર સ્ટોર-નખત્રાણા • ગાયત્રી મેડિકલ સ્ટોર્સ-નખત્રાણા • શ્રી વડવા લક્ષ્મીનારાયણ પાટીદાર સમાજ-નખત્રાણા • શ્રી દુજાપર પાટીદાર સમાજ-દુજાપર • શ્રી દેવપુર પાટીદાર સમાજ-દેવપુર • શ્રી રત્નાપર પાટીદાર સમાજ - રત્નાપર • શ્રી ઉમિયાનગર ગઢશીશા પાટીદાર સમાજ-ઉમિયાનગર ગઢશીશા • શ્રી નવાવાસ ગઢશીશા પાટીદાર સમાજ-નવાવાસ ગઢશીશા • શ્રી રાજપર પાટીદાર સમાજ - રાજપર • શ્રી વિરાણી સનાતન પાટીદાર સમાજ-વિરાણી • શ્રી ભેરૈયા પાટીદાર સમાજ -ભેરૈયા • શ્રી ક.ક.પાટીદાર સમાજ-જતાવીરા • શ્રી લક્ષ્મીનારાયણ પાટીદાર સમાજ-નખત્રાણા નવાવાસ • સિદ્ધિ ધોરમનાથ-દુધાવા • ડો. પી.જી. પટેલ-નખત્રાણા • ડો. રસીકભાઈ માકાણી-નખત્રાણા • ડો. શાન્તિલાલ સેંઘાણી-નખત્રાણા • કચ્છ એગ્રો સિમેન્ટ, કેસીંગ પાઈપ-નખત્રાણા • જયોતિ ઈલેક્ટ્રીકસ-નખત્રાણા • ઉમિયા ઝેરોક્ષ-નખત્રાણા • ડો. તુલસીદાસ એલ. પટેલ-નવજીવન હોસ્પિટલ,નખત્રાણા • ડી. કે. ટીમ્બર-નખત્રાણા • પટેલ શામજી હરજી ઘણાણી એન્ડ કાું.-નખત્રાણા • શંકર વિજય સો મીલ-નખત્રાણા • શ્રી રામ ટીમ્બર માર્ટ-નખત્રાણા • ટેકનો ઈલેક્ટ્રોનિકસ--નખત્રાણા • શ્રી ઘનાણી ટીમ્બર-નખત્રાણા • શીતલ જેન્ટસ વેર-નખત્રાણા • લક્ષ્મી પ્લાયવુડ સેન્ટર-નખત્રાણા • સત્યમ શો રૂમ -નખત્રાણા

મારુતિ એડ. ભરત જોષી - ૯૯૦૯૯૭૪૦૮૧

## દુનિયાના સમાચાર



**ડિઝાઇનર સ્વિમ સ્યૂટ:** સિડનીમાં યોજાયેલા ઓસ્ટ્રેલિયન ફેશન વિક દરમિયાન મોડેલે ફેશનેબલ ડિઝાઇનર સ્વિમ સ્યૂટનું પ્રદર્શન કર્યું હતું. એએફપી

### માતૃત્વ-કેરિયર સંભાળવા નાઓમીનો સંઘર્ષ

**લંડન:** હોલિવૂડની જાણીતી અભિનેત્રી નાઓમી વોટ્સ આજકાલ માતૃત્વ અને કેરિયરને સંભાળવામાં, સરખો ન્યાય આપવા રીતસર સંઘર્ષ કરી રહી છે. નાઓમીને બે સંતાનો છે, પરંતુ બન્ને મોરચે લડવામાં નાઓમી થાકી જાય છે. નાઓમી કહે છે કે, હું રોજ સવારે ઊઠીને નક્કી કરું કે, આજે 'ગૂડ મોમ' બની જઇશ, પણ પછી એમ થતું નથી.

### રહેમાનની પુત્રીને દવાખાને દાખલ કરવી પડી

**મુંબઇ:** મ્યુઝિક માસ્ટર એ.આર. રહેમાનની પુત્રી રેહિમાને કાર્ડિયાક પ્રોબ્લેમ્સ થતાં તેને સારવાર માટે દવાખાને દાખલ કરવી પડી હતી. ૧૨ વર્ષની રેહિમા પર બુધવારે રાત્રે તબીબોએ હાર્ટ સંબંધી સર્જરી પણ કરી હતી. રહેમાન સતત પુત્રીની સાથે રહ્યો હતો. મ્યુઝિકને પણ બાજુએ મૂકી દીધું હતું.

### ચંદીગઢ આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ

**ચંદીગઢ:** ચંદીગઢ નજીકના વિસ્તારોમાં શુક્રવારે સવારે ભારે વરસાદ તૂટી પડ્યો હતો અને ગરમીથી ત્રાહિમામ્ લોકોને રાહત મળી હતી. જો કે, આ વરસાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હોવાનું હવામાન ખાતાએ જણાવ્યું છે. વરસાદને લીધે તાપમાનનો પારો પણ નીચે ઉતરી ગયો હતો. હવે વીજળી, પાણીની સમસ્યા હળવી થશે.

### જેનિફર એનિસ્ટનના પરફેક્ટ ફિગરનું રહસ્ય ?

**લંડન:** ૪૧ વર્ષની વયે પણ ગજબનું દેહલાલિત્ય અને પરફેક્ટ ફિગર ધરાવતી જેનિફર એનિસ્ટનની આવી સરસ તંદુરસ્તીનું રહસ્ય જાણવા મળી ગયું છે અને તે છે બેબી ફૂડ ડાયેટ. જેનિફર અઠવાડિયામાં પાંચ દિવસ બહાર શૂટિંગ કરતી હોય છે ત્યારે જંક ફૂડનો આશરો લેવાને બદલે બેબી ફૂડ પર જ દિવસો કાઢે છે. એનિસ્ટન કહે છે કે, પ્યૂરી ફૂડ હેલ્થ માટે ખૂબ સારા છે.

**બુલંદ વિશ્વાસ** | આઠ વર્ષ પૂર્વે ત્રાસવાદીઓએ ફૈઝલ શાહના પિતાને ફૂંકી માર્યા હતા

# યુપીએસસી પરીક્ષાના અવ્વલ છાત્રને પણ આતંકવાદ દઝાડી ચૂક્યો છે

પિતા ગુમાવનાર ફૈઝલ આ સિદ્ધિનો હકદાર બનતા આજે તેમને ખૂબ 'મિસ' કરે છે

એજન્સી. નવી દિલ્હી, શ્રીનગર

યુપીએસસીની પરીક્ષામાં જ્યારે પાસ થવું, એ પણ કઠીન છે, ત્યારે તેમાં ટોપ પર આવવું અને શ્રીનગરના પ્રથમ છાત્ર બનવાનું શ્રેય મેળવનારા ફૈઝલ શાહ માટે આ પંથ કંઇ ફૂલોનો માર્ગ ન હતો. કાંટાળી કેડી હતી, તેમ છતાં ફૈઝલ હિંમત ન હાર્યો અને દેશભરમાં પ્રથમ આવ્યો.

દેશભરમાં પ્રથમ આવેલા ફૈઝલ માટે આ સિદ્ધિની સાથોસાથ મહત્ત્વની એ બાબત છે કે, ફૈઝલના પિતાનું આતંકીઓની ગોળીઓથી વિંધાઇને મોત નીપજ્યું છે. આઠ વર્ષ પૂર્વે પિતા ગુમાવનાર ફૈઝલે આત્મવિશ્વાસ જરાય નથી ગુમાવ્યો. પહેલી જ વાર સિવિલ સર્વિસિઝ પરીક્ષામાં બેસનાર ફૈઝલ પ્રથમ પ્રયાસે જ પાસ થઇ ગયો અને પોતાના અંગત દુઃખ અને પીડાને વિસારી 'ટોપર' બન્યો.

### મારે જલદી મારી માને મળવું છે: ફૈઝલ શાહ

**માત્ર** ૨૬ જ વર્ષનો ડો. ફૈઝલ કહે છે કે, અત્યારે હું મારી લાગણી વર્ણવી શકું એવી સ્થિતિમાં જ નથી. મારી ઇચ્છા મારા પરિવાર સાથે રહેવાની છે. મારે જલદી મારી માને મળવું છે. રિઝલ્ટ જાહેર થયા પૂર્વે ફૈઝલ દિલ્હી આવી ગયો છે.

#### હું મારા પિતાને ખૂબ 'મિસ' કરું છું

**કાશ્મીર** અને તેના પિતાની વાત નીકળે ત્યારે ફૈઝલ ખૂબ ઇમોશનલ બની જાય છે અને કહે છે કે, કાશ્મીર વેલીનું લોહિયાળ રૂપ મેં જોયું છે. ત્રાસવાદે મારા પિતાને છીનવી લીધા. આજે હું તેમને ખૂબ મિસ કરું છું. કેમ કે, હું નાનો હતો ત્યારે તેઓ મને વિજ્ઞાન, ગણિત શીખવતા. કાશ... આજે તેઓ મારી સાથે હોત !

#### ફૈઝલની માતા પણ ખૂબ ખુશ

**ફૈઝલની** માતા મુબીના બેગમ બિલકુલ શબ્દો ચોર્યા વિના જણાવે છે કે, દરેક કાશ્મીરી મારા પુત્રની સિદ્ધિ અને કઠીન પરિશ્રમનો ગર્વ લઇ શકે તેમ છે. મારા પતિએ ત્રાસવાદનું શરણું લેવાની ના પાડી એટલે તેમનું ખૂન કરી દેવાયું અને એટલે જ કૂપવાડા જિલ્લો છોડી મેં શેખ નારમાં ઘર લીધું અને મારા બન્ને બાળકોને ભણાવવા પર બધું ધ્યાન કેન્દ્રિત કર્યું.

#### લોકોની સેવા જ ફૈઝલનું ધ્યેય

**શિક્ષિકા** એવી ફૈઝલની માતા કહે છે કે, મારા પુત્રનું ધ્યેય તબીબ બન્યો ત્યારે પણ લોકોની સેવા કરવાનું હતું અને એ ધ્યેયમાંથી તે બિલકુલ વિચલિત થયો નથી. તે કોમ્યુનિકેશન ગેપ ઓછો કરવા, છોકરીઓને સમાન તક આપવા પણ પ્રયત્નશીલ છે.

### હોશિયારી ભારે પડી

જીવનમાં ક્યારેક અમુક ભૂલો એવી થતી હોય છે કે, હવે પછી તે ક્યારેય ન થાય તેવી પ્રાર્થના જ કરવાની રહે. એમાંય જો સત્તાનું અભિમાન કરીએ તો ગયા જ સમજો. બ્રિટનમાં ચૂંટણી ઉમેદવારને પણ તાજેતરમાં ગજબનો સબક શીખવા મળી ગયો. પ્લેન લઇને ઊડતાં પહેલાં ઠાવકાઇથી ફરતા નિજેલ ફરાજને હોશિયારી ભારે પડી હતી અને પ્લેન તૂટી પડતા જીવ પણ માંડ બચ્યો હતો.

## શાહરુખ ખાન મ્યુઝિકલ ડ્રામાનું નિર્માણ કરશે



એજન્સી. મુંબઇ

સુપરસ્ટાર શાહરુખ ખાન તેના બાળકો આર્યન અને સુહાનાને ખૂબ લાડ લડાવે છે. તે તેમના માટે ફિલ્મ 'રા-વન' તો બનાવે જ છે સાથોસાથ તેમને ખુશ કરવા એક મ્યુઝિકલ ડ્રામાનું નિર્માણ કરી રહ્યો છે.

બાળકોની એક ટેલિવિઝન ચેનલ પર 'ઇશાન' નામનો આ શોમાં ૧૧ જેટલા ગીતો થકી એક બાળકની પ્રેરણાદાયી વાર્તા વણી લેવાઇ છે. શાહરુખે પોતાની પ્રોડક્શન કંપનીના સૂત્રોને બહુ જલ્દી આ શોનું નિર્માણ પૂરું કરવા જણાવી દીધું છે. આ મ્યુઝિકલ ડ્રામામાં કેટલાક બાળ કલાકારો ઉપરાંત શ્રુતિ ઉલ્ફત, રાજેન્દ્ર મહેરા અને રાજીવન પૌલ જેવા ટેલિવિઝનના જાણીતા ચહેરાઓ ચમકે છે.

**સંતાનો માટે શાહરુખ અલાદીનનો જીન** પોતાના સંતાનો માટે શાહરુખ અલાદીનનો જીન હોય તેમ તેમની હર ખ્વાહિશ પૂરી કરે છે. તેણે મોંઘીદાટ ફિલ્મ રા-વન અને હવે મ્યુઝિકલ ડ્રામા તેના બાળકો માટે જ બનાવે છે.

## બોલિવૂડમાં રીમિક્સ સંગીતનું ચલણ હજુ વધશે: ડીજે સાશા

ભારતીય મૂળના આ ડિસ્કો જોકીએ યુએસમાં મેડોના માટે પણ રીમિક્સ કર્યું

પીટીઆઇ. નવીદિલ્હી

મેડોના જેવી પોપકવીન માટે મ્યુઝિક રીમિક્સ કરી ચૂકેલો ભારતીય મૂળનો અમેરિકન ડિસ્કો જોકી સાશા બીજીવાર ભારત આવ્યો છે. તેણે સ્વીકાર્યું કે, ભારતમાં પણ ઇલેક્ટ્રોનિક સંગીતનું ચલણ વધતું ચાલ્યું છે.

ડી જે સાશા મુંબઇ અને બેંગલુરુમાં શો કરવાનો છે. તેણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે, રીમિક્સ પણ એક પ્રકારે સંગીતની જ શાખા છે. તફાવત માત્ર એટલો છે કે રીમિક્સમાં ઇલેક્ટ્રોનિક તારની ઝણઝણાટીથી ઇન્સ્ટન્ટ સંગીત ઉત્પન્ન કરાય છે. ભારતમાં હવે તો ફિલ્મી સંગીતકારો પણ રીમિક્સને અપનાવી રહ્યા છે. કેમકે, વર્તમાન પેઢીને રીમિક્સ ગમે છે.



#### સીડી લોન્ચ કરશે

**ભારતમાં** રોકાણ દરમિયાન ડી જે સાશા રીમિક્સ મ્યુઝિકની પાંચ થી છ સીડી લોન્ચ કરશે. દરમિયાન વિવિધ શહેરોની કલબોમાં શો યોજાવાના છે.

## બોલ્ડ એન્ડ બ્યૂટિફૂલ પાત્રો ભજવવા અનુષ્કાની ઇચ્છા

રિલીઝ થઇ ચૂકેલી 'બદમાશ કંપની'માં તેનું પાત્ર અલ્લડ યુવતીનું છે

એજન્સી. નવીદિલ્હી

ફિલ્મ રબને બનાદી જોડીમાં મિડલ કલાસ પંજાબી યુવતીની ભૂમિકા ભજવ્યા બાદ મોડેલ ટર્ન્ડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા 'બદમાશ કંપની'માં શહેરની અલ્લડ છોકરીનું પાત્ર ભજવે છે. ફિલ્મ શુક્રવારે રિલીઝ થઇ ગઇ છે.

તેણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે, હું હવે એવા મોડર્ન અને બોલ્ડ એન્ડ બ્યુટિફૂલ પાત્રો ભજવવા માંગું છું કે જેની સાથે મારા યુવા દર્શકો સંકળાઇ શકે. જો કે, તે ચાહકોને બદમાશ કંપનીના બુલબુલના પાત્રને ન અનુસરવાની સલાહ આપે છે. બુલબુલ એક ગેંગમાં ભળીને કેટલાયને છેતરે છે.

અનુષ્કાનો દાવો છે કે રબને બનાદી જોડીમાં તાનીનું પાત્ર હજુ ય લોકોને યાદ છે. એ જ રીતે બદમાશ કંપનીનું આ બદમાશપાત્ર બુલબુલ યાદગાર બની જવાનું છે. તેણે નવા નિર્દેશક પરમીત શેઠીના કૌશલ્યના પણ વખાણ કર્યા.

#### અક્ષય સાથે ફિલ્મ 'પટિયાલા હાઉસ'

**અનુષ્કા** શર્માની વધુ એક ફિલ્મ 'પટિયાલા હાઉસ' નિર્માણાધિન છે. વિપુલ શાહ દ્વારા નિર્મિત આ ફિલ્મમાં તેનો હીરો અક્ષયકુમાર છે.'પટિયાલા હાઉસ' તેની ત્રીજી ફિલ્મ છે અને અગાઉ બન્ને ફિલ્મો કરતાં જુદી જ ભૂમિકા છે અને અનુષ્કાને એવી આશા છે કે, પટિયાલા હાઉસમાં તે પોતાની અભિનય ક્ષમતા દર્શાવી શકશે.

વડોદરાથી મુંબઇ જતી જેટ એરવેઝની

## ફ્લાઇટ ખોટકાતાં વડોદરા એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ

ધડાકા સાથે વિમાન હાલી ઉઠતાં મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા

ભાસ્કર ન્યૂઝ, વડોદરા

વડોદરાથી મુંબઇ જતી જેટ એરવેઝની ફ્લાઇટમાં ઉડ્ડયનની ૧૦ જ મિનીટમાં એક એન્જિન બંધ થઇ જતાં અચાનક ઇમરજન્સી ઉતરાણ કરવું પડ્યું હતું. ટેક ઓફ પછી ફ્લાઇટના ૧૪૩ મુસાફરો હજું તો સિટ બેલ્ટ છોડે તે પહેલાં જ ધડાકા જેવા અવાજ સાથે વિમાન હાલી ઉઠતાં મુસાફરોનો જીવ તાળવે ચોંટી ગયો હતો. જો કે પાયલોટની સમય સૂચકતાના કારણે વડોદરા એરપોર્ટ પર જ આ ખોટકાયેલા વિમાનનું સફળ લેન્ડિંગ કરી દેવાતાં મોટી વિમાની દુર્ઘટના થતાં રહી ગઇ હતી.

આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર, વડોદરાથી બોમ્બે જવા માટે નિર્ધારિત શિડ્યુલ કરતાં ૧૦થી ૧૫ મિનીટ મોડી ઉપડેલી જેટ એરવેઝની ફ્લાઇટ નં ૯૪૩૩ના મુસાફરો થોડી વારમાં મુંબઇ પહોંચવાની રાહ જોતાં હતા. વિમાન હજુ સ્થિર થાય તે પહેલાં ટેક ઓફની ૧૦ જ મિનીટમાં અંદાજે ૯ કલાકે અચાનક વિમાનમાં જોરદાર આંચકો આવતાં મુસાફરો અને ક્રુ મેમ્બરો પણ ગભરાઇ ગયા હતા.

જો કે ફ્લાઇટના કેપ્ટન રાજીવ પુરીને તરત જ અંદાજ આવી ગયો હતો કે વિમાનનું એન્જિન ખોટકાઇ ગયું છે.

## ૨૮મીએ કસાબને ફાંસી, રૂપેરી પડદે

મુંબઇ હુમલા પર બનેલી ફિલ્મ 'અશોક ચક્ર' ૨૮મીએ દેશભરમાં રિલીઝ થશે

પીટીઆઇ. નવી દિલ્હી

પાકિસ્તાની ત્રાસવાદી અજમલ આમિર કસાબને ખાસ કોર્ટે ભલે ફાંસીની સજા સંભળાવી, પરંતુ ખરા અર્થમાં કસાબને ક્યારે ફાંસી અપાશે તે કોઇ કહી શકે તેમ નથી. પરંતુ, ફિલ્મ પડદા પર તો કસાબને ૨૮મી મેએ ફાંસી મળી જ જશે. ૨૬/૧૧ મુંબઇ હુમલા પર બનેલી ફિલ્મ અશોક ચક્ર આ જ માસની ૨૮ તારીખે રિલિઝ થઇ રહી છે, જેમાં દર્શકો કસાબને ફાંસીએ ચડતો જોઇ શકશે. ફિલ્મમાં હોમી વાડિયાએ હેમંત કરકરે, અશોક કુલકર્ણીએ અશોક કામ્ટે અને આશિષ વિદ્યાર્થીએ તુકારામ ઑંબલેની ભૂમિકા ભજવી છે. ભોજપુરી એક્ટર કમાલ ખાન ફિલ્મ દેશદ્રોહીની આવનારી સિક્વલમાં એટીએસ અધિકારીઓના બલિદાનની ભૂમિકા દેખાડાઇ છે.

કમાલ ખાને જણાવ્યું હતું કે, મારી ફિલ્મમાં નવા ઘટનાક્રમને લીધે થોડું મોડું થયું. જ્યારે હવે કસાબને સજા સંભળાવાઇ જ છે, ત્યારે અમે જલદીથી જ શૂટિંગ આટોપી લેશું અને ફેબ્રુઆરી સુધીમાં ફિલ્મને રિલિઝ પણ કરી દેવાની યોજના છે.

#### રાજન વર્મા કસાબની ભૂમિકામાં

**અશોક** ચક્ર ફિલ્મમાં રાજન વર્મા નામના ન્યૂકમર અદાકારે કસાબની ભૂમિકા ભજવી છે. રાજન વર્માએ જણાવ્યું કે, ફિલ્મમાં કસાબને ફાંસી પર લટકાવાઇ રહ્યો છે એ દેખાડાયું એ જ લોકોના ઇરાદાનો પડઘો છે. સુનાવણી પૂર્ણ થાય એ પહેલાં જ અમે એવું નક્કી કર્યું હતું કે, કસાબને ફાંસીના માંચડે લટકાવી દેવો.

#### કસાબ વિરુધ્ધ રજૂ થયેલ પુરાવાઓ પ્રદર્શિત કરાશે

**મુંબઇ** પોલીસે ૨૬-૧૧ ત્રાસવાદી હુમલા અંગેના કેસમાં પુરાવા તરીકે ઉપયોગમાં લેવાયેલી સામગ્રી પ્રદર્શન માટે મ્યુઝિયમમાં મૂકવાનું આયોજન કર્યું છે. મુંબઇના જોઇન્ટ પોલીસ કમિશનર હિમાંશુ રોયે કહ્યું કે, કસાબ વિરુદ્ધના પુરાવાઓમાં એકે-૪૭, જીપીએસ ડિવાઇસ, નોકિયા મોબાઇલ હેન્ડસેટ, સેટેલાઇટ ફોન, પાણીની બોટલો, નાની હોડી, યામાહા એન્જિન્સ, બ્લેન્કેટ ટુવાલ, જેકેટ, હેડફોન્સ, ખાદ્યા સામગ્રીનો થેલો, ટૂથબ્રશ, ડિટર્જન્ટ પાઉડર અને ટિસ્યૂ પેપરનો સમાવેશ થાય છે.

## ફરીદાબાદમાં રિક્ષાચાલકનો મિત્રો સાથે મોડેલ પર ગેંગરેપ

પોલીસ દ્વારા એક આરોપીની ધરપકડ : બે ફરાર

એજન્સી. ફરિદાબાદ

ફરીદાબાદમાં એક રિક્ષા ચાલક તથા તેના બે મિત્રોએ મળીને ગુરુવારે રાત્રે એક મોડેલ કમ અભિનેત્રી પર બળાત્કાર કરતા ભારે ચકચાર મચી ગઇ હતી. ગેંગરેપ કરી ફરાર થઇ ગયેલા ત્રણ આરોપીઓમાંથી પોલીસ દ્વારા એકની ધરપકડ કરવામાં આવીછે.

૨૫ વર્ષીય મોડેલ તથા પાર્ટ ટાઇમ અભિનેત્રી ગુરુવારે રાત્રે રીક્ષામાં બેસી ઘેર જઇ રહી હતી ત્યારે સેક્ટર ૫૯માં નિર્જન સ્થળ પર રિક્ષાચાલક તથા તેના બે મિત્રોએ મોડેલ પર બળાત્કાર ગુજાર્યો હતો.

બળાત્કારનો ભોગ બન્યા બાદ મોડેલ તાત્કાલિક સેક્ટર નંબર ૫૫ માં આવેલા પોલીસ સ્ટેશન પર દોડી ગઇ હતી. ઝકીર નામનો આરોપી ઓળખાઇ જતા તેની તરત જ ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે સતીષ અને શંભુ નામના બે આરોપીઓની ધરપકડ કરાશે.

રોહિણી વિસ્તારમાં વસતી મોડેલનું ત્રણ દિવસનું શુટિંગ એક જ દીવસમાં આટોપી લેવાતા કામ પૂરું થઇ ગયું હતું. તેના માટે નિર્માતાઓ દ્વારા વાહનની કોઇ વ્યવસ્થા ન હોવાથી તે દિલ્હી જવા માટે એકલી જ રવાના થઇ હતી.

#### સાત વખત બળાત્કાર ગુજારાયો

**૨૫** વર્ષીય મોડેલ કમ અભિનેત્રી પર શેતાન રિક્ષા ચાલક અને તેના બે સાથીઓએ ફરીદાબાદમાં ગુરુવારે રાત્રે અવાવરુ વિસ્તારમાં સાત વખત બળાત્કાર ગુજાર્યો હોવાની વિગતો પોલીસ દ્વારા જણાવવામાં આવી હતી.

જાલીનોટ સાથે રાજકોટમાં પકડાયેલા પાંચ બાંગ્લાદેશી ૧૨ દી'ના રિમાન્ડ પર

## ગાંધીધામમાં ખરીદી ઊપરાંત ૪૦ હજારની નકલી નોટો વટાવી હતી

ભાસ્કર ન્યૂઝ. રાજકોટ

રાજકોટમાંથી જાલીનોટ સાથે પકડાયેલા પાંચ બાંગ્લાદેશીઓને અદાલતે ૧૨ દિવસના રિમાન્ડ પર સોંપ્યા છે, ત્યારે પુછપરછ દરમિયાન એવો ચોકાવનારો ખુલાસો થયો છે કે તેઓ કચ્છના આર્થિક શહેર ગાંધીધામમાં આવ્યા હતા અને ૪૦ હજારની નકલી નોટોને વટાવી હતી. તેમણે ગાંધીધામમાં નકલી નોટનોની મદદથી ૧૦ હજારની કિંમતની ખરીદી પણ કરી હતી જેમાં હજાર હજારની નકલી નોટો ધાબડી દેવામાં આવી હતી.

૨૮ એપ્રિલે વતનથી તેઓ ટ્રેનમાં અમદાવાદ આવવા બેઠા હતા. પરંતુ ઉંઘ ચડી જતાં અમદાવાદના બદલે ૧ તારીખે ગાંધીધામ પહોંચી ગયા હતા. ત્યાં હોટલમાં રોકાઇ એક દિવસમાં ૪૦ હજારની જાલીનોટ વટાવી હતી. ત્યાંથી સુમો કરી રાજકોટ આવીને ખોડિયારનગરમાં માસિક ૯૦૦ના ભાડાથી રૂમ રાખ્યો હતો. બે કલાકમાં ૪,૫૦૦ની ખરીદી પેટે એક હજારની ૧૦ જાલીનોટ વટાવી લીધી હતી. બીજા દિવસે સિનેમેકસમાં ફિલ્મ જોવા ગયા હતા. ૪ તારીખે સુમો કરીને ગોંડલ પહોંચી જુદી જુદી અનેક દુકાનમાંથી ૧૦ હજારની ખરીદી કરી એક હજારની ૫૫ જાલીનોટ વટાવી પરત રાજકોટ આવ્યા હતા અને પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા. ગાંધીધામ અને રાજકોટથી ફિરોઝની સૂચના મુજબના એકસીસ બેંક અને એસબીઆઇના સલીમ શેખ અને શમીલ અખતરના એકાઉન્ટમાં ૩૦ હજાર ૨૫ હજાર અને ૧૫ હજારની અસલી નોટ જમા કરાવી હતી.

## પીએસઆઇ આશિષ પંડ્યાની કોલડિટેઇલ સીડીમાંથી ગાયબ

ભાસ્કર ન્યૂઝ . અમદાવાદ

તુલસી ગંગારામ પ્રજાપતિના એન્કાઉન્ટરમાં ફરાર આરોપી એવા બનાસકાંઠા એસઓજીના તત્કાલીન પીએસઆઇ આશિષ પંડ્યાની એન્કાઉન્ટરના પહેલાની અને બાદની કોલડિટેઇલ સીડીમાંથી ગાયબ છે. આ સીડી સાથે ચેડાં થયાં છે કે નહીં તેની ચકાસણી કરવા સીઆઇડી ક્રાઇમે, બીએસએનએલમાંથી મેળવવામાં આવેલી માસ્ટર સીડી એફએસએલમાં મોકલી છે. સોહરાબુદ્દીન એન્કાઉન્ટરકાંડની સીડી ગાયબ થયા બાદ, તેના સાગરીત તુલસીના એન્કાઉન્ટરની કોલડિટેઇલની સીડીમાંથી ડેટા ગાયબ થયો હોવાથી ગુજરાત પોલીસતંત્ર હચમચી ઊઠ્યું છે.

બે કોલ અંગેની હકીકત પણ સીડીમાંથી ગાયબ છે. તેથી સી આઇ ડી ક્રાઇમે, આ કેસમાં અત્યાર સુધી તપાસ કરી ચૂકેલા તમામ અધિકારીઓની આ બાબતે પૂછપરછ કરવાનું નક્કી કર્યું છે.

૨૭મી ડિસે. ૨૦૦૬ના રાતના ૧૧.૩૦ વાગ્યાથી લઇને ૨૮મીની સવારે લગભગ ૫. ૧૫ વાગ્યા સુધી, એટલે તુલસીરામને એન્કાઉન્ટરમાં ઢાળી દેવાયો ત્યાં સુધી, બનાસકાંઠાના એસ પી વિપુલ અગ્રવાલથી માંડીને પી એસ આઇ આશિષ પંડ્યા અને તેના તમામ માણસોના મોબાઇલ સ્વિચ ઓફ આવ્યા છે.

## વણઝારાના માણસો પીએસઆઇ પંડ્યાને લેવા કચ્છમાં ઘરે ગયા 'તા

ભાસ્કર ન્યૂઝ. અમદાવાદ

સોહરાબુદ્દીનના સાગરીત તુલસી પ્રજાપતિના બોગસ એન્કાઉન્ટરમાં ધરપકડનો દોર શરૂ થતાં જ ચોંકાવનારી હકીકતો પ્રકાશમાં આવી રહી છે. સીઆઇડી ક્રાઇમનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે પીએસઆઇ આશિષ પંડ્યા ૨૩મી ડિસેમ્બર-'૦૬ના રોજથી કુલ ૬ દિવસની રજા પર હતા. આ સમયગાળા દરમિયાન બોર્ડર રેન્જના તત્કાલીન ડીઆઇજી ડી.જી. વણઝારાના આર.આર. સેલ (રેપિડ રિએક્શન સેલ)ના માણસો પીએસઆઇ પંડ્યાને બોલાવવા તેના વતન ભુજના મેઘપર ખાતે ગયા હતા.

સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર ૨૩મી ડિસેમ્બર-'૦૬થી બનાસકાંઠાના તત્કાલીન પીએસઆઇ આશિષ પંડ્યા કોઇ સામાજિક કામઅર્થે ૬ દિવસની રજા પર હતા. આ દરમિયાન ૨૪મી ડિસેમ્બરે બોર્ડર રેન્જના ડીઆઇજી વણઝારાએ એસ.પી. વિપુલ અગ્રવાલને ફોન કરી આશિષ પંડ્યા વિશે પૂછ્યું હતું. તે સમયે આશિષ પંડ્યાનો મોબાઇલ બંધ હોવાથી વિપુલ અગ્રવાલે પંડ્યાના ઘરના લેન્ડલાઇન નંબર પર મેસેજ મોકલાવ્યો હતો. તે સમયે વણઝારાની ઓફિસ ભુજમાં જ હોવાથી વણઝારાએ પોતાના આર.આર. સેલના માણસોને પંડ્યાના ઘરે મોકલીને તેને પોતાની ઓફિસે બોલાવ્યો હતો.

વણઝારાને મળ્યા બાદ પંડ્યા ૨૬મીએ એકાએક ડ્યૂટી પર હાજર થઇ ગયા હતા, પરંતુ આશ્ચર્યજનક સંજોગોમાં તેઓ પોતાની એસઓજીની ઓફિસે ગયા ન હતા. સીઆઇડી ક્રાઇમને આશંકા છે કે ૨૬મીના રોજ અન્ય કેટલાક પોલીસ કર્મચારીઓ સાથે પંડ્યા છાપરી ગામ નજીક એન્કાઉન્ટર કરવાના સ્થળનું નિરીક્ષણ કરી આવ્યા હતા.

Digitially Archived by: www.realpatidar.com/library

*Gini & Jony Stores* : • **Rajkot -** Iscon Prozone Mall, Shop No.203,Near BigBazaar Tel. 0281-6454123 • **Grand Central Mall** - Shop No. 23 Ground Floor, Nana Mava Road Tel. 6593895 • City Plaza, Dr. Yagnik Road Tel. 2468514 • **Jamnagar -** Mehul Cinemax**,** Airport Rd. Tel. 0288 6499112 • Zaver Chambers,Near Manek Centre,P.N Marg Tel. 0288 2663032 • **Gandhidham -** Shop N0. N- 49, &50, Ground floor & First floor, Main Market • **Bhavnagar -** Shop. No 6, Shoppers Plaza, Waghawadi Rd. Tel. 0278 3001651 •**Junagadh -** F-5/6, 1st floor, Balaji Avenue, Near Moti baug Tel. 0285 2650012

***Also available at :*** • **Rajkot -** Option, Yagnik Road • Maruti Kids, Kothariya Main Road • **Jamanagr** - Thaker's, Opp DKV Colledge

***Disclaimer :*** "The Company is proposing, subject to receipt of requisite approvals, market conditions and other considerations, a public issue of its equity shares and the Company has filed a Draft Red Herring Prospectus with the Securities and Exchange Board of India ("SEBI"). The Draft Red Herring Prospectus is available on the website of SEBI at www.sebi.gov.in and the website of the BRLM i.e. Edelweiss Capital Limited at www.edelcap.com. Investors should note that investment in equity shares involves a high degree of risk and for details relating to the same, see the section titled "Risk Factors" of the aforementioned offer document."

આપણો દેશ ચાલે છે, ચર્ચા પર. પરંતુ, સાચી અને સ્વાસ્થ્ય ચર્ચા માટે આવશ્યક છે, ખરી સૂચના અને ભરોસાપાત્ર જાણકારી. સાચી દિશા અને યોગ્ય નિર્ણય માટે જીવનના પ્રત્યેક વળાંક પર, ચાહે એ વ્યક્તિગત હોય કે વ્યાવસાયિક, યોગ્ય ચર્ચાની જરૂર હોય છે. આપની આ જ આવશ્યકતાઓને ધ્યાનમાં રાખીને આપને સાચું વિવરણ અને વિશ્લેષણ પૂરું પાડે છે, આપનું પોતાનું દૈનિક ભાસ્કર જૂથ.

**ભારતનું સૌથી મોટું અખબાર જૂથ.**

दैनिक भास्कर समूह | दैनिक भास्कर | દિવ્ય ભાસ્કર | बिज़नेस भास्कर | DNA Read the world

દૈનિક ભાસ્કર સમૂહ - 11 રાજ્ય, 48 આવૃત્તિ, 3 ભાષા
મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, પંજાબ, ચંડીગઢ, હરિયાણા, ગુજરાત, નવી દિલ્હી, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ

website: www.bhaskar.com, www.divyabhaskar.com

EuroRSCG/DB/10

# ૨૫ હજાર કડવા પાટીદારોની હાજરીમાં બંધારણ પસાર

realpatidar.com

નખત્રાણા ખાતે યોજાયેલા બંધારણને લગતા સંમેલનમાં ઉપસ્થિત અગ્રણીઓ તેમજ સમાજના બહોળી સંખ્યામાં ઉમટેલા જ્ઞાતિજનો નજરે પડે છે. તસવીર ભરત જોષી

## નખત્રાણા વિદ્યાર્થીભવન ખાતે ૨૯ મુદ્દાઓને બહાલી અપાઇ

ભાસ્કર ન્યૂઝ. નખત્રાણા

અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજના બંધારણ અને ધારાધોરણના નિયમોનું પાલન કરવા અત્રેના વિદ્યાર્થીભવન નખત્રાણા ખાતે અંદાજિત ૨૫ હજાર પાટીદાર જ્ઞાતિની ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અસાધારણ સભામાં જુદા જુદા ૨૯ મુદ્દાઓને સર્વાનુમતે હાથ ઉંચા કરીને બહાલીથી પસાર કરવામાં આવ્યા હતા. કચ્છ તેમજ કચ્છ બહાર કોઇ પણ જગ્યાએ રહેતા કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિના ભાઇ-બહેનો વચ્ચે પરસ્પર સ્નેહ સંગઠન, સહકાર અને એકતાની ભાવના વધે તેવા પ્રયત્નો કરવા સમયોચિત સામાજિક રીત-રિવાજોમાં સુધારા વધારા કરી એક બીજાને વધારેમાં વધારે ઉપયોગી થઇ શકે તેમજ સમાજનાં રીત-રિવાજોમાં એકરૂપતા સ્થપાય તેવા પ્રયત્નો કરવા જણાવાયું હતું. પ્રમુખ રામજીભાઇ નાકરાણીના અધ્યક્ષ સ્થાને મળેલી અસાધારણ સભામાં મહામંત્રી મોહનભાઇ ધોળુએ સભ્યની તમામ મુદ્દાઓની છણાવટ કરી હતી. બધારણ સમિતિના કન્વીનર અબજીભાઇ વિશ્રામ કાનાણીએ સુધારેલા અમુક મુદ્દાઓ વાંચી સભળાવ્યા હતા.

સમાજનાં બંધારણને લઇને છેલ્લા ૧૫ દિવસથી કચ્છ અને પાટીદાર જ્ઞાતિમાં મુદો છવાયેલો રહ્યો હતો. આજની બેઠકમાં સુવર્ણ જયંતી મહોત્સવને ભવ્ય રીતે ઉજવવા જ્ઞાતિના પ્રમુખે સમાજના ભાઇઓ પાસે દાનની ટહેલ નાખતાં અડધા કલાકમાં સીતેર લાખની રકમ આવી હતી.

ડી.એસ.પી. વાબાંગ જામીરની સૂચનાથી ડીવાયએસ પીસીટી સુથારની આગેવાની હેઠળ ૨ સીપીઆઇ, ૯ પીએસઆઇ તેમજ ૧૦૦થી વધારે કર્મચારીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. નખત્રાણા મામલતદાર દર્શનાબેન ભગલાણી ઉપસ્થિત રહ્યા હતા. સુવર્ણ જયંતી સમિતિના ચેરમેન ગંગારામભાઇ સાંખલા, ગોપાલભાઇ ભાવાણી, મોહનભાઇ ધોળુ, નરશીભાઇ પટેલ, વાલજીભાઇ ચૌહાણ, મનસુખભાઇ રૂડાણી, યુવા સંઘના પ્રમુખ જયંતીભાઇ લાકડાંવાળા, દેવજીભાઇ ભાવાણી, સામજીભાઇ નાકરાણી, માવજીભાઇ છાભૈયા, લાલજીભાઇ રામાણી, વાલજીભાઇ ભગત, રતીલાલ પટેલ, દેવજીભાઇ લીબાણી, પ્રેમજીભાઇ કેશરાણી, રમેશભાઇ વાઘડિયા, રતીલાલ પોકાર, જયેશભાઇ છાભૈયા, દેવશંકરભાઇ ધનાણી, અમૃતલાલ ઠાકરાણી, રવિલાલ રામજિયાણી તેમજ કચ્છના ૧૪૬ ગામના પાટીદાર જ્ઞાતિના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન મોહનભાઇ ધોળુ અને આભારવિધિ વાલજીભાઇ ચૌહાણે કરી હતી.

# ભુજના દેશલસર તળાવમાં ડૂબી જવાથી આધેડનું મોત

## મથલમાં સળગીને યુવાનનો આપઘાત

ભાસ્કર ન્યૂઝ. ભુજ

શહેરના ભીડ ગેડ નજીક આવેલા દેશલસર તળાવમાં ન્હાવા પડેલા અંજારના આધેડનું ડૂબી જવાથી મોત થયું હતું, જ્યારે નખત્રાણા તાલુકાના મથલ ગામમાં અગમ્ય કારણોસર યુવાને સળગીને આપઘાત કરી લીધો હતો.

પોલીસ દફતરેથી જાણવા મળતી વિગતો મુજબ ભુજમાં ભીડનાકા નજીક આવેલા દેશલસર તળાવમાં શુક્રવારે સવારે કાસમ ભચુભાઇ કેવરે આધેડ વયના પુરુષની લાશ તરતાં જોઇ હતી. આ અંગે તેમણે પોલીસને જાણ કરતાં મૃતદેહને બહાર કાઢીને પોસ્ટ મોર્ટમ માટે ખસેડાયો હતો. તપાસ દરમિયાન સાંજે મૃતદેહની ઓળખ થઇ ગઇ હતી. આ લાશ અંજારના જુમ્મા જુસબ કેવરની હતી. તે તળાવમાં ન્હાવા પડ્યા હતા, ત્યારે ડૂબી ગયા હતા એવું પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં બહાર આવ્યું છે.

મૃતકના ભાઇ હાસમ આમદ કેવરને મૃતદેહનો કબજો સોંપવામાં આવ્યો હતો.

બીજી અપમૃત્યુની એક ઘટના નખત્રાણા તાલુકાના મથલમાં બની હતી. અબ્દુલકરીમ ઇબ્રાહીમ પીંજારા નામનો ૧૮ વર્ષીય યુવાન તા.છઠ્ઠી મેની સાંજે કોઇ અગમ્ય કારણોસર તે પોતાના ઘરે શરીર પર કરોસીન છાંટીને સળગી ગયો હતો. ગંભીર હાલતમાં સારવાર અર્થે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં શુક્રવારે તેણે દમ તોડી દીધો હતો.

પોલીસે આ ઘટનામાં

# યુનિ.ની છાત્રાઓને ફીમાં રાહત આપવા રચાઇ કમિટી

## સેનેટની બેઠકમાં લેવાયા મહત્ત્વના નિર્ણય : આર્કિયોલોજી વિભાગ શરૂ કરવા દરખાસ્ત

ભાસ્કર ન્યૂઝ. ભુજ

કચ્છ યુનિવર્સિટીની સ્વનિર્ભર કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ફીમાંથી રાહત આપવા ખાસ કમિટીની રચના કરવામાં આવી છે, જેના દ્વારા વિશેષ ફંડ ઊભું કરી સ્કોલરશિપ આપવા વિચારાયું હતું.

આજે યોજાયેલી સેન્ટરની બેઠકમાં અનેક મહત્ત્વના નિર્ણયો લેવાયા હતા, જેમાં ઓર્કિયોલોજી વિભાગ શરૂ કરવા, શ્યામજી કૃષ્ણ વર્મા વિશે યુનિ.માં અલગ કોર્નર શરૂ કરવા જેવી બાબતોનો સમાવેશ થાય છે. પ્રારંભમાં કુલપતિ ડો.શશિરંજન યાદવે સૌ સભ્યોને આવકાર્યા હતા. પ્રથમ બેઠકની મિનિટ્સને તથા વાર્ષિક અહેવાલ તથા હિસાબોને બહાલી અપાઇ હતી.

પ્રો.વખતસિંહ જાડેજા, પ્રો.કે.વી.પાટીદાર, પ્રો.રમેશ લુહાણા, પ્રો.એમ.ડી.દવે, પ્રો.કલ્પેશ સોરઠિયા, પ્રકાશ કરમચંદાણીએ રજૂ કરેલા ૧૯ પ્રસ્તાવો પર ચર્ચા-વિચારણા બાદ હકારાત્મક નિર્ણયો લેવાયા હતા. કેટલાક પ્રસ્તાવો પાછા ખેંચાયા હતા. સ્વનિર્ભર કોલેજોમાં ભણતી કચ્છની કન્યાઓને ઊંચી ફીમાંથી રાહત આપવા કોપર્સ ફંડ ઊભું કરવાનું સૂચન કરાયું હતું, તો ત્યાંને ત્યાં જ એક સમિતિની રચના કરી દેવાઇ હતી, જેના અધ્યક્ષસ્થાને પ્રો.પાટીદારને નિયુક્ત કરાયા હતા. પૂર્વ કુલપતિ ડો.કાંતિભાઇ ગોર સલાહકાર તરીકે નિમાયા છે. ડો.યાદવે ચોઇસ બેઇઝડ્ ક્રેડિટ સિસ્ટમનો આછેરો ખ્યાલ આપીને આ અંગે સજ્જ થવા પ્રાધ્યાપકોને જણાવ્યું હતું. તેમણે યુનિ.ની નવી યોજનાઓ પર પ્રકાશ પાડ્યો હતો. યુનિ.માં આર્કિયોલોજી વિભાગ શરૂ કરવા માટે સરકારને અરજી કરાઇ છે અને રૂ. ૬ કરોડના ખર્ચ સાથે વિભાગ શરૂ કરાશે. ઉદ્યોગોને સહકાર મેળવીને આગામી જૂનથી યુનિ.માં સેન્ટર ફોર એક્સેલન્સ શરૂ કરાશે, જે દ્વારા વિવિધ પ્રોફેશનલ કોર્સિસ શરૂ કરાશે.

# ભડલી, થરાવડા જમીન કેસના મુખ્ય સૂત્રધારની ધરપકડ

ભાસ્કર ન્યૂઝ. ભુજ

નખત્રાણા તાલુકા ભડલી અને થરાવડાના ખેડૂતોની જમીન બારોબાર વેચી મારનારા મુખ્ય સૂત્રધારની એલસીબીએ શુક્રવારે ભુજમાંથી ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરી છે.

બહુચર્ચિત એવા ભડલી, થરાવડા જમીન કૌભાંડ અંગે વિગતો આપતાં એલસીબીના સૂત્રોએ જણાવ્યું હતું કે, મૂળ માંડવી તાલુકાના મોટી રાયણના અને હાલે ભુજમાં રહીને જમીન દલાલનો વ્યવસાય કરતાં ઉંમર અબ્દ્રેમાન અબડાની પોલીસે શુક્રવારે ભુજમાંથી ધરપકડ કરી હતી. ટ

પોલીસે પ્રાથમિક પૂછપરછ કરતાં તેમણે એવું કબૂલ્યું હતું કે, આરોપી કોઇ પાર્ટી જમીન ખરીદવા માટે તૈયાર હોય તો તેને ભડલી અને થરાવડા ગામની સીમમાં લઇ જતો અને અન્ય ખેડૂતોની જમીન તેમને બતાવી દેતો.

સામેની વ્યક્તિને જમીન પસંદ પડી જાય તો તે બોગસ જમીન માલિકને ઊભો કરીને બોગસ દસ્તાવેજોના આધારે તેમને જમીન વેચી મારીને વેચાણ દસ્તાવેજ પણ બનાવી દેતો હતો. આ શખ્સની વધુ ઉલટ તપાસ કરવા માટે તેને અદાલતમાં રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવશે. પૂછપરછ દરમિયાન હજુ વધારે શખ્સોના નામો ખૂલે તેવી શક્યતાઓ વ્યક્ત

# ગરમી ફરી વધી : કંડલા ૪૧.૧, ભુજ ૪૦.૨

ભાસ્કર ન્યૂઝ. ભુજ

કચ્છમાં આજે ગરમીમાં ફરી વધારો થયો હતો. ભુજમાં આજે પારો ૪૦.૨ ડિગ્રીએ પહોંચી ગયો હતો. કંડલામાં ૪૧.૧ ડિગ્રીથી લોકો શેકાયા હતા.

અકળાવનારો તડકો અને ગરમ વાયરાને લીધે બપોરના બહાર નીકળવું દુષ્કર બન્યું હતું. આજે પવનની ગતિ મંદ પડતાં તાપ વધારે અનુભવાયો હતો. છેલ્લા બે દિવસથી બપોરે સામાન્યથી વધુ તાપ અનુભવાઇ રહ્યો છે.

આજે ભુજમાં નીચું તાપમાન ૨૬.૨, કંડલામાં ૨૬.૯, નલિયામાં ઉંચું ઉષ્ણતામાન ૩૬.૬ અને ૨૬.૫ તેમજ માંડવીમાં ૩૬.૧ તથા ૨૬.૧ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

જય અંબે જય ભવાની જયશ્રી બલદેવ બાપા

**શ્રદ્ધાંજલિ**

**સ્વ. કલ્યાણજીભાઇ હરિરામભાઇ ગણાત્રા - ગઢશીશા**

ઉ. વ. ૮૫, સ્વ. તા. ૪/૫/૨૦૧૦, મંગળવાર

ગઢશીશાના જૂની પેઢીના સંત સમાન, જીવદયાપ્રેમી, માનવતાના મોતી સમાજ રત્ન, સાધુ-સંતો, પશુ-પક્ષી અને ગરીબોના હમદર્દ, સતત જયઅંબેનું રટણ કરનારા એવા દેવપુરુષ પૂ. કલ્યાણજી બાપાને શ્રદ્ધાપૂર્વક વંદન સહ... શ્રદ્ધાંજલિ

- **શિવ શક્તિ કોમ્પ્લેક્સ એન્ડ સોમનાથ ગેરેજ,** માધાપર હાઇવે, ભુજ-કચ્છ.
- **મદારસિંહજી બાબુભા સોઢા એવમ્ સમસ્ત પરિવારજનો,** G.M.D.C. ગઢશીશા.
- **શ્રી કાનજીભાઇ નારાણભાઇ સંઘાર,** માંડવી તા. ઉપપ્રમુખ યુવા ભા.જ.પ.
- **રવીલાલ પ્રભાશંકર જોષી** જોષી પરિવાર, ગઢશીશા
- **દેવજીભાઇ વિશ્રામભાઇ ઉકાણી સહપરિવાર** પ્રમુખશ્રી, ગઢશીશા વિકાસ સમિતિ, ગઢશીશા
- **શ્રી જાડેજા માધુભા સતુભા** ગોણિયાસર, તા. માંડવી-કચ્છ. પ્રમુખશ્રી, કોંગ્રેસ આઇ માંડવી તાલુકો
- **રાજેન્દ્રગિરિ એન. ગોસ્વામી** રાજુ લાઇટ મંડપ ડેકોરેટર્સ, ગઢશીશા-કચ્છ.
- **રવીલાલભાઇ નરભેરામભાઇ સોની સહપરિવાર** દેના બેંક, ભચાઉ-કચ્છ.
- **હર્ષદગિરિ નથુગિરિજી ગોસ્વામી** આશાપુરા એસ્ટેટ એજન્સી, ગઢશીશા-કચ્છ.
- **જુસબ ઈસ્માઈલ વેણ મિસ્ત્રી (જુષી)** સોમનાથ ગેરેજ, માધાપર-હાઇવે રોડ.

રાજુ એડ-ગઢશીશા



YOUR JOB SEARCH ENDS HERE...

**ભાસ્કર appointment** Every Tuesday, Thursday & Saturday

| Bhuj | Rajkot + Bhuj | Rajkot+Bhuj+Bhavnagar & Surendranagar | Bhavnagar | Ahmedabad | Baroda | Surat | All Gujarat | Contact 4 Advt. |
|---|---|---|---|---|---|---|---|---|
| Rs.150/- | Rs.200/- | Rs. 400/- | Rs. 300/- | Rs. 950/- | Rs. 330/- | Rs. 275/- | Rs. 1680/- | 9909944060, 9909944072 |

AN ISO 9001-2008 COMPANY

**જોઈએ છે**

| | |
|---|---|
| પ્રેસ ઓપરેટર | ૨૦ |
| ટર્નર | ૩૦ |
| ફિટર | ૨૫ |
| હેલ્પર | ૫૦ |

- દૈનિક વેતન (૮ કલાકના) રૂા. ૧૮૦થી વધુ
- માસીક તથા વાર્ષિક બોનસ/૬-મહિને પગાર વધારો
- પ્રોવીડન્ડ ફંડ તથા કંપનીના અન્ય લાભ મળશે.

**ફાલ્કન પમ્પસ્ પ્રા. લી.**

૩૯/૪, વાવડી ઈન્ડ. એરીયા, હોટલ કિષ્ના પાર્કની પાછળ, ગોંડલ રોડ, રાજકોટ-૪. ફોન : ૨૩૭૦૮૦૧-૨-૩-૪-૫. મો. : ૯૭૨૭૭ ૦૦૫૯૬/૭

રૂબરૂ મળવાનો સમય સાંજે ૩ થી ૬

Looking for the leaders who can lead from the front

**REQUIRES**

The largest, ISO / TS Certified and constant growing foundry needs below mentioned candidates on immediate appointment. Best package offers which commensurate with qualification and experience. Assured growth and prospective future in line of performance.

**MARKETING ENGINEER**

B.E.-Metallurgy /Mechanical Engineer with Min. 5-7 yrs. experience of same cadre. Candidates from foundry ind. will be preferred

**Q.C.INCHARGE**

Degree/Diploma Mechanical Engineer with 3-4 yrs. experience of same cadre is preferable.

**SUPERVISOR - WAX ROOM**

Graduation with 2-3 yrs. experience in same cadre is preferable (Fresher may also apply)

**STORE INCHARGE & STORE ASSISTANT**

**EXCISE CLERK**

Graduate with Min. 5-7 yrs. of Experience in same capacity. Previous experience in foundry shall add value.

**PERSONNEL OFFICER**

Graduate / M.S.W / HR with Min. 5-7 yrs. experience in same cadre. Candidate must be familiar with all Govt. norms & capable to manage work force of 200 + Employees.

**ASSISTANT PERSONNEL OFFICER**

Graduate / M.S.W., with 2-3 yrs experience of same cadre is preferable.

Apply within 5 days with complete details, recent photo & expected salary.

The Personnel Department :

**INTRICAST PVT. LTD.**

25/28, Galaxy Industrial Estate, 15Km. Rajkot-Gondal Road, Village : Shapar, Rajkot- 360 024 Tel:02827-252051, 252052, 252053 Fax : 02827-252054 E-mail : info@intricastindia.com

admiracle


# કચ્છ ભાજપના બાકી રહેતા મંડલના હોદ્દેદારોની વરણી

ભાસ્કર ન્યૂઝ. ભુજ

કચ્છ જિલ્લા ભાજપના નખત્રાણા, અંજાર અને ગાંધીધામ ભાજપના પ્રમુખ અને અન્ય મહામંત્રીઓની નમણૂક ગુરુવારે જિલ્લા ભાજપના અધ્યક્ષ જયંતીભાઇ ભાનુશાળીએ કરી હતી.

ભાજપના નવા સુધારેલા બંધારણ પ્રમાણે કચ્છના બાકી રહેતા પ્રમુખોની નિમણૂકો થઇ હતી, જેમાં ગાંધીધામ શહેર ભાજપના પ્રમુખ તરીકે ભરતભાઇ ગોરધનદાસ રામવાણી, મહામંત્રી પદે દામજીભાઇ ભાનુશાળી અને ગોવિંદભાઇ પારૂમલાણી વરાયા હતા, જ્યારે અંજાર તાલુકા ભાજપના પ્રમુખ પદે ગોપાલભાઇ માતા, મહામંત્રી તરીકે રમેશભાઇ બકુત્રા, પ્રદીપભાઇ પરમામર આરૂઢ થાય છે. પક્ષના નખત્રાણાના પ્રમુખપદે લાલજીભાઇ , હંસરાજભાઇ રામાણી અને મહામંત્રી તરીકે તાનસેનભાઇ, ટોકરશીભાઇ શાહ તથા રાજેશભાઇ પલણ વરાયા હતા. મહામંત્રીઓમાં રાપર શહેર મહામંત્રી પદે ભરતભાઇ ત્રેવાડિયા તથા નાનજીભાઇ ઠાકોર તાલુકા ભાજપના મહામંત્રી તરીકે, રાજેન્દ્રભાઇ ઠક્કર ભયાઉ શહેર ભાજપ મહામંત્રી તરીકે, નરેન્દ્રદાન ગઢવી તાલુકા મહામંત્રી પદે, પ્રફુલ્લઝરૂ, ગાંધીધામ તાલુકા મહામંત્રી પદે નવીનભાઇ કાતરિયા, અંજાર શહેર ભાજપમંત્રી પદે, રેવાલાલ પાટીદાર, મુન્દ્રાના મહામંત્રી પદે મહમદ સિદ્દિક જુણેજા, ભુજ શહેર મહામંત્રી તરીકે, હિતેશભાઇ ખંડોર, તાલુકા મહામંત્રી તરીકે નરેશ શાહ, માંડવી શહેર ભાજપ મહામંત્રી તરીકે કેશવજીભાઇ રોશિયા, તાલુકા મહામંત્રી પદે વિઠ્ઠલદાસ દરજી અબડાસા તાલુકા મહામંત્રી પદે અને અમૃતલાલ પટેલની લખપત તાલુકા ભાજપના મહામંત્રી તરીકે નિમણૂક કારઇ હોવાનું ભાજપે એક યાદીમાં જણાવ્યું

# માધાપરમાં શિવપુરાણમાં યોજાયો વિવાહ

ભાસ્કર ન્યૂઝ. માધાપર

માધાપર નવાવાસના મોટા ચોકમાં દશનામ ગોસ્વામી સમાજ યોજિત શિવપુરાણ જ્ઞાનયજ્ઞમાં લગ્નગ્રંથિથી જોડાયેલા નવદંપતીની શિવપાર્વતીની વેશભૂષામાં મંદિરેથી કથામંડળે જાન પહોંચતાં સામૈયું કરાયું હતું. માધાપર દશનામ ગોસ્વામી મહિલા મંડળના સહયોગથી અમૃતગિરિ પ્રેમગિરિ ગોસ્વામીના યજમાન પદે ચાલતા જ્ઞાનયજ્ઞ મહોત્સવના વિવિધ પ્રસંગોનું હંસદેવગિરિજીએ રસપાન કરાવ્યું હતું. શિવવિવાહ લગ્નોત્સવ નિમિતે કથા મંડપમાં અરવિંદગિરિ જેઠીગિરિના પુત્ર દીક્ષિતકુમાર સાથે રમેશગિરિ જેરામગિરિની પુત્રી હેતલબેન લગ્નગ્રંથિથી જોડાયા હતા.આ પ્રસંગે સમૂહપ્રસાદના દાતા નારાયગિરિ પ્રેમગિરિ, ભીમગિરિ હીરાગિરિ, હર્ષદપુરી, બિલેશ્વ મંદિરના મહંત ચમનગિરિ, મુખ્ય યજમાન અમૃતગિરિ, સન્માન કરવામાં આવ્યું હતું. શનિવારે રાત્રે ૯ વાગ્યે યોગેશપુરી ગોસ્વામી અને જીતુગિરિ અંતરજાળવાળાની સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે.


**દિવ્ય ભાસ્કર એડવોકેટ નોટિસ** રૂા. ૧૨૦/- કોલમ સે.મી. સમગ્ર કચ્છમાં ફેલાવો


**ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટ અંગે જાહેર નોટીસ**

મોજે : વટાછડ, તા. ભુજની સીમ મધ્યે આવેલ ખેત વિષયક જમીન જેના રે.સ. નં. ૧૬/૧ ના સહ માલિકો નોતીયાર રાજબાઇ, નોતીયાર ઇબ્રામ તથા નોતીયાર જુણસ સાલેમામદ રહે વટાછડ, તા. ભુજ વાળાએ ઉપરોક્ત મિલ્કત સબંધી અમારી પાસે ટાઇટલ કલીયરન્સ સર્ટિફીકેટની માંગણી કરેલ છે. જેથી મિલ્કત સબંધી કોઇપણ વ્યક્તિને માલિકી તથા અન્ય કોઇપણ રીતે વરવાંધો તકરાર હોય તેમણે આ નોટીસ પ્રસિદ્ધ થયેથી દિન-૪ માં નીચે જણાવેલ સરનામે આધાર પુરાવા રજુ કરવા. મુદત વિત્યે ટાઇટલ કલીયરન્સ સર્ટિફીકેટની કાર્યવાહી હાથ ધરવામાં આવશે જેની સર્વેએ આ નોટીસથી નોંધ લેવી.

ભુજ - કચ્છ. તા. ૮-૫-૨૦૧૦

**કે. એચ. વૈશ્નવ**
એડવોકેટ

સરનામું : મહંમદ પન્નાહ ચેમ્બર્સ, ન્યુમિન્ટ રોડ, ભુજ - કચ્છ. મોઃ ૯૮૨૫૭ ૩૬૦૦૬

**केन्द्रीय विद्यालय रेलवे गांधीधाम**

केन्द्रीय विद्यालय रेलवे गांधीधाम में अन्दर व बहार रंग रोगंन करने के लिये व सफाई कर्मचारी, माली व स्कियोरिटी गार्ड के कोन्ट्रेक्ट हेतु निविदाए आमंत्रित की जाती है। इच्छुक फर्म अपने लेटर हैड व टीन नम्बर जमा करा कर विद्यालय से दिनांक 22/5/2010, 10 से 12 बजे तक टेन्डर फार्म 100 रूपये कार्यालय में जमा कराकर प्राप्त कर सकते है। टेन्डर फार्म जमा करने की अंतिम तिथि 22/5/2010, 2 बजे तक होगी। प्राचार्य

**ભારતીય વાયુ સેના**

**ઓપન ટેન્ડર ઈન્કવાયરી નં. એએફ સ્ટેશન ભુજ / સીગ્નલ્સ/૦૧/૨૦૧૦ સ્ટેશન કમાન્ડરનું કાર્યાલય, વાયુ સેના સ્ટેશન, ભુજ (કચ્છ) ગુજરાત-૩૭૦૦૧ રજીસ્ટ્રેશન ઓફ વેન્ડર્સ ફોર સપ્લાય ઓફ સ્પેર પાર્ટ્સ ઓફ કોમ્યુનીકેશન ઇકવીપમેન્ટ, ટેલીફોન, એએમસી કન્સર્નડ વીથ કોમ્યુનીકેશન ઇકવીપમેન્ટ.**

૧. સ્ટેશન કમાન્ડર, વાયુ સેના સ્ટેશન, ભુજ, કચ્છ, ગુજરાત ભારતના રાષ્ટ્રપતિ વતી અને માટે માત્ર રજીસ્ટર્ડ વેન્ડરો દ્વારા આવેદનો આમંત્રિત કરે છે. જે કોમ્યુનીકેશન સ્પેર પાર્ટ્સ, ઇકવીપમેન્ટ, કેબલ્સ, મેઇન્ટેનન્સ ઓફ ઇકવીપમેન્ટ, એએમસી અને અન્ય સંબંધિત ક્ષેત્ર જે એએમસીના સપ્લાયના ધોરણ પર ડીલીંગ કરતા હોય.

૨. વેન્ડરોએ નીચેની બાબતો આવેદન સાથે અવશ્ય જોડવી.
(એ) તેઓની માન્ય રજીસ્ટ્રેશન સર્ટીફીકેટની નકલ
(બી) સંબંધિત ક્ષેત્રને લગતી ગત સંચાલિત પ્રોજેકટ / રેકોર્ડના અનુભવની માહિતી.
(સી) અંતિમ ભરેલા આઈટી રિટર્નની નકલ.

૩. આવેદન સ્ટેશન કમાન્ડર, વાયુ સેના સ્ટેશન, ભુજ (કચ્છ) ૩૭૦૦૦૧ ગુજરાત લેટેસ્ટ બાય ૧૩.૦૦ કલાક ૦૧ જુન, ૧૦ના રોજ સબમીટ કરવાનું રહેશે. કોઈપણ જાતની તપાસ હેતુ ટેલીફોન નં. ૦૨૮૩૨-૨૪૪૦૦ એકસટેન ૨૦૦ પર સંપર્ક કરવો.

davp 10802/11/0029/1011

**મિલિટરી એંજિનિયર સર્વિસીસ**

કમાંડર વર્કસ એંજિનિયર્સ (એએફ) ભુજ ભારતના રાષ્ટ્રપતિ વતી નિમ્નદર્શિત કામની નિવિદા આપવા માટે ઈજારદારોની પસંદગી કરવા માટે એમઈએસના પાત્ર એનલિસ્ટેડ ઈજારદારો તથા લાયકાત ધારાધોરણ સંતોષતા હોય એવા અન્ય સરકારી વિભાગો સાથે કામ કરતા એનલિસ્ટેડ/અન એનલિસ્ટેડ ઈજારદારો પાસેથી ૧૫ મે ૨૦૧૦ સુધીમાં અરજીઓ આમંત્રિત કરે છે.

| | |
|---|---|
| કામનું નામ | એર ફોર્સ સ્ટેશન ભૂજ ખાતે રન વે હટની જોગવાઈ |
| કામની અંદાજિત કિંમત | રૂા. ૭.૫૦ લાખ. |
| પૂર્ણતા અવધિ | ૦૪ (ચાર) મહિના. |
| એમઈએસ સાથે એનલિસ્ટેડ ન હોય એવા ઈજારદારો માટે બાનાની રકમ | કોઈપણ અનુસૂચિત બેંકમાંથી કોલ મની ડિપોઝિટ રીસીપ્ટના રૂપમાં રૂા. ૧૫,૦૦૦/-. બી.જી.બી સ્વીકાર્ય નથી. |
| નિવિદાની કિંમત | જીઈ (એએફ) ભુજની તરફેણમાં ભુજ ખાતે ચુકવણી પાત્ર કોઈપણ રાષ્ટ્રીયકૃત બેંકમાંથી ડીડી/બેંકર્સ ચેકના રૂપમાં રૂા.૫૦૦/- |
| અરજીઓ સ્વીકારવાની આખરી તારીખ | ૧૫ મે ૨૦૧૦ |
| લાયકાત ધારાધોરણઃ | |
| (એ) એમઈએસ એનલિસ્ટેડ ઈજારદારો માટે | એમઈએસના માન્ય ઈજારદારોની યાદી પર વર્ગ 'ઈ' કક્ષા (એ). |
| (બ) અન્ય ઈજારદારો માટે | (i)રૂા. ૩ લાખથી ઓછાનહીં હોય એવા મૂલ્યના ૩ કામો અથવા રૂા. ૫ લાખથી ઓછા નહીં એવા મૂલ્યનાં ૨ કામો અથવા રૂા. ૭.૫ લાખથી ઓછા નહીં એવા મૂલ્યનું એક કામ સંતોષકારકરીતે પૂર્ણ કર્યા હોવા બાબતે અથવા ગત બે વર્ષ માટે સરેરાશ વાર્ષિક ઉથલો રૂા. ૧૦.૦૦ લાખથી ઓછો ન હોય, કામકાજી મૂડી રૂા.૧.૫ લાખથી ઓછી ન હોય અને અચળ સંપત્તિનું મૂલ્ય રૂા. ૪.૫૦ લાખથી ઓછું ન હોવા બાબતે એમઈએસના એનલિસ્ટેમેન્ટ ધારાધોરણ સંતોષતા હોવા જોઈએ.<br>(ii) સરકારી વિભાગમાં કોઈ રીકવરી આઉટસ્ટેન્ડિંગ હોવી જોઈએ નહીં. |
| નિવિદા આપવાની તારીખ | ૧૭ મે ૨૦૧૦ના રોજ અથવા તે પછી |
| નિવિદા સ્વીકારવાની તારીખ | ૦૮ જૂન ૨૦૧૦ |

(૧) નિવિદાના મૂલ્ય પેટે આવશ્યક મૂલ્યના ડીડી/બેંકર્સ ચેકના સથવારા વિનાની અરજી નિવિદા આપવા માટે લક્ષમાં લેવાશે નહીં.
(૨)એમઈએસના ઈજારદારોની માન્ય યાદી પર ન હોય એવા ઈજારદારોએ તેમની ઉપર દર્શાવ્યા મુજબ પાત્રતા પુરવાર કરવા માટે સરકારના કોઈપણ ખાતામાં રિકવરી આઉટસ્ટેન્ડીંગ નથી તે અંગેના સોગંદનામા સહિત જરૂરી દસ્તાવેજો સામેલ કરવાના રહેશે.
(૩) નિવિદા આપવા માટેની અરજી નકારવામાં આવે તેવા કિસ્સામાં અરજદારને નિવિદાનું મૂલ્ય પરત કરવામાં આવશે, જોકે ઈજારદાર નેકસ્ટ હાયર એંજિનિયર ઓથોરિટી એટલે કે સીઈ (એએફ) અમદાવાદને, નિવિદા આપવા માટે તેમની અરજી નકારાવા બાબતે અપીલ કરી શકે છે , જેમનો નિર્ણય આખરી અને બંધનકર્તા રહેશે અને ઈજારદાર નિવિદા ન અપાવા બદલ કોઈ વળતર કે જે કાંઈ હોય તે મેળવવા પાત્ર હશે નહીં.
(૪) ઉક્ત વિગતો એમઈએસની વેબસાઈટ www.mes.gov.in પર પણ ઉપલબ્ધ છે. નિવિદા આઈએએફડબલ્યૂ-૨૧૬૨ની પૂર્ણ સૂચના અને એનલિસ્ટમેન્ટ ધારાધોરણ એમઈએસની તમામ કચેરીઓમાં તથા એમઈએસ વેબસાઈટ પર પણ ઉપલબ્ધ છે.

davp 10102/11/0453/1011

realpatidar.com

# ચાંદ્રોડામાં જમીન મુદ્દે ધમાસાણ

**લોકોનો પથ્થરમારો: પોલીસનો લાઠીચાર્જ: પીએસઆઇ સહિત જવાનોને ઇજા: પાંચથી વધારે ગામલોકો ઘવાયા**

ભાસ્કર ન્યૂઝ. અંજાર

ધમાલ બાદ ચાંદ્રોડા ગામે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. -ભાવેશ ગોર

અંજાર તાલુકાના ચાંદ્રોડા ગામમાં શુક્રવારે જમીન સંપાદનની બાબતે ગામલોકો અને પોલીસ વચ્ચે બોલાચાલી થતાં મામલો બિચક્યો હતો અને ગામલોકોએ પોલીસ ઉપર પથ્થરમારો કર્યા હતો જ્યારે જવાબમાં પોલીસે લાઠીચાર્જ કરતા ચકચાર મચી હતી. બંને પક્ષોએ સામ-સામે અથડામણને પગલે પીએસઆઇ- કર્મચારીઓ અને ગામલોકો ઇજાગ્રસ્ત થયા હતા.

અંજાર તાલુકાના ચાંદ્રોડા ગામની જમીન ગ્રામ પંચાયતની મંજૂરી વગર સરકારે કોઇ ખાનગી કંપનીને લીઝ ઉપર આપી દેવાનો નિર્ણય કર્યો હતો. આ મામલે થોડા દિવસો અગાઉ ગ્રામલોકોએ વિરોધ નોંધાવવા સાથે સરપંચ સહિતના પ્રતિનિધિ મંડળે કચ્છ કલેક્ટરને આવેદનપત્ર આપી લીઝની જમીન રદ ...અનુસંધાન પાના નં. ૭

### ૩૭૫ જણના ટોળાં સામે સામૂહિક હુમલાની ફરિયાદ

જમીન મુદ્દે શુક્રવારે ચાંદ્રોડા ગ્રામજનો વચ્ચે થયેલી અથડામણ અને પથ્થરમારાના પગલે પોલીસે સરકારી કામકાજમાં રૂકાવટ બદલ કુલ ૨૭ શખ્સો ના નામજોગ કુલ ૩૭૫ લોકોના ટોળાં સામે ગુનો નોંધ્યો હતો.પીએસઆઇ એમ.બી. ખિલેરીની ફરિયાદના પગલે પોલીસે ચાંદ્રોડા ગામના રપંચ ...અનુસંધાન પાના નં. ૭

અસ્મિતા પર્વના પ્રારંભે લેવા પટેલ સમાજના ૨૮ જેટલા યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યાં હતાં. આ પ્રસંગે યોજાયેલા સમારંભમાં ઉપસ્થિત પ્રદેશ ભાજપના અધ્યક્ષ આર. સી. ફળદુનું વિશેષ અભિવાદન કરાયું હતું. ધારાસભ્યો રમેશભાઇ મહેશ્વરી, ધનજીભાઇ સેંઘાણી, તારાચંદ છેડા, જયંતીભાઇ ભાનુશાલી, આર.આર. પટેલ, અરજણભાઇ પીંડોરિયા વગેરે જોડાયા હતા. -મયૂર ચૌહાણ

**પટેલ પરિવાર સતપંથ સમાજના મહોત્સવમાં ભાગ લેવા આવ્યો હતો**

# સિનુગ્રા પાસે અકસ્માત: ત્રણના મોત

**ગમખ્વાર અકસ્માત બાદ ટોળાંએ ટ્રેઇલરને સળગાવ્યું : દસ ઘવાયા**

ભાસ્કર ન્યૂઝ. અંજાર

રોષમાં આવેલા લોકોએ વાહનોને સળગાવ્યાં હતાં. -ભાવેશ ગોર

અંજારથી મુન્દ્રા જતા માર્ગ પર સિનુગ્રા પાટિયા પાસે શુક્રવારે બપોરે ટ્રેક્ટર અને ટ્રેઇલર વચ્ચે અકસ્માત સર્જાતાં ટ્રેક્ટરમાં સવાર પટેલ પરિવારના ત્રણ સભ્યોના જીવનદીપ બૂઝાઇ ગયા હતા, જ્યારે અન્ય સાતથી આઠ લોકોને સામાન્યથી અસ્થિભંગ સહિતની ઇજાઓ પહોંચી હતી. અંજાર તાલુકાના ખેડોઇ પાસે ઉજવાઇ રહેલા અખિલ ભારતીય સતપંથ સમાજના મહોત્સવમાં ભાગ લેવા શુક્રવારે પીરાણાથી પટેલ પરિવાર પોતાના મૂળ વતન ખેડોઇ આવ્યો હતો . ખેડોઇ આવ્યા પછી આ પરિવાર શુક્રવારે સાંજે ટ્રેક્ટરમાં સવાર થઇ પોતાની વાડી તરફ જઇ રહ્યો હતો, ત્યારે મુન્દ્રાથી આવી રહેલા ટ્રેઇલર નં. યુ.પી.૧૭.બી. ૧૭૯૪એ ટ્રેક્ટરને અડફેટે લેતાં આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ...અનુસંધાન પાના નં. ૭

# કચ્છી લેવા પટેલ સમાજનો વિકાસ અન્યો માટે અનુકરણીય

**ત્રિદિવસીય અસ્મિતા પર્વના પ્રારંભે ભાજપ અધ્યક્ષે કરી પ્રસંશા**

ભાસ્કર ન્યૂઝ. ભુજ

કચ્છી લેવા પટેલ સમાજે દરેક ઘટકોમાં સમતોલ અને પૂર્ણ વિકાસ માટે જે પ્રયત્નો કર્યા છે તેને મળેલી સફળતા અન્યો માટે અનુકરણીય સાબિત થઇ રહી છે. ભુજમાં લેવા પટેલ સમાજનાં ત્રિદિવસીય અસ્મિતા પર્વના પ્રારંભે પ્રદેશ ભાજપ અધ્યક્ષ આર. સી. ફળદુએ આ ...અનુસંધાન પાના નં. ૭


FOR BOYS & GIRLS
સ્પીડ હાઈટ™ ફેમસ
અસરકારક આયુર્વેદિક દવા
NO SIDE EFFECT
લો, ફર્ક જુઓ
Adv. is an Information for RM Practitioners, Results may varies

અભિનંદન રાઉમા સમાજનું ગૌરવ

રાઉમા આસિફ અલીમામદ (મલક)
ધો. ૧૧ કોમર્સમાં ૮૧.૮૮% સાથે પ્રથમ નંબરે પાસ થવા બદલ રાઉમા સમાજ અને લાકડિયા ગામ ગૌરવ અનુભવે છે. અલ્લાહ તાલ્લાહ આપને ઔર રોશની બક્ષે જે સમાજ અને દેશને રોશન કરે... આમીન.
-: શુભેચ્છક :-
• રાઉમા અનવર હુસેન (મલક) પ્રમુખ, પરિવર્તન યુવા વિકાસ ટ્રસ્ટ પૂર્વ કચ્છ.
• મલક પરિવાર, લાકડીયા-કચ્છ.

આઝાદી સાંધાના દુખાવાથી...
Leeford
Ortho-Aid CAPSULES/ OIL
હલ્કી-ફુલ્કી જિંદગી માટે હલ્કો-ફુલ્કો ઉપાય !
MEGASLIM CAPSULE
Leeford Healthcare Ltd.
Ahamdabad : 97274-21495, Gheekanta : 25505210, Bapunagar : 22970777, Maninagar : 29295568, Vasana : 30024508, Shahibagh : 99240 64450, Gheekanta : 25508514, Naranpura : 079-27683431, Ashramroad : 825308128, Gandhinagar : 23235694, Surendranagar : 222910, Idar : 02778-251370, Patan : 320539, Mehsana : 222096, Palanpur : 02742-266604, 258194, Deesa: 02744-230677, Visnagar : 222361, Radhnapur : 278015, Tharad : 222205
Toll-Free Helpline: 1800 180 2322

જાપાની તેલ™
શોખીન લોકો પણ ઉપયોગ કરી અસર જુએ

સાંધા, ઘૂંટણો, કમર દર્દથી છુટકારો
૧૦૦% આયુર્વેદિક
JOLLY રેડ ગોલ્ડ
પીડાઓનું તેલ અને કેપ્સૂલ
એક વાર જરૂર અજમાવો
દરેક મેડિકલ સ્ટોર પર ઉપલબ્ધ 093175-50500

નવા કુદરતી વાળ ઉગાડો ફક્ત થોડાક દિવસમાં
વાળ ની કોઇપણ સમસ્યા હોય તો અત્યારે જ ફોન કરો
9328045992
9638088999
તારા હોમિયોપેથી ક્લિનિક
રાજકોટ.વડોદરા.અમદાવાદ.સુરત.પુના.મુંબઇ

શું આપ રોકાણ કરવા માંગો છો ?
આજે જ અમારા પ્રોજેક્ટમાં ૧ લાખનું રોકાણ કરો અને ૬ મહિના પછી ૧,૩૦,૦૦૦/- રૂા. પરત મેળવો.
☞ આપણાં નાણાની સલામતી માટે બેંક ગેરેંટી મેળવો.
☞ તો રાહ શું જુઓ? આજે જ અમારો સંપર્ક કરો.
MAX GROUP
Trust Marble, Madhapar, Bhuj-Kutch.
Mo. 93277 11629

ઋતુરાજ® આયુર્વેદિક તેલ એન્ડ શેમ્પુ
ગૃહ ઉદ્યોગ
● ૩ દિવસમાં ખરતા વાળ બંધ થાય
● ૩ દિવસમાં ખરતા વાળ બંધ નો થાય તો ૪ દિવસે બોટલ પાછી આપી જવી ૨૫% વાપરેલી
● ખોડો દુર થાય ● વાળ ફાટતા હોય તો બંધ થાય
● ૩૫ દિવસમાં વાળ ૨ ઈંચ જેટલા વધે*
● ગરમીથી જ ટાલ પડેલ હોય તો તેમાં નવા વાળ ૩૫ દિવસમાં આવે.*
નોંધ : ટાલની કોઈ ગેરંટી નથી.
નવા પેકીંગમાં ઉપલબ્ધ
ખાસ નોંધઃ નકલથી સાવધાન
જે કોઈ ફાલતુ તેલ વાળા કહે તો આ મોબાઈલ નં. ૯૮૨૫૩ ૨૦૩૨૦ ઉપર સંપર્ક કરો.
અમારી શાખામાં પહેલા કોઈ હતા નહીં. છે નહી. આવશે પણ નહીં.
*Condition apply.
Marketed By :
ઋતુરાજ માર્કેટીંગ પ્રો. ઉદય સુદાણી
દરેક મેડિકલ સ્ટોર્સમાં ઉપલબ્ધ
મેન્યુ. બાય : પીઠવડી. તા.: સાવરકુંડલા જી. અમરેલી. (ગુજરાત)


## શ્રધ્ધાંજલી

સ્વ.નરેન્દ્ર આણંદજી ખોના
સ્વ.તા.૦૬/૦૫/૨૦૧૦

હૃદયનો ઘાવ ક્યારેય રૂઝાશે નહીં,આંખોના આંસુ ક્યારેય સુકાશે નહીં,
સદાય હસતો આપનો ચહેરો સ્મૃતિ પટ પરથી ક્યારેય ભુલાશે નહીં,
પરમ કૃપાળુ પરમાત્મા આપના દિવ્ય આત્માને શાંતિ આર્પે એજ પ્રાર્થના.

: શોકાતુર :

હિતેન વી.ભટ્ટ – વલસાડ
નયન બી.ગોર – મુંબઈ
નિલેષ એમ.ગોર – સાંધવ


શુધ્ધતા અને સમૃધ્ધી ની ઉજવણી.
અખાત્રીજ ઑફર
હીરાના દાગીના પર 15% સુધી ની છૂટ*
સોનાના દાગીનાની ઘડામણ પર 25% સુધી ની છૂટ*
TANISHQ
*શરતો લાગુ. આ ઑફર તારીખ 30 એપ્રિલથી 16 મે, 2010 સુધી ઉપલબ્ધ. ઘરેણાનું દરેક નગ, એક ટાટા પ્રૉડક્ટ, તેના સોના અને હીરાઓની શુધ્ધતા માટે, તનિશ્ક, તરફથી પ્રમાણિત કરવામાં આવે છે. અમારી અનોખી ગોલ્ડન હાર્વેસ્ટ સેવિંગ્સ સ્કીમનો લાભ લો. www.tanishq.co.in પર અમારી મુલાકાત લો.
રાજકોટ - ડો. યાજ્ઞિક રોડ, ઇમ્પીરીયલ પેલેસ હોટલની સામે; અમદાવાદ - ઑફ્ફ સીજી રોડ - સત્કાર બિલ્ડિંગ, સ્વાગત ચાર રસ્તા, નવરંગપુરા - ટેલી: 66090455 / 56; મણીનગર - સેફ્રોન 1, જગાભાઈ પાર્ક, રામબાગ - ટેલી : 66090470 / 71; સેટેલાઇટ રોડ - ઇસ્કોન સેંટર, શિવરંજની ક્રોસ રોડ, ટેલી: 66090477 / 78.


## શ્રદ્ધાંજલી / પ્રાર્થના સભા

જન્મ : ૧૩-૦૪-૧૯૭૧
સ્વર્ગવાસ : ૦૬-૦૫-૨૦૧૦

### સ્વ. નરેન્દ્ર આણંદજી ખોના

આપની અણધારી વિદાય આપણા કુટુંબને આભ તુટયા સમાન દુ:ખ નાં આસુંઓની નદીઓ વહી શોકના સાગરમાં સમાવી ગઇ છે.
આપના આત્મા ને પ્રભુ ચીર શાંતિ પ્રદાન કરે એવી પરમાત્માને અશ્રુભિની પ્રાર્થના....

**: શોકમગ્ન કુટુંબ :**

માતૃશ્રી – ગં. સ્વ. કાંતાબેન આણંદજી ખોના
ભાઇઓ – લહેરચંદ આણંદજી ખોના
– પ્રદિપ આણંદજી ખોના
– જવેરચંદ આણંદજી ખોના
બનેવી – મયુર જેઠાભાઇ લોડાયા
– વિપુલ કિશોર મૈશેરી

પત્ની – દિપા નરેન્દ્ર ખોના
ભાભી – લીલાવંતી લહેરચંદ ખોના
– મીનલ પ્રદિપ ખોના
– ચેતના જવેરચંદ ખોના
બહેન – રીટા મયુર લોડાયા
– જયવંતી વિપુલ મૈશેરી

પુત્ર / પુત્રી : વિધી, જય, કેવન
ભત્રીજા / ભત્રીજી : મીકીર, પ્રતીક, પ્રણવ, જીત, સમતા
ભાણેજ / ભાણેજી : અલ્પા, સાગર, જીનેન

**તથા સમસ્ત સ્વ. આણંદજી હિરજી ખોના પરીવાર**

**એકટીવ કારગો મુવર્સ – સ્ટાફગણ**

**પ્રાર્થના સભા : શનિવાર તા. ૦૮-૦૫-૨૦૧૦**

**સમય : સાંજ ના ૫.૦૦ થી ૬.૦૦ કલાકે**

સાધુ વાસવાણી ઈન્ટરનેશનલ સ્કુલ, લીલાશાહ સર્કલની બાજુમાં, લીલાશાહ નગર, ગાંધીધામ (કચ્છ)

realpatidar.com